

શ્રી જૈન સસ્તી વાંચનમાળા. નં. ૧૫ રૂ. ૪ રૂ.

ॐ હા� શ્રી પાર્વતનાથાય નમઃ

મહાન् સંપ્રતિ

અથવા

જૈન ધર્મનો દિગ્ભિજય.



લખક:- મહાપીતાલ ન્યાલચંદ શાહ



પ્રકાશક,

જૈન સસ્તી વાંચનમાળા—મુ. ભાવનગર.

વીર સં. ૨૪૫૨

વિકલ સં. ૧૬૮૨

કિંમત ર. ૧/-/-

પ્રેમો પહાર.

શ્રીમાન्

લાવનગર—ધી આનંદ પ્રી. પ્રેસમાં શાહ ગુલાખ્યાંદ
લલુ ભાઈએ છાયું.

(પ્રકાશક-સર્વ હક્ક સ્વાධીન રાખ્યા છે.)



શેડ પુનમચંદ કરમચંદ કોટાવાળા.

સમર્પણ.

સદગુણાલંકૃત શોઠળ સાહેબ,

**શ્રીમાન् શોઠશ્રી પુનમચંહ કરમચંહ
કાટાવાળા-પાટણ.**

જૈન સમાજમાં જેમનાં કાર્યો અગમગી રહ્યાં છે,
જેમની લાખોની સખાવતો સમાજને અજાણ પમાડી
રહી છે, તેવા પુણ્યશાળી પુરુષરળને સમર્પણ આપવું
ચોભ્ય જ ગણ્યાય. વળી મારા વડીલ કાકાશ્રી હામોદરદાસ
કેશરીચંહ આપને ત્યાં લાંબો વખત રહ્યા હતા, જે અંગે
આપ અમારા કુટુંબ ઉપર હજુ પણ વાત્સન્યલાવ
ખતાવી રહ્યા છો. તેવા આપના સરળ સ્વભાવી ગુણોને
અંગે આ પુસ્તક પ્રેમપૂર્વક સમર્પી કૃતાર્થ થાડિ છું.

લીઠ આપનો
અચરતલાલ.

આસાર.

પાટણું નિવાસી શ્રીમાન् શેડ શ્રીપુનમચંદ
કરમચંદ કોટાવાળા કે લેઓએ આ વખતે એ
શત્રું જ્ય તિર્થની ‘નવાણું યાત્રા’ કરી અપૂર્વ લા
લીધા છે, તેની યાદગિરિ નિમિત્તે આ પુસ્તકની એ
મથી ૨૫૦) નકલ લઈને મારા કાર્યને સહાતુભૂત
આપી છે તે માટે તેઓશ્રીનો આલારી છું. એજ—

લીઠ

પ્રકાશકો.

શ્રી

પાઠ્ય નિવાસી—

શ્રીમાન् શેડ પુનમચંહ કરમચંહ ડોટાવાળાનું

જીવન ચરિત્ર.

—→★(◎)★—

નવક્રમ સંવત ૧૯૩૦ ના જેણે ચુદી ૧૧ ના દિવસે ગામ ડોટા
ને આપશ્શીનો જન્મ થયો. જન્મ થયા પછી છેડ દિવસે આપના
તુંશી ચંદ્રનથાડનો સ્વર્ગવાસ થતાં આપની અપરમાતા બાધ
રમર બાધએ સગા પુત્રની માડક પ્રેમથી ઉછેરી મોટા ડર્ચી.
મચપણુથી પુણ્યપ્રદૃતિના યોગે ડેગળણીમાં આગળવધી ધાર્મિક સં-
દ્ધારો શરૂઆતી જ હોવાથી ધાર્મિક અભ્યાસમાં પણ પંચપ્રતિક્રમણ,
જીવવિચાર આદિ પ્રકરણો, કર્મચંદ્ર ઉપરાંત નયચંહ, આગમસાર,
વિગેરે ન્યાયના ગ્રંથો તેમજ સંસ્કૃત પુસ્તકોનો અભ્યાસ કરવા ઉપ-
રાંત શુદ્ધરાતી, દર્શાવા અને પર્શિયન લાધાનું સારું જ્ઞાન મેળવ્યું
ઇતું તફુપરાંત સંગીતકળાનું સારું જ્ઞાન હોવાથી પોતાના ધરદેરા-
પુરમાં પૂલ વિગેરેમાં સંગીતથી લક્ષ્ણમાં અપૂર્વ આનંદ લેતા હતા.
અને હજુપણું પ્રલુપજ્ઞનમાં તેવો જ લાલ આપશી હ્યો છો.

સંવત ૧૯૩૬ ના વैશાખ માસમાં શેડ નાગરદાસ ગુલાભચંદ-
નાં પુત્ર ઉજમલાકાલની પુત્રી સૌં સમરતાઈ સાથે
લગ્ન નાનીવયમાં આપણું લગ્ન થયું હતું. સંવત ૧૯૪૬
માં આપને ત્યાં મોતીબાઈ નામે પુત્રીનો જન્મ

થયો. જેમનાં લગ્ન બાધુ સાહેબ પનાલાલજી પુનમચંદજીના પુત્ર
મોહનલાકાલજી સાથે ધર્ણી ધામધુમથી થયાં હતાં. જેમાં ધાર્મિક કિયા
તરીકે, રાંતીસનાન, જળયાત્રાનો વરયોડો, નવકારશી અને ડેળવરણી
સંબંધી મેલાવડાઓ. વિગેરે કરી મોટાં ધનામો વહેંચવામાં આવ્યાં
હતાં. આની ધાર્મિક સાર્વજનીક પ્રવર્તિઓ લગ્ન પ્રસંગે ખરેખર
આદરણીય ગર્ણી શકાય જે આપે આદરી હતી. શ્રીમતી મોતીબાઈ
સ્વપ્લાવે શાંત, સુશીલ અને ગંભીર છે.

શેડજીની વય ૩૦ વર્ષની થતાં પુત્ર પ્રાપ્તિ ન થવાથી શેડજીના
માતુશ્રીએ ખીજું લગ્ન કરવાનો આગ્રહ કરવાથી સં. ૧૯૬૧ માં
શેડ લીખાલાઈ ભહેડમચંદને ત્યાં તેમની પુત્રી મોતીબાઈ સાથે લગ્ન
થયાં. સં. ૧૯૬૪ ના અરસામાં એ પુત્રની પ્રાપ્તી થદ; પરંતુ કર્મ
વશાત્ બંને બાળકો થોડાજ માસમાં સ્વર્ગસ્થ થયાં. મોતીબાઈ પણ
સં. ૧૯૬૫માં સ્વર્ગસ્થ થયાં.

સં. ૧૯૬૫ના વैશાખ શુદી ૫ પાઠણુમાં શેડ લહેરચંદ દેવ-
ચંદના પુત્રી શ્રીમતી હીરાલક્ષ્મી સાથે ત્રાજીવારનું લગ્ન થયું. જેએઓ
સરળસ્વલાની, શાંત, સુશીલ, વિનયી અને કાર્યકુશળ હોએને ધાર્મિક
અને નૈતિક અભ્યાસમાં સમયનો સદૃપ્યોગ કરે છે. જેએઓ એક
આદર્શ સત્તારી છે.

શેડશ્રી નાનપણુથી જ વ્યાપારમાં તીવ્યાદ્વિવાગ હોવાથી અનેક

પ્રકારના વ્યાપારોની ખીલવણી કરતા હતા.. હાં-
વ્યાપાર માં અરીમનો, શેરોનો મોટો વેપાર એકીંગ, અનાજ
કાપડ વીજેરે ધણી જતના વ્યાપારોથી દ્વયસંપા-
દ્ધ કરી તેનો સહબ્ય કરવા ઉપરાંત, અનેક મનુષ્યોને નિભાવે છે.

તેમનાં માતુશ્રી આધ સૌલાય્ય તેમજ શેડ્શ્રી કરમચંદળના
હાથે શ્રી શંજ્ય ગરિરાજ ઉપર શ્રી આદીશ્વર
શેઠ કરમચંદળ ભગવાનની દુંડમાં જગતશેઠના દેરાસરની જોડે
ના હૃથે થયેલાં એક અન્ય શાખરબ્યધી મંદિર અંધાની શ્રીપાર્વતી-
ધાર્મિક કાર્યો નાથ સ્વામીની સ્થાપના કરી હતી. જેમાં લગભગ
૪૦૦૦૦ હજારનો ખર્ચ કર્યો હતો, વળી તેઓ-
શ્રીના હાથે સાત સંધો નીકલ્યા હતા. તેમાં શ્રી સિદ્ધાચળ તર્થનો
જરી પાળતો સંધ, શ્રીતારંગાજી, કુંભારીયાજી, અમદાવાદ, મિરનાર,
સોરાઠ, પંચતિર્થી વિગેરે, છેવટ સં. ૧૯૪૫ માં શ્રીકિશરીયાજી મારવાડ
પંચતિર્થીનો મોટો સંધ કાટ્યો હતો જેમાં લગભગ ૧૫૦૦ માણસ
૧૫૦ ગાડાં અને ૧૫૦ સાંધુ સાંધીનાં ઢાણાં હતાં ચાર મહીને આ
યાત્રા પુરી થઈ હતી. આ સંધોમાં રૂ. ૧૦૦૦૦૦ એકુલાખ લગભગ
નાદર રકમ ખરચાધ હતી. તે ઉપરાંત તેમના હાથે ઉજમણું નવકા-
રશી, અદ્દાદમહેત્સવ અને કોટામાં અંજનશલાકા વીજેરે ધાર્મિક
કાર્યો ધણું થયાં હતાં. લગભગ ૮૦ નવકારશી ૪ ઉજમણું વીજેરે-
માં આશરે રૂ. ૧૦૦૦૦૦ એક લાખ ખરચાધ હતા.

— પૂજ્ય પિતાશ્રીની સાથે નાની ઉમરથી જ ધાર્મિક
શેઠલુ હુસ્તાક કાર્યોમાં જોડાધ દરેક કાર્યો કર્યા, જે અત્યારે
થયેલા ધાર્મિક જગતના ચોકમાં ઝીર્તિ-સ્તંસર્પે ઝળહળી રહ્યાં છે.
કાર્યો જેનો લાલ દરેક નૈન અંધુચો લઘ રહ્યાં છે.

૧ પાઠથુમાં શ્રી સ્થાનતપાર્થનાથ સ્વામીની ધર્મશાળામાં લગ-
ભય રૂ. ૪૦૦૦૦ હજાર આપના પિતાશ્રીના
પાઠથુ અને વખતમાં ખરચાયા હતા, જેનું ખાત સુહૃત્ત
ખાલીતાણુંની પિતાશ્રીએ આપના જ હાથે કરાવેલું, તેનું સંમાર
ધર્મશાળાએ કામ આપે હાલમાં કંઠી રૂ. ૧૦૦૦૦ ખરચ્યા
તથા સં. ૧૬૫૩ છે. સાથે લાઘણી તરીકે પુરટકોનો સારો સંગ્રહ
માં અત્યરુહ કરી યાત્રીઓને તેમજ સમાજને એક ઉપયોગી
સાધન કરી આપ્યું છે.

૨ પાલીતાણુમાંની આપના ધમ શાળામાં રૂ. ૪૦૦૦૦ આપના
પિતાશ્રીના વખતમાં ખરચાયા હતા; તેનું ખાત સુહૃત્ત પણ
આપને જ હાથે ચચું હતું. તેનું સમારકામ હાલમાં જ આપે
કરાવી રૂ. ૫૦૦૦ લગભગ ખરચ્યા છે.

૩ સં. ૧૬૫૬ ના બ્યાંકર દુષ્કાળમાં મીદની જગ્યામાં (જ્યાં
હાથ આપનો રહેવાનો બંગલો છે) ત્યાં અત્યરુહ ખોલ્લી
અપંગ માણુસોને અન વજ્ઞ આપી લગભગ રૂ. ૨૫૦૦૦
ચિતાશ્રીના વખતમાં ખરચાયા હતા.

સં. ૧૬૫૬-૬૦ માં અમદાવાદમાં ભરાયેલી નેરાનલ ડાંગ્રેસના
ટેલીગ્રેફ, વીડીએર્સ અને શહેર સંભાવિત અહરથો-
ડાંગ્રેસ તથા નૈન ને લારે ધામધુમથી છવનીંગ પાર્ટી આપી હતી.
ક્રી. કેન્દ્રરાન્સને તેમજ મુખ્યદાતી નૈન ક્રી. ૦ કેન્દ્રરાન્સને પણ છવ
છવનીંગ પાર્ટી નીંગ પાર્ટી આપી હતી. આવી રીતે ધર્મસેવા અને
રાષ્ટ્ર સેવાના સન્નેંગો પણ આપે સાચવીને લગ-
ભય રૂ. ૫૦૦૦ નો ખર્ચ કર્યો હતો.

સં. ૧૯૬૧માં પૂજન્ય પિતાશ્રીને પગલે અનુમતી પૂજન્ય
પિતાશ્રીની પિતાશ્રીની પાછળ ગામ-કોડા, પાલીનાણા અને
પાછળ પાટણુમાં અડાઈ મહોત્સવો, જ્વેરાતની આંગા-
અહૃદિમહોત્સવો એ સાથે કરાતી સ્વામીનાતસદ્ય (નવકારશા) અને
ઘણી ઘણી ધામધુમથી કરવામાં આવ્યાં હતાં નેમાં
સ્વામીનાતસદ્ય લગભગ રૂ. ૧૦૦૦૦ નો ખર્ચ કર્યો હતો.

પાટણુની ડેંઠો માં સં. ૧૯૬૨ માં પાટણુની નેંઠો ક્રેંડો ડેંફરન્સ
ડીસેપ્શન કમી- નિમંત્રી રીસેપ્શન ઇમીટીનું પ્રમુખસ્થાન આપ્ય
દીનું પ્રમુખસ્થાન સ્વીકારી લગભગ રૂ. ૨૦૦૦૦ નો ખર્ચ કર્યો હતો.

સં. ૧૯૬૫-૬૬ પાટણુમાં પૂજન્ય **પિતાશ્રી પાછળ** મોટો અહૃદિ-
મહોત્સવ સાથે નંદીસરકીય તથા શાખરાજ, ગીર-
શહેર જમણા. નારજીની રચના, દાનાસીકુમાર, મધ્યારીદુ, પંચાંદી
વિગેરના દશ્યો ઘણી ધામધુમથી કરીને તે પ્રસંગ
પ્રીતિલોજન (શહેર જમણા) આપ્યું હતું. તેમાં ગામના તથા આસ-
પાસના ઘણા ગામેનું લગભગ એક લાખ માણુસ એકન ઘણું
હતું નેમાં (રૂ. ૫૦૦૦૦) ખર્ચ કરવા ઉપરાંત સં. ૧૯૬૬ માં
શ્રી વીશા શ્રીમાળીની ન્યાતમાં તેમજ સ્નેહી સંબંધીઓમાં પાત-
ણની ડાડીયોની લ્હાણી કરી હતી; તેમજ ગામના દરક દેરાસર-
જીમાં પૂજા-પ્રલાવના, આંગાયો રાત્રી જગરણ વાગેરેમાં (રૂ. ૨૦૦૦૦)
ખર્ચી આ પ્રસંગમાં એકદર (રૂ. ૭૦૦૦૦) નો ગંજવર ખર્ચ કર્યો
હતો. નણુસે વર્ષાં આવું ગામજમણ નહિ થયેલ હોવાથી આખા
શહેર તરફથી આ માંગડીક દિવસની વાદગીરી કાયમ રાખવા હેઠેસ
માટે તે દીવસે પાખી પાળવાનો છરાવ કરવામાં આવ્યો હતો. નેનો
દ્વારા ઘણું ઉત્સાહ અને પ્રેમથી આપની આપવામાંઆવ્યો છે.

સંવત ૧૯૬૭ માં પાઠણમાં વિશાળ અનગૃહ ખોલી અપંગ
અને નિરાધાર માણુસોને અન, વસ્ત્ર, પુરાં પાડવા.

ગુજરાતમાં હુ- સાથે ડેક્ટર ડેડારીને તેમની ખાસ સારવાર માટે
કાળિવખતે પાઠ- રેકો દ્રેક રીતે મદ્દ કરી તેમજ ચુમ દાનની
ખુમાં ખોલાવેલું એક પેટી ખોલી ચીડીઓ દારા ધણુા માણુસોને
અનગૃહ. ધણુા ગાનોમાં મદ્દો મોઝલી લગભગ રૂ. ૨૦૦૦૦
વીશ હળવરનો ખર્ચ કર્યો હતો.

સંવત ૧૯૭૨ માં અનાજની મોંધવારીને લીધે એક ખાસ
દુકાન ધર્મશાળામાં ખોલી ગરીબ અને ભધ્યમ
સરતા અનાજની વર્ગના માણુસોને જીવાર એ પૈસે શેર નામની
દુકાન. કિમતે પૂરી પાડી રૂ. ૫૦૦૦) તું તુકશાન સહન
કરી લોકાનો આશીર્વાદ લીધો હતો.

સંવત ૧૯૭૩ માં ગામ ચાર્ચપમાં શ્રી શામળા પાર્શ્વનાથજીના
પ્રાચીન તિર્થમાં મહાદેવજી સંબંધી તકરાર હો-
ચા દ્ર્યપના લવાદ વાથી નૈનો અને સમાતો વચ્ચે મોટો વિગ્રહ
તરીકે. થયો હતો તેનો ધણો વખત ઝગડો ચાલ્યા પછી
છેવટે ખંને પાર્ટી (બધા શહેરીઓ) તરફથી
એકજ લવાદ તરીકે આપતેજ પસંદ કરી નીમવામાં આવ્યા હતા,
જે ઓછું સન્માનનીય ન ગણ્યાય !

શ્રી શામળાપાર્શ્વનાથજીના દેરાસરમાં ધર્મશાળામાં ડેઢપણ
જાતની દ્યાખલગીરી (અરસપરસનો વિરોધ) નહિ રહેવાથી નૈનો
અને સમાતો વાગેરે આખા શહેર તરફથી એ વાત સાંભળી ધણી-
ખુશાલી અતાંતી કુલના હારતોરાથી વધાવી લીધા હતા. અને તેપછીના
દીવાન સાહેબ મનુઆધના રવછરતે શહેર તરફથી આપને માનપત્ર

આપવામાં આયું હતું. આ પ્રસંગે ચાર્ચપની ધર્મશાળામાં મેડો અંધાવી રી. ૨૦૦૦) તેમજ આ ચુકાદાને અંગે રી. ૨૦૦૦) ખરચ કરી આવી રીતે તન-મન અને ધનનો બોગ આપ્યો હતો.

સં. ૧૯૭૬ માં પારણુંથી તારંગાજી, લોયણીજી, ડેશરીયાજી,

રાણપુરજી, ભક્તિજી, માંડવગઢ, ઉન્નેન, આયુલું, ~~અં~~

યાત્રાએ. ગીરનારજી, વેરાવળ, પ્રલાસપારણું, અંતરીક્ષજી

અને શ્રી સિદ્ધાયગાજી વિગેરેની યાત્રાએમાં લગ-

ભગ નણું મહીના કરી રી. ૫૦૦૦) નો વ્યય કર્યા હતો.

સંવત ૧૯૭૮ નું પર્યુપણુપર્વ શ્રી કોટા મુકામે થયું હતું તે

પ્રસંગે અદૃમની તપસ્યા કરીને શ્રી મહાદીરસ્વા-

શ્રી કોટામાં મીના પારણું નીમીઠે જલવાત્રાનો વરદોડો ચ-

પ્રયુષણું પર્વ. ડાંયો હતો. જે કોટામાં અત્યારસુધીમાં પહેલો હતો,

રાન્યના તમામ હાથી, ઘોડા, પાયદશ વિગેરેની

ધર્મધીજ સામગ્રી સાથે આ વરદોડો એક માધ્યમ સુધી લંઘાયો હતો.

વળી ઓશવાળ કોમમાં ધણેણું વંબતથી એ તુડ હતાં તે આપે એક-

નિઃ કરીને આ બંને શુભ પ્રસંગોની ઝુશાલીમાં કોટાના સંભાવીત

ગૃહસ્થો સાથે મોડું જમણું (સ્વામીવાત્સલ્ય) કર્યું હતું જેમાં રી.

રી. ૫૦૦૦) લગભગ ખર્ચ કર્યા હતા.

સંવત ૧૯૭૯ માં મહાલક્ષ્મી પાડમાં શ્રી મુનિસુત્રતસ્વામીના

હેરાસરજીના જીર્ણોક્ષારની રીપમાં પ્રથમ આજે

મહાલક્ષ્મી પા- રી. ૨૫૦૦) ભરેલા હતા. તે હેરાસરજીમાં મહા

ડાના હેરાસરજીની શુદી પ ને દિવસે શ્રી મુનીસુત્રતસ્વામીજી ગાઢી

પ્રતિધા. ઉપર બીરાજમાન થયા તે સમગ્રે આપતી હેખરેખ

નીચે પ્રતિધાના દરેક કાર્ય. થયાં હતાં જેમાં જળ-

યાત્રાના એ વરદ્યોડા ધર્મશી ધામધુમથી નીકળ્યા હતા તેમાં એ
નામણુદીરા-રથ હાંકવાનું-રથમાં બેસવાનું તથા છી ચોપદાર સાં-
બેદ્વા વાગેરેની ઉઠામણુમાં રૂ. ૧૦૦૦) અને શાંતિસનાત્ર ૦^{૧૩}
વામાં ચોખા (રૂ. ૧૦૦૦) તેમજ નવકારશી વિગેરેનું જમણુ ૦^{૧૪}
૦૫૦૦ (રૂ. ૨૫૦૦) મળી કુલ રૂ. ૧૨૦૦૦) નો ખર્ચ કર્યો હ
એમાં

૧ શ્રી પાટણુની પાંજરાપોળના સ્થાયીએ^{૧૫}
(રૂ. ૧૨૧૦૧)

૨ શ્રી પાટણ નૈન મંદળ બોર્ડિંગના સ્થા-
નું ફરુંમાં રૂ. ૩૫૦૧)

૩ શ્રી પાટણ નૈન બાળાશ્રમના સ્થાધ ફરુંમાં
(રૂ. ૨૫૦૧)

૪ શ્રી પાટણ નૈન મંદળ પાર્શ્વનાથજીના
આપી આપ પેર્સન થથા ૦^{૧૬}
ણુઠી નૈન સંસ્થાઓ શ્રી નૈન ધર્મ^{૧૭}
સારક સભા. શ્રી નૈન આતનંદ સભા લાલ^{૧૮}

શ્રી પાટણ લેમાચાર્ય નૈન સભા શ્રી પાટણ
નાણું ય નૈન ગુરુકુળ, શ્રી મહાધીર વિદ્યા
મુંબધ વાગેરે સંસ્થાઓ માં આપે લાધા
ખર થઈ સાહિત્યને પણ સારે ઉતેજન
પેણું છે. તથા પાટણ બાલાધ કલા^{૧૯}
લાધા મન્યર થવા ઉપરાંત કીકટ માટે ૩
૧૦૦૦) આપી મેળબરેને રમત-ગમત તથ
વ્યાયામનું સાખન કરી આપ્યું હતું.

- ૫ અનારસ વિશ્વ વિદ્યાલયને શ્રીયુત મહનમોહન
માલવીયા હસ્તક રૂ. ૧૫૦૦૧) આપ્યા હતા.
જેમાં (રૂ. ૫૦૦૦) શ્રી નૈન ક્રેન એર્ડિંગ
રૂ. ૫૦૦૦) શ્રી નૈન ક્રેન લોઝંગ એ
રૂ. ૫૦૦૦) જનરલ ઇંઝમાં એ પ્રમાણ
અવસ્થા કરવા આપ્યા હતા.
- ૬ ધારમાં ક્રીસ્ટખાનપાર્ચનાથલના હેરાસરણના
ળાંબુંદ્રારનું કામ ચાલુ છે નેમાં (રૂ. ૧૦૦૦૦)
લગભગ ખર્ચ થવા ૨ અવ છે.
- ૭ ક્રી કેટામાં ધર્મશાળા તથા ઉપાશ્રયનું એક
વિશાળ મદાન તૈયાર થાય છે કે જે ધર્મ-
શાળા તરીકે નૈનોને ઉત્તેવામાં, સાધુ સા-
ધીના ઉપયોગ માટે, સ્વામીનત્સલ્ય કરવા
માટે તેમજ નૈનના આગણે ધાર્મિક અને
નીતિનું શિક્ષણ લઈ રહે તેવી પાડશાળા-
અને લાયએરી વીજેરે કરવાના હેતુથી બાંધ-
વામાં આવેલ છે. જેમાં (રૂ. ૧૦૦૦૦) લગભગ
ખર્ચ થવા સંભવ છે. આ ઉપરાંતપર દીપો
નેવી કે હેરાસરણ, ઉપાશ્રય, પાંજરાપોળ,
સાત ક્ષેત્રો સાર્વજનીક સંરથાઓ, મંડળો વી-
જરેની દીપોમાં ગુંત દાનોમાં, તિર્થસ્થાનોમાં
અને તેવાજ સાર્વજનીક કાર્યમાં દરવરસે (રૂ.
૧૦૦૦૦) લગભગ ગણુતાં વીશ વરસમાં (રૂ.
૨૦૦૦:૦) એ લાખ લગભગની નાદર રૂકમનો.

સહભ્યય કર્યો ગણાય. આવી રીતે એકંદર લ-
ગણગ રૂ. ૫૦૦૦૦) પાંચ લાખની ગા-
જનર રકમનો સહભ્યય થયો છે.

સંવત ૧૯૮૨ ના કારતક માસમાં સહદુટુંબ પાલીતાણું આવી
બાપારી વ્યવસાય છોડીશાંતિ લઈ, નવાણું યાત્રા
**શ્રી પાલીતાણા-
ની નવાણું યાત્રા.** કરી લક્ષિતનો અપૂર્વ લાલ લીધો અને તે પ્રસંગે
તથા પાઠણું ૫- નવકારશી કરી મોહનથાળનું જમણ આયું હતું.
ચાયતી ઇંડ. તેમજ પાલીતાણાની જુદી જુદી સંસ્થાઓને
યથાયોગ્ય મદ્દ આપી હતી. વળી નાની મોટી
પંચતિર્થી તથા અનાર પાર્શ્વનાથ પંચતિર્થની
યાત્રા પણ વચ્ચે ગાળે કરી લક્ષિતનો સંપૂર્ણ લાલ લીધો છે.

શ્રી શત્રુંજય ઉપરના પોતાના દેરાસરમાં રંગરીપેર કામ કરાયું
છે આવી રીતે ચાર માસ સુધી તદ્દન નિવૃત્તિ લઈ શેડ સાહેબે તેમજ
તેમનાં પતિન સૌ. હીરાલદરભી બાધ્યો કિયા સાથે અદિત્પૂર્વક યાત્રા-
નો લાલ લઈ જીવનનું સાર્થક કર્યું છે. આ યાત્રામાં લગભગ રૂ.
૧૦૦૦૦) નો સહભ્યય કર્યો છે. ઉપરાંત પાઠણમાં નૈન પંચ ૫-
ચાયતી ઇંડ (નૈન લાધ્યો અને બાધ્યોને આર્થિક સહાય અને
જરૂરીયાત મદ્દ તરીકે આપવાનું ઇંડ) કરવામાં આવ્યું તેમાં આં.
રૂ. ૫૦૦૦) આપીને એક જરૂરીયાતવાળી સંસ્થાને સહાનુભૂતિ આ-
પી છે, જે સંસ્થામાં આપની પ્રમુખ તરીકે નીમણુંક થયેલી છે.
આવા વખતમાં બાપારી વ્યવસાય છોડી ધાર્મિક જીવન ગુજરાતી
લક્ષનો સહભ્યય કરવાનું આપના જેવા પુણ્યશાળીનેજ સુઝે છે.
જે ખીન શ્રીમંતોને અનુકરણીય છે.

- ૧ શ્રી પાટણ વીશાઅમાળી ન્યાત તરફથી.
- ૨ શ્રી પાટણ હેમચંદ્રાચાર્ય જૈન સભા તરફથી
- શેઠ અને મળેલાં ૩ શ્રી પાટણ શહેર જમણુના માનપત્રનો દાખ-
લો સંં ૧૬૬૫.
- ૪ શ્રી કરી પ્રાંતની રૈયતના સભાસદ તરીક
વડોદરાની પહેલી જ ધારાસભામાં આપના
નીમણુંક થઈ તે અદ્દ પાટણના સમસ્ત મ-
હાજન તરફથી સં. ૧૬૬૪ ના ફાગણ વદ
પ ના રોજ અપાયેલું માનપત્ર.
- ૫ ચાર્ચપ ડેસના લવાદ તરીકે આપે ને બાહો-
શીથી કાર્ય કરી. નીવેડો લાભા તે અદ્દ
સમસ્ત શહેર તરફથી વડોદરા રાજ્યના દીવાન
મનુલાદ સાહેયના સ્વહરસ્તે અપાયેલું માનપત્ર.
- આપશ્રીનો રાજ્ય સાથેનો સંબંધ પણ એક કૈન તરીક ધણોજ
પ્રશસનાય છે. વડોદરા નરેશ શ્રીમંત સરકાર
- રાજ મહા- સયાજીરાવ ગાયકવાડ સાહેય આપના નીકટ
રાજના સાથેનો સંબંધના અંગે આપને ત્યાં ડીનરપાર્ટીમાં પધાર્યા
સંબંધ. હતા. શ્રીમંત કેદા નરેશો પણ આપને પોતા-
ના ભાયાતોની બેઢકમાં ખાસ બેડક આપેલી છે
અને ભાયાતોના કેલુંજ માન આપને આપવામાં આવે છે. સીવાય
રાધનપુર, પાલુનપુર, ભાવનગર, ઝાલ્યરાપાટણ (રાજ્યપુતાના) વીમેરે
ગામોના રાજ મહારાજ સાથે આપશ્રી સારો સંબંધ ધરાવો છો ને
જૈન ડેમને મગર થવા જેવું છે.

આપે અનેક રીતે શહેરની, કરી પ્રાન્ત મહાજન સભાના પ્રમુખ તરીક પ્રાંતની, દેશની, રાજ્યની અને જૈન ડેમની અણમોલ સેવા અગની છે. તેને અંગે પાદ્યણું સંસ્થાએ તેમજ અન્ય સંભાવિત અફસ્થે તરફથી જુદાં જુદાં માનપત્રો ધર્યું ધામધુમથી પ્રજાકિય સમારંભ વચ્ચે આપથીને આપવામાં આવેલાં છે જેનો વિસ્તાર અને આપનું વિસ્તૃત જીવન ચરિત્ર શ્રી ભગવતો સૂત્ર લાખાંતર, ચાર્દ-પણું અવસ્થેન તેમજ હીલદી ફરાર ડારોનેશનના દ્વિદીશ પુસ્તકમાં આવેલું છે જેથી અતે તો તેની ભાવ હુંક નોંધ લેવામાં આવી છે.

— ← (●) → —

જૈન સસ્તી વાંચનમાળા દર વર્ષે માત્ર રૂ. ૩ માં ૮૫૦ થી ૬૦૦ ધાનાંના ઈતિહાસીક પુસ્તકો નીયમીતપણે આહુકેને આપે છે. ઈતિહાસીક ઉત્તમ વાંચન તેજ-ઇવન સુધારણાનો અમુલ્ય માર્ગ છે. આહુક થવા લખો:—

જૈન સસ્તી વાંચનમાળા.

૩૦ રાધનપુરી બજાર-ભાવનગર.

મુસ્તાવના.

નૈનધર્મ એ કૃતીયનો ધર્મ છે—રાજધર્મ છે, એ કાંઈ હવે ખુપું રહી શકું નથી. પૂર્વે જગત ઉપર અનેક નૈન રાજયો પોતાની સત્તા અલોવી ગયા છે. છતાં નૈન ધર્મને આરાધી આત્મકલ્યાણ પણ સાખી ગયા છે. એ નૈન રાજયોની શરવીરતા એમનાં તેજ અને ગૌરવ, ધર્મ-પ્રિયતા હવે ધીરે ધીરે જગતની દષ્ટ આગલ ખડા થતાં જાય છે જો કે એ પ્રાચિન જાહેરલાલી પર અંધકાર છવાઈ ગયો છે છતાં એ બેઠી ઐતિહાસિક સત્યો જગતના ચોકમાં રજુ કરવાનો અમારો પ્રયાસ છે. નૈન ઐતિહાસિક પ્રસંગો ગુજરાતના ધતિહાસમાં નેકે અગ્રસ્થાન ભોગવે છે. છતાં અનેક ઐતિહાસિક પ્રસંગો તાર્થી એની આખી સંકલના—સાંકળ ઉલ્લિ કરીને જગતની આગળ એ પ્રાચિન યથાર્થ દસ્ય રજુ કરીએ છીએ.

આપણો આ ધતિહાસ વિકસ સંવતની બીજી સહીથી લગભગ પૂર્ણ નો છે. એટલે એના પ્રાચિનતા તો ધણી જુની કહેવાય. એ સમયની દુનીયા તો નૈનતત્વથી ઝળહળી રહી હતી. નેક ન્યાતો કે પેટા જાતિએ તો તે સમયે પણ હતી છતાં એ સર્વે જાતિએ બહુધા નૈનધર્મ પાળતી હતી. રાજયો પણ અધા નૈનધર્મનાજ રાગી હતા. એટલે પ્રણ પણ એ ધર્મની અનુયાયી અને તે સર્વથા શક્ય હતું.

આપણી વાર્તાના સમયના ધતિહાસમાં મહાન પ્રભાવિક પુરુષ સંપ્રતિ હતા. જેમના ધર્મગુરુ આયુસુહસ્તિ શાસનમાં નાયક

સમા ભહાવીર સ્વામીના આઠમા પદ્ધતર ગચ્છનાયક હતા. તેમના પ્રતિ-
ઓધથી ઓધ પામેલા મહાન् સંપ્રતિએ જૈન ધર્મ માટે શું નથી કર્યું?

કૃતિહાસનો બારીક અભ્યાસ કરનાર કોઈપણ જૈન નામધારી
ઘ્યક્તિ મહાન् સંપ્રતિથી અજણું તો નજ હોય, આને પણ
જૈનોમાં એ મહાન् સંપ્રતિનું પુણ્યવંત પ્રાતઃસ્મરણીય નામ ધેરધેર
ગવાય છે. એનું કારણ શું? આપણા ઉપર-જૈનો ઉપર એમના ઉપકારો
અગણીત છે. જૈન મંદિરો, જરૂર્ણ્ણકારો, જિન પ્રતિમાઓ તેમજ ચતુ-
વર્ષધ સંધના ભક્તિ કરીને એમણે આપણું ઉપર કાંઈ થોડો ઉપકાર
કર્યો નથી. જૈનધર્મના સંપૂર્ણ ગૌરવને વધારનાં એ પવિત્ર પુરુષનું
કથાનક આ નલ્લકથામાં તમે જોશો!

પોતે અહિસાના ઉપાસક છતાં એમણે ત્રણું ખંડ પૃથ્વીને તાથે
કરી સોળહનલર રાજાઓને પોતાના સામંત બનાવ્યા હતા. વાસુદેવ નહીં
પણ વાસુદેવ સમાન ત્રણું ખંડના ધર્ણી મહાન् સંપ્રતિનાં એમે વિરોધ
શું વર્ણન કરીયે! આ નવલકથા વાંચશો ત્યારેજ એમના પરાક્રમ તેજનું
વાંચકને ભાન થશો. કે બાસ્યાવસ્થામાંથીજ એમનાં બળ, પરાક્રમ,
આતુર્ય અદ્ભુત હતાં. બધે હનલર વર્ષના વચ્ચમાં થર ચડી ગયા છતાં
હજુ જાણે ગઈકાલેજ થઈ ગયા હોય એમ આખી જૈન કોમ એમના
ગુણુંઘામ કરે એ પુરુષપુંગવ સાધારણુંતો ન હોય.!

એમના અનેક ઉપકાર તળે દખાયેલી જૈનપ્રગણ-આપણે એમને
માટે જેટલું કરીયે એટલું થોડુંજ કહેવાય. છતાં કુલ નહીંતો પુલની
પાંખડી અર્પણું કરીને પણ આપણે એમની તરફ આપણું લક્ષ્ણ પ્રગટ
કરવી જોઈએ એ ઉપકારક પુરુષનું નામ સ્મરણું, કૈતિહાસિક જીવન
જગતના ચોડમાં હમેશાં કાયમ--અવિચિળ રહે એ માટે આપણે કાંઈક
કરતું જોઈએ. તમારી અમારી સર્વ કોઈના એ પવિત્ર ઇરજ હોવાય.

મહાન् સંપ્રતિ એ મહાન् પુરુષ મૌર્યવંશમાં થયેલા હેતાથી ધતિ-
હાસને અનુદ્ધક્ષીને મૌર્યવંશીય પ્રથમ પુરુષ ચંદ્રગુત્થી લઈને બિંદુ સાર,
અર્થેપણ, કુણ્ણાલ ને સંપ્રતિ સુધીનો ધતિહાસ આનવલ કથામાં રસ ભરી
શૈલીથી તમારી આગળ પ્રગટ થશે ચંદ્રગુત્થેતને વિષમ સંલેગોમાં રાજ્ય
મળતું તેનો પ્રધાન ચાણુાક્ય ખાલણું હોય છીં નૈન ધર્મ ઉપર તેની
અચળાંદ્રા, એની ચતુરાદ, રાજ્ય ચલાવવાની કુનેહ, એનાં અદભૂતકાર્ય
એ અધું સંવિસ્તર આ ધતિહાસમાં રણું થશે. તેમજ બિંદુસાર એના
સમયમાં ખાપટને અગે ચાણુાક્યે કરેલું અનશન, બિંદુસારનો પઢાતાપ
તેમજ અશોકનાં અદભૂત પરાક્રમો કાર્યોની સંકલના પણ અમે જળવી
રાખી છે. કે જેથી વાયક આ નવલકથામાં રસપૂર્વક ભાગ લઈ રહે.
અશોકનો પુત્ર કુણ્ણાલ, ખાળપણુમાં એને મળેલી યુવરાજપદ સહિત અવ-
તિની સમૃદ્ધિ, સાવધી માતાતું જોર, એ ધર્મને પરિણામે ખાળકુણ્ણાલને
અધત્વ, સત્રાદ અશોકને સંતાપ, કુણ્ણાલના સહનશક્તિ એની પ્રલુબ્ધકિત
અને છેવટે કુણ્ણાલના પતિન શરદકુમારીથી થયેલો મહાન સંપ્રતિ
નો જન્મ, કુણ્ણાલનું ગવૈયાના વેશમાં પિતાના દરખારમાં આવતું, સત્રા
ટના વરદાનમાં રાજ્યની માગળી, એ બાદ સંપ્રતિનો પિતામહે કરેલો
રાજ્યાલિષેક, અપરમાતાની નિરાશા, ખાપટ, પ્રપંચ અને એનું પરિ-
ણ્ણામ, આખરે દુઃખમાંથી સુખ થતાં થયેલો ધર્મનોજ્ય અને અન્યાયને
માર્ગ ચાલનારાઓને શિરપાવમાં મલેલી નિરાશા એ સર્વે તમને આ
નવલકથામાંથી પ્રામ થશે.

સંપ્રતિ ચરિત્ર, પરિશિષ્ટ પર્વ, ઉપદેશપ્રાસાદ, નૈન પ્રાચિન અવા-
ચિન ધતિહાસ, નૈન ધર્મનો પ્રાચિન ધતિહાસ, વગેરે અનેક ઐતિહાસિક
પુસ્તકોના આધારે આ કથા લખાયેલી છે.

ને મહાન સંપ્રતિને ધેર ત્રણ ખંડનું સાખ્રણ્ય છીં નૈનેતર ઐતિ-
હાસોમાં તો એમનું નામ પણ જોવાતું નથી. મહાન, અશોક, ચંદ્રગુત્થ,

મહાન સિકંદર, મહાન નેપોલિયન આદિ પુરખો કરતાં પણ જેમણે પોતાના પરાક્રમથી તણું ખંડ પૃથ્વી જીતી હતી, તેની કાંઈ પણ રૂપરેખા ધૂતિહાસના પાને સુવર્ણુ અક્ષરે ન ડેતરાય એતો શોચનાય કહેવાય. માટે એ નરશૈષ્ઠનું જીવન ધૂતિહાસ રૂપે હમેશાં જળવાઈ રહે, સમાજ એના કર્તવ્યથી સત્તાથી અને વૈલબ્યથી માહિતગાર થાય એટના માટેજ આ પ્રયાસ છે. તે સિવાય પ્રસંગને લગતો ખીંચે પણ ધૂતિહાસ નમને આ નવલક્ષ્યાભાં દ્રષ્ટિએ પડશે.

આ નરમાતાઓ પોતાના સ્વાર્થને માટે કેવી ખટપદો કરે છે; છતાં અનીતિનું પરિણામ પણ તેવું જ ભોગવતું પડે છે. અને સત્યનો આ ખરે વિજય થાય છે. જૈનેતરો અહિંસાને ભારતની પરાધિનતાનું કારણુંમાનીને આજે એને કંવખોડી રહ્યા છે પણ ચુસ્ત અહિંસાવાદીઓ દ્વારા સાગર છતાં પોતાની સમશેર શરૂઆતે માટે હમેશાં ખુલ્લીજ રામે છે. શરૂઆતી મધ્યમાં નિડર પણે ચુભીને શરૂ સૈન્યનો નાશ કરે છે. અહિંસાવાદી ચુદ્ધિમાં પાછી પાની કરતા નથી એ અધું આ ધૂતિહાસથી સ્પષ્ટ થશે.

અહિંસાભાં ચુરત છતાં પણ જૈનૌનાં પ્રાચિન તેજ-ગૌરવ-પ્રભાવ આજે લગભગ નાણ થયાં છે. જેથી આવાં ધૂતિહાસમય દ્વારાનુકોયી નાણ પ્રાય થયેલાં જીવન નવપક્ષવિત થાય, પ્રાચિન ડાલની એ પ્રતાપમય ભાવના દરેક જૈન બંધુઓભાં સતેજ થાય અને એમની દાઢિ વિશાળ અની ફરીને જીવનમાં નવ જીવન પ્રગટે ! એજ હૃદયગત ભાવના સાથે વિરભું છું.

લેખક —



વિષયાનુક્રમણીકા.

નંબર.	વિષય.	પૃષ્ઠ.
૧ લું.	આળ યુવરાજ ...	૧
૨ લું.	તિષ્યરક્ષિતા ...	૮
૩ લું.	નંદનાચાર્ય. ...	૧૫
૪ લું.	રાજસભામાં ...	૨૧
૫ લું.	સાવકી માનો રનેલ.	૨૮
૬ લું.	પૂર્વ પરિચય ...	૩૫
૭ લું.	ધતિહાસ પરિચય.	૪૭
૮ લું.	ચાણુાકચની ચતુરાધ.	૫૫
૯ લું.	ચંદ્રશુમ.	૬૬
૧૦ લું.	ભુલનો ભોગ ...	૭૬
૧૧ લું.	મહાનુ અશોક.	૮૭
૧૨ લું.	અવિતબ્યતા. ...	૮૫
૧૩ લું.	મતલખની મોહમાં.	૧૦૭
૧૪ લું.	એકજ ભૂલ. ...	૧૧૫
૧૫ લું.	પરિવર્તન. ...	૧૨૪
૧૬ લું.	એ ચંદ્ર તે કોણ ! ...	૧૩૧
૧૭ લું.	કુણુલની પ્રલુ લક્ષિત. ...	૧૪૩

,, ૧૮ મું.	એક લિખારી.	૧૫૦
,, ૧૯ મું.	આશાનું એક કિરણ.	૧૫૮
,, ૨૦ મું.	આશાને હિંડોળે.	૧૬૬
,, ૨૧ મું.	અંધ સિતારવાળો.	૧૭૪
,, ૨૨ મું.	ઘેંચાઘેંચ.	૧૮૪
,, ૨૩ મું.	કાળી રાતે.	૧૯૩
,, ૨૪ મું.	પરિણામ.	૨૦૦
,, ૨૫ મું.	પશ્ચાત્તાપ.	૨૦૮
,, ૨૬ મું.	ખાળ તેજ.	૨૧૭
,, ૨૭ મું.	વિશ્વ વિજયીનાં માતાને નમન.	૨૨૩
,, ૨૮ મું.	આર્થસુહસ્તિ સ્વામી	૨૩૦
,, ૨૯ મું.	જીવંતસ્વામી....	૨૩૭
,, ૩૦ મું.	રથયાત્રામાં	૨૪૬
,, ૩૧ મું.	હવે મારે શું કરવું જોઈએ ?	૨૫૨
,, ૩૨ મું.	ફુનિયા ધર્મને માર્ગે.	૨૬૧
,, ૩૩ મું.	ગનેંદ્રતીર્થમાં આર્ય મહા ગિરિ સ્વર્ગે.	૨૬૮
,, ૩૪ મું.	ગનેંદ્રપદ તિર્થ.	૨૭૪
,, ૩૫ મું.	કંદ્ધક નવાજૂની (ધુગ પ્રધાનો)...	૨૭૮
,, ૩૬ મું.	અલંતી પાર્વિનાથ	૨૮૩
,, ૩૭ મું.	અખંડિત આગ્ના	૨૮૮
,, ૩૮ મું.	ઉપસંહાર	૩૦૩



જૈન સસ્તી વાંચનમાળાનું નામ—

દરેક જૈન ભંડુઓની જાણુમાં છે કે, અમોએ સં. ૧૯૭૮-૮૦-૮૧ તથું વર્ષનાં પુસ્તકો વાર્પિક રા. એમાં પાંચસો પાનાના લીસાએ આહકોને આવ્યાં છે. દીવસે દીવસે આહકોનો વધતો જતો સંતોષ અને ઉત્તરોત્તર પ્રગટ થતાં ધતિહાસીક ઉત્તમ પુસ્તકો હવે દરેકના જાણુવામાં આવ્યાં છે. (સં. ૧૯૮૨) થી અમોએ રા. ૩) માં ૮૫૦ પાનાનાં પુસ્તકો આપવાનું નકી કર્યું છે અને તેથી હવે દરેક જૈન ભંડુ આ લાભ લેવા નહિ ચુકે એવી આશા છે.

સં. ૧૯૮૦-૮૧ નાં આઠ પુસ્તકો નવા થનાર આહકોને શીલકભાં હણો. સાં સુધી તેજ લવાજમમાં ભળશે.

સં. ૧૯૮૧ નાં પુસ્તકો—	પૃષ્ઠ.	કિમત.
૧ શ્રી સિદ્ધસેન દિવાકર યાને વિક્રમના સમયનું હિંદ. ...	૩૦૪	૧-૮-૦
૨ શ્રી સંખેશ્વરા પાર્શ્વનાથ ચરિત્ર. ...	૧૫૬	૧-૮-૦
૩ શ્રી કેશીમુનિ અને પ્રદેશી રાજા. ...	૧૦૦	૦-૬-૦
	૬૬૦	૩-૬-૦

સં. ૧૯૮૨ નાં પુસ્તકો—

ગાઈ સાલમાં વધુ અપાયેલાં પૃષ્ઠ—	૧૫૦	૦-૮-૦
૧ જૈતોના મહાન રત્નો.	૧૬૦	૧-૦-૦
૨ શ્રી બંધુપલદુસ્કુરિ અને આમરાજ ભાગ ૧ લો. ...	૨૬૦	૧-૮-૦
૩ મહાન સંપ્રતિ અને જૈન ધર્મનો દિગ્વિજય. ...	૨૮૦	૧-૮-૦
	૮૫૦	૪-૮-૦


લખો:—જૈન સસ્તી વાંચનમાળા

રાધનપુરી બનાર—ભાવનગર.

અમારાં ભીજાં નિત્યનાં ઉપ્યોગી પુસ્તકો તેમજ બ્રહ્માવના કરવા લાયક પુસ્તકો.

૧	પાંચપ્રતિક્રમણુ પોકેટ સાઈઝ પૃષ્ઠ ૩૦૦ કિમેત સી નકલના પાડું રેશમી પુદું નવસમરણ ઉપરાંત ભીજાં સ્લોટ્રો છદ્રો રાસ સાથે. ૦-૧૦-૦ ૫૦-૦-૦
૨	આત્મવીરની કથાએ (વાંચતાં જ છદ્યમાં ધાર્મિક સંસ્કારની છાપ પાડનારં રસીલી ભાષામાં લખાયેલું)....	... ૦-૫-૦ ૨૦-૦-૦
૩	જૈન નિત્ય પાઠ સંઅઙ્ગ નવસમરણ ઉપરાંત ભીજાં સ્લોટ્રો છદ્રો રાસ વિગેરે સાથે.	૦-૩-૦ ૧૨-૮-૦
૪	વિજય શોઠ અને વિજયા શોઠાણી.	૦-૪-૦ ૧૫-૦-૦
૫	ધલાયચી કુમાર ચરિત્ર.	૦-૩-૦ ૧૦-૦-૦
૬	અરણિક મુની	૦-૩-૦ ૧૦-૦-૦
૭	સ્નાતપૂજા પંડિત શ્રી દેવચંદ્ર કૃત તથા અષ્ટ પ્રકારીપૂજના દોહા.	૦-૨-૦ ૧૦-૦-૦
૮	શ્રી પાંચપ્રદીપની અનુપૂર્વિ.	૦-૨-૬ ૭-૦-૦
૯	શ્રી પુણ્ય પ્રકાશનું સ્તવન.	૦-૧-૦ ૫-૦-૦
૧૦	જૈન નિત્ય સ્મરણમાલા.	૦-૨-૦ ૦-૮-૦
૧૧	રત્નાકરપંચચીરી.	૦-૦-૬ ૨-૮-૦
૧૨	પર્વનિધિ વિગેરેના ચૈત્યવંદનાદિનો સંઅઙ્ગ. (સાધ્વીશ્રી લાભશાળવાળું)	૧-૪-૦
૧૩	શ્રી આહિનાથ ચરિત્ર ભાષાંતર પાડું રેશમી પુદું. (વાંચન માળાના ગ્રાહકને સં. ૧૬૮૦ માં અપાયેલું.)	૧-૮-૦

લખો:—જૈન સસ્તી વાંચનમાળા
ગ્રાહનપુરી અનાર—ભાવનગર.



॥ॐ ह्रीं श्रीं पार्वनाथाय नमः

મહાન् संપ्रति

अथवा

८८. ધર્મનો હિન્દુજ્ય.



પ્રકરણ १ લું.



આળ યુવરાજ.

સમય પ્રાતઃકાળનો હોવાથી અત્યારે એ ઘોડેસ્વારે।
પ્રભાતની ખુશનુમા હુવાનો ઉપલોગ કરતા નગર અહુદા
ચાલ્યા જતા હતા. એ ક્ષીપ્રા નહીનાં શુભ્ર જલ પેતાની રૂપેરી
ચાદર ખીછાવી પ્રેશુકનું આકર્ષણું કરી રહ્યાં હતાં. એક બા-
નુએ નહીનો વિશાળ પ્રવાહુ, ખીણ તરફ નાના મોટા તરવ-

રેથી રમણીય થયેલો આ રમણીય પ્રદેશ ઘોડેસ્વારેને આનંદ જનક હતો. અશ્વો પણ જાણે સુખરસીદીયા થયા હોય એમ શીતલ વાચુની લહેરો અનુભવતા મંદમંદ ગતિએ ચાલતા હતા. બન્ને અશ્વો એક સરખા હેખાતા હતા. એક અશ્વ ઉપર પ્રૈઠ વયનો પુરુષ બેઠેલો હતો, જ્યારે બીજા અર્ધ ઉપર સાત વર્ષનો બાળક હતો. સાત વર્ષની નાની ઉમર છતાં એની ચાલાકી અદ્ભૂત હતી. એ બાદ્ય તેજનો પ્રભાવ અપૂર્વ હતો, એનામાં બાદયોચિત તોઝાન, મસ્તી, હુકમ કરવાની ટેવ આદિ અંકુરાચો અત્યારથી પ્રગટ થયેલા પ્રત્યક્ષ હેખાતા હતા. એ પ્રૈઠ માણુસ સાથે બાળક અનેક પ્રકારની વાતો કરતાં નવું નવું પૂછતો હતો.

“ આ અવંતી પણ અમારા નગર જેવું છે. કેવું સુંદર શહેર છે ? ” એ બાળકે આનંદ ભર્યા ઉદ્ગાર કાઢ્યા.

“ હા ? ચુવરાજ ! શા માટે આ શહેર સુંદર ન હોય ! આ શહેર માળવ દેશનું તિલક ગણ્યાય છે. ને એની રાજ્યધાની પણ આ અવંતીજ ! લક્ષ્મી અને માળવાની સુંદરતાનું આ શહેર મુખ્ય સ્થળ છે. ” એ પ્રૈઠ પુરુષે કહ્યું.

“ બાપાજીએ મને અહીંયા મોકદ્યો એ ઢીકજ કર્યું છે. આવો આનંદ મને ત્યાં કે બીજે કૃયાંય પડત નહીં, મને રોજ અહીંયા કુરવા આવવાનું બહુ ગમે છે. અશ્વ હોડાવવો, તલવાર ફેરવવી, તીર ફેંકવાં, હોડવું, કુસ્તી કરવી વગેરે રમતોમાં પણ રસ પડે છે. ” બાળકે કહ્યું.

“ ચુદ્ધ કરવાની રમતો તમારે ધ્યાન આપીને શીખવી જોઈયે. ચુવરાજ ? તે સાથે થાડુંક ભાણુતાં ગણુતાં પણ હવે તમારે શીખવું જોઈએ. પુરુષે તો કલમ, કડછી ને બરછી એ ત્રણે કળામાં પ્રવીણુ થવું જોઈએ. ”

“ એટલે એ કઈ તણુ કણા ! કાકાજી ? ”

“ કલમ એટલે ભાણવા ગણુવાની કણા, પુરુષે લખતાં વાંચતાં અવશ્ય શીખવું. તેમાં વળી તમારે તો ખાસ શાસ્ત્રનો અભ્યાસ હવે કરવો જોઈએ. જેને રાજ થવું હોય એ જો કેણાવાયેલ ન હોય તો એના રાજવહીવટમાં ઘણી ખામીએ. આવે છે. ભાણવાથી બુર્ઝિ ખીલે છે. રાજ પ્રણ ઉલયનું હીત સમજી શકાય છે. ખામીએ સુધારી શકાય છે. રાજ્ય અને પ્રણની ઉત્તતિ કરવામાં શાસ્ત્ર ઘણું જ સહાયકારક બને છે. કડછી એટલે પુરુષે રાધણુ કળામાં પણ હેંશીયાર થવું આવશ્યક છે.”

“ પુરુષે રાંધવું ? રાંધવું એ તો સ્વીએનું કામ છે. ” ભાલકે એમ કહીને મોં મચ્કોડયું અને હુસ્યો. “ તમે આવી નિર્માલ્ય વાત શું કરો છો ? કાંઈ શૂરવીરતાની વાત કરો તો ગરૂમત પડે ? ”

“ એ પણ ખરું ! બરછી એટલે તલવાર, ભાલો, તીર, વગેરે ફેંકતા પણ આવડવું જોઈએ. એ ચુદ્ધ કણા તમને શીખવામાં આવે છે, જેમ જેમ મોટા થશો એમ તમે એ ચુદ્ધમાં પારંગત થશો. તમે નિર્માલ્ય થધ જશો. તમે બાળક છો તેથીજ

કડથીનું મહત્વ તમને સમજાતું નથી. પણ પ્રસંગ આવતાં એની પણ કેટલી જરૂરીઆત છે, તે કોઈક જ સમજ શકે ? ”

“ હા. લડવું, મારામારી કરવી, ખીજને દખાવી હેવો એવું એવું તો મને અવશ્ય ગમે. એ શાસ્ત્રોની કળા શીખતાં તો મને કેવો આનંદ આવેછે; એની તમને શી ખખર પડે ? ”

“ ત્યારે શાસ્ત્રનો અભ્યાસ પણ તમને ગમતો નથી શું ? ”

“ હું ભાણીશ પણ..... ”

“ તો સારું ! મહારાજની રજા મંગાવી તમને લાણા-વાની શરૂઆત કરશું ? ”

“ તે તો ઠીક....પણ આ નહીંમાં આપણે નહાશું. રમ-વાની પાણીમાં લારે મજા પડશો. ”

“ અત્યારમાં શું નહાવું ? વળી હજુ તમને તરતાં ખરૈ-ખર આવડતું નથી ને ચા નહીનાં પાણી તો ઉડા રહ્યાં. ”

“ તે હું તો અવશ્ય નહાવાનો ! મને તરતાં આવડે છે, આપણે થોડી વારમાં નહાઈને પાછા ફરશું, અત્યારમાં નહાવાની કેવી ગમત પડશો ? ” ખાલકે પોતાનો અશ્વ થોલાવ્યો.

“ ચુવરાજ ? નહાવું હોય તો લક્ષે પણ અહીંથા જળ સાથે મસ્તી કરવી એ ઠીક નથી. તેમાંચ ચા. પાણી અતિશય ઉડાં ? આપણે આરે જઇયે ત્યાં તમને નહાવાની ખૂબ મનાપડશો. ”

“ ઠીક ત્યારે આરે ચાડો ? ” ચુવરાજે પોતાનો થોડા

પાછો ક્રેરવ્યો. એની પછવાડે એ પ્રોફ સ્વાર પણું પાછો કર્યો. કેાદ પણું રીતે ચુંબરાજનું ચિત્ત પ્રસન્ન રાખવું એ એનું કર્તાવ્ય હતું. કુંબરની ગમે તેવી ઉદ્ધતાદ હોય, મદ્દતી હોય, પણ સ-મળવીને કે બીજી દિશામાં એનું મન વાળીને એને હુમેશાં પ્રસન્ન રાખી એનું મન કેળવવું એ એનું તેમજ બીજા અનેક પુરુષોનું કર્તાવ્ય-કર્મ હતું, હતાં એ બાળયુવરાજના સંસ્કરોજ એવા હતા કે “હું રાજ છું ? આ બધા મારા સેવકો છે ?” જેથી એ કેાદને પણું ગણુતો નહીં. અનેક ખીચો, અનેક દાસદાચીઓ, અનેક પુરુષો એને પ્રસન્ન રાખવાને અહુનીંશ આતુર હતાં, સુંદર શરીર અને બાદયોચિત આ-નંદી સ્વભાવને લીધે ખીચો તેમજ પુરુષોને તે એક સરખો પ્રિય થઈ પડ્યો હતો. બીજી તરફ એના જીવનને કંઈપણ ઉની આંગ આવે તો એના એકના જીવન પાછળ હળવૈ જીવેનો લોગ હતો, એમ તેઓ સમજતા હતા. કંઈક રાજ-ભયથી, કંઈક સ્નેહથી, યુવરાજના જીવનની સલામતી માટે સર્વ કેાદ એક સરખાં આતુર હતાં.

પાછા ક્રેલા એ બોાદેસ્વારો મંહમંદ ગતિએ આરા તરફ ચાદ્યા. એ બાળક વચ્ચમાં અનેક પ્રકારના પ્રક્રિયાઓ પૂછતો. બાદ્યકીડાથી અનેક કુતુહલ કરતો કેાદ વખત એ પ્રોફ પુરુષનું માથું પણું પકવતો. આરે આવ્યા એટલામાં કુમારનો વિચાર કર્યો. અત્યારમાં અસંખ્ય માણુસો આવ-જાવ કરી રહ્યાં હતાં. અનેક તરણું ચુવતીઓ પાણીનાં બેડાં લઇને સખીઓ સાથે વાતો કરતી ગમના ગમન કરતી જોવાતી.

શાંતિનું સામ્રાજ્ય હોવાથી શહેર આનં દમાં મસ્ત હતું. શહેરનાં તેજ, જૈરવ, રૂપ એનું સૌંદર્ય આકર્ષણું કરી રહ્યું હતું. એ ખંડું આ ઘોડેસ્વારે જોતા પસાર થતા હતા. એ કુદરતી સૌંદર્યો એમનાં દિલ પ્રસન્ન કર્યા હતા.

“ કાકાળ ? ચાલો પાછા ફરીયે ? ” કુમારે કહ્યું.

“ કેમ ? નહાવાનો વિચાર નથી કે શું ? ” એ ગ્રોફ પુરુષે જણ્ણાંયું.

“ નહીં ! નહીં ? દિવસ બહુ ચરી ગયો છે. આપણે કીલ્લામાં જવું જોઇએ. ”

“ જેવી તમારી મરણ ? ”

નગરના નાના મોટા દરેક માણસો એ ઘોડેસ્વારોને નમન કરી વિનય પૂર્વીક માર્ગમાંથી ખસી જતા. સીપાઈએ, તથા અધિકારી વર્ગ લશકરી દ્વેષે સલામતી આપી એમની પ્રસન્નતા મેળવવાને ઉત્સુક રહેતા. ખન્નેના પોશાક રાજવંશીઓ છતાં કુરવા જવાના જેવા શીકારી હતા. નગરના મુખ્ય દરવાજામાં પ્રવેશ કરી તેએ સાથે સાથે પોતાના કીલ્લામાં ચાઢ્યા ગયા.

એ ગ્રોફ પુરુષ તે અવંતીનો હકેમ માધવસિંહ હતો. હાલમાં ટેટલાક વખતથી તે મગધેવર અશોક સમ્રાટનો માધવસિંહ સામંત ગણુંતો હતો, નિયમીત રીતે મહારાજ અશોક તરક્કથી અવાર નવાર કારલારીએ-હકેમો બહલાતા હતા.

આલકુમાર તે મગધાધિપ મહારાજ અશોકનો પુત્ર

કુણુલા હતો. કુણુલને જનમ આપતાંજ એની માતા મરણ
પામી હતી. જેથી કુણુલપુત્ર ઉપર મહારાજની અતિ દૃપા
વરસતી હતી. રાજ્યનો વારસ કુણુલહોવાથી ખાદ્યાવસ્થામાંજ
મહારાજે કુણુલને યુવરાજ પદવી આપી દીધી. એ દીર્ઘ દર્શી
મગધેશ્વરે વિચાર્યુ કે, “હું રાજ્યવ્યવસાયમાં પડેલો હોવાથી
આ નમાયા કુંવરની સંભાગ રાખી શકીશ નહીં. આ ખાગક
રાજ્યનો વારસ હોવાથી સાવકી માતાઓને આંખમાં કણુની
માઝક ખુંચતો હુશે. અને કદાચ એ સમયનીજ રાહ જોતી
હુશે તો મારી ગરૂલતીને લાલ લઈ રખેને ખાળકના જીવનને
વિનિવર કરે ! મારે એ સાવકી માતાઓથી પુત્રને ફૂર રાખવો
જોઇએ.” ઈત્યાહિક વિચાર કરીને અશોક રાજીએ કુણુલને
ચતુરંગી સેના સહીત અને વિશ્વાસુ પ્રધાનો સાથે ઉજા-
યિની મોકલી આપ્યો. દેવતાની માઝક કીડા કરતાં યુવરાજ
કુણુલ અવંતિમાં રહીને સુખપૂર્વક પોતાનો કાલ નિર્ગમન
કરતો હતો. એ યુવરાજ ઉપર નિયમિત રીતે સગ્રાટ પોતાના
હૃથથી કાગલ લખીને એની તરફનું પોતાનું જહાલ ખતા-
વતો. આજ કેટલાય વર્ષોથી કુણુલ અવંતિમાં કાલ નિર્ગમન
કરતો હતો, અનુકૂમે એની ઉમર આડ વર્ષની થઈ.

કુમારની લણવા યોગ્ય ઉમર થવાથી પ્રધાનોએ મગધે-
શ્વરને કુંવરની હુકીકત લખી જણુવી ખુશી અખરના સમા-
ચાર આપ્યા.



પ્રકરણ ૨ જી.

તિષ્યરક્ષિતા.

“ ખાઈ સાહેબ ! આપ ગુસ્સે ન થાવ તો એક વાત કહું ! ” એક દિવસે એકાંતને અવસર મેળવીને એક દાસીએ પોતાની ખાઈને કહ્યું.

“ શી છે તારી વાત ! ” બેદરકારીથી એ શેડાણી બોલી.

“ આપ આજ કેટલાક દિવસથી આમ ઉદાસ જણ્ણાઓ છો. મર્નમાં જાણે કંઈ શાલ્ય ભરાયું હોય એમ આપના હૃદયની કંઈ ખણર પડતી નથી. એ શું ? ” દાસીએ કહ્યું.

“ તારે તેનું શું કામ છે ! તારે દાસી માણુસને વળી મોટાઓના કામમાં માથું મારવાની પંચાત શી ! ”

“ ખાઈ ! તમારું કોઈ કાર્ય બન્નવી તમારું નિમક હું હુલાલ કરી શકું. તમને મારાથી બની શકે તો હું મદદ આપી શકું ! ”

“ તું મને મદદ આપી શકે ! તારે વિશ્વાસ શો શ્યામા ? ”

“ વિશ્વાસ તો અમારામાં રાખવોજ જોખાએ. આજ સુધી તમારી સેવા કરી છતાં તમે અમારું હૃદય ન પારખી શક્યાં એ પણ અમારી કમનશીખીજને ! ” કંઈક નારાજ થતાં શ્યામા બોલી.

“ શ્યામા ! શ્યામા ! તું એટલુંચ નથી સમજતી, પેલી રંડ છોકરો સુકીને ભરી ગઈ. હુમેશની મને ભારતી ગઈ. ગરીબ બિચારો મારો મહેંદ્ર ? ” એ ખાંગએ નિર્વાસભર્યા ઉદ્ગાર કાઢ્યા.

“ મેં પણ એજ અટકળ કરી હુતી. કે એ શોકયે મરતાં મરતાં પણ વેર વાળ્યું. બાઈજી એ નમાયા છોકરા ઉપર મહારાજના ચારે હૃથ છેની ? ”

“ અરે ! શું કરીએ આપણે, કે મહારાજે એને અવંતી મોકલાવી દીધો, નહીતર કયારનોય એની મા પાસે મોકલાવી દીધો હોત ! મારા મહેંદ્રનો માર્ગ નિષ્કંટક કર્યો હોત ? ”

અને એ તમારા પુણ્ય કામમાં હું પણ નિમક હુલાલીથી તમને મદદ કરત, બાઈજી ! ” શ્યામ આચરણવાળી શ્યામાએ ખગતામાં ધી હોમી ઉત્તેજન આપ્યું.

“ છતાં જે મને તક મળશે તો ભલેને ઉજજયિનીમાં રહ્યો; અહી એઠાં એઠાં જ્યારે હું એને રાજ્યબ્રાહ્મ કરીશ ત્યારેજ મને જંપ વળશે. ”

“ આપનું કથન સર્વથા સત્ય છે બાઈ સાહેબ ! જોયુંને રાજ્યએ બચપણુથી એને યુવરાજ પદવી આપીને રાજ્યનો વારસ બનાવ્યો છે તે ? આપ મહારાજને સમજવી શકતાં નથી શું ? ”

અરે હું તો વાત વાતમાં ઘણીય વખત મહારાજને મો-હુભાણુમાં મુંઝવી કામ કાઢી લેવા સમયની રાહ જોઉં છું.

પણ મહારાજ સમને ત્યારે ને ? બીજુ બધી વાત સાંખળે,
પણ એ કુણાલની વાત આવે ત્યાં બસ્ત ધ્યાનજ ન આપે ? ”

“ એક દિવસ ખૂબ્ પ્રેમ બતાવી ઘાયલ કરી કામ કાઢી
દ્યોને બાઇ ? પ્રેમમાંને પ્રેમમાં એક વખત કખૂલ કરી જાય
પછીતો જગ જીત્યા ? પ્રયત્ન છોડવો નહીં. જેવા તમે અત્યારે
મહારાજનાં માનિતાં છો એવીજ રીતે રાજમાતા થવાનું
શું તમને નથી ગમતું ? અત્યારથી જે નહીં ચેતો તો એ
શોકયના પુત્રના તિરસ્કારથી ફેંકેલા રોટલાના ટુકડા પર એક
દિવસ તમારે પરાધિનપણે જીવન શુભરવું પડશો ને
તમારા મહેંદ્રની તો કોણ જાણે શું હાલત થશો ? ”

એ બધુંય હું સમજું છું તેથીજ હુમેશાં જગૃત-
સાવધ છું. મહેંદ્રને રાજ્યનો વારસ ઠરાવવાના હું અનેક
પ્રયત્નમાં છું, ક્રક્તા સમયનીજ રાહ જોઉં છું. ”

“ પ્રભુ ! તમારા એ મુખારક કામમાં સહાય થાવ !
તમારી મનોકામના પૂર્ણ થાવ ! ”

“ હું રાત દિવસ એજ પ્રયત્નમાં છું કે રાજને કેવી
રીતે સપડાવી દઈ માર્દ કામ કાઢી લઈ ? આહા ! શું
રાજ તે જાણે એને જોઈને—એની પાછળ દિવાનો અન્યો છે.
એટલે કુર એ સુવોછે છતાં કેટલી બધી કાળજ રાજે છે. ગરીબ
મારો મહેંદ્ર ! એનો અર્ધ સ્નેહ પણ મારા દિકરા ઉપર કોઈ
દી બતાવ્યો છે ? શું એ બધું હું મૂર્ખ છું કે ન સમજું ?
પણ વખત આવ્યે વાત ! ” તિરસ્કાર પૂર્વક રાણી હોલી.

કંઈક કોધથી કંઈક તિરસ્કારથી એનું સુંદર શરીર કંપતું હતું, એ ગૈર વદન ઉપર કોધની રક્તવણીંય છાયા છવાઈ રહી હતી. ને શ્યામ મુખવાળી શ્યામા પોતાની શેડાણીને હુઃખમાં દિલાસો દ્ધ રહી હતી.

મગધની તે સમયની સર્વ શોલાના સ્થાન રૂપ, સમય ઐશ્વર્ય યુક્ત એવા પાટલીપુત્ર નગરના એક વિશાળ અને સ્વર્ગના વિમાનનો પણ તિરસ્કાર કરતા હૃદભુવનમાં અલ્યારે આ ખને સ્થીએ બેડી બેડી વાતો કરતી હતી. હુનીયાની રૂપ-વતી સ્થીએના મહને મહીન કરનારી એક સ્થી તો મહારાજ અશોકની માનિતી તિષ્ઠરક્ષિતા હતી. ભારત સામાદ મહારાજ અશોકની માનિતી પુત્રવતી છતાં બિચારી હુઃખી હતી. એ અવળચંડુ વિધિ સર્વ સુખમાં પણ કંઈને કંઈ વિઘ્ન ઉપસ્થિત કરી મનુષ્યના જીવનની મરફતી કરે છે. મગધરાજ અશોક નૃપતિને ધણી રાણીએ હતી. એમાં આ તિષ્ઠરક્ષિતા મુખ્ય હતી. મહારાજ ઉપર પોતાના રૂપથી, ચાતુર્યથી ને :હાવલા-વથી જે પ્રલાવ પાડી શકતી એવું કૌશલ્ય અન્ય રાણીઓમાં નહોતું. જેથી મહારાજને પ્રાણુથી પણ અધિક પ્રિય હતી. રાજ્યકાર્યના પ્રસંગે પણ એને પૂછતા, એની સલાહ લઈને કાર્ય કરતા. એ માનિતીની પ્રસભતા માટે મહારાજ શું ન કરતા? છતાં એ કુટિલ રાણીને સંતોષ થતો નહીં. કેમકે એનું લક્ષ્ય જુહુજ હતું. એ લક્ષ્યબિંદુ હજુ સુધી માનિતી છતાં મહારાજ પાસે સિંદ્ર કરાવી શકી નહોતી. અધી વાતોમાં એની મરજુ સાચવનારા મહારાજ કુણુલના

સંખંધમાં એણું જે વાત કરતી તે બધી સાંભળી એનો સ્વાર્થ કર્ણી જતા જેથી એ નમાયા બાલકના સ્વાર્થને કંઈ ઉની આંચ ન આવે એ માટે મહારાજ ખૂબ ધ્યાન રાખતા હતા.

મહારાજ અશોકને કુમારોમાં કુણાલ જેમ અવંતીમાં પિતાના પસાયથી અમનયમન કરતો હતો, બીજે પુત્ર મહેંદ્ર પણ એનાજ સરખી ઉમરનો તિષ્યરક્ષિતાનો પુત્ર હતો. તે સિવાય બીજી પણ પુત્રો હતા. તેમજ સંધમિત્રા નામે પુત્રી પણ હતી. રાજકુમાર મહેંદ્ર માતાપિતાની છાયામાં ઉછરીને માટે થતો હતો. માતાપિતાનો એ લાડકો બાલક, બાલક છતાં તૌક્ષાન-મસ્તીમાં અગ્રેસર હતો.

એ તિષ્યરક્ષિતાનો સ્વભાવ પ્રથમથી જ ઉચ્ચ હતો, રાજકાજમાં પણ માશુ મારીને પોતાનું ધાર્યું કરાવતી. આજે એના સ્વભાવને પોષણું કરનારું એક મહાન કાર્ય એની નજર આગળ ખડું થયું વર્ષો થયાં હૃદયમાં રહેલું શલ્ય તે કાઢી શકી નહોતી. કુણાલને એની માતાની સાથે જ મોકદી દેવામાં ખટપત્ર કરવાની તિષ્યરક્ષિતાએ ખામી રાખી નહોતી. પણ મનુષ્ય ગ્રયતન કરતાં ઈશ્વરાધ્યા-હૈવેચા બળવાન હોવાથી બાળકુમાર કુણાલ તિષ્યરક્ષિતાના સકંનામાંથી અકર્માત્મ બચી ગયો ને સામાદ્ર અશોક પણ ચેતી ગયો કે આ નમાયો કુણાલ એની માતાની અવિઘમાનતાથી શોકયોનો લોગ થઇ પડશે. આજે એનું કોઈ નથી લક્ષ્મીનાં લાલચુ દાસ દાખીયો માર્ફતે એ કુયારે સપડાઈ જશે એ અનિશ્ચિત હતું, જેથી એને તરતજ યુવરાજ પૃદ્વી આપી અવંતી મોકદી દીધેઓ. મહારાજને સમજાવવાની

આ અધમ સ્વીએ ધાર્ણી કોશિષ કરી જેએ પણ વ્યર્થ ? મહા-
રાજ સમજુ ગયા હતા કે આ સ્વાર્થાંધ સ્વી ક્યારે શું કરશે
એ કહી શકાય એમ નહોતું. જેથી એના કહેવા ઉપર પુરતું
ધ્યાન નહોં આપતાં. પોતાનાં આએ માણસો સાથે એને રવા-
ને કર્યો. તે અંતરમાં ગુસ્સાથી ફેરફારી અને નાશીપાસ થયેલી
કુટિલ તિખ્યરક્ષિતા હાથ ધસતી રહી ગઈ, નજીવી ભૂલથી
એ બચી ગયો. એ માટે એના નિર્દ્દ્યહૈયામાં પસ્તાવો થયો,
છતાં એ નાહિમત થઈ નહીં કોઈ વખતે જે તક મલશે તો
એનો બરાબર ઉપયોગ કરી આ વૃદ્ધિ પામતો કાંટો જડમૂળથી
ઉઝેડી નાંખી પોતાના મહેંદ્ર માટે આ વિશાળ રાજ્યમાર્ગ
લવિષ્યને માટે સાકુ કરવો એ તેનો નિશ્ચય હતો. જ્યારે
જ્યારે એ મહેંદ્રને જેતો ત્યારે એ જુસસો ઉલ્લાંઘ જતો તે
મરનાર શોકને મનમાં અનેક કહુવાઓ આપતો.

આવા પરિવર્તનથી એનો સ્વરૂપ ચીડીયો થઈ ગયો
હતો. એ ચિત્તાના આવેશથી કોઈ કાર્ય ઉપર રાખીનું ચિત્ત
લાગતું નહીં. મહારાજ અશોકની પદુરાણી છતાં એની આ-
શાચો-વાસનાઓ એને અધમ માર્ગ તરફ ધસડી જઈ નીચ
કાર્ય કરવાને પ્રેરી રહી હતી. અનેક દાસ, દાસી, અખુટ વૈસવ
છતાં એના હૈયામાં આગ સળગતી હતી. એ આગથી એનું હૈયું
ધગધગી રહ્યું હતું. એટલું જ નહીં પણ એ આગમાં બિચારાં
નિરપરાધી દાસ દાસી હોમાતાં હતાં. જગતમાં સામાન્ય રીતે
એવો નિયમ હોય છે કે મોટા માણસોને ગરીબ માણસોની

કિંમતે સમજતી નથી. એવાં કંઈ જીવનોની કિમત વસુલ કરવા છતાં તિષ્યરક્ષિતાના હૈયામાં શાંતિ નહોણી.

પોતાનું કાર્ય પાર પાડવાને એ મનમાં અનેક સંકદ્ય વિકદ્યો કરતી. વારંવાર એ બાળ કુણાલ એની સામે સ્ક્રમ શરીરે ઉલેલો જણાતો તે સમયે એનો જાન લેવાને ખંજર લઈ ધર્મી જતી હતી. પણ એ કંઈ સત્ય કુણાલ નહોણો કે એ એને મારી શકે. વળી એ એવા અતિ જુસ્સાની આગને મહારાજના સથથી છુપાવવાને કોશીષ કરતી કેમકે મહારાજને વિશ્વાસમાં લઈ વિશ્વાસધાત કરી કાર્ય સાધવાની એને હજુ હેંશ હતી. જેથી પોતાની આવી ચેષ્ટા જે મહારાજ જાણી જાય તો એક છેર્હી બાકી રહેલી ઇચ્છા પણ ધુળમાં મળી જાય. એ હેતુથી પોતાના અંતરનો ભર્મ મહારાજ કે અન્ય કોઈના સમજવામાં ન આવે તે માટે તિષ્યરક્ષિતા ધર્મી જંલાળ રાખતી. જાણે કુણાલ સાથે પોતાને કંઈ લાગતું વળગતું ન હોય એવી રીતે મહારાજની આગાળ વતી મહારાજનું મન મેળવવાના વિશ્વાસ ઉત્પત્ત કરવાના અનેક પ્રયત્નો કરવા લાગ્યી. આ એરી નાગણ્ય હાલમાં તો એરનો ધુંટડો હૈયામાંજ રાખી સમય વ્યતિત કરવા લાગ્યી.



પ્રકુરણ ઉ જી.

નંહનાચાર્યે.

“ ગુરુ ! આપને સુખશાતા તો છેને ? ”

“ હા ? તમોને હીડો તો વિશેષ, મહારાણીજી ? ”

“ આ ઘણા દિવસથી આપનાં દર્શને આવવા આતુર હતી. પણ અવાતું નહોતું. પણ આજે તો ચાહીને આપનાં દર્શને આવી છું. ” આવનાર રમણીએ કહ્યું.

“ ગુરુ દર્શને તો અવશ્ય આવવું જ જોઈએ. એનાથી સત્તસંગનો લાલ થાય ને પાપ નાશ પામે તમને ખબર છે. શાસ્ત્રમાં તો દેવ કરતાં પણ ગુરુનો મહિમા અધિક વર્ણિત્યો છે.”

“ શા માટે ? ગુરુ કરતાં તો દેવ મોટા કહેવાય ? છતાં દેવ કરતાં ગુરુને મોટા કહેવાનું કારણ કંઈ ? ” આતુર હૃદયે એ સુંદર સ્ત્રીએ પૂછ્યું.

“ કારણ એજ કે દેવને તો આજે ઘણું છેકું પડી ગયું. સંસારના અજાની જીવોને એવા દેવનું સ્વરૂપ ઓળખાવનાર તો અમારા જેવા મહાન् ગુરુજ છે. અમારા જેવા ગુરુ જગતમાં વિદ્યમાન નહોત તો આજે આખા ભારત વર્ષ ઉપર લગભગ ઐદ્ધ ધર્મ પ્રસરી રહ્યો છે તે નહોત ? ” કંઈક ગર્વભર્યી એ ઉદ્ગાર હતા. મુખ ઉપર સંતોષ, પ્રસન્નતાની લાગણી ઝેલાઈ હતી.

“ ખરી વાત છે આપ સમા સમર્थ પુરુષોનોજ એ પ્રભાવ છે કે મગધરાજ જેવા આજે આપના લક્ત છે.” એ મુંદરીએ કહ્યું.

“ અમારો ધર્મજ એવો પવિત્ર અને શુદ્ધ છે કે એનું સ્વરૂપ જોણતાં સહેલે પાળવાની અલિલાધા થાય ? સાચાટ અશોકે અમારા ધર્મનું પાલણું કરીને એની શોભા વધારી છે. આજે હમારા હુલારો સાધુઓએ દેશ પરદેશ વિચરીને જૈદ ધર્મની મહત્તમ વધારી છે.”

“ આપ સમર્થ છો આજે મારા પતિ જેવા મગધ સાચાટના પણ આપ માનનીય અને પૂજ્ય ગુરુ છે જેથી આપની પાસે હું આશિષ લેવા આવી છું.”

“ જૈદ ગુરુ ચ્યમક્યો.” મહારાણીલ ? એવી કઈ વસ્તુની તમને ન્યૂનતા છે કે જેથી મારી પાસે તમે આશિષ લેવા આવ્યા છો ? ”

“ છે ગુરુવર્ય ? છે ? આપ મને આશિર્વાદ આપો ? મારાં કષ્ટ કાપો ? ”

“ કહો ! તમારી શી ઇચ્છા છે ? તમારી એવી કર્ય વાસના અધૂરી છે કે તમે પૂર્ણતા ચાહો છો ? ” જૈદાચાર્યે જણાયું.

“ મહારાજ ? મને આશિષ આપો કે જેવી હું રાજરાણી છું તેવીજ હું રાજમાતા પણ થાઉં ? બોલનારી મગધરાજની પકુરાણી તિષ્યરક્ષિતા હતી.

સાંલગનાર તે સમયનો પ્રણયાત જૈદ્વાચાર્ય નંદનાચાર્યે હતો. ઉપગુરુના ઉપદેશથી—એના અહિંસાના તત્ત્વથી મહાન અશોકે બૌધ્ધ ધર્મ સ્વીકાર્ય પછી એની રાણીએ પણ જૈદ્વાચાર્યની અનન્ય લકૃતા બની હતી. ઉપગુરુની જગ્ગા અન્યારે નંદન નામના લિક્ષુના હાથમાં હતી.

કંઈક વિચાર સ્કુરતાં પદ્મરાણી તિખ્યરક્ષિતા પોતાના શુરુ નંદનાચાર્ય સાથે ખાનગી મસલત કરવાને જૈધ મઠમાં આવી હતી. એની સાથે એની પાંચ સાત દાસીએ હતી, શુરુને વંદન કરી એઠા પછી છેવટે એણે શુરુ પાસેથી રાજમાતા થવાનો આશિર્વાદ દ્રિચ્છયો.

અત્યારે જૈદ્વાચાર્ય એકાંતમાં બેઠેલા હતા. એમના શ્રિષ્ટ્યો. અહાર અલ્યાસ કરતા હતા. જેથી અવસર સાધીને રાણીનું વચ્ચન સાંલગીને નંદનનું હૃદય ચંમકયું છતાં એણે ગલિરતાથી રાણીનું કદ્યું. “ રાણીનું ! એમાં શું નવાઈ છે જેવાં અત્યારે તમે મહારાજનાં માનિતાં છો તેવીજ રીતે એક દિવસ રાજમાતા પણ અવશ્ય થઈ શકશો ! ”

“ આપ શા ઉપરથી એમ કહો છો ? આપને ખખર છે મહારાજે ચુવરાજ પદવી તો પેલા કુણુલને આપી રાજ્યનો વારસ તો એને ઠરાયો છો. ”

“ તેથી શું ? એ તો કાળ કાળનું કામ કરીજ રહ્યો છે. શાલ્વિષ્યની વાતો આપણે અદ્વિતીયાના મનુષ્યો શું સમજુણ્યો ? ”

“ પ્રભુ ! આપ કંઈ લવિષ્ય વતી શકો છો અગર તો આપ.....” રાણી તિથ્યરક્ષિતા બોલતાં બોલતાં અટકી ગઈ.

રાણીના બોલવાનો ભાવ બૈદ્ધાચાર્ય સમજુ ગયો છતાં અનાણું થઈને પૂછ્યું. “ કહો તમે શું કહેવા માગો છો ? ”

“ લુ ! જરા એ તો ખાનગી વાત છે ? આપ કામ કરી શકો તો એક ખાનગી વાત કહું. ” રાણીએ કહ્યું.

“ કહો ? તમારી શું ધર્યા છે ? તમારું ગમે તેવું હુક્કર કાયં પણ હું કરી દઈશા. ”

રાણીએ શ્યામા સિવાય બધી દાસીએને ખણાર ખણર રાખવા સમજાયું ને દ્વાર આગળ શ્યામાને ઉલ્લી રાણી આસ્તેથી બોલી. “ મહારાજ ! એવું કંઈ આપ કરી શકો કે એ કુણુલનું કામ ખલાસ થાય ? મારો પુત્ર રાજ થાય ? ”

“ પણ, જુઓને રાણીજી એ તમારું કથન સત્ય છે, તમારું કામ તો થશે પણ એ એકદમ કંઈ સિદ્ધ થાય ? એવાં મોટાં કામ તો ધીરે ધીરે થાય ? ”

“ બલે ? ધીરે ધીરે પણ એ જેરી કાંટો મૂળમાંથી ઉએડી નાખવો બોઇએ. કોઈ એવો કામણું મણુનો મંત્રપ્રયોગ કરો કે એ ફરીને પાઠલીપુત્ર જેવાજ ન પામે ? ”

“ રાણીજી ? આની સરળ ચાવી તો તમારી પાસે છે તમે મોહુથી રાજને વશ કરી તમારું કામ કેમ કાઢી લેવાં નથી ? આવું સુંદર સ્વરૂપ અને વાણીનું ચાતુર્ય તમને બક્ષીસ છે તો એનો ઉપર્યોગ તમે કાં કરતાં નથી. ”

“ ભગવાન् ? મારું આ રૂપ અને કંપા મહારાજને રીજવી શકે ખરાં પણ કાર્ય કરાવી શકે તેમ નથી. તેથીજ આપની પાસે આવી છું. -તમારે શરણે આવી છું. હું તો રાજને સમજવતાં થાકી ગઈ છું. હવે તો આપ સમજવો ? મને તો લાગે છે કે એમને સમજવવા એજ મુશ્કેલ છે. ”

“ તમારા મોહમાં અંનાઈ રાજ ઘેડો ન થયો તો મારાથી સમજવો મુશ્કેલ છે : છતાં તમારા મહેંદ્ર મારે હું અવશ્ય પ્રયત્ન તો કરીશ. એના વિચારો ફેરવવા હું કોશીષ કરીશ. ”

“ મહેંદ્ર આપનોજ છે, એમ સમજને આપ કાર્ય કરશો. આટલું મારું કાર્ય આપને અવશ્ય કરવું તો પડશો. ”
મહારાણીએ દ્રઢતાથી કહ્યું.

“ અનતા લગી તો અવશ્ય ? પણ તમારે અવારનવાર આવવું-જવું. ”

“ ને આપને પણ અવશ્ય અમને દર્શન હેવા પધારવું ? આપ રાજસભામાં તો આવો છો. ઉપદેશ હેવાને ખણાને અંતઃ પુરમાં આવતા હો તો કેવું સારું ? આપના દર્શનનો ને બાણીનો લાલ તો અમને મળો ? ”

“ એશક ; તમારું કથન સત્ય છે. મહારાણી સાહેબા ? પરમ કૃપાળુ અમારા ખુદ્દ ભગવાનુ ઉપર લડુસો રાખો, એમની કૃપાથી આપનું કામ સત્તવર સિદ્ધ થશો. ”

“ તો આપને પણ અવશ્ય લાલ થશો. અત્યારના સમય

કરતાં મારો મહેંદ્ર રાજ થતાં આપણું ધર્મની અધિક ઉજ્જવિ કરશે. ઐદ્ધધર્મનો હિંગુવિજ્ય કરશે. ”

મહારાણુનાં વચન સાંલળી એ ધર્માલિમાની ઐદ્ધધર્મના સુખમાંથી પાણી શુટયું. “ જરૂર ધર્મના વિજ્ય મારે અમે ગમે તે કરવા આતુર છીએ. ઐદ્ધધર્મનો વિજ્ય દ્વારા જગતમાં ચારે દિશાએ ઝ્રાંકેલો જોવાને અમે તો ઉત્સુક છીએ. ”

“ આપના પસાયથી મારો મહેંદ્ર રાજ્ય ઉપર આવશે તો હું તો આપની એક અનન્યા લકૃતા થઈશ. રાત હિવસ આપની ચરણ સેવા કરી મારી લુંદળી સક્રણ કરીશ. અહું ! એ આપના ઉપકારનો બદલો હું શી રીતે વાળીશ ? ” રાણુએ ઐદ્ધશુરુનો આભાર માન્યો.

“ તમારું કાર્ય સિદ્ધ થાય તો તમે ગમે તે રીતે બદલો આપી શકો છો. તમે ઐદ્ધ ધર્મનાં અનન્ય લકૃત થઈ સેવા કરો એ બદલો કાંઈ જેવો તેવો નથી. ”

નંદન અને તિષ્ઠરક્ષિતાને વાતો કરતાં કેટલોક સમય પસાર થઈ ગયો પણ એમને સમયનું ભાન રહ્યું નહીં જેથી ક્ષાર ઉપર ઉલેલી શ્યામાએ જણુંબું. “ બાઇસાહેખ ? સમય બહુ થઈ ગયો છે તો આપણે હવે જવું જોઈએ ? ”

“ હા, શ્યામા ? આપણે હવે અટ જવું ટીક છે. તારી સલાહ વ્યાજણી છે. ” એ આનંદી વાતમાંથી નિવૃત્ત થતાં મહારાણુએ શ્યામાને કહ્યું. “ શ્યામા ? જ આપણો રથ તૈયાર કરાવ એટલામાં હું આવું છું ? ”

“ ખાઈ સાહેબ અટ આવજો ? ” એમ એલતાં ક્યામાં
ત્યાં આગારથી પસાર થઈ ગઈ.

રાણીએ વારંવાર હસ્તી હગ્રીને પોતાની વાતની દઢ
સહીમણુ કરી. નંદન પણ મીઠી નજરે નિહાળતો એ સુંદર
વદન નિહાળી રહ્યો હતો. અન્ને એક ભીજના સ્વાર્થમાં
રમતાં હતાં. અન્નેના વિચારે જુદાજ હતા. સંસાર દ્વાપ
શેત્રંજ ઉપર કોણું જાણે અન્ને શો દાવ ખેડી રહ્યાં હતાં ?

થાડીવારે મહારાણીલું વાતો કરતાં ખાડાર નીકળી
રથમાં એઠાં. રથમાં એઠે એઠે પણ ગુરુને વંદન કરવાતું ન
ભૂદ્યાં. જેત જોતામાં રથ ત્યાંથી પસાર થઈ ગયો. રથ
દેખાયો ત્યાં લગી એ બૈદ્ધ ગુરુએ એ દિશા તરફ નિરિક્ષણ
કર્યું. “ આહા ? કેવી આ જમાનાની સુંદર સ્ત્રી ? ” કંઈક
વિચારે એ સાધુના હૃદયમાં આવ્યા.



પ્રકૃતાણુ ૪ થું.



રાજસભામાં.

ને સમયમાં આપણી નવલકથા શરૂ થાય છે તે સમય આ-
જથી લગભગ ૨૨૦૦ વર્ષ પૂર્વનો હતો. તે સમયે ગહાન સમાદ્દ
આશોકનો ભાગ્યરવિ સમસ્ત ભારત ઉપર પ્રકાશ આપી રહ્યો
હતો. ભારતભૂમિના સર્વે રાજન્યે એના તેજમાં દળાઈ એને

ખંડણી આપી રહ્યા હતા. એણે પોતાની તલવારનું પાણી કલિંગની લડાઈમાં ભતાવી આપી જગતને પોતાના પરાક્રમનો પરિચય કરાવ્યો હતો. એ લયંકર ચુદ્ધમાં કલિંગવાસી વીરે ત્રણ વર્ષ પર્યંત અશોકવર્ધનની સામે ઉલ્લાસ હતા. અને એ સ્વદેશાલિમાનની વેહિકા ઉપર ૧૦૦૦૦૦ કલિંગવાસીઓનાં અલિહાન દેવાયાં, ૧૫૦૦૦૦ લડતાં પકડાયા અને અનાજની મેંઘવારીથી લાખો ભૂખે તરસે ટળવળી મુવા એતો જુદા ?

મહારાજ અશોકના રાજ્યનો વિસ્તાર ફર અફ્ઝાનિ-સ્તાન, સિંધ, ઉત્તરે નેપાલ પૂર્વમાં અંગાલા, કલિંગ, પશ્ચિમે સૌરાષ્ટ્ર ને કંચ્છ અને વિંધ્યાચળની દક્ષિણે મહૈસુરની ઉત્તર હુદ પર્યંત અશોકવર્ધનની આણ ફરતી હતી. રાજ્યની વ્યવસ્થા સાચવવા માટે સામાન્ય ચાર મથકો રાખ્યાં હતાં. ઉત્તરમાં તક્ષશિલા, પૂર્વમાં કલિંગ, દક્ષિણમાં સુવર્ણગિરિ ને પાંચમમાં ઉજાયિની. આ દરેક સ્થળે જુદા જુદા હકેમ-દંડનાયકોની ગોઠવણું કરવામાં આવી હતી. સિંહલદ્વિપ-લાંકાનો રાજ એને પ્રસત્ર કરવાને અવનવાં લેટણ્યાં મોકલતો હતો. મહારાજ અશોક ઐંદ્ર ધર્મ સ્વીકારેલો હોવાથી અત્યારે એણે ઐંદ્ર ધર્મને ઉત્તેજન ઠીક ઠીક આચું હતું..

ઐંદ્રાચાર્ય ઉપગુમના સમાગમમાં આવ્યા પછી સમ્રાટને જીવદ્યાનું તત્વ સમજતાં એને ઐંદ્ર ધર્મનો પાશ લાગ્યો હતો. કલિંગના ચુદ્ધમાં લાખો જીવોની આઢૂતિએ એનું હૃદય હુચમચાંયું હતું. મનુષ્યના અમૂલ્ય જીવનની કિંમત એના હૈયામાં ઉતરી હતી. જેથી એણે પોતાની તેજ તલવાર ભ્યાન

કરી અહિંસા તરફ પોતાનું લક્ષ્ય કેળવ્યું. આ અમુદ્ય તકનો જૌદ્ધાચાર્યે એને અનુકૂળ ઉપદેશ આપીને સદ્ગુપ્તેણ કર્યો. રાજા જૌદ્ધ થયો. ઉપગુમાચાર્યનો અનન્ય લક્તા થયો.

જૌદ્ધાચાર્ય ઉપગુમ પ્રતિહિવસ સમ્રાટની રાજ્યસભામાં આવીને ધર્મોપદેશ કરતો. મહારાજને અનુકૂળ ઉપદેશ આપીને રાજાને જૌદ્ધધર્મમાં એવો તો ચુણ્ણ બનાવ્યો કે એને દેશપરદેશ ધર્મોપદેશ કરવાને ધર્મોપદેશકે મોકલવાનો વિચાર થયો. એજ ઉપગુમની જગાએ આજે નંદન હુતો.

એક હિવસ રાજ્યસભામાં સમ્રાટની નજીક સિંહાસન ઉપર પોતાના શિષ્યોથી પરવરેલા નંદનાચાર્ય ધર્મસંખંધી અર્ચા કરતો એઠો હુતો. ધર્મને લગતા અનેક પ્રક્રો ઉપસ્થિત થતા એનું જૌદ્ધગુરુ પોતાની છુદ્ધિ અનુસાર સમાધાન કરતો. પોતાના ધર્મની રાજ્યસભા ઉપર ધ્રાપ પાડી રહ્યો હુતો. સર્વજ્ઞ જુદ્ધહેવનાં વખાણું કરી એના તરફ સકલ સભાનાં ચિત્ત આકર્ષણ પ્રયત્ન કરી રહ્યો હુતો.

‘મહારાજ ? ભગવનું જુદ્ધની જન્મ નગરી કપિલ વસ્તુ હિમાલયની તળેટી પાસે આવેલી એની આપે અવશ્ય યાત્રા કરવી જોઈએ’ નંદનાચાર્ય વાતવાતમાં જણાવ્યું.

“ એ કપિલ વસ્તુનો તો પ્રાઃય નાશ થયો છે ને વારુ ? ” રાજાએ પૂછ્યું.

“ હા ? આપનું કથન સત્ય છે. છતાં લાગવનનાં નયાં ચરણું સ્પર્શ થયાં હોય એવી ભૂમિ પણ વંદન કરવા ચોણ્ય

છે તો આતો યુદ્ધ લગવાનની જનમભૂમિ કહેવાય ! રાજનું ? એના માહાત્મ્યમાં તે શું ખામી હોય ? ”

“ અવશ્ય એ ભૂમિનાં દર્શન કરી આપણે પાપમલ થૈબાં જોઈએ. હુણ યુદ્ધ લગવાનને થયાં બહુ વર્ષો થયાં તો નથી એટલામાં એ નગરીનો કેવી રીતે નાશ થયો વાર્ડ ? ” સાંચારે પૂછ્યું.

“ આજથી લગભગ ૨૫૦ વર્ષ પહેલાં યુદ્ધ લગવાન સર્વજ્ઞ થયા તે પછી એમણે કારીની પાસે સારનાથમાં આવીને ઉપદેશની શરૂઆત કરી. અનુક્રમે મગધહેશમાં જ્યારે વિહાર કરતા કરતા યુદ્ધ લગવનું આવ્યા તે સમય મગધરાજ શ્રીણુક (બિંબિસાર) રાજ યુદ્ધનો ભક્ત થયો. ” નંદનાચાર્યે પૂર્વની જુની વાતનાં પડલ ઉપેડયાં.

“ બિંબિસાર તો જૈન હતા ! ” વચ્ચમાં રાજએ પૂછ્યું. “ હા ? એ પાછળથી જાતપુત્ર મહાવીરના ઉપદેશથી જૈન થયો હતો પણ પ્રથમ તો જૈદ્ર હતા. તેની પછી તેનો પુત્ર અણતશત્રુ-કેણુક મગધ સાંચાર થયો એ પણ પ્રથમ તો જૈદ્ર હતો. પણ પાછળથી એ રાજ જૈદ્રનો દુરમન થયો, એણે યુદ્ધના દ્વેષને લીધે કપિલ વસ્તુનો નાશ કર્યો. ” જૈદ્રાચાર્યે જુના હુણનું સમરણું કરતા એક મોઠો નિઃશ્વાસ મૂક્યો.

“ એ કપિલ વસ્તુ સિવાય ખીજાં કોઈ તીર્થ સ્થળો છે કે ? ” અશોકે પૂછ્યું.

મોટામાં મોટું તે સારનાથ. તેમજ ગયાણું, એ પ્રચ-

ગાની નજુક સરચુનહીના કાંઠે પલાસના વનમાં બુદ્ધ ભગવંતે તપ
કયું હતું. ત્યાં એમને ઓધિસત્વ પ્રાપ્ત થયું હતું. રાજ-
ગૃહ નગરમાં એમનો—અમારો મઠ બુદ્ધ ભગવંતે પોતાના
સ્વહૃસ્તે સ્થાપન કર્યો છે. જ્યાં આજે ૫૧ સાધુઓ નિવાસ કરી
રહ્યા છે. ને કુર્શીનગરમાં એ હેઠમુક્ત થયા છે. શ્રાવણી વર્ગે રે
પ્રસિદ્ધ સ્થળો પણ એ પ્રલુના ચરણ રજેજ પાવન થયાં છે.
એવા પવિત્ર તીર્થ સ્થળોનાં દર્શન કરવાથી અનેક ભવનાં
સંચિત પાપનો નાશ થાય છે. આત્મા પવિત્ર થાય છે.”
બૌદ્ધ ગુરુએ કહ્યું.

“ ભગવન् ! આત્મા તો ક્ષણીક છે. આપ તો આત્માને
ક્ષણીક માનો છો ! સમયે સમયે આત્મા નાશ પામે છે ને
નવો ઉત્પત્ત થાય છે તો પછી આપણે પુન્ય-પાપનો હિસાબ
કેવીરીતે આંકી શકીયે ? ” રાજાએ પૂછ્યું.

“ એ તમારું કથન વાન્નિવિક છે. આત્મા ક્ષણે ક્ષણે
અદ્વાતો હોવાથી કર્મ કરનાર પણ અન્ય છે એનો લોગવનાર
પણ કોઈ અન્યજ છે. એ સિદ્ધાંતનાં ઉંડા-ગંભીર રહુસ્ય રાજનુ?
તમારાથી ન સમુજય ? માટે બુદ્ધ ભગવાન્ ઉપર શ્રદ્ધા
રાખવી જોઈએ એવાં પવિત્ર સ્થળોનાં દર્શન તો અવશ્ય કરવાં
જોઈએ.” ગુરુએ શ્રદ્ધા રાખવાનો મહામંત્ર રાજને બતાવ્યો.

“ આપનું કથન સત્ય છે. ગુરુ મહારાજ ? આપના
ધર્મોપહેશથી મારી કુખુદ્ધિ આજે નષ્ટ થઈ ધર્મની મતિ
સાકુ સાકુ અંકાઈ ગઈ.”

“ એ તમારી સરલતા, મુજનતાનું લક્ષ્ય છે. કેટલાક

એવા લારે કર્મી જનોને તો અખુટ ઉપહેશની ધારા વરસાવવા છતાં પણ એનું કહોર હૈયું પીગળતું નથી. તો ધર્મની તે વાતજ શી ? ”

“ એ બધું આપની કૃપાનું કૃગ ! ”

“ રાજનું ! જેવી રીતે તમે ધર્મ ચુસ્ત થયા એવી રીતે પ્રજામાં ઐદ્ધધર્મનું તત્ત્વ ફેલાય એ માટે આપે પ્રયાસ કરવો જોઈએ ? ”

“ એ ગાટે તો આપના ઐદ્ધ બિક્ષુઓ દેશ પરહેશ ઉપહેશ આપી રહ્યા છે. આપ કહો તે મારાથી ઘનતી મહદ્દ હું પણ આપી કંધક ધર્મ સેવા બજાવી શકું ? ”

“ સલ્ય છે તમે બુદ્ધના સાચા અનન્ય લક્ષ્ણ છો, તમને એ ચોંચનું છે. આપે મોટી પાઠશાલાએ સ્થાપન કરી એમાં ઐદ્ધધર્મનું શિક્ષણ અપાવી ઐદ્ધપંડિતો તૈયાર કરવા. એ પંડિતો ઉપહેશકો આપની તરફથી આપના રાજ્યમાં ફરીને ઐદ્ધધર્મનો ફેલાવો કરે તો પ્રજા ઉપર સારી અસર થાય ? ”

“ આપની વાત મારા ધ્યાનમાં ઉત્તરે છે. આપ શુલ્ષ મુહૂર્તો પાઠશાળા સ્થાપન કરો. જે કંઈ ખર્ચ થાય તે રાજ્ય-તિનેરીમાંથી પગાર કરવામાં આવશે. દેશ પરહેશના હુલરો વિદ્યાર્થીઓને લાલ આપી ઉપહેશકો તૈયાર કરવો ? ” ઐદ્ધ ધર્મ હિંગંત પર્યંત ફેલાવો ? ”

અત્યારના સમયને એ વસ્તુ અનુકૂળ છે. આજે ભારત ઉપર જયાં જુઓ. ત્યાં જૈનત્વ છિવાઈ રહ્યું છે. ચારે વણોમાં

આજે જેમ જૈનપણું જોવાય છે. એવી રીતે ઐદ્ધત્વ પ્રસરણું જોઈએ. એ મનોરથ આપણો જે સફળ થાય તો બુદ્ધલગ્નવન્નની સેવા આપણે યથાર્થ બનવી કહેવાય. ”

“ લગ્વન્ ? બુદ્ધ અને મહાવીર તો લગ્ભાગ સમકાળીન થયા છે. છતાં જ્યાં ત્યાં આટલો બધો જૈન ધર્મનો પ્રચાર થયેલો કેમ જોવાય છે ? અમારા વડીલો પણ જૈન ધર્મના અનુયાયી હતા. એમની પૂર્વના મગધસત્રાટો પણ શ્રીમહાવીરનાજ લાક્ત હતા. ” રાજુએ પૂછ્યું.

“ માટેજ રાજુન્ આપણે ઉપદેશકોદ્રારા ઐદ્ધત્વ ઝેલાવવા કટીણદ્વથવું જોઈએ. એટલી અમારામાં ખામી છે કે બુદ્ધ લગ્વન્ જેવી અમારામાં શક્તિ નથી, એમાં અમને રાજની મહદ્દની પણ જરૂર છે. ” નંદને નિરાશ થતાં જણાવ્યું.


“ વળી એ પણ કારણું હશે કે જૈન ધર્મ તો પૂર્વ પરંપરાથી ચાહ્યો આવે છે. ને બુદ્ધલગ્વાન તો હાલમાં જ થઇને એમણે નવા ધર્મની શરૂઆત કરી. ” રાજુએ કહ્યું.

તે પણ ઠીક છે. જાતપુત્ર મહાવીર એ ચોવીશમા તીર્થ-કર છે એમની પૂર્વે પહેલાં ત્રૈવીશ તીર્થંકરો થઇ ગયા એમાં પ્રથમ તીર્થંકરે શરૂઆત કરી પરંપરાએ દરેક તીર્થંકરોએ એમાં વૃદ્ધિ કરી. તેમ આપણે તેવી રીતે જૈનત્વનું જેર હઠાવી ઐદ્ધત્વ સ્થાપન કરવા તૈયાર થવું જોઈએ. ”

વાતોમાં સમય પૂર્ણ થતાં રાજ્યસલા બરખાસ્ત કરી.

રાજ શુરુને લઈને અંતઃપુરમાં ગયો ત્યાં અંતઃપુરમાં પણ રાણી-એને ધર્મેપદેશ આપી નંદન પોતાના સ્થાનકે રવાને થયે.

અનેક પ્રકારના પોતાનો ધર્મ હિગંત બનાવવાની ચો-જના એ નંદનાચાર્યના ભગજમાં રમી રહી હતી. એની સ્પર્ધા કરતો જૈન ધર્મ આજે જગતમાં જ્યવંત હતો. એના જેવું પોતાના ધર્મનું મહાત્વ જગતમાં છવાય તો ખુદ્દ લગવાનની કેવી અપૂર્વ સેવા બનાવી કહી શકાય ? તે પછી એણે પાઠ-શાળામાં પંડિતો તૈયાર કરવાની યોજના તરતજ મહારાજની મદદથી અમલમાં મૂકી.



પ્રકરણ ૫ મું.

સાવકી માનો સનોહ.

એક દિવસ રાજ પોતાના એકાંત વિચાર ભુવનમાં એડો હતો. અવંતીથી હુતનો પેગામ આવેલો, એ વાંચી એના હૃદયમાં કંઇ કંઇ વિચારે ઉલલાંયા. “કુમાર દિવસે દિવસે મોટો થતો જાય છે તો હુવે એણે અલ્યાસ કરવો એજ ઢીક છે. આવું વિશાળ સાખ્રાન્ય જો એ ભણેલો હુશે તો વ્યવસ્થાપૂર્વક ચલાવી શકશે. વળી હું પણ ઈચ્છું છું કે એના પોતાના હુથના લગેલા કાગળો મારી ઉપર કયારે આવે ! બહેળા વિદ્યાલ્યાસથી, અનેક શાસ્કોના પઠનથી ખુદ્દી કેળવાય છે. ભગજમાં અનેક પ્રકારના નવીન વિચારે સ્કુરે છે. ચાતુર્યના

આંકુરે પ્રગાટ થાય છે. એનાથી સત્ય અસત્ય પારખવાની શક્તિ આવે છે. વિદ્યા વગરનો માણુસ એ કાંઈ માણુસ નથી. પંડિતોની સલામાં જરાય શોભતો નથી. ઉલટો તેમને હંગી રૂપ થાય છે. મારે હું તો કુમારને ભણુવવો એજ એને મારે હીતકારી છે. ” ધર્માદિ વિચાર કરતાં સમારે પોતાને હાથેજ કાગળ લખીને તૈયાર કરવા માંયો.

મહારાજનું ધ્યાન કાગળ લખવામાં એકાચ હતું એવામાં એ વિચાર બુવનમાં એક વ્યક્તિએ પ્રવેશ કર્યો. એણું જેણું કે મહારાજ કાગળ લખવામાં એક ચિત્તવાળા છે. ઓહો ! આવા આદરપૂર્વક કેને કાગળ લખતા હુશે. ધીમે પગલે ચાલતી રાણની પછવાડે આવીને તે વ્યક્તિ ઉલ્લી રહી. પોતે કાગદ ન વાંચી શકે એવી રીતે ફર ઉલ્લી રહી.

એ વ્યક્તિ તે મહારાજની પદૃરાણી તિષ્ઠરક્ષિતા હતી. ગમે લારે ને ગમે તે સમયે અન્તઃપુરમાં મહારાજની પાસે આવી શકતી. એવી મહારાજની એની ઉપર અથાગ પ્રીતિ હતી. પ્રસંગે રાજકાજમાં પણ રાજ સાથે ચર્ચા કરી શકતી હતી. કેટલીક વાર સુધી રાણની એકાચતાનો જ્યારે ભાગ ન થયો. લારે પોતાનું આગમન રાજને જણુવવા એ રાણની સન્મુખ આવીને ઉલ્લી અને ખુંખારો કર્યો. એ એના મધુરલાવ ભર્યા ખુંખારાથી મહારાજનું એકાચ ધ્યાન ભાગ થયું. “ ઓહો ! મહારાજ ? આપ એના તે શું કાર્યમાં ગુંથાયા છો કે હું કયારનીય ઉલ્લી ઉલ્લીને થાકી ગઈ છતાં આપનું ધ્યાન વિચલિત ન થયું ? ”

પદ્મરાણીનો જવાખ સાંભળીને મહારાજે એના સામું જોયું ને હુસ્યા. રાણીલું પણ એમના હુસ્તવાથી હુસ્યા. “આપતો બહુજ વ્યવસાયમાં પડી ગયા કે આત્મીય જનોને પણ ભૂલી જવ છો. ”

“તમે કંઈ અત્યારે ભૂલાં પહુંચાંકે શું? ” રાજાએ પૂછ્યું.

“ અમે તો તમારા વગર ભૂલાંજ છીએને, પણ તમને અમારી શ્રી પડી હોય ? ”

“ કેમ ! એમ આવો છો વાર્ડ ! કંઈ મર્મિમાં આવો છો ! શું ? ”

“ આપને માટે રાત દિવસ અમે ગાંડાં થઈને કુરીયે ને આપને તો અમારે માટે કંઈ નહીં. ”

“ અમને તમારે માટે કંઈ નથી એમ તમે શા ઉપરથી સમજ્યાં વાર્ડ ? ”

“ અમે કેમ ન સમજ્યે ? અમે પણ શેર ધાન્ય ખાઈએ છીએ. ”

“ તો અમે કૃયાં ધુળ ખાઈએ છીએ. મહારાણીલું ? તમાર્ડ ચિત્ત આને ખિજી કેમ જણ્યાય છે ? ”

“ આપ કોઈ દિવસ અમારી સાથે એસીને એ વિનોદની વાત પણ કરો છો ? ખસ રાજ્ય રાજ્ય ને રાજ્ય ! એ રાજ્યનીજ રાત દિવસ ચિંતા કરો છો ! રાજ થયા એટલે કંઈ ધરના માણુસ ઉપરથી સ્નેહ ન જતો રહે ? ” તિણ-

રક્ષિતાએ રાજની જોડમાં આસન લેતાં કહ્યું.

રાજની જોડમાં આસન લેતાં તિથ્યરક્ષિતાએ કાગળ ઉપર વાંકી નજરે જોયું તો એ કાગળ ખુવરાજ કુણુાલ ઉપર લખાતો હતો. એ એના સમજવામાં આવ્યું, કાગળ જોડ એના હૈયામાં તાલાવેલી લાગી કે કાગળમાં શું લખ્યું હશે. અવસર મળે તો આપણે અવશ્ય વાંચવું તો જોઈએ.

રાજને પણ એ અરસામાં કાગળ લખીને સંપૂર્ણ કર્યો. “ હેવી ! ધર્મ, અર્થ અને કામ એ ગ્રણે ખુર્ખાર્થ આપણે અરસ પરસ ખાધા રહિતપણે સાધીયે છીએ. સુખ લોગવવામાં આપણે શું ન્યુનતા રાખીએ છીએ. ” લખેલો કાગળ એક ખાળુએ મુક્તાં રાજ ઓદ્યો.

એટલામાં છ વર્ષનો રાજકુમાર મહેંદ્ર અને ચાર વર્ષની સંઘમિત્રા અંદર ઢોડી આવ્યાં.

મહેંદ્રને જોઈ તિથ્યરક્ષિતાએ કહ્યું ” દ્યો આ તમારો મહેંદ્ર આવ્યો ? મારો મહેંદ્ર બિચારો ગમે તેવો પણ.... ” રાણી ઓલતાં ઓલતાં અટકી ગઈ.

અન્ને છોકરાં માતા પિતાના જોળામાં એસી ગયાં. ને અરસ પરસ રમવા લાગ્યાં. અનેક સંનેગ વિનેગોમાં પસાર થતી મોટાં માણુસોની લંદગી જ્યારે જુદી હોય ત્યારે ખાણ-કેની નિર્દોષ સૃષ્ટિ પણ જુદીજ હોય છે.

“ રાણીજ ! કેમ અટકી ગયાં ?

“ કંઈ નહી એ તો સહેજ ? મહારાજ ? ”

“ નહી એ તો તમારે અવશ્ય કહેવું પડશે. ”

“ પણ એવી નજીવી વાતમાં હું આપને શું કહું ? ”

“ જે તમારા મનમાં હોય તે ? ”

“ મારા મહેંદ્રને આપ યુવરાજપદ ન આપી શકો ? ”

“ રાણી ? યુવરાજ તો જે મોટો હોય તેનું થઈ શકે ? ”

“ તેથીજ આપે કુણુલને યુવરાજપદ આપ્યું છે ? ”

“ ખરાખર છે. છતાં મહેંદ્ર પણ રાજ કરી શક્શે. કેમકે જે હેંશીયાર અને રાજ્યને યોગ્ય હોય તે રાજ તો થઈ શકે છે. આપણું ધાર્યું કંઈ ઓછુંજ બની શકે છે. ”

“ એ તો વિધિના લેખની વાત છે. પણ એમાં આપની મહેરખાની તો નહીજ ને ? ”

“ એમાં મહેરખાની શી ? એક સાથે કંઈ એ ગ્રણુંને સાથે યુવરાજપદ આપી રાજ્યના વારસઠેરવી શકાય ? ”

“ ઠેરવી શકાય ? અલખત; એમાં આપનો વિચાર દદ હોય તો એ પ્રમાણે પણ કરી શકાય ? ”

“ એટલે તેમાં તું શું કહેવા માગે છે ? ”

એટલું જ ફૂકતા કે આપને એ છોકરામાં એટલો બધો શો મોહ લાગ્યો છે કે એની આટલી બધી કાળજી રાખો છો ? આપને તો બધા પુત્રો તરફ સમાનવૃત્તિ રાખવી જોઈએ. ”

“ તને ખરાખર નથી; રાણી ? એ છોકરો ભા વિનાનો છે. ”



એ નમાયા છોકરાનું ધ્યાન જે હું ન રાખું તો એની લંદ
ગીનો અંત આવી જય ? ”

“ એનું કારણ વાડું ? ” તિષ્યરક્ષિતાએ અજાણુપણે
પૂછ્યું.

કારણ ખુલ્લું જ છે. એ રાજ્યવારસ યુવરાજ હોવાથી
દરેકની નજરમાં આંખમાં કણ્ણાની માફક ખુંચતો હશે. એની
લંદગીની તરફી કઈક રાખ્યો સમયની રાહ જોતી હશે. ”

“ તેથી જ આપે એને અવંતીમાં રાખ્યો છે. ”

“ હા ? એમ જ છે. ”

રાખ્યો મનમાં ગાંડ વાળી કે રાજ એમ સમજાયો.
સમજે એમ નથી. પણ કોઈ એવો સંઝેગ ઉલ્લો થાય તો જ
કાર્ય સાધી શકાય. એટલામાં રાજ અને રાખ્યીની વાતોમાં
ભંગાળું પડ્યું. દાસીએ આવી હાથ જોડી વિનિતિ કરી કે—“મહા-
રાજ ? લોજન તૈયાર છે. ”

રાજ રાખ્યી જમવાને ઉઠ્યાં રાજની અંગુલી મહેંદ્રે
પકડેલી અને રાખ્યી પાસે સંધભિત્રા હતી. બન્ને જણ્ણાંત્યાંથી
જમવાના ઓરડામાં ચાઢ્યાં ગયાં.

દૈવયોગે કાગળની વાત વિષયાંતર થવાથી રાજના
મગજમાંથી તો નિકળી ગઈ હતી પણ રાખ્યીના મગજમાં એ
વાત રમ્યા કરતી હતી. આ અમૃહ્ય સમય જતો કરે એવી એ
મુર્ખ નહોતી. એ કાગલ વાંચવાને આતુર થઈ ગઈ હતી,

રાજની પાસેથી કયા નિમિત્તે છુટાં પડવું એનાચે વિચારમાં હતી. રાજ જમવા એઠા, રાણી પણ પાસે એઠેલી હોવાથી એ ખાનાની તપાસમાં હતી, એક તરફ મહેંદ્ર અને સંઘમિત્રા પણ જમતા હતાં. તરતજ રાણી હિશાચે જવાનું ખાનું કાઢી જમવાના ઓરડામાંથી બહાર નીકળી. તે જ્યાં રાજ પ્રથમ એઠા હતા ત્યાં આવી પહોંચી ત્યાં પડેલો કાગળ રાણીએ અટપટ વાંચી લીધો. એના વદન ઉપરથી અનેક પ્રકારના છાયા પસાર થઈ ગાઈ. એણે કૂર અદૃહાસ્ય કર્યું. હૃદયમાં અનેક તર્કવિતર્ક કર્યા. જલદી નેત્રાંજનની શરીરી લઇને થુંકથી લીંજવી અંજન સહિત કરી એક ડેકાણે જરાક ભાત્ર સુધાર્યું અકાર ઉપર બિંદુ ભાત્ર કર્યું. ને કાગળ હતો એમ જ સુકી હીધો ને અટપટ બહાર નીકળી ત્યાં શ્યામ સુખવાળી શ્યામા સામે ભળી. એની કાર્યકુશળતાથી શ્યામા ચેતી ગાઉ હતી કે આને કંઈક છે ખર્દું ? શ્યામાને જોઈ રાણી હસ્તી. રાણીના એ કૂર હાસ્ય ઉપરથી શ્યામાએ કહ્યું. “ કાં બાઉ સાહેબ ? કંઈ કાર્યની ચાવી હાથ લાગી ? ”

“ અત્યારે તો એમ જણ્યાય છે. કાર્યની શરૂઆત કરી છે. પૂર્ણ થાય ત્યારે એના ક્રતની તો માલૂમ પડે. ” આસ્તેથી રાણીએ કહ્યું.

“ એસ હવે આપણી ક્રતોહ છે. બાઈસાહેબ ? ”

“ તો તારા મોંમાં સાકર ? ”

શ્યામાને જણ્યાવી રાણી એકદમ મહારાજ જમતા હતા

તેમની પાસે આવી. નિરાંતે મહારાજને જમાડ્યા. અત્યારે એનાં દિલમાં શાંતિ હતી, પ્રસન્નતા હતી. મહારાજ જમીને પાછા દિવાનખાનામાં આવ્યા અને જ્યાં પાનસોપારી ખાય છે એટલામાં તો અવંતી જવાનો હૃત તૈયાર થઈને મહારાજ પાસે આવીને નમ્યો. રાજાએ કુણુલને લખેડો કાગળ પરખી-ડીયામાં પેક કરી એની ઉપર મહેરથાપ કરી હૃતને આપ્યો. કેટલાક સુખથી આપવા ચોણ્ય સમાચાર આપ્યા. હતે કાગ-લને નમીને ઉંચકી લીધો, પછી મહારાજને નમીને તે અધ્યાર્થ થાજ અવંતી તરફ ચાઢ્યો ગયો.

— ● — ● —

મહરણુ દુ તું.

— ● —

પૂર્વ પરિચય.

આ અવસરપિણી કાલનો આજે પાંચમો આરો ચાલે છે પહેલો સુષ્પમ સુષ્પમ નામનો આરો ચાર કોડાકેડી સાગરો-ગમ પ્રમાણુ હોય છે એ આરાની શરૂઆતમાં પુરુષનું આયુષ્ય ત્રણુ પહ્યોપમ ને શરીર ત્રણુ ગાઉનું હોય, અનુક્રમે હીન થતાં બીજા સુષ્પમ નામના આરામાં એ પહ્યોપમનું આયુષ્ય અને એ ગાઉનું દેહમાન હોય, એ બીજો આરાનું પ્રમાણુ ત્રણુ કોડાકેડીનું જાણુવું. એ બીજો આરો પુરો થઈને ત્રીજો આરો એસેછે ત્યારે મનુષ્યના શરીરનું પ્રમાણુ એક ગાઉ અને આયુષ્ય એક પહ્યો-

પમનું હોય છે. ત્રીજા આરાનું પ્રમાણું એ કોડકેડી સાગ-
રેપમનું હોય છે. એનું નામ સુષમ દુષમ છે. આ ગ્રણે
આરામાં ચુગલિક મનુષ્યો હોય છે તેએ સ્વી અને પુરુષ
સાથેજ જન્મે છે. કદ્વપવૃક્ષ પાસેથી ઇન્દ્રિત વસ્તુ મેળવીને
કુષાય રહિતપણે સંસાર સુખ લોગવતાં પોતાનું જીવન વ્ય-
તીત કરે છે. અદ્વય કુષાયવંત હોવાથી મરણું પામીને પણ
દેવલોકમાં જય છે. એ ત્રીજા આરાના અંતમાં શ્રી દૃષ્ટલ-
દેવનો જન્મ થયો.

દૃષ્ટલદેવ ચુગલિક ધર્મ નિવારીને વ્યવહાર માર્ગ
પ્રવતાવ્યો. પહેલા રાજ થયા પ્રથમ ધર્મ પ્રવર્ત્તક થયા
પ્રથમ તીર્થંકર થયા. તેમનાજ પુત્ર ભરત આ અવ-
સર્પિણીમાં પહેલાં ચક્રવર્ત્તિ થયા. પ્રથમ તીર્થંકર મોક્ષો
ગયા પછી ગ્રણ વર્ષ અને સાડા આડ માસે ચોથા આરો એડો
એ ચોથા આરાનું પ્રમાણું ૪૨ હુલર વર્ષ ન્યુન એક કોડક-
કેડી સાગરોપમનું છે. ચોથા આરાની શરૂઆતમાં પાંચસે
ધનુષ્ય પ્રમાણું શરીર અને કોઈ પૂર્વનું આચુષ્ય પ્રમાણુ
હતું. એ ચુગની શરૂઆતમાં ભરત ચક્રવર્ત્તી હતા.

શ્રી દૃષ્ટલદેવ ભગવાનને કેવલજ્ઞાન ઉત્પત્ત થયા પછી અંત-
મુહૂર્તમાં મોક્ષ માર્ગ શરૂ થયો. એમની અસંખ્યાતી પાઠ પર-
પરા સુધી મોક્ષ માર્ગ ચાલુ રહ્યો. એમના સમયમાં હુન્યામાં
મહાનમાં મહાન લૈનધર્મ હતો. રાષ્ટ્રધર્મ કહો કે રાજ્યધર્મ સર્વ
કોઈ દૃષ્ટલ ભગવાને કહેલા ધર્મને માનનારા હતા. જો કે એમના
પુત્ર કચ્છ મહાકચ્છાદાદિ તાપસ થઈ વનક્રલ ખાતા હતા

છતાં ભાવથી તો એ દૃષ્ટસાહેબને પુજનારા એનું ધ્યાન ધરનારા હતો. ભરતનો પુત્ર મરિચી ત્રિદંડી થઈ ગયો હતો. છતાં એ પણ દૃષ્ટસાહેબનું ધ્યાન ધરતો જૈન સાધુઓની સેવા કરતો હતો. દૃષ્ટસાહેબનું શાસન લગભગ અર્ધઆરા પર્યાંત ચાલેલું. દૃષ્ટસનાથને થઇ ગયાં પચ્ચાસ લાખ ડેટી સાગરો-પમ કાળ વહી ગયો ત્યારે એમનીજ પાઠપરંપરામાં વિનિતા નગરીને વિષે ખીંચ અણુતનાથ તીર્થંકર થયા. તેમની વખ્તમાં સગરનામે ખીંચ ચક્કી થયા.

સગર ચક્કવર્તીનાજ જઈનુકુમારાદિક સાઠ હજાર પુત્રો દેશાટન કરવા નિકળેલા, તેઓ ફરતા ફરતા અધ્યાપદ પર્વતની પાસે આવ્યા. અધ્યાપદની યાત્રા કરતાં એનાં લાભ મંદિરો જોઈ પોતાના પૂર્વજની કીર્તિનું રક્ષણ કરવા માટે એમણે અધ્યાપદ પછવાડે દંડરતનથી ફરતી ખાડી કરી. અને ગંગાનું પાણી એમાં વાજ્યું. એથી ભુવનપતિના નાગકુમારના ભુવનેમાં ખગભગાટ થવાથી નાગકુમારના ઈંદ્ર-ભૂતાનેંદ્રે પોતાની દષ્ટિ-જવાગાથી ખાળી ભસ્મ કર્યા. તીર્થ લક્ષ્ણ કરતાં મરણ પામેલા એ સગર રાણના પુત્રો ભારમા દેવલોકે ગયા. ગંગાના પ્રવાહુથી ગામ અને નગરોને નુકશાન થવાથી સગરે પોતાના પૌત્ર લાગીરથકુમારને આજા કરી. લાગીરથકુમારે ત્યાં જઈ ભૂતાનેંદ્રને પ્રસન્ન કરી જાનહીવીને પાછી સમુદ્ર સાથે મેલવી દઈ લોકેનું સંકટ ફૂર કર્યું. ત્યારથી ગંગા એ જાનહીવીને કે લાગીરથી નામે ઓળખાય છે.

અગવાન અળતનાથના મોક્ષગમન પછી ત્રીસ લાખકોડ સાગરોપમ પસાર થયા ત્યારે સંભવનાથનું નિર્વાણ થયું. તે પછી દશલાખકોડ સાગરોપમે શ્રીઅલિનંદન નિર્વાણ. એમ વીશ તીર્થંકર પર્યંત કેટલોએ કાલ ચોથા આરાનો પસાર થઈ ગયો.

વીશમા તીર્થંકર મુનિસુવત સ્વામી મગધહેશની રાજ-ગૃહી નગરીમાં ત્રીશ હજાર વર્ષના આયુષ્યે ઉત્પત્ત થયા. એ-ગણીસમા મહિલનાથ પછી ચોપનલાખ વર્ષે મુનિસુવત મોક્ષ ગયા. મુનિસુવતસ્વામીના સમયમાં હસ્તિનાપુર નગરમાં પદ્મ નામે રાજ રાજ્ય કરતો હતો. એને વિપળુકુમાર અને મહાપદ્મ એ પુત્રો હતા તેમાં મહાપદ્મ છ અંડ પૃથ્વી સાધીને નવમા ચક્રવર્તી થયા. એ મહાપદ્મ ચક્રવર્તીને નમૂર્દી નામે પ્રાણણુ પ્રધાન હતો. ચક્રવર્તીએ એક દિવસે પૂર્વે એને વરદાન આપેલું હેવાથી નમૂર્દીએ મહાપદ્મ પાસેથી કાર્તિક શુદ્ધ ૧૪ સુદ્ધીનું રાજ્ય માગી લીધું. ચક્રવર્તી એને રાજ્ય આયું ને પોતે અન્તઃપુરમાં રહ્યો.

નમૂર્દીએ હિંસામય એવો યજા આરંભ્યો અનેક પ્રાણણો, દૂષીયો, એ યજામાં આવી નમૂર્દીનાં વખાણ કરી દક્ષિણા મેલ-વવા લાગ્યા. એવી રીતે દરેક દર્શનના લોકો-નેતાઓ એના યજામાં આવ્યા પણ એ યજા હિંસામય હેવાથી નૈનયતિએએ એમાં લાગ ન લેવાથી નમૂર્દી ગુરુસે થયો. દૈવયોગે એ સમયે મુનિસુવત સ્વામીના શિષ્ય સુનતસ્કુરિ અનેક શિષ્યો સાથે ત્યાં ચોમાસું હતા. નમૂર્દીએ સ્કુરિને ઓલાવી સંભળાવી ઢીધું

કે “ દરેક દર્શનના પંડિતોએ મારા યજામાં ભાગ લીધો છે.
પણ તમે શા માટે ન આવ્યા. ”

“ રાજન ? એ હિંસામય યજામાં જૈનયતિએ ભાગ ન
હઈ શકે ? સુવ્રતસ્કુરિએ કહ્યું.

“ આવો અનુપમ પૂણ્યમય યજા હિંસામય છે કેમ ?
કીક છે સાત દિવસની તમને મુહૂર આપું છું કે મારા રાજ્યની
હદ છોડીને તમારે જતા રહેવું ? ”

“ રાજન ? ચોમાસામાં સાધુએ વિહાર ન કરી શકે ?
તેમાં પણ વળી સમસ્ત ભરતક્ષેત્રમાં તમારું રાજ્ય હેવાથી
સાધુએ કૃયાં જય ? ” સુવ્રતસ્કુરિએ સમજવવાની કોશીષ કરી.

ગાઠ અજાનરૂપી અંધકારમાં અંધ થયેલા તેમજ અલિ-
માનરૂપી દ્રષ્ટિધરથી ડોલતા એ નમુચીને ભગડર આત્મા
જરીપણ સમજ્યો નહીં. “ સાત દિવસ સુધીમાં જે તમે મારી
હદ છોડીને નહીં જતા રહેતો તમને બધાંને ભરાવી નાંભીશ
એ યાદ રાખજો. ”

સુવ્રતસ્કુરિ ઉપાશ્રયમાં આવ્યા. નગરના સર્વે સજજનોએ,
મંત્રીઓએ નમુચીને બહુ સમજવ્યો. પણ ગમે એટલું પાણી
મુશાગધાર પડવા છતાં ભગશીણીએ પાણાણ પડળે ખરે કે ?
એ નમુચીએ કોઈનું કથન સંબંધ્યું નહિ.

સુવ્રતસ્કુરિએ પોતાના આકાશગામી વિદ્યાવાળા એક
શિષ્યને મેરું પર્વતના શિખર ઉપર તપ કરતા મહાપદ્મ ચક-
વર્તીના વડિલ અંધુ વિષ્ણુકુમારને તેડવા મોકદ્યો. એ શિષ્યે

ત્યાં જઈને વિષણુકુમારને સર્વો હકીકત કહી સંભગાવી. એથી વિષણુકુમાર એ શિષ્યને લઈને હુસ્તિનાપુર આવ્યા. ગુરુને વાંદી ખીજે દિવસે વિષણુકુમાર મુાન રાજસભામાં જયાં યસ થતો હતો. ત્યાં આવ્યા. નમુચી સિવાય સર્વો પ્રાક્તણો, દૃષ્ટીઓ, અને પ્રધાનો તેમજ અન્ય રાજાઓ એમને નમ્યા.

વિષણુકુમારે નમુચીને સમજવવામાં કચાશ રાખી નહીં પણ વિનાશકાળે વિપરીત બુદ્ધિ એ મુજબ એણે કંઈ પણ સાંભગવાની સાક્ષ ના પાડી. અને સાત દિવસ પછી હું એ સર્વોને મારી નાંખીશ આજે એક દિવસ તો ઓછો થયો છે. એવો પોતાનો નિશ્ચય કહી સંભગાવ્યો.

“ ઢીક ત્યારે મને એકલાને તો રહેવાની થાડી જમીન આપીશને ? ”

“ હા ! ફક્ત ત્રણ ડગલાં જમીન તમને મળશે ? ” એ ગર્વિષ નમુચિએ કહ્યું.

તે પછી વિષણુકુમારે વૈકિયલઘિધથી એક લાખ જોજનનું શરીર વધાર્યું જાંબુદ્ધિપની પૂર્વ પાત્રિમ જગતી (કીલ્લા) ઉપર એ પગ મૂકીને “ હવે ત્રીજે પગ ક્યાં મુકું જમીન આપ ? ” કોધથી ધમધમતા વિષણુકુમારે કહ્યું. તેમનું આવું ભયંકર કૃત્ય જોઈ નમુચી મૈન રહ્યો એટલે વિષણુકુમાર મુનિએ ત્રીજે પગ એની છાતી ઉપર મુકીને એને પાતાલમાં ચાંપી દીધો. એથી નમુચીનું શરીર પાતાલમાં પેસી જયું. એનો આત્મા શરીર છાડીને સાતમી નરકપૃથ્વીનો મેમાન થયો.

વિષણુકુમારે લાખ જોજનપ્રમાણુ શરીર કરવાથી પૃથ્વી ખળલગવા લાગી. પર્વતોનાં શિખરો પડવા લાગ્યાં, જ્યોતિષી દેવો પણ ભય પામ્યા. અરે ‘આ શું’ બધા પ્રકાંડમાં ખળલગાટ થઈ રહ્યો. ચક્રવર્તી અન્તઃપુરમાંથી હોડતો આવી વડીલ બંધુના કોધને એના ચરણુમાં પડી શાંત કરવા લાગ્યો, વિદ્યાધરો અને ગંધર્વો આ મહા સુનિનો કોધ શાંત કરવા માટે મધુરનાં આકાશમાં ગાન કરવા લાગ્યા. એવા અનેક મધુર કેલાહલથી જેમ જેમ આ મનસ્વી સુનિનો કોધ શાંત થતો ગયો. એમ એમણે પોતાનું શરીર સંક્ષેપવા માંડયું. અનુકે વિષણુકુમાર સુનિ પોતાના સુળ સ્વરૂપમાં સ્થિત થયા. ચક્રવર્તીએ એમને ખમાવ્યા. એવી રીતે નમુચીનો ઉપસર્ગ નિવારી વિષણુકુમાર સુનિ ઉપાશ્રેય આવ્યા. આચાર્ય પાસે આવી એનું પ્રાયાશ્રત કર્યું. સંઘનું કાર્ય છોવાથી તેમને કાંઈ હોષ લાગ્યો. નહોતો તો પણ સ્વાધ્યાય ધ્યાન તેમજ ઈરિયાવહિ વડે શુરૂની સમક્ષ આલોચના કરી, છેવટે વિષણુકુમાર સુનિ શિવવધુના ભરતાર થયા.

આ મહાઉત્પાત શાંત થવા પછી જણે કરીથી જન્મ્યા હોય એવી રીતે સર્વે મનુષ્યો સારું જમણુ-હર્ષજમણુ જમતાં અને શુલ વસ્ત્ર પહેરી એક ખીજને જુહાર કરતા સુખશાતા પૂછવા લાગ્યા. એ હિવસ કાસ્તક સુદિ પડવાનો હતો ત્યારથી દરેક કાર્તિકી પડવે મનુષ્યોમાં જુહાર કરવાનો ને મનગમતાં હર્ષજમણુ જમી નવાં વસ્ત્ર પહેરવાનો રિવાજ થડ થયો. જે આજે પણ જગત્માં પ્રસિદ્ધ છે. આ વિષણુકુમારના દાંતથી

અન્ય ભતિઓએ જેડી કાદયું ને પોતાના શાસ્ત્રમાં એક મોટું પુરાણું ઉલ્લબું કરી “ સો યજ્ઞ કરનાર ખલિરાળને લગવાને વામનનું રૂપ કરી છુયો ને પાતાલમાં ચાંચ્યો. ” એ રીતે એ પુરાણું પ્રસિદ્ધ કર્યું.

એ મુનિસુવ્રત સ્વામીના તીર્થમાં રામ લક્ષ્મણને રાવણું આડમા ખગહેવ વાસુદેવ ને પ્રતિવાસુદેવ થયા છે. રામ લક્ષ્મણના સમયમાં એક ગૈતમનામના રૂષિ થયા છે. ન્યાયશાસ્ત્રના કર્તા આજ ગૈતમ હોય એ અનવાળેગ છે. મુનિસુવ્રતસ્વામીના મોક્ષગમન પછી છલાગં વર્ષે એકવીશમા નમિનાથનું મોક્ષગમન જાગ્યાવું એ નમિનાથના સમયમાં દશમા હરિષેણું નામે ચક્રી થયા ને એમના શાસનમાં જ્ય નામે ત્રણું હજર વર્ષના આયુષ્યવાગા અગોયારમા ચક્રવર્તી થયા.

એકવીશમા નમિનાથના મોક્ષગમન પછી પાંચલાખ વર્ષે નેમિનાથનું મોક્ષ ગમન સમજવું. નેમિનાથના સમયમાં છેદલા વાસુદેવ ખગહેવ ને પ્રતિવાસુદેવ શ્રીકૃષ્ણ, ખગહદને જરાસંધ થયા. એમના સમયમાં વ્યાસ રૂષિ થયા એમણે વેદોની રચના કરી. કે વેદો અત્યારે સુધારાવધારા સાથે પ્રચલિત છે. બાકી તો રૂષલહેવના સમયમાં એમણે રચેલા વેદો તો નવ તીર્થંકર પર્યાત રહ્યા. ત્યારપછી સંધ વિન્દ્યેટ જવાથી પ્રાણાશ્વાસોએ નવી નવી શુદ્ધિઓ રચી પોતાની માન્યતા ચાલુ કરાવી. કેથી જગતમાં લારથી સંયતિને બદલે અસયાંતિની પૂજા થઈ ને આજ સુધી લોકમાં ચાડે છે. તે પછી દ્વારા શીતલનાથ તીર્થંકર થયા પણ એમનો સત્ય ઉપદેશ એ પ્રાણાશ્વા

ભાસોએ માન્ય રાજ્યો નહી ને ત્યારથીએ જૈનોના નિંદક થયા છતાં લોળા લોકોને શરમાવી પોતે ગૃહસ્થ ચુડ તરીકે જગતમાં :પુણ્યા લાગ્યા. આએ, દાન વર્ગેરેમાં ઉત્તમ પાત્ર પોતેજ પોતાની જતને ગણ્યાવી જગતને ઠગવાવડે ધન એકદું કરવા માંડયું એમની પરંપરાએ રચાયેલી નવીનવી શ્રુતિઓને વ્યાસરૂષિએ એકઢી કરીને વેદની રચના કરી.

નેમિનાથના સમયનો કાગ એ તે સમયમાં ધાણોજ સુધે રેકો કાગ ગણ્યુતો. નેમિનાથ પ્રભુને કેવલજ્ઞાન થયા પછી એ વર્ષે મોક્ષનો માર્ગ ચાહુ થયો તે તેમની આઠપાઠ સુધી મોક્ષનો માર્ગ ચાહુ રહ્યો. એક હજાર વર્ષના આયુષ્યવાળા નેમિનાથના મોક્ષગમન પછી ૮૭૭૫૦ વર્ષે શ્રીપાર્વતીનાથ ભગવાન મોક્ષ ગયા. નેમિનાથ પ્રભુ મોક્ષ ગયા પછી કેટલેક કાળે પંજાખ-પાંચાળ દેશના કંપિલ્યપુર નગરમાં સાતસો વર્ષના આયુષ્યવાળા અંધાદા નામે ણારમા ચક્કવતી થયા. આ ભરતખંડમાં એ છેદલા ચકી થયા. છ માસમાં એમણે છ ખંડ પુરુષી તાણે કરી ભરતશેનના અધિપતિ થયા. નેમિનાથ અને પાર્વતીનાથના અંતરમાંએ ચકી થયા.

ત્રૈવીશમા તીર્થકર પાર્વતીનાથ કાર્શીના રાજ અખસેનના કુમાર હતા. એ રાજ પરંપરાએ ચાદ્યા આવતા નેમિનાથના શાસનમાં જૈનધર્મ પાળતો હતો. પાર્વતીકુમાર જ્યારે કુમારાવસ્થાને પાખ્યા તે અરસામાં કમઠનામનો એક પ્રાણીય પોતાની કંગાળ હાલતથી કંટાળી સંસારસુખની આશાએ તાપસ થઈ ગયો હતો તે કુરતો કુરતો અને પોતાની તપક્ષ્યર્થી સર્વને

આશ્ર્મિં પમાડતો કાર્શીનગરમાં જહીવીના કિનારા ઉપર આવી પંચાગિન તપ કરતો હતો એના અભિનદુંડના એક મોટા કાષ્ઠમાં એક વિષધર દગ્ધ થતો કોઈ જાણી શકયું નહી જેથી પાર્શ્વકુમારે લ્યાં આવી દ્વારા સમજાવવા કમઠને ઉપરેશ કર્યો... ખણું એ અશાન તપકરનાર કમઠ ઉલટો કોધવશ થયો તેથી પાર્શ્વકુમારે અનુચર પાસે એ કાષ્ઠને જયણુથી ઝડાવ્યું. ને લોકોની નજર આગળ અર્ધદગ્ધ સર્પ તરતજ ખાહાર નિકળી પડ્યો એ મૃત પ્રાયઃ થયેલો સર્પ પ્રલુનાં દર્શન પામી નવ-કાર સાંસળણવાવડે નાગકુમાર દેવલોકમાં ઈદ્રની પદવી પામ્યો આજે જે ધરેણુંદ્ર શાસન લક્ષિતનાં કામ કરી રહ્યો છે. અને તેમાંથી શ્રીપાર્શ્વનાથનો તો વિશેષ કરી લક્ત એવો જૈન શાસનમાં પ્રસિદ્ધ છે. જે જૈન સંધનાં કષ્ટ સાંસળણીને વારંવાર દોડી આવી સંધનાં વિસ્તો હૂર કરે છે એ ધરેણુંદ્ર એ નાગનો જ જીવ છે. પ્રલુના દર્શનનું એ ઝ્લ-માહાત્મ્ય છે.

શ્રીપાર્શ્વનાથ તે પછી દિક્ષા લઇ મૈનપણે વિચરવા લાગ્યા. એક દિવસ કોઈ તાપસના આશ્રમ પાસે કુવાની નજી-કમાં વડ વૃક્ષની નીચે રાત્રિના કાયોત્તસર્ગ ધ્યાને રહ્યા છે. એવામાં પેલો કમઠ તાપસ આજે આ હુન્યામાં નહતો એ તાપસનો ભવ પૂર્ણ કરીને બુવનપતિ નિકાયમાં મેધમાલી નામે દેવ થયો હતો. પ્રલુ ઉપર પૂર્વનું વેર સાંસારી એમને ઉપસર્ગ કરવાને દોડી આવ્યો. પોતાની દેવશક્તિથી વિવિધ પ્રકારના ઉપસર્ગ કર્યા પણું એ ભગવનું ઉપસર્ગથી ચલાયમાન ન થયા ધ્યાગનો વરસાદ વરસાન્યો, પછી હેત્યો વિકુલ્યા.

આખરે થાકીને મુશ્લધારે મેધ વરસાવ્યો. પૂર્ણીને જલમય કરી લીધી જલપ્રવાહ પ્રભુને ઢીંચણું પર્યાત, પછી જનું સુધી નાભી લગ્ની વધતાં વધતાં નાસિકાપર્યાત જલ આવ્યું. છતાં ભગવન્તો નિશ્ચત હતા. જે બધા વિશ્વનાં મનોવાંચિત પૂરવાને સમર્થ છે તે પ્રભુ જલમાં શી રીતે ઝૂણે !

એ સમયે ધરણેં દનું આસન કંપાયમાન થયું અને અવધિજ્ઞાનથી આ ઉત્પાત જાહી પોતાની દેવીએ સાથે ત્યાં ઢોડી આવ્યો. ભગવાન નીચે કુમલની રચના કરી નાગનું ઝૂપ કરી ભગવંતનું શરીર લપેટી મસ્તકે ઝણુાવડે છત્ર ધર્યું. જેમ જેમ પાણી વધતું જાય એમ કુમલ ઉંચે આવે પણું ભગવન ઝૂણે નહીં. કમઠ જલ વરસાવીને થાક્યો પણું ભગવનને ઝૂપાવી શક્યો નહીં. આ તરફ ધરણેં પણું અવધિજ્ઞાનથી કુમઠનો ઉત્પાત જાહી એની નિર્બંત્સના કરી.

કુમઠે ભયભીત થઈને પોતાની માયા સંકેતી લીધી ને ભગવંતને નમી પડ્યો શત્રુલાવે પ્રગટ થયેલા એ કુમઠે ત્યાં સમકિત પ્રાપ્ત કર્યું.

કુમઠ-મેધમાળી ઉપસર્ગ કરી રહ્યો ને ધરણેં દ લક્ષિત કરી રહ્યા છે. એવા શત્રુ અને મિત્ર બન્ને ઉપર જેમની સમાન મનોવૃત્તિ છે તે પાર્શ્વનાથ પ્રભુ જગતનાં વિઘ્નો દૂર કરે.

કેવલજ્ઞાન પામી સો વર્ષનું આયુષ પૂર્ણ કરી સમેત-શિખરના પાહાડ ઉપર પાર્શ્વનાથ મોદ્દે ગયા. આને પણ એ પહાડ પારસનોપહાડ એ નામે ઓળખાય છે, એ પાર્શ્વ-

નાથ પ્રભુને કેવલજીાન થયા પછી ગ્રણ વર્ષે મોક્ષનો માર્ગ શરૂ થયો ને તેમના સુકિતગમન પછી ચાર પાટ સુધીએ માર્ગ ચાલુ રહ્યો.

શ્રીપાર્થિનાથ પછી ચોવીશમા મહાવીર સ્વામી રૂપે વર્ષે મોક્ષ ગયા શ્રીપાર્થિનાથની પાટે શુલકરા ગણુધર થયા તેમની પાટે હરિદતજી થયા તેમની પછી ચોથા આર્ય સમુદ્ર થયા તેમની પછી પાચમા સ્વયંપ્રલસૂરિ થયા એ સ્વયંપ્રલસૂરિના શિષ્ય પિણીતાશ્ય મુનિને એક ખુદ્ધકીર્તિનામે શિષ્ય હતો એણે બ્યાદમત નામે એક નવીનમત ચલાવ્યો સ્વયંપ્રલસૂરિની પાટે છુટા કેશિકુમાર મુનિ થયા. અરમતીર્થંકર મહાવીરના સમયમાં આ કેશીગણુધર વિઘમાન હતા. એમણે રૈતાંખી નગરીના નાન્તિક પ્રદેશીરાજને ઉપદેશ આપી જૈન અનાવ્યો હતો.

એક દિવસ કેશીગણુધર અને ગૌતમસ્વામી અચાનક એકઠા થઈ ગયા. ધર્મચર્ચા કરતાં સરળ હૃદયના કેશીગણુધરે મહાવીરસ્વામીનો માર્ગ માન્ય રાખ્યો. વીર પ્રભુને કેવલ થયા પછી ચારવર્ષે મોક્ષનો માર્ગ શરૂ થયો ને તેમની પાટે ગ્રણ પાટ સુધીએ માર્ગ ચાલુ રહ્યો. આનંદ; કામહેવાદિક દશ તો મહાવીરના મોટા બારવતધારી શ્રાવક હતા. એ બધા વચ્ચમાં દેવતાનો એક અવતાર કરીને ગીજે લવે સિદ્ધિને વરશે તે સિવાય મહાવીરસ્વામીના સમયમાં નવજણે તો તીર્થંકરનામ-કર્મ ઉપાજ્ઞન કર્યું. જે આવતી ઉત્સર્વીણીમાં તીર્થંકર થા

મોદ્દે જરો. ^૧શ્રેણિક, ^૨મહાવીરના કાડા સુપાર્થનો જીવ. ^૩શ્રેણિક પૌત્ર ઉદ્યાયી રાજનો જીવ, ^૪પૈટિલાચાર્યનો જીવ^૫ શંખ શ્રાવકનો જીવ ^૬સત્યકીવિદ્યાધરનો જીવ, ^૭સુલસાનો જીવ ^૮રેવતિ શ્રાવિકનો જીવ ને ^૯ અંખડ તાપસ સુલસાની પરિક્ષા કરનારો એમ નવજણું શ્રી વીર પ્રભુના શાસનમાં તીર્થંકર પહવી પામ્યા છે. શ્રી મહાવીરના મોક્ષ જ.મન પછી ગ્રણ વર્ષને સાડા આઠ માસે પાંચમો આરો એકવીશ હજાર વર્ષનો એઠો. આ આરાની શરૂઆતમાં સાત હાથનું શરીર અને ૧૩૦ વર્ષનું આચુષ્ય પ્રમાણ જણુંનું,

એવી રીતે તેવીશ તીર્થંકરો બાર ચક્રવર્તી, નવ વાસુદેવ, નવ બ્રહ્માદેવ ને નવપ્રતિવાસુદેવ તેમજ નવનારદ એ ઇકાંતેર પુરુષો ચોથા આરામાં થયા તે પહેલા તીર્થંકર તો ત્રીજા આરાના અંતમાં થઈ ગયા છે એજ બાંહાંતેર પુરુષો થયા. અને બાર દૃદ્ધ મેળવતાં ૮૪ શલાકી પુરુષો થાય છે. એ બધા જૈનધર્મી જણુંબા નારહો પ્રથમ તો પરિપ્રાજક હોય છે. પણ પાછળથી ભાવનૈન થઈને આત્મસાધન કરી મોક્ષનો માર્ગ સાધે છે.

—૪૮(૧)૫૦—

પ્રકરણ જ મું.

ઇતિહાસ પરિચય.

વીશમા તીર્થંકર મુનિસુવતસ્વામી રાજગૃહી નગરીમાં જન્મ્યા હતા તેમજ છેલ્દો પ્રતિવાસુદેવ જરાસંધ પણ રાજ

ગૃહીમાં હતો. મહાવીરસ્વામીના સમયમાં મગધરાજ બિંબિ-
સારથણું રાજગૃહી નગરમાં રાજ્ય કરતો હતો પણ આ રાજ
ગૃહીએ જુદી જણાય છે. બિંબિસારની રાજ્યધાની રાજગૃહી તો.
એના પિતા પ્રસેનજીત રાજ્ય વસાવી હતી. પ્રસેનજીત રાજ
સુધી મગધનારાજાએની રાજ્યધાની કુશાચ્ચપુર ગણ્યાતી હતી.
એમાં આગનો ઉપક્રમ વારંવાર થવાથી મગધરાજ પ્રસેનજીતરા-
જાએ નવીન નગરી વસાવી એનું નામ રાજગૃહી રાજ્યનું. પ્રસેન-
જીતને શ્રેણિકુમાર વગેરે સો કુમારો હતા. એમાં શ્રેણિક ગાહી.
ઉપર આવ્યો. શ્રેણિક પ્રથમ બુદ્ધના સમાગમમાં આવવાથી યૌદ્ધ
થયેલો પણ અનાથી મુનિના દર્શનથી તેમજ ચિહ્નણુંના પ્રય-
તનથી શુદ્ધ જૈન થયો. એવામાં શ્રીમન વીરપ્રભુને કેવલજ્ઞાન પ્રાપ્ત.
થયું ને તે રાજગૃહી સમવસર્યા. મગધરાજ શ્રેણિક એમનો અન-
ન્ય ભક્ત થયો. માળિવાનો રાજ ચંદ્રપ્રદોત એમનો અવિરતિ
આવક હતો વત્સ દેશની કોશાંખીનો રાજ શતાનિક અને એનો
પુત્ર ઉદ્ધ્યન, સિંહુ સૌવિરદેશના વિત્તસથ નગરનો રાજ ઉદ્ધાર્યો
દશાર્ણ દેશનો દશાર્ણભદ્ર વિશાળનગરીનો. ચેટકરાજ, કાર્શી
અને કોશાલદેશ (અચોધ્યા) ના રાજએ ક્ષત્રીયકુંડનો નંદિ-
વર્ધનરાજ પોલાશપુરનો. વિજ્યરાજ, પોતનપુરનો પ્રસંગચંદ્ર
હિમાલયની ઉત્તરે પૃષ્ઠ ચંપાના શાળને મહાશાળ કનકપુરનો
પ્રિયચંદ, મહાપુરીનગરનો ખલરાજ, અને ચંપાનગરનો દા-
રાજ આદિ નૈન રાજએ એમના ભક્ત હતા.

શ્રેણિકના અભયકુમાર, મેધકુમાર, હંહ ને વિહંહુકુમાર,
નંદિબેણુકુમાર આદિ કુમારોએ શ્રી વીરપ્રભુ પાસે દીક્ષા લીધી

હતી. વિશાળાના ચેટકમહારાજની કુવરીએ મૃગાવતી, સુજોષ્ઠા, ચિહ્નાણ વર્ગેરેએ પણ મ્રત અહણુ કર્યાં હતાં. ધર્માં વર્ષપર્યંત શ્રેણિકે મગધનું રાજ્ય લોગવતાં જૈનધર્મનું આરાધન કર્યું; તે પછી એમનો પુત્ર કોણિકુ મગધરાજ થયો. એને ચંપાનગરી વસાવી ત્યાં રાજ્યાની સ્થાપન કરી. પોતાના ખાડુખલથી ત્રણ અંડ પૃથ્વી હંદાવી સર્વે શત્રુરાજાને જીતી તાણે કરી લીધા. ને અજતશત્રુ એ નામે પ્રસિદ્ધ થયો. એનો પુત્ર ઉદાયિ પણ એની પેઠે શ્રી મહાવીરનો લક્ષ્ણ હતો. અજતશત્રુ હૌદ્ધોનો હૃષમન હતો.

બુદ્ધના એક શિષ્ય દેવદત્તે બુદ્ધને વિનતિ કરી કે ભગવન् ! આપણે સાધુને વનવાસ, લુર્ણ વસ્ત્ર ધારણ, ગોચરીથી આહાર અહણુ અને માંસ ત્યાગ. એ ચાર નિયમ પાળવા પણ ગૌતમબુદ્ધે એ વચન માન્ય રાખ્યાં નહીં. એ પછી દેવદત્તે અજતશત્રુને આશરે આવી નવો મત કાઢ્યો પણ એ લાંબો સમય ટક્યો નહીં. અજતશત્રુ પણ ન્યારે વિજય યાત્રા કરવા નિકળ્યો. ત્યારે સાવથીનગરી કણને કરીને કપિલવસ્તુ જીતી લઈ એનો નાશ કરી નાળ્યો. એમના માંસાહાર આદિ દોષોથી એ ગુસ્સે થયો હોય એમ લાગે છે કે આવાં નવાં ધતીંગો હુન્યાને ઠગવાને માટે નહીં જોઈએ. હુન્યામાં એનું રાજ્ય એકછત્ર છતાં હૌદ્ધધર્મનો એણે નાશ કર્યો નથી.

કર્ષ વર્ષો પર્યંત જગતનું સામ્રાજ્ય લોગવ્યા પછી એનો પુત્ર ઉદાયી તખતનશીન થયો, પિતાના મરણુથી એ

નવા ચંપાપતિને ચંપામાં ચેન પડયું નહીં, વારંવાર એ પિતાને સંભાળીને શોકાકુલ રહેતો જેથી મંત્રીઓએ નવીન નગર વસાવાની યોજના કરી. તેને માટે યોગ્ય ભૂમિની તપાસ કરતાં ગંગાના કિનારા ઉપર એક સર્વોત્તમ ભૂમિ જોવામાં આવી. ત્યાં આગામી નવીન નગરની સ્થાપના કરી પાટલિપુત્ર એવું એ નગરનું નામ આપી ઉદાયી નરપતિએ ત્યાં શુદ્ધ ઝુંઝુતો રાજ્યગાહી સ્થાપી.

જેવી રીતે અન્નતશત્રુએ દીર્ઘકાલપર્યંત રાજ્ય લોગવ્યું એમ એના પુત્રે પણ લોગવ્યું, મહાવીરસ્વામીની હૃયાતિમાંજ શ્રેષ્ઠિક મરણ પામ્યો ને અન્નતશત્રુ ગાહીએ આવ્યો. મહાવીર પછી જૌતમસ્વામી કેવલજ્ઞાન પામ્યા. બાર વર્ષ પર્યંત કેવલી પર્યાય પાળીને મોક્ષે ગયા. એ સુધર્માં ગણુધરને વાંદવાને અન્નતશત્રુ મોટી ઝર્દી સહીત આવ્યો હતો.

જે વર્ષમાં શ્રીમહાવીર નિવાર્ણ પામ્યા એજ સમયમાં માળવાની રાજ્યધાની ઉજજયિની નગરમાં પાલકનો રાજ્યાભિષેક થયો. ને જ ખુસ્ત્વામીની પ્રભાવસ્વામીની સાથે દીક્ષા પણ એજ વર્ષમાં થઈ, શ્રીમનું મહાવીરની પાટે જૌતમ ગણુધર આવ્યા નથી પણ ખુદ ભગવંતે જ સુધર્માસ્વામીને પદ્મારોહણ કર્યા હતા જેથી જૌતમસ્વામીએ ગંધીનો ભાર સુધર્માસ્વામીને સાંપી મહાવીર પછી એમને પદ્મધર સ્થાપ્યા. શ્રીમહાવીર પછી વીશ વર્ષો જ્યારે સુધર્માં ગણુધર મોક્ષે ગયા તે પછી તેમની પાટે જ ખુસ્ત્વામી આવ્યા. દીર્ઘકાળપર્યંત જ ખુસ્ત્વામી કેવલીપણે વિચરી શ્રીમહાવીરથી ૬૪ વર્ષો મોક્ષે ગયા.

ભગવનને નિર્વાણ પામ્યાને ૬૦ વર્ષ થયાં ત્યારે મગધરાજ ઉદ્ધારી અપુત્ર મરણ પામવાથી મગધતું તખ્ત નંદ નામના એક પુરુષના હાથમાં આવ્યું. તેજ વર્ષમાં પાલકનો નાશ થવાથી માલવાનું રાજ્ય મગધની સાથે બળી ગયું.

એ નંદના વંશમાં અનુકૂમે નવ નંદ થયા. એ નવે નંદ કૈનધર્મના અનુયાયી અને પરાકર્મી હતા, એ પહેલા નંદના રાજ્યકાલની શરૂઆતથીજ તેમને કદ્યપક નામે એક મહા અમાત્ય હતો. એના વંશને અનુકૂમે નંદોનું મહા મંત્રીપણું કરતા આવ્યા. એ નાગરધ્રાણણ છતાં ધર્મે કૈન હતા.

જ્યારે નવમો નંદ પાટલીપુત્રના તખ્ત ઉપર આવ્યો તે સુમયે કદ્યપકવંશનો શક્તાગ નામે એને મહા અમાત્ય હતો. એ શક્તાગને શ્રીયક અને સ્થુલિલદ એવા એ પુત્ર હતા. તેમજ યક્ષાદિ સાત પુત્રીઓ હતી. નંદરાજની સલામાં વરડૃચિ નામે એક મહા વિદ્રાન ધ્રાણણ પંડિત હતો. તે સિવાય એક વ્યાડી નામે પણ પંડિત હતો.

વરડૃચી, વ્યાડી અને પાણીની એ ત્રણે એક જ ગુરુના શિષ્ય હતા. પાણીની મુર્ખ હોવાથી એને કંઈ આવડતું નહી. જેથી હિમાલય ઉપર જઈ તેણે તપ કર્યું ને શંકર નામના કેાઈ દેવનું વરદાન મેલવી એ પ્રખર પંડિત થયો. ત્યારપણી એણે અધાર્યાયી રચી જેની આગામ વરડૃચી આહિનાં વ્યાકરણ પણ નિસ્તોજ જણુવા લાગ્યાં.

એ વરડૃચિ પંડિત રૈજ રાજની સલામાં એકસો ને આડ

નર્તીન કાવ્યો ખોલતો, જેથી રાજી શક્તાળ મંત્રીના કહેવાથી ૧૦૮ સુવર્ણ મહોરો આપતો હતો. પ્રતિદિવસ આવી રીતે સુવર્ણ મહોરો આ પ્રાણમણુ લઈ જતો હોવાથી મંત્રીને ચિંતા પેડી કે આમ કરવાથી તો રાજી લંડાર ખાલી કરી નાખશે. જેથી એ વરડુચીના ક્ષેડોકો જુના છે એવું નંદરાજને સાખીત કરી અતાંથું ત્યારથી એ ૧૦૮ મહોરો મલતી વરડુચીને બંધ થઈ. વરડુચી પણ આ વેર મનમાં રાખીને એનો ઉપાય હૃથ લાગે ત્યાં લગી સમયની રાહ જેવા લાગ્યો.

ગંગા નહીંમાં ચંત્ર ગોઠવીને ૧૦૮ સોના મહોરોની થેલી રાખી પ્રલાતના સર્વ લોકની સમક્ષ વરડુચી ગંગાની સ્તુતિ ૧૦૮ ક્ષેડોક વડે કરતો અને એની કળ દ્યાવતો જેથી સુવર્ણ મહોરોની થેલી ઉચ્છળીને એના ખોગામાં પડતી હતી. એવી રીતે રાત્રીના એ થેલી મુદ્રા આવતો ને પ્રલાતના એ પ્રમાણે પ્રગટ કરવાથી વરડુચીની કીર્તિ બધે દૂલાધ ગઈ. રાજના સાંભળવામાં આ વાત આવવાથી એને ખંડુ આશ્વર્ય થયું. એણે મંત્રીને વાત કરી કે આ શું ?

મહા અમાત્યે એની પછવાડે છુપો જાસુસ મુદ્રાને એનું પેંકળ જાણી લીધું. એ ૧૦૮ મહોરોની થેલી કઢાવી લીધી. એને દિવસે પ્રાતઃકાલે રાજી સહિત મંત્રી તથા લોકો વરડુચીનો ચ્યામતકાર જેવા ગંગાને કિનારે આવ્યા. વરડુચીએ બડા આડંભરથી ગંગાની સ્તુતિ કરી કળ દ્યાવી પણ એ મહોરોની થેલી રેઝની માઝક એના ખોગામાં પડી નહીં. વારંવાર કળ

દખાવતાં છતાં પણ કાંઈ વળયું નહીં ત્યારે એ હજારેં માણસની મેદનીમાં આંખો પડી ગયો.

શક્તાગ મંત્રીએ પેઢી ૧૦૮ સુવર્ણ મહેરાની એકી વરરૂપી આગાગ રજુ કરીને કહ્યું “જે આ તારી સુવર્ણ મહેરા કે ? ”

વરરૂપીએ પોતાની સુવર્ણ મહેરા જેતાં જ એગાગી જે ના કહે તો ૧૦૮ મહેરા જતી રહે ને હા કહે તો જોંડા પડી જથ્ય. છતાં લોલવૃત્તિ ભગવાન હોવાથી એણે હા કહીને એકી લગ્ન લીધી, તે કપ્ટી લોકમાં તિરસ્કારને પાત્ર થયો.

એ શક્તાલ મંત્રીનો મોટો પુત્ર સ્થુલિલદ્ર રાજની માનિતી કોશા વેશયાને ઘેર રાત દિવસ પડી રહેતો, તેને ત્યાં સ્થુલિલદ્રને સંસારમુખ લોગવતાં બાર વર્ષનાં નહાણું વહી ગયાં. કાગાંતરે શક્તાલમંત્રીના સ્વર્ગિગમન પછી નંદરાજને શ્રીયકને ઓલાવી મંત્રીમુદ્રા આપવા માંડી ત્યારે શ્રીયકે હુથ જેડી વિનંતિ કરી કે “મારા મોટા ભાઈ સ્થુલિલદ્રજી કોશાને ઘેર રહ્યા છે, એમને ઓલાવીને આપો ? ”

શ્રીયકનાં વચન સાંભળી નંદરાજને સ્થુલિલદ્રને ઓલાવવાને કોશાને ત્યાં સીપાહીએ મોકદ્યા. કોશયાની રજી લઈ સ્થુલિલદ્ર નંદરાજની આગળ હાજર થયો એટલે એના પિતાનો વૃત્તાંત જણાવી મંત્રીમુદ્રા એને આપવા માંડી. સ્થુલિલદ્ર એડીકવાર વિચાર કરવાની રજી માર્ગી રાજને ઝડ વિચાર કરીને હાજર થવા કરમાયું.

સ્થુલિભદ્ર અશોકવાડીમાં જઈ વિચાર કરવા લાગ્યા. વિચાર કરતાં એમને વૈરાગ્ય ઉત્પન્ન થયો. ને પોતાને હાથે જ પંચમુદ્ધી લોચ કરી સાધુ નેવા થઈ રાજસભામાં આવી રાજને ધર્મલાલ આઈયો. સ્થુલિભદ્ર તે પછી સાધુ થઈને ચાહ્યા ગયા. ને રાજને મંત્રીમુદ્રા એમના નાના બંધુ શ્રીયકુને આપી. સ્થુલિભદ્ર સંભુતિવિજ્ય આચાર્ય પાસે આવીને એમની પાસે દીક્ષા અહણુ કરી અનુક્રમે ખહુશુત થયા. તે સમયમાં સંભુત-વિજ્ય અને ભાદ્રભાહુ ચૌદ્પૂર્વધર નૈનશાસનમાં સ્થંભ સમાન ગણ્યાતા હતા. સ્થુલભદ્ર પણુલિ ચૌદ્પૂર્વ સુધી ભણ્યા છેલા ચૌદ્પૂર્વી સ્થુલીભદ્રજ ગણ્યા.

મહાવીર સ્વામી પછી ૬૪ મેં વર્ષે જાંબુન્નામી મોશે ગયા તે પછી તેમની પાટે પ્રભવસ્વામી ત્રીજા પદૃધર થયા. પ્રભવસ્વામી વિધ્યાચળ પર્વતની સમીપે આવેલા જયપુર નગરના રાજ વિધ્યના પુત્ર હતા. પ્રભવ યુવરાજ હતો. તે સિવાય એને લધુ બંધુ પ્રભુનામે હતો. ભવિતવ્યતાથી વિધ્યરાજને યુવરાજ પ્રભવને રાજ્ય નહી આપતાં નાના પુત્ર પ્રભુને રાજ્ય આઈયું. જેથી માની પ્રભવ પિતાના નગરનો ત્યાગ કરી વિધ્યાચળની સમીપ ભૂમિમાં એકગામ વસાવીને રહેવા લાગ્યો. લુંટકાટ કરી પોતાની આજુવિકા ચલાવવા લાગ્યો. અનુક્રમે ૫૦૦ ચોરોનો એ પ્રભવ સરદાર થયો. એક દિવસ તેઓ બધા જાંબુન્નામીનું ધર લુંટવાને આવ્યા. ત્યાં જાંબુકુમારનો ઉપદેશ સાંશળી કો જર્દે વૈશાખવંત થયા ને એમની સાથે દીક્ષા લેકું આત્મ કલ્યાણ આઈયું. એક વર્ષતનો મહાન લુંટારાનો સરદાર નૈન ધર્મનોને

શ્રીમહાવીરનો ત્રીજે પદ્મધર ચૈદપૂર્વનો જાણ થયો. જંખું સ્વામીને સુધર્મા સ્વામી મોક્ષ ગયા કે ડેવલરાન થયું ને શ્રીમહાવીર પછી ૪૪ મેં વર્ષે પ્રભવ ચૈદપૂર્વના જાતા થઈ ખુગપ્રધાન થયા. ખુગપ્રધાને એકાવતારી હોય છે.

શ્રી મહાવીર પછી ચોસઠમેં વર્ષે જંખુસ્વામી મોક્ષ ગયા તેજ વર્ષમાં શાખ્યંભવ નામના રાજગૃહીના સમર્થ પ્રાણાંધુને પ્રભવસ્વામીએ પોતાની પાટે સ્થાપવા સારું દીક્ષા આપી. તે ચૈદપૂર્વના જાતા થયા. વીર પછી ૭૦ મેં વર્ષે પ્રભવ સ્વામી શાખ્યંભવસ્તૂરિને પોતાની પાટે સ્થાપી સ્વર્ગલોકમાં ગયા. ચૈદપૂર્વના જાણ જધન્યથી છફું દેવલોક સુધી જઈ શકે છે.

નવમા નંદના સમયમાં ભાડખાડુ અને સંભૂતિવિજ્ય વિદ્યમાન હતા એ સ્થુલિલદે રાજસભામાંથી નિકળીને સંભૂતિ વિજ્યપાસે વીર સંવત ૧૪૬ માં દીક્ષા અહંકૃ કરી એ આપણે જોઈ ગયા. એ નવમાનંદ પછી પાટલીપુત્રની ગાઢી ઉપર મૌર્ય-વંશીય ચંદ્રગુમ્બ ભારત સાદ્ર થયો.

— ● —

પ્રકુરણુ ૮ મું.

આણુક્યની ચતુરાધ.

આણુક્ય નામનો પ્રાણાણ નિર્ધનાવસ્થાથી કંટાગીને ધન કર્માવાને નિકળ્યો. એણે સાંભળ્યું કે પાટલીપુત્રમાં નંદ-

રાજ પ્રાક્ષણુને સુવર્ણ આપે છે. જેથી તે એ હિશા તરફ ગયો; દૈવયોગે નંદના દ્વારપાલોએ તેને નહી અટકાવવાથી તે રાજ-મહેલમાં ધુની જઈ નંદરાજના સિંહાસન ઉપર એસી ગયો. એવામાં સ્નાન કરીને અનેક પ્રકારના આભૂષણુને ધારણુ કરતો રાજ નિમિત્તિઓનો હાથ પકડીને ત્યાં આવ્યો તો ચાણુક્ય પ્રાક્ષણુને આસન દખાવીને એઠેલો જોઈ નિમિત્તિયે રાજને કહ્યું. “ હેવ ? આવી રીતે એઠેલો આ માણુસ તારા રાજ્યનો નાશ કરનાર થશે માટે મીઠા વચનથી આ પ્રાક્ષણુને ઉદ્ઘાડો કેમકે અચિનને સળગાવવાથી તો હાનીજ થાય. ”

રાજના હુકમથી દાસીએ ખીંચું આસન આપી ચાણુક્યને કહ્યું. “ હે પ્રાક્ષણુ ? તું આ આસન ઉપર બેસ ? અને મહારાજનું આસન છોડી હે ? ”

એ આસન ઉપર ચાણુક્ય પોતાનું કમંડલ સુકતાં બોલ્યો. “ આ આસન ઉપર મારું કમંડલ રહેશો. ”

દાસીએ ત્રીંખલાં આસન સુક્યું તો તેંઉપર તેણે પોતાનો ત્રિંદ મૂક્યો. એવી રીતે જેટલાં આસન સુકવામાં આવ્યાં તેટલાં એણે જુહી જુહી વસ્તુઓથી રોકી લીધાં.

રાજ ચાણુક્યના આવા વર્તાનથી ગુસ્સે થયો, ને તેના પગ પકડી એને જમીન ઉપર પણાડ્યો. ગુસ્સે થયેલા ચાણુક્યે પ્રતિશા કરી કે. ” “ હે રાજન્ ? તારાવંશ સહિત તને રાજ્ય પરથી જડ મૂલથી ઉઘેડી નામીશ્ચ ત્યારેજ તને હું છોડીશ. ”

“ ન તારાથી થાય તે કરજે; ભામટા ? ” એવી બોલતાં

નંદના સુલોટોએ ગરહન પણીને એને ખાડારંકાળી મુક્યો.

નગરની ખાડાર નિકળેલો ચાણુક્યં જ્યારે એનો બુસનો શાંત થયો ત્યારે મનમાં વિચાર તો થયો “ અરે ! મેં કેવી આકરી પ્રતિજ્ઞા કરી ? કોધને વશ થઈ આવી વિષમ પ્રતિજ્ઞા કરેલી કેવી રીતે હું સિદ્ધ કરીશ કે થયું તે ખરું પણ હવે પ્રતિજ્ઞા તો મૂલ્ય કરવી નોઈએ કેમકે રણુસંઘામમાં મરણું, પણ લોકમાં હાસીને પાત્ર થઈને તો નજ લુવવું. મને યાદ છે કે ખચ પણુમાં જ્યારે મારો જન્મ થયો તે વખતે મારી દાઢનું વૃત્તાંત અમારા શુરુ સાગરસ્તુરિ નામના પ્રણ્યાત આચાર્યને મારા પિતાએ એનું ફ્રલ કંઈ પુછેલું. ત્યારે શુરુએ કહેલું કે “ તારો પુત્ર મહાખુદ્ધિવાન અને મહોટો શાન થશો. ”

પણું પિતાએ નરકને આપનારું રાન્યે સમજુ મારી દાઢો પાંચીકાથી ઘર્સી નાખી. અને તે હકીકત ફરીને શુરુને નિવેદન કરી. તેથી શુરુએ પિતાને ઠપકો આપ્યો “ હે લદ ! તો આ શું કર્યું ! પ્રાણીઓએ જેવું કર્મ કર્યું હોય તેવું અવશ્ય લોગવું પડે છે. તો ખાલકની દાઢાએ. ઘર્સી નાખીછે છતાં કોઈને આગેવાન કરીને એ મોટું રાન્યે લોગવશો. ” પૂર્વે સાંભળેલી એ વાતો અત્યારે સમરણુમાં આવે છે માટે મારે પ્રયત્ન કરવો એજ કર્તાવ્ય છે. હેઠળ પાતયામિ વા કાર્ય સાધયામિ.

અસ સ્તોર્ય કદાચ પરિશ્રમમાં ઉણો, પુઢ્યી ઉલટાઈ જય પણું મારું વચ્ચે કહિ નિષ્ઠ્રણ ન થાય. ” ઈત્યાદિ વિચાર કરતા

ચાણુકયે પરિપ્રાજનકનો વેશ ધારણુ કરી જ્યાં ત્યાં પરિષ્ઠમણુ કરવા માંડયું. તે નંદરાજના મયુરપોષકેના ગામમાં ગયો તે સમયે મયુરપોષકેના નાયકની પુત્રીને ગર્ભ રહ્યો હતો એને ચંદ્રનું પાન કરવાનો દોહ્દદ ઉત્પન્ન થયો હતો. પણ એની એ અલિલાષ પૂર્ણ ન થવાથી યમને વેર જવા જેવી થઈ ગઈ હતી.

નાયકે ચાણુકયને વાત કરવાથી એ ગર્ભ પોતાને આપવાની શરતે એણે નાયકની પુત્રીનો અલિલાષ ખુદ્ધિ પૂર્વક પૂર્ણ કર્યો.

ચાણુકય ત્યાંથી ધાતુઓની ખાણમાં ગયો ત્યાં ધાતુવાર્તી લોકો પાસેથી ધણું દ્રવ્ય ઉપાર્જન કરી પાછો આવ્યો તો એક બાળક રાજ બનીને છોકરાયો. સાથે રમત કરતાં જોયો. અત્યાંત ગર્વિષ ઓવા તે બાળકની સુંદરતા, ચાલાકી જોઈ ચાણુકય ખુશી થયો. એ બાલક પાસે જઇ તે ઓહ્યો “ દેવ ? હું પ્રાણણ છું મને પણ કંઈક આપોને ? ”

“ અરે પ્રાણણ ? ચા ગાયોનાં ટોળાં અરે છે એ તું લઇ જા ? ” એ ગર્વિષ બાલકે કહ્યું.

“ તો તો એના માલિકો મને મારીજ નાખેને ? ”
ચાણુકયે કહ્યું.

“ અરે શું તું નથી જાણુતો કે પૃથ્વી તો તલવારને અળે લોગવી શકાય છે ? ” બાલકના શૂરવીરતાનાં વાક્ય સાંશળી ચાણુકયે તપાસ કરી કે ‘ આ બાલક કેનો છે ? ’

તેને ખખર પડી કે “ આ બાળક ગામના નાયકની

હિકરીનો હિકરો છે ને એનું નામ પણ ચંદ્રગુપ્ત ? એ ગર્ભમાં હુતો ત્યારથી એને એક પરિવ્રાજકને અર્પણ કરી હીધો છે ” એ સાંભળીને ચાણુાક્ય ખુશી થઈ બાળક પાસે આવ્યો.

“ હે વત્સ ? આવ ? આવ ? મારી પાસે આવ ? તું જે પરિવ્રાજકને અર્પણ કરાયો છે તે હું પોતેજ છું, મારી સાથે ચાલ હું તને ખરેખરે રાજ ઘનાવું, આવા રમતના રાજ્યથી તારું શુ વળવાનું છે. ” એમ કરી ચાણુાક્ય તે બાળક ચંદ્રગુપ્તને અઈ ત્યાંથી ચાલ્યો ગયો, ધાતુવાદથી મેળવેલા દ્વયથી એણે ચતુરંગી સેના સર્જું કરીને ચંદ્રગુપ્તને રાજ કરી સ્થાપ્યો. અને પોતે એનો મહામંત્રી થયો.

એ સકલ સૈન્યની સાથે એણે પાટલિપુત્રને ઘેરી લીધું એટલે નંદરાજ પોતાની સર્વે સામચી સહિત નગર ખડાર આવ્યો. ને યુદ્ધમાં ચંદ્રગુપ્તનું લશ્કર છિન્ન લિન્ન થઈને પલાયન કરી ગયું જેથી પોતાનો પરાભવ જાણીને ચાણુાક્ય પણ ચંદ્રગુપ્તને લઇને નારી ગયો. નંદરાજએ ચાણુાક્યને પકડવાને સ્વારો હોડાવ્યા એને પકડી લાવનારને મોઢું છનામ જહેર કર્યું.

ચંદ્રગુપ્ત અને ચાણુાક્ય પગપાળા ચાલતા એક તલાવની પાણ ઉપર આવ્યા એટલામાં તેમની તપાસ કરતો એક ઘોડેસ્વાર એમની તરફ આવતો ચાણુાક્યે જેયો જેથી ચાણુાક્યે ચંદ્રગુપ્તને પાણીમાં દુષ્કરી મારી સંતાઈ જતા કહું તે સુજખ ચંદ્રગુપ્ત પાણીમાં અદૃશ્ય થઈ ગયો. ને પોતે ઘોણી ઘની કૃપદાં ઘોલા લાગ્યો. એ દરમિયાન તે ઘોડેસ્વાર લાં આવી

પહેંચ્યો એણે ધોખીને પૂછ્યું “ અરે ? તે અહીંથી ચાણુાક્ય અને ચંદ્રગુમને નાશી જતાં જોયા ? ”

“ ચાણુાક્યની મને ખખરસ નથી પણ ચંદ્રગુમ તો આ તલાવના જલમાં અહૃદ્ય થયો છે ? ” તે ધોખી અને લાચાણુાક્યે કહ્યું.

તરતજ ધોડેસ્વાર ધોડા ઉપરથી નીચે કુઠી પણો ને ધોખીને ધોડાની લગામ પકડી રાખવા કહ્યું ત્યારે ધોખી ઓછ્યો ” મહેરભાન ? હુંતો આવા ધોડાથી ડર્ઢ છું માટે ધોડાને જાડ માંચ બાંધ્યો ? ”

ધોડાને જાડ સાથે બાંધી તલવાર અને વસ્ત્ર કિનારા ઉપર સુક્રી તે તલવારમાં પગ સુકે છે તેટલાનાં પાછળાથી ચાણુાક્યે તેનીજ તલવારથી એને મારી નાણ્યો.

ચાણુાક્યે તે પણી ચંદ્રગુમને બહાર ઓલાવી તે મરનારના ધોડા ઉપર એસાડી પોતે પણ ચડી ઝેડો ને ત્યાંથી પસાર થઈ ગયા.

એક ગામની નળુક આવી પહેંચ્યા ત્યાં ચંદ્રગુમને કક્ષીને ભૂખ લાગેકી તેથી ચંદ્રગુમને ગામ બહાર ઉધાનમાં સુક્રી પોતે ગામમાં ચાણ્યો, માર્ગમાં મરવાને આતુર થયેલો ને નશીખનો કુટેલો એક પ્રાણી કંઠ પર્યેંત જમીને પેદ ઉમર હાથ ફેરવતો આવતો હતો, અતિશય ખાવાથી એનું ગાગર જેવડું પેટ ક્ષાડું ક્ષાડું થઈ રહ્યું હતું એને ચાણુાક્યે પૂછ્યું “મહારાજ ! આ ગામમાં કયાંય જમવાનું મળે કોમ છે કે ? ”

“ હું ધણ્યંય ? આજે ગામમાં એક યજમાનને ઘેર મહોત્સવ હોવાથી અતિથિઓને દર્હાની કરાયો વિશેષ પ્રકારે આપે છે તો તું પણ જઈને જમી આવ ? જો આ હું પણ જમીને ચાલ્યો આવું છું ? ” ગાગર સમા પેટ ઉપર હાથ પંપાગતાં ભટ્ટળુ બોલ્યો ને પેટ ખતાવ્યું.

ભટ્ટળુનો જવાબ સાંસારિ ચાણુકયે વિચાર્યું કે “ ચંદ્ર શુસ ઉધાનમાં એકડો છે અહીયાં હું પણ ગામમાં જઉંછું વાગી નંદરાજનો કોઈ માણુસ મળે તો જો કુમળાણતી ? તેમજ જો ત્યાં ચંદ્રશુસ પકડાઈ ગયો તો પકી સારું સર્વસ્વ નાશ પામશે. માટે મારે તો આની પાસે કરાયો મંગાવી લઈ ચંદ્રશુસની કુધા મટાડવી જોઈએ. ” જેથી પ્રાણણુને કરાયો કેવા મોકદ્યો જે લઈને એનાથી ચંદ્રશુસની ભુખ મટાડી.

ત્યાંથી ચાણુકય ચંદ્રશુસને લઈને આગળ ચાલ્યો તે સાયંકાળે એક સભ્રિવેશમાં-રખારીના નેસડામાં આવ્યો ને જલ્દાને માટે કોઈ વૃદ્ધ રખારણુને ઘેર ગયો.

હૈવયોગે તે રખારણે પોતાના ખાગડેને જમવા થાગીમાં અત્યાંત ઉષ્ણ રાખ પીરની હતી. તે ઉષ્ણ રાણમાં એક ખાળું હાથ નાંખ્યો. હાથના દાંડવાથી તે ખાળું ચીસ પાડી. જેથી રખારણ ગુસ્સે થઈને બોલી કે “ અરે સુર્ખી ? તું પણ ચાણુકય જેવો ખુદ્દિ રહિત જણ્યાય છે શું ? ”

ચાણુકય આ શાબ્દો સાંસારિને ચમકયો તેથી એણે એ વૃદ્ધ રખારણ પાસે આવીને કહ્યું. ” ડોસ્તી મા ! તમે જે ચાણુકયની ઉપમા આગી એ ચાણુકય તે કોણુ ! ”

“ એ ચાણુકય ચંદ્રગુપ્તને આગળ કરીને પાઠલીપુત્રને
જીતવા જનાર ! નંદરાજને જીતવા જતાં બિચારો પોતેજ
જીતાઈ ગયો ! ” ડાસી એટલું બોલીને હસ્તી.

“ હાર જીત તો દૈવાધિન કહેવાય ! એમાં તમે હુસ્યાં
શું માતાજી ! ”

“ એની મુર્ખતા પર ! ” ડાસી ફરીને બોલી.

“ એની મુર્ખતા ! કઇ એની મુર્ખતા વાર્ડ ? ” ઉત્સુ-
કૃતાથી ચાણુકયે પૂછ્યું.

“ એ ચાણુકયે એકદમ પાઠલીપુત્રને વૈચ્ચું તે ? ”

“ તો ત્યારે બીજું એને શું કરવું ઉચ્ચિત હતું
માતાજી ? ” ડાશીની વાતમાં ચાણુકયને રસ પડવા માંડયો.
એને લાગ્યું કે આની પાસેથી કંઈ નવીન ચુક્તિ મળશે.

“ એ મૂર્ખ ચાણુકયે એમ ન વિચાર્યું કે પ્રથમ આસ-
પાસનો સુલક વશ કરીને પઢી રાજ્યધાની ઉપર ચઢાય તો
અદ્ય પ્રયાસે ઝર્ટેકું થાય. તેવી જ રીતે આ છોકરાએ પણ
પ્રથમ અડાએ પડાયેથી ચાટયા વિના એકદમ વચ્ચમાં
હાથ નાખ્યો. ” ડાશીનાં વચ્ચન સાંસળી ચાણુકયની બુદ્ધિ
ઠેકાણે આવી એને લાગ્યું કે ડાશીનું વાક્ય સત્ય હતું. એના
કદ્દા પ્રમાણે કર્યું હોય તો કદાચ ઝાવી શકાય. બાલક થકી
પણ હિતકારી વચ્ચન અહુણું કરવું એ નીતિ છે કેનેથી નંદરાજનું
રાજ્ય મેલવવામાં એ રખારણું વચ્ચન એણે અગીકાર કર્યું.

ચાણુકયે તે પઢી ફરીને લશકર એકદ્દું કરવા માંડ્યું.

ને ચંદ્રગુપ્તને તેનો અધિક્ષર બનાવ્યો. કોઈ મોટા રાજની સહાય લેવા ચાણુકય હિમવત્કૃટ (હિમાવય) પર્વત ઉપર અયો ત્યાં બિલલોનો નાયક પવંતક નામે રાજ હતો. એની સાથે મિત્રાઈ કરી લીધી. એક દિવસે ચાણુકયે એ પર્વતકને પોતાનો ઉદ્દેશ કહી સંભળાવ્યો તેને કલ્યુ કે “ જો તમે મદ્દ કરો તો નંદનું રાજ્ય જડમુગથી ઉઘેડી નામી એની લક્ષ્મી આપણે બન્ને વહેંચી લઈએ. ”

પર્વતે ચાણુકયનું વચન અંગીકાર કર્યું. એ થોડા દિવસમાં પોતાના સકલ સૈન્ય સહિત સુજગ થઈને ચાણુકય સાથે ચાહ્યો. આગળ ચંદ્રગુપ્ત પણ સૈન્ય સહિત એમને મલ્યો. મોટા સૈન્ય સાથે ચાણુકય, ચંદ્રગુપ્ત અને પર્વતક નંદરાજના મુલકમાં આવી પહેંચ્યા. આગ્રપાસનો મુલક સાખી લઇને નંદરાજના એક મોટા નગરને ઘેરો ઘાડ્યો, પણ એ નગર સ્વાધિન થયું નહીં, તેથી ચાણુકય પરિવાજકનો વેશ લઇને એનું કારખું શોધવાને નગરમાં હાખલ થયો. લમતાં લમતાં એણે સારી રીતે પ્રતિષ્ઠિત થયેલી હેવીએની મૂર્તિએ બેઘ, એને લાગ્યું કે ખરેખર આ મૂર્તિએના પ્રભાવથી જ આ નગર ભાગી શકાય તેમ નથી. મારે આ મૂર્તિએનું ઉત્થાપન શી રીતે થાય ? એનો ઉપાય ચિંતવના લાગ્યો.

ધળ્યા દિવસનાં ઘેરાથી લોકો કંટાળી ગયા હતા જેથી રઘવાયેલા લોકોએ આવીને આ પરિવાજકને પૂછ્યું. “ ભગવન् ! આપ કહી શકશો—આ નગર ઉપરથી આકૃત ક્યારે ફૂર થશે તે ? ”

ચાણુકયને અનાયાસે તક મલી ગઈ, એણે પ્રસંગતા પર્વત કહ્યું. “ જો તમારે નગરને આદૃતથી સુકૃત કરવું હોય તો આ હેવીઓની મૂર્તિઓને ઉત્થાપે ? જ્યાં સુધી આ હેવીઓ બેઠેલી છે ત્યાં લગી આદૃત પણ તમારા ઉપર ચોટેલી છે એ નક્કી સમજને ? ”

ચાણુકયનાં વચન સાલગીને નગરજનોએ મૂર્તિઓ ઉત્થાપવા માંડી, તેમ તેમ ચાણુકયના સંકૃતથી ચંદ્રગુપ્ત અને પર્વતક ફૂર ચાદ્યા ગયા. જેથી નગરજનો હુર્ષ પામ્યા ને મૂર્તિઓ ઉઘેડી ખાડો કરી નાખ્યો..

શ્રાડીવાર પઢી ચંદ્રગુપ્ત અને પર્વતે એ નગરી ઉપર હુલ્લો કરીને જીતી લીધી. એ નગરીનો લાંગ કરી શેષ રહેલો બાકીનો દેશ જીતીને મોટા લશકર સાથે એ બન્ને રાજીઓએ ચાણુકયને આગળ કરીને પાટલીપુર નગરને વેરી લીધું. અભિ-માનમાં અંધ થયેલો નંદરાજ લશકર સહિત લડવાને આવ્યો, પણ એના પુણ્યનો ક્ષય થવાથી યુદ્ધમાં હારીને એનું લશકર નારી ગયું ને રાજ નિર્ણય થયો છેલ્લી ઘડીયે નંદ પકડાયો ત્યારે એણે ચાણુકયની દ્વારા મારી એની પાસેથી જીવિતદાન માર્યું. ત્યારે ચાણુકયે કહ્યું. “હે નંદ ! તો મને ગરદન પકડીને સલામાંથી બાહુર કાઢ્યો. હતો પણ હું તો તને જીવિતદાન આપું છું તેથી ખુશીથા ? અને એક રથમાં તારી મરળું પડે તેટલું દ્વય લઈને બાહુર નીકળા, તને ડેઝ ઉપરવ કરશે નહીં. ”

ચાણુકયનાં એવાં મર્મલેદી વચન સાંસળીને વિજળીના જેવી ચંદ્રા રાજ્યલક્ષ્મીને ધિક્કારતો પોતાની એ સીઓ, એક પુત્રી

અને સારાં સારાં રતનો ભરીને રથ તૈયાર કર્યો. એક વિષ ક-
ન્યાને શત્રુ ઉપર વેર લેવાની ખાતર ધરમાં રાગી આડીની
સાર વસ્તુઓ નંદરાજને લઈને રથમાં ભરીને તે ચાલતો
થયો. નંદરાજનો રથ ચાલતો હતો તેવારે નંદની પ્રિયપુત્રી
ચંદ્રગુમને જોઇને મોહ પામી, આતુરનયને અને જેવા લાગી.
તે જોઇને નંદરાજને એને રથ ઉપરથી ઉતારી ચંદ્રગુમ પાસે
મોકલી હીધી. ને પોતે ચાહ્યો ગયો.

નંદપુત્રી પિતાના રથ ઉપરથી ઉતરીને ચંદ્રગુમના રથ
ઉપર ચડવા લાગી તે સમયે ચંદ્રગુમના રથના ચક્કનાં નવ
પાંખડાં લાંગી ગયાં. જેથી ચંદ્રગુમ અપશુકન માની
એને અટકાવવા લાગ્યો. લારે ચાણુાક્ય ઓછ્યો “વત્સ !
આતો શુલ શુકન થયા, એને અટકાવતો ના ? ”

“ કેવી રીતે શુલ શુકન સમજવા ! ” ચંદ્રગુમને પુછ્યું.

“ તારાથી લઈને નવ પહેડી સુધી તારું રાજ્ય શત્રુ
રહૃત નિષ્કંટકપણે ચાલશે ” ચાણુાક્યે કહ્યું. ચાણુાક્યનાં
બચન સાંભળીને નંદપુત્રીને ચંદ્રગુમને રથમાં એમાડીને રથ
નગરમાં દાખલ થયો.



પ્રકરણ દ મું

ચંદ્રગુમ.

ચંદ્રગુમ અને પર્વત ખલ્લને નંદરાજના મહેલમાં આવ્યા, ત્યાં નંદરાજની વિષકન્યાને લેઇને પર્વત એની ઉપર મોહી પડ્યો. જેથી એના સ્પર્શ માત્રથી એર ચડવાવડે પર્વતનો નાશ થયો. ને એનું રાન્ય પણ ચંદ્રગુમના હાથમાં આવ્યું. ચંદ્રગુમ એવી રીતે મોટા રાન્યનો ધણી થયો, શુલ સુહુર્તે ચાણુાકયે ચંદ્રગુમનો રાન્યાલિષેક કર્યો પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ થવાથી એણે પોતાની શિણા છોડી. વીરનિર્વાણ પણી ૧૫૫ વર્ષો વીત્યા પણી ચંદ્રગુમ મગધસાહ થયો. ચતુર ચાણુાકય એનો મહામંત્રી થયો.

મયુરપોષકના નાયકને સુરા નામે પુત્રી હતી, એ સુરાને પુત્ર ચંદ્રગુમ હોવાથી ચંદ્રગુમનો વંશ મૌર્યવંશ કહેવાયો. તે પણી ચાણુાકયે રાન્યની વ્યવસ્થા તરફ લક્ષ્ય લગાડ્યું. કેટલાક નંદરાજના અનુક્ષવી પુરુષો વિષમ પ્રદેશમાં રહીને રાન્યમાં ચોરી કરી ચંદ્રગુમને છેરાન કરતા હતા જેથી નગરની રક્ષા કરવામાં સમર્થ એવા એક કોલિક નામના કુટ બુદ્ધિને ટેટવાલ બનાવ્યો; એ કોલિકે વિશ્વાસ પમાડીને લોજનાદિકનો સત્કાર કરવાના ખાને ચોર ખનેલા નંદરાજના માણસોને ઓલાવીને મારી નાખ્યા. ચાણુાકયની બુદ્ધિથી ચંદ્રગુમનું રાન્ય એવી રીતે નિષ્કંટક થયું.

ચાણુકયે ત્યાસ્તપદી પોતાની સ્વી તેમજ કુટુંબને તેડા-
નીને પાટલીપુત્રમાં અપાર સુખમાં રાહયાં. ચાણુકયની સ્વી
પોતાના પતિનો રાંજ સમેત વૈભવ જેણને ખુશી થણું.

પૂર્વે એક દિવસ પોતાની ગરીબીમાં ચાણુકયના સસ-
રાએ એની સીનું અપમાન કરેલું એ સસરાએ ચાણુકયને
રાજનો મહામંત્રી જાણ્ણી એની પાસે આવીને પોતાનો અપરાધ
અમાવ્યો “હે જમાઈ? પહેલાં અમારા પુત્રના વિવાહ વખતે
તમારી સીને (અમારી પુત્રીને) આ નિર્ધનની સ્વી છે એમ
જાણ્ણી અમેાચે એનો સત્કાર કર્યો નહોતો. એને નિમિત્તે
અમે તમારોજ તિરસ્કાર કર્યો છે, તો અમારા ઉપર કૃપા
કરીને એક વખતને માટે તમે માફ કરનો.” સસરાની આવી
પદ્ધતાપવાળી લાગણી જેણે ચાણુકય પણ એની ઉપર પ્રસન્ન
થયો. મહાન પુરુષો નમેલા ઉપર હુમેશાં પ્રસન્ન જ થાય.
સમયને જાણુનારા ચાણુકયે પોતાના સસરાને તેમજ બીજા
સંખ્યાઓને એમની ચોઘ્યતા સુનાખ ગામ વગેરે આપીને
સુખી કર્યા. જગતમાં ઉગતા સૂર્યને ડોણ નથી નમતું ?

ચંદ્રગુરૂનો રાજ્યભાંડાર ખાલી જેણ ચાણુકયે ચુકિત
પ્રચુકિતથી એ ભાંડાર ભરપુર કર્યો.

ચંદ્રગુરૂત રાજ્યવ્યવસાયમાં પડ્યો, મિથ્યાત્વી ખ્રાસાણ
વગેરેનાં શાસ્ત્ર સાંભળી તે ઉપર એને પ્રીતિ થવા લાગી. તે
જાણુને એક દિવસ ચાણુકયે તેને એકાંતમાં કહ્યું. “ વત્સ ?

એવા ધર્મનું પાતન કરવું કે નથી પાપથી લેપાચેલ આત્મા પણ ભવસાગર તરવાને સમર્થ થાય ? બાકી તો પાખંડી, ધર્ત લેકોએ આજીવિકા માટેજ વ્રત ધારણ કરેલાં હોવાથી તેમનાથી તારે હુંમેશાં હુર રહેવું ? ”

“ આપ કયો ધર્મ આરાધવા કહો છો ? ” ચાણુક્યને અંદ્રગુપ્તે પૂછ્યું.

“ હું તો જૈનધર્મનો અનન્ય લક્ત છું. દરેક ધર્મવાળાએ કરતાં એ ધર્મમાં મને કંઈ અધિક મહુત્વ સમજાય છે. તેમજ મારા કુલ પરંપરામાં પણ એ જૈનધર્મજ ચાહ્યો. આવે છે. ”

“ મારું મન પણ એવા સારા ધર્મને મારે આતુર થાય છે પણ કંઈક પરીક્ષાપૂર્વક એની ખાતરી થાય તો હીક ? ”

“ તારું કહેવું વાસ્તવિક છે. કેમકે અજાનરૂપ અંધકારમાં ફેસેલા કેટલાક શુરૂઆ સુર્ખ ખલાસીએની માઝેક પોતે પણ ખુડે છે અને લક્તોને પણ સંસાર સમુદ્રમાં ડુખાડે છે. ”

“ હે પૂજન્ય ! આપનું કથન સત્ય હુશે તેઓનું આવું હુરાચારવાળું આચરણ આપે કહી પ્રત્યક્ષ નોયું છે કે સાંભળવા ઉપરથી કહો છો ? ”

“ તેમનું હુરાચારણ હું તો સારી રીતે જાણું છું પણ તને હું પ્રત્યક્ષ ખતાવી આપીશ. ”

એક દિવસે ચાણુક્ય મહામંત્રીએ દરેક પાખંડી ધર્મ-

વाणीच्चोने पोतपोतानो धर्म कुहेवाने ओलाभ्या. એ સર્વે
 પાખंડીઓને રાજના અંતઃપુરની પાસે એકાંતમાં એસાડયા.
 ત્યાં અંતઃપુર પાસે એ બુદ્ધિવાન् ચાણુકયે બારીક ચુનાના
 લુકા પ્રથમથીજ પથરાવી રાખ્યો હતો. એ લંપટ પાંખડી
 ધર્મવાળાઓચે ચંદ્રગુપ્ત ન આવ્યો ત્યાં લગી ઉઠીને જળીના
 બાકાંઓમાંથી એના અંતઃપુરની સ્વીચ્છાને જોયા કર્યું. રાજ
 આવ્યો એટલે બગલા સરણી મુદ્રા કરીને એ બધા એગ્રી ગયા.
 રાજને પોતપોતાના ધર્મનું સ્વરૂપ કહીને તે સર્વે ચાલ્યા ગયા.

મહા બુદ્ધિવંત ચાણુકયે રાજને ચુનાના લુકા ઉપર
 પડેલાં પગલાં બતાવી કર્યું કે “ વસ ! જે એમનાં પગલાં ?
 જ્યાં સુધી તું અહીંયાં નહોતો આવ્યો ત્યાં લગી એ બધા
 લંપટો તારું અંતઃપુર જોતા હતા. આ લોકોની આવી લંપટ
 પ્રવૃત્તિ જોઈ ચંદ્રગુપ્ત તેમનાથી વિરકૃત થયો. ”

ખીને દિવસે ચાણુકયે એ ચુનાના લુકા સરંગો કરાવી-
 ને શૈતાંમર જૈન મુનિઓને ઓલાભ્યા. એમને રાજના
 ખાનગી એરડામાં એસાડયા. જ્યાં સુધી રાજ આવ્યો નહીં
 ત્યાં લગી એ મહામુનિઓ સ્વાધ્યાય અને આવશ્યક કિયામાં
 લીન થઈ જીતેંદ્રિય પણુથી મૂર્તિની પેઢેમ એગ્રી રહ્યા. રાજ
 આવ્યો એટલે એને ધર્મ સંભળાવીને એ જૈન મુનિઓ ઇન્-
 ચા સમિતિમાં એક ચિત્તવાળા થઈ પોતાની વસ્તીમાં (ઉપા-
 શ્રયમાં) ચાલ્યા ગયા. તેમના ગયા પછી ચતુર ચાણુકયે
 અંતઃપુરના ગવાક્ષ નીચેની રેતી જેમની તેમ પગલા વગરની

ચંદ્રગુપ્તને ખતાવી કહ્યું કે : “ રાજનુ ? આ મુનિઓ પાંખડી-
ઓની જેમ અહીંયાં આવ્યા નથી. જેથી એમનાં પગલાં
જોવાતાં નથી. શીવ વધુની ઉત્કંઠાવાળા એ મહામુનિઓ.
આવી સ્વીએને તૃણુ સમાન ગણે છે. ” ચાણુકયે એવી રીતે
પરીક્ષા કરાવી આપવાથી રાજ જૈનધર્મમાં પ્રીતિવાળો થઈ
પંચમહાવત પાળનારને ગુરુ માનવા લાગ્યો. અને પાંખડી-
ઓથી તે વિરક્ત થયો.

એક દિવસ ચાણુકયે વિચાર કર્યો. કોઈ અંજન સિદ્ધ
પુરુષ અદૃશ્ય રહીને કહાચ રાજને એર આપી હે તો ટીક
નહીં, માટે ચંદ્રગુપ્તને ધીરે ધીરે વિષાહાર સધાવું કે જેથી
એર એને રસાયણ જેવું થાય. અને વિષનો વિકાર એને અસ-
ર ન કરે ” એમ ચિંતવીને બુદ્ધિ નિધાન ચાણુકયે રાજને
દિવસે દિવસે અધિકાધિક વિષાહાર કરાવા લાગ્યો.

એ અરસામાં ચંદ્રગુપ્તની ધારણીનામે પદ્મરાણી ગર્ભ-
વંતી થઈ એને રાજની સાથે એસીને જમવાનો અલિલાષ
થયો. એ હોહલો પૂર્ણ ન થવાથી ચંદ્રની કળાની માર્ક એ
ક્ષીણુ થવા લાગ્યો. જેથી રાજીએ એક દિવસ એને ‘પૂછ્યુ’. “ હે
પ્રિયે ? શા હું એ તું પ્રતિ દિવસ કૃપણપક્ષમાં ઉદ્ય પામેલા
ચંદ્રની કળાની માર્ક ક્ષય પામે છે. ”

“ સ્વામિન ! મારી દુર્ખલતાનું કારણ મને એક હોહદ
ઉત્પન્ત થયો છે; તેજ છે ? ”

“ અને તે હોહદ ? ”

(૭૧)

“તમારી સાથે એસીને એક થાળીમાં લોજન કરવાનો ?”

“હે પ્રિયા ! શાંત થા : આવતી કાલે એ તારી છબીઓ
હું પૂર્ણ કરીશ ? ”

એ વાતની ચાણુકયને અંખર પડતાં એણે કંઈં કે “તારું
લોજન તું એને આપીશ નહી કેમકે તારું આ સર્વ લોજન
વિષ મિશ્રિત છે ”

પણ રાણીએ હું મેશાં લોજન માગવાથી એક દિવસે
ચાણુકયના આવવા પહેલાં રાન્નાએ તેણીને એક કોળીયો આપ્યો.
તે રાણી ખાવા લાગી એવામાં ચાણુકય આવી પહોંચ્યો. ત્યારે
રાણીને આતી જોઈ ચાણુકયે કહ્યું. “ અરે પોતાના આત્માની
કૈણણી આ તે શું કર્યું ? ”

હુવે સર્વનાશ થવાનો સમય પ્રાંત થાયું ત્યારે ધુદ્ધિ-
વંતે અર્ધું નાશ કરીને પણ અર્ધ બચાવવું જોઈએ આ જેરથી
રાણી અને ગર્ભ બન્નેનું ભૂત્યુ થશે તો હુવે એમાંથી એકને
તો શુવાડું. એમ એલતાં એ મનસ્વી ચાણુકયે હાથમાં
અંજર લઈને આસ્તેથી રાણીનું ઉદર ચીરી નાણ્યું. રૈહણું
ચળની ભૂમિમાંથી જેમ રત્નને કાઢે એમ તેણીના ઉદરમાંથી
પુત્રરૂપ રત્નને ખેંચી લીધો. ચાણુકયે એ પુત્રરૂપ ગર્ભને ઘૃત આ-
દિની અંદર રાખીને એના ખાડીના દિવસો પૂર્ણ કર્યો. ગરીબ
ખિચારી ધારિણી ! એ તો આ લોકની સુસાક્રી પુરી કરી ગઈ.

તેની માતા જ્યારે વિષ મિશ્રિત અજ્ઞ-લોજન ખાતી

હતી, ત્યારે વિષનું એક બિંદુ બાલકના મસ્તક ઉપર પડ્યું હતું જેથી ઉપર ભૂમિમાં જેમ ધાન્ય ન ડો તેમ એ બાળકના મસ્તક ઉપર તેટલા બાળમાં વાળ ઉગ્યા નહિ. અને તેથીજ એનું બિંદુસાર નામ પાડ્યું. ધાવ માતાથી લાલન પાલન કરતો બિંદુસાર વૃદ્ધિ પામવા લાગ્યો.

પૂર્વે નંદરાજના સમયમાં થીકનો મહાન સિકંદર સારત ઉપર ચડી આવેલો ઈ. સ. પૂર્વે ઉર્જમાં તે સમયે એણે પંબળના પૌરસ રાજને હુરાવ્યો તે પણી એ ત્યાંથીજ પાછો ઝરેલો ઈ. સ. પૂર્વે ઉર્જમાં સિકંદરનું મરણ થતાં એનો સેનાપતિ સેવ્યુકેસ સિરિયાનો રાજ થયો. એણે ઈ. સ. પૂર્વે ૩૧૨ થી ૨૮૦ સુધી રાજ્ય કર્યું ઈતિહાસની ગણુની પ્રમાણે ચંદ્રગુમ ઈ. સ. પૂર્વે ઉર્જમાં ગાહી ઉપર આવ્યો અને ૨૬૨ સુધી એણે રાજ્ય કર્યું.

લગભગ ઈ. સ. પૂર્વે ૩૧૨માં સેવ્યુક્ય ચંદ્રગુમ ઉપર ચડી આવ્યો. બન્ને વચ્ચે ભયંકર ચુદ્ધ થયું એમાં સેવ્યુક્સ હારી ગયો. જેથી એની પાસેથી ચંદ્રગુમે પંબળ, સિંધ અને હાલનો અઙ્ગાનિસ્તાન તથા બહુચિન્તાન સુધીનો મુલક લઈ લીધો. અને એની સાથે સંધી કરી. સેવ્યુક્સે પોતાની કન્યા ચંદ્રગુમ સાથે પરણુવી. એ ચંદ્રગુમે સાથના અનુભવ પણી યવનોએ તુરતને માટે હિંદુસ્તાન શ્રતવાનું કાર્ય પડતું મૂક્યું.

ચંદ્રગુમેનું રાજ્ય હિંદુકુશ, હિમાલય, બદ્ધ અને વિંધ્ય પર્વત સુધી ફેલાયેલું હતું. ગુજરાત, સોરઠ ઉપર પણુ

એનોજ અમલ ચાલતો હતો. જુનાગઢનું સુદર્શન સરોવર એના સમયમાં બંધાયું હતું. આવડા મોટા રાજ્યનું રક્ષણ કરવાને એની પાસે સૈન્ય પણ મોટું હતું. છ લાખ પાયદલ ત્રીસ હુનર ઘોડેસ્વાર ને નવ હુનર ગજદળ વગેરે ચતુરંગી સેના હતી. મહાપદ્મનંદના સમયમાં તો આઠ હુનર રથ પણ હતા ચંદ્રગુમના સમયમાં પણ એ હશે. એના સમયમાં તક્ષ-શ્રીલા, અયોધ્યા શ્રાવસ્તી, વૈશાલી, પાટલીપુત્ર નાલંદા, ગયા, રાજગૃહ, તામ્રલિંગિત, ઉજનયિની, કૈસામણી, વાણ્ણુરમ્ભી વગેરે શહેરો વેપાર અને વિદ્યા માટે પ્રખ્યાત હતાં.

નૈનધર્મ પાળવામાં જાગૃત એવો ચંદ્રગુમ રાજ એક દ્વિસ પાખીને દ્વિસે રાતના પૌષ્ઠ લઈને જ્ઞાન ધ્યાનમાં લીન હતો, તેવામાં ત્રીજી પોરીસીને વિષે સુખે સુતાં સ્ત્રતાં એ રાજા-એ સોણ સ્વરૂપનાં ફીઠાં. જાગૃત થયેલો એ રાજ સ્વરૂપાં સંખંધી વિચાર કરવા લાગ્યો. સ્ત્રોહિય થવાથી રાજએ પૌષ્ઠ પાયો.

એવામાં યુગપ્રધાન શ્રીયશોભદસૂરિના પદૃધર અને સંભૂતિ-વિજ્યસૂરિના અનુજ બંધુ ગુડ્લાઈચૈદ્પૂર્વના જાણું શ્રુતધર લાદ-બાહુસ્વામી પાંચસો શિષ્યોના પરિવાર સાથે વિહાર કરતા પાટલીપુત્ર નગરના ઉધાનમાં સમવસર્યા. લાદબાહુસ્વામી શ્લીતિ-પ્રતિષ્ઠાનપુરમાં શ્રી મહાવીર સંવત ૮૪માં જન્મ્યા, સં. ૧૩૬ માં એમણે દીક્ષા લીધી. સં. ૧૫૬ માં સંભૂતિવિજ્યસૂરિ સ્વર્ગ જતાં એ યુગપ્રધાન-પદૃધર થયા.

મગધરાજ ચંદ્રગુપ્ત ચાણ્ણક્ય સાથે મોટી ધામધુમથી

કોણિક-અભિતશત્રુની પેઠે ભદ્રખાહુસ્વામીને વાંદવાને આવ્યો. પાંચ અલિગમ સાચવી રાજ સૂરિને વાંદી દેશના સાંભલવાએઠો. દેશનાને અંતે સર્વ સલાજન સમક્ષ રાજએ પોતાને આવેલા સોણ સ્વર્ણનો અર્થ પૂછ્યો. “હે ભગવન् ? એ સ્વર્ણનું શું શું કુલ થશે ? ”

રાજનાં વચન સાંભળીને શુંતકેવલી ભદ્રખાહુ સ્વામીએ સંધ સમક્ષ એ સ્વર્ણનો અર્થ કહી સંભળ્યો. “હે રાજન् ? તને પ્રથમ કદમ્પવૃક્ષની શાખા લાંગવાનું સ્વર્ણ આવ્યું તેનું કુલ આજથી હુવે કોઈ રાજ ચારિત્ર અહુણું કરશે નહીં. બીજે સ્વર્ણને અસ્ત થતો સ્ફૂર્ય જોયો, તેનું કુલ હુવે કેવલજ્ઞાન (શુંતકેવળા, ચૈંડ પૂર્વ) વિચ્છેદ જશે. ત્રીજે સ્વર્ણને ચંદ્રને વિષે છિદ્ર જોવામાં આવ્યાં તેના કુલ તરીકે હુવે પછી ભગવન મહાવીરસ્વામીના પ્રરૂપેલા ધર્મમાંથી અનેક ઝાંટા નિકખશે, ચાથે સ્વર્ણને ભૂતો નાચતાં જોયાં. જેથી અન્ય દર્શાની-કુમતિ પુરુષો ભૂતોની પેઠે નાચશે. પોતાના મતની વૃદ્ધિમાં ઝાવી જશે, પાંચમે સ્વર્ણને બાર ઝણુવાળો કૃષ્ણ સર્પ જોયો જેથી બાર વર્ષનો હુકાળ પડશે, (એમના સમયમાં તે પછી બાર વર્ષનો હુકાળ પડયો) છદ્રે સ્વર્ણને આવતું વિમાન પાછું વળ્યું તેથી હુવે ચારણ લાંઘવાંત મુનિ લરતક્ષેત્રમાંને ઔરવતક્ષેત્રમાં આવશે નહીં. સાતમા સ્વર્ણમાં કમળને ઉકરડા ઉપર ઉગેલું જોયું, તેનું કુલ એ છે કે હુવેથી વૈશ્યના હાથમાં જૈનધર્મ જશે જેથી એનું મહત્વ ઘટી જશે. આઠમે સ્વર્ણને ખદ્યોત-આગિ-

યાને પ્રકાશ કરતો હેણ્યો તો તેથી હવે પદ્ધીના કાળમાં રાજધર્મ એવા જૈનધર્મનો પ્રલાવ ન્યુન થશે ને ખદ્ઘોતની માઝુક પાખંડી ધર્મો ઉદ્ય પામશે, નવમા સ્વનામાં મોટું સરોવર પાણીવગર સુકાયેલું જેણું, અને તેના દક્ષિણ લાગમાં શાડુંક જગ હીહું તેથી મહાવીર જુનેશ્વરનાં જન્યાં પંચકદ્વાણું થયાંછી ત્યાં ધર્મની હાની થશે પણ દક્ષિણ દિશામાં ધર્મની પ્રવૃત્તિ થશે. દશમે સ્વને સુવર્ણની થાગીમાં કુતરાને ક્ષીરનું લોજન કરતા જેયો તેથી ઉત્તમ જનોની સંપત્તિ નીવકુળમાં જશે તેમજ તેઓ પૂર્વના દ્વાય ધર્મને છોડીને હિંસામય ધર્મને માનનારા થશે. અગીયારમે સ્વને હાથી ઉપર કુતરાને એડેલો જેયો તેથી જે શ્રીમતે! રાજાઓ છે તે પ્રજને પીડનારા થશે. હલકા કુગમાંથી રાજાઓ થશે પણ ઈક્ષવાકુ કે હરિવિશમાં કોઈ રાજ ઉત્પત્ત હુંબેથી થશે નહીં. બારમા સ્વનેનમાં સુસુદ્ર મર્યાદા મુક્તો જેયો તેથી રાજાઓ ઉન્માર્ગિગામી ને ક્ષત્રીયો વિશ્વાસધાત કરનારા થશે, તેરમા સ્વનેનમાં મોટા રથને નાનો વાછરડો જેડેલો હીડો. તેથી પ્રાય: કોઈ વૈરાઘ્ય ભાવથી હીક્ષા અહુણું કરશે નહીં. ચૌહમા સ્વનેનમાં મોટા મૂલ્યવાળું રત્ન તેજ રહિત હીહું. કેથી ભરત તથા ઐરવત શૈત્રમાં સાધુઓ કલેશ કરનારા, માયાવી, ખીજાઓને દુઃખ આપનારા, ને અવિવેકી થશે. પંદરમે સ્વને રાજકુંવરને આગાઠ ઉપર એઠેલો જેયો તેનું ઇલ હવે પછી રાજકુંવરો રાજ્ય ભ્રષ્ટ થશે. સાગમે સ્વને કાગા વર્ણના એ હાથીઓ ચુદ્ધ કરતા જેયાં તેથી મેધ અદ્ય થશે. પુત્રો માતા પિતાની

સેવા કરશે નહીં. શિષ્યો અવિનયી બની ગુરુની હિતશિક્ષા સાંભળશે નહીં. આઈએ માંડો માંડે લડનારા થશે.” એ પ્રમાણે સેણે સ્વર્ગનોનું ક્રિય લદ્ધાહુસ્વામીએ કહી બતાવ્યું. પર્વદા ભાવી કાલની સ્થિતિ સાંભળીને સ્થાનિત થઈ ગઈ. “ ગુનેશ્વરનું વચ્ચન અન્યથા ન હોય આ વિષમ આરો જગતને હુઃપદાઈ છે.” રાજી એ વિચારતો ગુરુને વાંહી નગરમાં આવ્યો. પર્વદા પણ પોતપોતાને સ્થાનકે ગઈ. લદ્ધાહુસ્વામી તે પણ અન્યત્ર વિહાર કરી ગયા. વીર સંવત ૧૭૦ માં સુધુલિઅદને પોતાની પાટે સ્થાપી લદ્ધાહુસ્વર્ગે ગયા.



પ્રકરણ ૧૦ મું.

ભૂતનો ભોગ.

ચંદ્રગુણતને ભારતનું સામ્રાજ્ય લોગવતાં કંઈ વર્ષો પસાર થઈ ગયાં. એ દરમિયાન તેના મહૂા અમાત્ય ચાણુકાએ સુઅંધુ નામના પ્રાક્ષણુને એની હેંશીયારીથી અને દાક્ષિણ્યતાથી ચંદ્રગુણતનો પ્રધાન બનાવ્યો. કારણ કે ચાણુકય પણ રાજ્યલક્ષ્મી લોગવતાં વૃદ્ધ થઈ ગયો હતો, હવે એનું મન પણ કંઈ આત્મકદ્વારા તરફ ઠોક્કું તેથી એણે સુઅંધુને મંત્રી બનાવ્યો, પણ સુઅંધુ તો અત્યારથી ચાણુકય માટે ખરપણ કરવા લાગ્યો. સ્વતંત્ર મંત્રીપદ પ્રાણી કરવાને ચાણુકય ઉપર

મત્સર લાવાને એનાં છિદ્ર શોધવા લાગ્યો ને સમાદચંદ્રગુપ્તને તે નિમકહરામ પ્રાણણું સમજાવવા લાગ્યો. પણ ચંદ્રગુપ્તે એની એકે વાત સાંલળી નહીં. જેથી તે સમયની રાહ જોતો કાલજ્ઞેપ કરવા લાગ્યો.

ચંદ્રગુપ્તના સમયમાં મધ્ય એશીયાના સરદાર સેવ્યુક્સ સાથે સલાહ થયા પછી એના તરફથી મેગાસ્થનેસ નામનો એક એક્ષાર્ચી ચંદ્રગુપ્તના દરખારમાં રહ્યો, આ એલચી ઈ. સ. પૂર્વે ૩૦૬ થી ૨૬૮ સુધી ચંદ્રગુપ્તના દરખારમાં રહ્યો હતો.

ચંદ્રગુપ્તના કાલમાં પાટલીપુત્રની લંખાઈ નવ માઇલની હતી ને પહેણાઈ હોઢ માઈલ છે એને ફરતાં લાકડાની દિવાલ હતી, અને તે દિવાલમાં ડેક્કેકાણે તીર મારવા માટે કાણાં રાખ્યાં હતાં, શહેરના રક્ષણ માટે આ દિવાલની પછવાડે ખાઈ હતી.

ઇતિહાસને હિસાએ ઈ. સ. પૂર્વે ૩૧૬ માં ચંદ્રગુપ્તે પાટલીપુત્રમાં રાજ્યગાહી સ્થાપી ને ઈ. સ. પૂર્વે ૨૬૨ સુધી એણે રાજ્ય કર્યું.

ચંદ્રગુપ્ત તે પછી વૈરાગ્યભાવથી ચારિત્રભાવને ધારણું કરતો અનુક્રમે સ્વર્ગદ્વારાકમાં ગયો. તેની પછી તેનો પુત્ર બિંહુસાર મગધની ગાહી ઉપર આવ્યો. એ બિંહુસાર પણ ચાણુક્યને પિતાની માર્ગ સેવતો હતો. એ સમયમાં વળી પેલા સુખંધુ પ્રાણણે ચાણુક્ય વિર્દ્ધ ખટપટ જગાવી. એણે બિંહુસારને એક દિવસ એકાંતમાં કહ્યું કે, “હે સ્વામિ ! જે કે આપે મને મંત્રીપદ ઉપર સ્થાયે નથી, તો પણ આપનું કંઈક હિત

જીથું છું. કુલવંત પુરુષોનો એવો આચરિ છે કે એમણે સ્વામીનું હિત કરવું જોઈએ. આપે હમેશાં યાદ રાખવું કે આ ચાણુક્ય મંત્રીશર મહા ધાતડી ને વિશ્વાસધાતક છે.”

સુખધુનાં વચન સાંભળીને રાજ અમક્યો. “ ચૂપ ! ચૂપ ! મુર્ખા ! એ શું એદ્યો ! ”

હું તો પહેલાંથી જાણું હતો કે મારા વચન ઉપર આપને વિશ્વાસ ન આવે ! પણ મહારાજ લગાર થાલો ! હું આપને એની આતરી કરી આપું ? ” નિમકૃદામ સુખધુએ કહ્યું. આજે જગતમાં ઉપકાર ઉપર પગુ અપકાર કરનારા જનોનાં કયાં તોટો છે ?

“ તું શું આતરી કરાવી આપે છે. ” બિહુસારે તિરસ્કારયુક્ત કહ્યું.

“ એ પાપી ચાણુક્યે આપની માતાને પેટમાં અંજર મારી નાખી છે. મારે આપે પણ આપનું ચન્દ્રથી રક્ષણ કરવું ? ”

“ મારા માતાને મારી નાખી એની આતરી શું ? ” રાજીએ શાશ્વત અતાવ્યો.

“ તે આપ આપની ધાવ માતાને પૂછી જુઓને ? ” એ અધમ સુખધુએ રાજના કાનમાં વિષ રેડવામાં આડી ન રાખી.

બિહુસારે તરતજ ધાવમાતાને એવાવી તે પ્રાત પૂછી જોઈ. ધાત્રીએ પણ તે પ્રમાણે કહ્યું. જેથી બિહુસાર કેપાચમાન થયો.

ખીજે હિવસે સવારમાં જ્યારે ચાણુકય રાજસભામાં
આવ્યો ત્યારે રાજને સુખ ફેરવી હીધું જેથી ચતુર ચાણુક્ય
ચેતી ગયો કે “રાજના કાનમાં કોઈ હુર્જન પુરુષે વિષ રેડયું
છે.” એમ વિચારી તે પોતાના મકાને ગયો. તપાસ કરતાં
માલુમ પડ્યું કે “એ બધું પેલા સુખંધુરું કૃત્ય હતું.” જેથી
એના હૈયામાં વૈરાગ્ય લાવના જગૃત થઈ. “ઓહો ! એ
સુખંધુર્યેજ આ બાલ રાજને ભરમાવ્યો છે. અરે મેંજ
એને પૂર્વી પ્રધાનપદ આપાવ્યું હતું તેથી મારી ઉપર ઉપ-
કાર કરવાને બદલે એણે પોતાના જલિને યોગ્ય કરી બતાવ્યું
છે. સંસારમાં ડોઈ કોઈનું નથી. હું પણ હવે રાજચિંતા
કરીને વૃદ્ધ થઈ ગયો છું. તો હવે જીવીને કેટલું જીવીશ ? તો
કંઈક આત્મકર્ત્યાણુ કરવા હવે પરલબ્ધને માટે મારે તૈયાર થવું
જોઈએ. જન્મથીજ જગતમાં ઉત્તમ એવો જૈનધર્મ મળવા
છતાં રાજ્ય વ્યવસ્થાયને અંગે મેં એનું ભરાભર પાલન
કર્યું નથી. તેથી વિધિએ મને આ સંકેતથી જાયત કર્યો છે,
તો એ બાલ રાજને ખાતરી કરવવાથી સર્યું. હવે જગતમાં
મારી કઈ ધર્ષા અધુરી છે કે આવો અપૂર્વ સમય હાથ
આવેલો મારે શુમાવવો ? જે આ તક હું શુમાવું તો મારા
જેવો એવકુઝ કોઈ નહીં, માટે મને જગતવાને એ સુખંધુર્યે
તો મિત્રની ગરજ સારી છે ! છતાં મારી બુદ્ધિથી હું એને
પ્રતિકાર તો અવસ્થ કરીશ. પણ હું એવું કરીશ કે એ જગ-
તમાં જીવતાં છતાં એના પણ આત્માનું કર્યાણું થાય ને પ્રધાન
પદવીથી પણ સુકૃત થાય.”

એ પ્રમાણે વિચાર કરી મહા ઉથ યુદ્ધિવાળા ચતુર ચાણુકયે શ્રેષ્ઠ ગંધને યોગમંત્રાદિકથી સંસ્કારિત કરીને એક લખેલા લોજપત્ર સાથે એક ડાખલામાં ભર્યો. તે ડાખલો લાખથી ખરાખર બંધ કરી તેણું એક પેટીમાં સુક્યો તે પેટીને સો નાળાં વાસીને પોતાનું સર્વસ્વ હોય એમ એને ધરના અંદરના ભાગમાં રાખ્યી.

ત્યાગની કૃષ્ણવાળા એ મનસ્વી ચાણુકયે પોતાનું ધન સાતે ક્ષેત્રમાં વાવરવા માંડયું. મિત્ર અને સંખાંધીજનો ઉપર તેમની યોગ્યતા સુજાય ઉપકાર કર્યો. નિરાશ્રિત, હીન અને દરિદ્રીઓને દ્વારાથી દાન આપીને કુદુંધીજનોની પણ વ્યવસ્થા કરી. તે પછી મહા વૈરાગી એવો ચાણુકય શહેરની બહાર એક સુકા છાણુવાળા દગલા પાસે આવ્યો ત્યાં એક સ્થળ ઉપર એસી જીવનના કર્તાવ્યનું એણે પ્રતિકમણ કરવા માંડયું. કરેલાં પાપોનો પદ્ધતાવો કરતાં એણે સર્વે પાપ સ્થાનકો હમેશને માટે વોસરાવી હીધાં. ચાર શરણ અંગીકાર કરતો અને ચોરાશી લાખજીવાયોની સાથે ખમતખામણું કરતો કાયાને વોસરાવી અનશન કરીને રહ્યો.

ચાણુકયની આ હુકીકત ધાવમાતાએ જાણી કે તરતજ એ શાન પાસે દોડી આવી. રાજ પણ ચાણુકયની હુકીકત સાંભળીને વિચારમાં પડી ગયો. હતે તેને એકદમ સાવધ કરી એલી, “હે વત્સ ! તને જીવિતદાન તથા રાજ્ય આપનાર આ મહામંત્રી ચાણુકયનું તેં અપમાન શામાટે કર્યું ? ”

“ તારા કહેવાથી ? કારણું કે તેં કલ્યાં હતું કે એણે મારી માતાને મારી નાખી છે.” રાજાએ ખુલાસો કર્યો.

“ અરે લોળા બાળરાજ ! તેં અર્થનો અનર્થ કર્યો. એણે તો ઉલટાં તને મરતાં બચાવ્યો છે. તારી માતાએ જ્યારે હું ગર્ભમાં હતો ત્યારે એક એવું અકાર્ય કરેલું જેને લીધે તમો બન્ને મરવાનાં હતાં પણ ચતુર ચાણુકયની કાર્યદક્ષતાથી તું બચી ગયો અને તારી માતા મરી ગઇ.” એ ધાવમાતાએ યથાર્થ હુકીકત કહી. સંભળાવી.

રાજાએ ખરી હુકીકત જાણી એનુલે અને ઘણો પસ્તાવે થયો. પોતાને કુણુદ્ધિ આપનાર ! પેલા અધમ સુખાંધુ ઉપર ગુસ્સે થયો. અરે વત્સ ? એણે તો ઉલદું તને રાજ્ય આપ્યું છે. તારા હિતને મારે તો એ સંસારમાં રહ્યો હતો. નહીંતર એને તારા રાજ્યનું શું કામ હતું ? તારા પિતાને પણ એણે જ રાજ્ય અપાવ્યું હતું. તો પછી એને તારા રાજ્યની શી તૃપ્યું હોય ? ” ધાત્રીનાં વચન સાંભળી રાજ એકદમ ચાણુક્ય પાસે દોડી આવ્યો. એના મંત્રીઓ, એનું અંતઃપુર તેમજ નાગરીકો, વગેરે એનાં દર્શને દોડી આવ્યા. રાજ એને પગે પડી પોતાના અપરાધની માર્પી માગતો આંખમાંથી અશ્વ પાડતો બોલ્યો ? ” હે તાત ! મેં અજ્ઞાનપણે આપની અવસ્થા કરી છે તો મારો એ અપરાધ ક્ષમા કરો ? ને આપ આપનું રાજ્ય ચલાવો ? મારો ત્યાગ ન કરશો ? ખાલક કહાચ પિતાના ખોગામાં વિષા કરે એથી કાંઈ એને તજ દેવાતો

નથી. માટે તમે મારી ઉપર કૃપા કરી ચાહો ? હું તમારો આજાંકિત થઈને રહીશ ? ”

બાળકની માઝક નિર્દેખ વચનો બોલતા બિહુસારને એ મહા મનસ્વી ચાણુક્યે કહું. “ હે વત્સ ! હવે આ પ્રાર્થનાથી સચું ? કારણુ કે મારા શરીર ઉપર પણ હું નિસ્પૃહ છું. તો પછી રાન્યનું મને શું પ્રયોજન હોય ? મેં તો અનશન અંગીકાર કરું છે. ”

“ અરે મને ધિક્કાર થાઓ ? આવા મહાપુરુષ ઉપર મેં કુણુદ્ધિ કરી. ” વગેરે બોલતો ચાણુક્યને અમાવસ્યા લાગ્યો ને કરી કરીને આજીજી કરી. પણ મર્યાદાથી સમુદ્રની કેમ પોતાની પ્રતિજ્ઞાથી ન ચલાયમાન એવા ચાણુક્યને જાહીને રાજ બાળકની માઝક રડતો અને પઢ્યાતાપ કરતો નગરમાં ગયો. ધીન મંત્રીએ અંતઃપુર તથા નાગરિક જનો પણ એ મહાત્યાગીનાં દર્શન કરી પાગમણને ધોતા પોતપોતાને સ્થાનકે ચાલ્યા ગયા.

રાજના કેાપથી સુખંધુ મંત્રી વેલડીની માઝક ધૂજતો રાજના પગમાં પડી મારી માગવા લાગ્યો. “ હે દેવ ! મારો અપરાધ ક્ષમા કરો ! સમ્યગુ હકીકિત જાણ્યા વગર મેં ચાણુક્યને દુષ્ટિ ઠરાવ્યો એ માટે આપ રજ આપો તો હું ચાણુક્યને જઈને અમાવું ? ”

માયા કપટથી રાજની રજ મેળવી સુખંધુ ચાણુક્ય પાસે આવ્યો ને માયાભાવથી એને અમાવ્યો. પણ એણે

મનમાં ચિંતાબ્યું કે “ ચાણુકુય ને પાછો આવશે તો અરેઅર
મારાં સ્વજન કુદુંબ સહિત મારું જડમૂળ ઉંગેરી નાખશે.
મારે હું જ એનું કાશળ કાઢી નાખું ? ”

આવા કુવિકદ્વપથી રાની પાસે આવીને આડંબર સહિત
એની પૂજા કરવાની રજા માંગી. “ હે લગવનું ? મેં ચાણુ-
કુયનો અપરાધ કર્યો છે તો તેના પ્રાયર્ક્ષિત સારું તેની હું
પૂજા કરું ? ”

રાનીની બીજુવારની આજા મેળવી એ હૃદ્દ સુખંધુએ
અનશનમાં રહેલા ચાણુકુય પાસે આવીને આડંબરથી પૂજા
કરવા લાગ્યો સંધ્યાકાળે ચાણુકુયની પૂજા કરી તે સુખંધુ
શુદ્ધ છાણુમાં ધૂપનો અંગારો નાંખી ચાદ્યો ગયો.

વાયુના જોરથી સુકા છાણુમાં એ અંગારો ધૂંધવાઈને
પ્રદીપ્ત થયો. એ અભિનથી ચાણુકુય દુઃખ થવા લાગ્યો પણ
એના જીવનરૂપ એનો શુદ્ધભાવ તો અખંડિત રહ્યો એની
શુલ્ષ ભાવના વૃદ્ધિ પામવા લાગી. “ હે જીવ ? વિષા, સુત્ર,
મગ, પચીનો અને હુર્દંધથી લરેલા આ શરીર ઉપર તું
પ્રીતિ ન કર ? કેમકે આ શરીર તો ગમે ત્યારે એક દિવસ
અભિનમાં બળવાનું છે. એ કંઈ આત્માની પાછળ જતું
નથી પણ આત્માએ કરેલાં શુલ્ષશુલ કર્મો જ એની સાથે
નાય છે, મારે પૂર્વે કરેલાં હુસ્કર્મેને આ સમયે લોગવીને
એ થકી સુકત થા ! અને સમભાવમાં રહે ? કેમકે અત્યારે
હિંસા, મૃષાવાહ, ચોરી, મૈશુન અને પરિથિહ તેમજ ચારે
ગ્રકારના આહારનાં તેં વિવિધે, મન, વચ્ચનને કાયાવડે પચ્ચા-

અમાણુ કર્યાં છે. કર્મનો કથ્ય કરવામાં તો શત્રુઓની મિત્રની માઝક ઉપકાર કરનારા થાય છે. માટે એવા સર્વને હું અમાણું છું ને તે પણ મારા પ્રત્યે અમો ! સકલ જીવોની સાથે મારે મૈત્રીભાવ છે કેાર્ધ સાથે મને વેર નથી. મારાથી થયેલી અનેક જીવહિસાચ્ચો, અપરાધો કેવલજાની પ્રભુઓ જાણું છે એ સવે અપરાધોની અરિહુંત પ્રભુઓની સાક્ષીએ હું આદોચના કરું છું. અજાની એવા આ જીવે આ જીવમાં કે ગતલવોમાં અપરાધો કર્યા હોય એવા સર્વ અપરાધોને હું મિથ્યાહુંકૃત આપું છું. એવી રીતે પોતાના હુંકૃતની નિંદા કરતો, અને કરેલા સુકૃતની અનુમોદના કરતો મોક્ષપુરીના આધાર એવા અરિહુંત આદિ ચાર શરણુને વાર વાર અંગીકાર કરવા લાગ્યો. પંચ પરગોધિ મંત્રનું મનમાં સ્મરણ કરતાં ચાણુકય સુખંધુના અભિનના ઉપસર્ગથી દૃગ્ય થઈને સમભાવે મરણ પામીને સ્વર્ગ લોકના દીક્ષનું મંત્રીપદ લોગવવા ગયો.

ચાણુકયના મરણથી રાજ પ્રભામાં શોક પ્રસરી રહ્યો. ધણ્ણા દિવસ સુધી રાજ એના ગુણોને સંભારતો બાળકની માઝક આંખમાંથી અશ્વ પાડતો હતો. ફૂકત એક સુખંધુજ પ્રસર થયો હતો એક મોટા રાજ્યનો હીવે એ મહા અમાત્ય થયો. સુખંધુએ ચાણુકયના ધનની આશાએ રાજ પાસેથી ચાણુકયનું મકાન રહેવા માટે માણયું. રાજ આજા આપવાથી સુખંધુ ચાણુકયના મકાનમાં રહેવા ગયો. તો ઉજજડ એવા આખા ધરમાં ફૂકત એકજ ઓરડો મજબુત રીતે બંધ કરેલો જાયો.

આ ઓરડામાં ચાણુક્યનું ધન હશે એમ સમજુને અણે
 એ ઓરડો ઉધાર્યો તો તેમાં એક પેટી દીહી સો તાળાવાની
 એ પેટીને જેઠ એણે વિચાર્યું કે “ નક્કી આ પેટીમાં અમૃત્ય
 રત્નો હશે ? ” પછી સુખંધુએ પેટીનાં સોચે તાળાં લાંગી
 નાખ્યાં. ને પેટી ઉધાડી તો અંદર સુગંધી વસ્તુએથી ભરેલો
 ડાખલો જેયો. “ હા ! હવે જાણ્યું ! આ ડાખલામાંજ રત્નો
 લરેલાં લાગે છે. તે વિના એની આવી સંભાળ સંભવે નહિ. ”
 એમ વિચારી શ્રીકૃલની માર્ક્ઝ એણે ડાખલો ફેઝ્યો. તો તે
 માંથી લોકેટર દિવ્યગંધ એના જેવામાં આવ્યો. ગંધ લુખ્ય
 મધુકરની માર્ક્ઝ એ ગંધ સુખંધુએ સુંધ્યો, એની સુગંધીથી
 વિસ્મય પામીને તે પોતાનું મસ્તક હુલાવવા લાગ્યો. પછી
 વારંવાર સુંધવા થકી હર્ષ પામેલા સુખંધુની પેલા લોજપત્ર
 ઊપર ઢાંચે પડી. એ વાંચતાંજ એના હોઠ બીડાઈ ગયા. એ
 લખેલા લોજપત્રમાં એણે શું વાંચ્યું. કે જેથી એનું મન
 વિધાદ પામી ગયું. જીવતાં છતાં એ સુવા જેવો થઈ ગયો:
 તેમાં લખ્યું હતું કે, “ આ સુગંધી પદાર્થ સુંધ્યા પછી ને
 કોઈ બુદ્ધિવાન ઠંડું જલ પીશે તથા અદ્રસ લોજન જમશે,
 મનોહર ગાયન સાંસલશે, વિલાસ ચુક્ત સ્ત્રીના સંગને ધંઢશે
 કે પુણ્પાદિકની મનોહર સુગંધ લેશે, અથવા નાટકો જેશે. એ
 પાંચ વિષયમાંથી એક પણ વિષયને લોગવશે તે તુરત મૃત્યુ
 પામશે ” એ વાંચી સુખંધુ તો આલોજ બની ગયો. હા ! હા !
 કરતો પોકાર કરવા લાગ્યો. એણે નિશ્ચય કર્યો કે “ બુદ્ધિ
 નિધાન ચાણુક્યનો આ પ્રયોગ વૃથા તો નજ હોય, એણે એક

પુદ્ધને તે સુગંધિએ સુંધાડી એને વિષયોમાં જેડતાં તરતજ મરણ પાંચો. એને લાગ્યું કે તે અત્યારે જીવતાં સુઅલો હતો. મોતને હત એની સામે ઉલો રહી પડકાર કરી રહ્યો હતો જગતમાં તે અત્યારે મહામંત્રી છતાં એકલો અટુલો નિરાધાર હતો. બુદ્ધિમાન ચાણુક્યની ચુક્કિસ કણ થઈ હતી. એણે એને જીવતાં માયો હતો કરેલાં પાપકર્મનું કળ અહીંને અહીંજ તરતજ પ્રગટ થયું. જે પહવીની ખાતર એણે ચાણુક્યરૂપ કાંટો હું કર્યો હતો તે કાંટો એના શરીરમાં હુમેશને માટે હુવે લાગી ગયો હતો. થાડીવારમાં એ પણ મરવાનો હતો. આ સુવર્ણ ક્લવા મીડા સંસારમાં તે હુવે અવ્ય સમયનો મેમાન હતો. અરે પાણી વગર કેમ ચાલે. ખસ્ત પાણી પીધું કે એની જુંદગી ખલાસ હતી. “ હા ! હુવે મારે શું કરવું ? જીવવાનો કોઈ ઉપાય ચાણુકયે લખ્યો છે કે અસ મોતનો જ પેગામ સુકી ગયો છે ? ” એણે આગળ વાંચવા માંગ્યું. “ તે છતાં એને જીવવાની ઇચ્છા હુશે તો ભસ્તક ને દાઢી સુંડાવી ભીક્ષાવૃત્તિમાં જે મલે એવું તુચ્છ લોજન કરે, સાધુનાં વસો પહેરી જ્ઞાનરહીતપણે મુનિના આચરણથી રહેશે તો જ જીવી શકશે.” આ પ્રમાણે વાંચીને ઇચ્છા નહીં છતાં પણ કુક્તા જીવીતવ્યની લાલસાએ મુનિ થવાનો એણે વિચાર કર્યો. “ હાય ! મારી બુદ્ધિને ધિંઝાર થાએ ! એરેખર ચાણુક્ય એ એકજ બુદ્ધમાન હતો કે જેણે મરતાં મરતાં પણ મને આવી રીતે જીવતાં મુદ્દો કર્યો છે. ”

ભાવરહીત નટની પેઠે સુખંધુ તે પછી મુનિ થઈ પૃથ્વી ઉપર વિચરવા લાગ્યો એ અભવી પાપિષ્ઠ સુખંધુ અનંતાલવ સંસારમાં ભાગ્યે.

જીવિતાનું

પ્રકરણ ૧૧ મું.

મહાન् અશોક.

માન્દ્રાદ ચંદ્રગુપ્તે મેળવેલું વિશાળ રાજ્ય બિંહુસારે વ્યવસ્થાપૂર્વક સંભાળી રાખ્યું આ રાજને કાલ શાંતિમાં થયો. હતો, દીર્ઘકાલ પર્યાંત રાજ્ય ચલાવીને ચંદ્રગુપ્તે રાજ્યની જડ મજબૂત કરેલી એનું ફ્રલ બિંહુસારે સારી રીતે લોગવ્યું. ધતિહાસ દશ્ટિએ ઈ. સ. પૂર્વે ૨૬૨ માં બિંહુસાર ગાહી ઉપર આવ્યો. જૈન ધતિહાસ જોતાં શ્રી મહાવીર પછી ૨૩૫ વર્ષે બિંહુસાર મગધેશ્વર થયો. ઈ. સ. પૂર્વે ૨૭૨ સુધી ભારતનું સામ્રાજ્ય બિંહુસારે લોગવ્યું. ચંદ્રગુમના સમયમાં એના પુત્રો જેમ ધીન પ્રાંતના સુખાએ હતા તેમ બિંહુસારના પુત્રો પણ મોટા મોટા પ્રાંતોના સુખાએ હતા. બિંહુસારને ધણ્ણા પુત્રો હતા. એમાં અશોક નામે પણ એક પુત્ર હતો. અશોક કદરૂપો પણ બહુદ્ધર હતો, ખાળપણુથી એ તોંકાની છોપાથી એના પિતાને એ ગમતો નહીં. જેથી એને ઉજજન, માળવાની સુખાગિનિ આપી ત્યાં મેડુલી દીકે. પછી એને હૃદતાજીસીલા

મેઅલવામાં આવ્યો હતો પણ એ બહાદુર અશોકે તક્ષશીલા જઈ બળવાખોરોને કેર કરી શાંતિ ફેલાવી પોતાના પરાકમમાં વધારો કર્યો ઈ. સ. પૂર્વે ૨૭૨ માં બિંહુસાર પરલોકવાસી થયો ત્યારે અશોક ફૂરના દેશમાં હતો. તેને રાજ્ય મેળવવામાં અનેક મુશ્કેલીએ નડી હતી છતાં એકદમ પોતાના સૈન્ય સાથે તે તક્ષશીલાથી નિકળીને પાટલીપુત્ર નગરે આવ્યો, કેટલીક મુશ્કેલી પછી એણે પાટલીપુત્રનું સિંહાસન કણજે કર્યું. પોતે ઈ. સ. પૂર્વે ૨૭૨ માં મગધેશ્વર તરીકે રાજ્ય ગાહી ઉપર આવ્યો.

ગાહી ઉપર આવ્યા પછી અશોકે કેટલાંક વર્ષ રાજ્યની વ્યવસ્થા કરવામાં ગાય્યાં, પિતાની હૃદ્યાતીમાં માળવામાં અદ્ધાનિસ્તાનની રાજ્યાની તક્ષશીલામાં સુખા તરીકે એણે કામ કરેલું, એટલે રાજ્ય વહિવટની વિગતોથી એ વાકેદ્ગાર હતો. ચાલુાક્યની ઘડી કાઢેલી રાજ્યનીતિનો અમલ ચલાવતાં અશોકને એછો અનુભવ મળ્યો નહીં હોય. એના રાજ્યનો વિસ્તાર હિંહુકુશથી આસામ સુધી અને કાશ્મીરથી કુપણા નદી સુધી (મહારાષ્ટ્ર) હતો, ઇક્તા પૂર્વ કિનારા ઉપર આવેલો કલિંગ દેશ મગદી સાથે પોતાની સ્વતંત્રતા બળવી રહ્યો હતો. બંગાળાના ઉપસાગરને કાંડે મહી નહીં અને જોદાવરીની વર્ચ્યેનો ભાગ તેને કલિંગ દેશ કહેતા હતા એની સ્વતંત્રતા મહાન. અશોકે ગાહી ઉપર આવતાં જ અઠકાવવાનો યત્ન કર્યો.

અશોક નાનપણુમાં બહુ તોકાની ને કૂર હતો. ગાહીએ

આવતાંજ પાટકીપુત્રમાં ‘એક નરકાસ્થાન’ બનાવ્યું હતું. એણે એક મેરા મેદાનમાં ચારે ભાંનુએ મજાખુત ફીવાલો અણીને અંદર ધારવાલાં ચકો, ધગધગતા લોહના થંભાએ, તેલની ઉકળતી કડાચો, વગેરે ગોઠવ્યાં હતાં. પરમાધારી—જમડાઓની જગા એમના સીપાહીઓએ લીધી હતી. જે કોઈ શુન્ઝેગારનો શુન્ઝો સાખીત થતો એને આ જાગતા જમડાઓ આ નરકાલયમાં લાવી વિવિધ યાતના પમાડી મારી નાખતા. શરૂઆતમાં શુન્ઝેગારો માટે આ નરકાલય હતું પણ પાછળથી જે કોઈ જણે અજણે આ સ્થાન ઉપર આવી ચડતો એને પણ એ જમડાઓ. જુદી રીતે નરકાલયમાં લાવીને મારી નાખતા હતા.

એક વખત કોઈ કારણુસર બુદ્ધધર્મનો કોઈ લિક્ષુક ત્યાં જઈ ચડ્યો. આ સ્થાન પાસે આવતાંજ પેલા જાગતા પરમાધારીઓ એને પકડીને અંદર લઈ ગયા. એને મારી નાખવાની તૈયારી કરવા લાગ્યા. લિક્ષુકે એ પરમાધારીઓને કહ્યું. કે—“મરી ગયા પહેલાં મને ઈશ્વરની સ્તુતિ કરવાને બેધડીની રાજ આપવી. પછી તમારે જે કરવું હોય તે સુઝેથી કરો ?”

આ બેધડી દરમિયાન એક ખીનો માણુસ ત્યાં ફેસાઈ પડ્યો. નરકાલયના રખેખાળોએ એને પકડી લાવી એક ચક ઉપર ચડાવી એનું માથું કાપી નાખ્યું. આ ભયંકર દેખાવ જોઈ પેલા લિક્ષુનું હૃદય તો વીધાઈ ગયું. શરીરની નાશવંત સ્થિતિ જોતાં એ નરકાલયની યાતનાનું નિરિક્ષણું કરતાં એને વૈરાગ્ય આવ્યો. વૈરાગ્ય અને ઈશ્વરની સ્તુતિ કરતાં એ સાહુને

બેધડી પછી ચેલા માણુસોએ ઉકાગતી તેલની કડામાં નાખ્યો. તેલ ધાણું જ ગરમ હતું અને એની નીચે અગિન પણ સાખત હતો. છતાં આશ્રમ્ય કે આ લિક્ષુ તેલ કડામાં પડ્યો કે તરતજ અંદરનું તેલ ઠરી ગયું !

અનયથ થયેલા માણુસો એકખીજના સામે જેવા લાન્યા. જાણું મંત્રથી સ્તંભિત થયા હોય એમ ચિત્રવત થઈ ગયા. સમાટ અશોકને આ સમાચાર પહોંચ્યા કે તે હોડતો લ્યાં આવ્યો. એને પણ આ દેખાવ જોઈને આશ્રમ્ય થયું.

અશોકે આ લિક્ષુકને તેલની કડાઈમાંથી બહાર કઢાવ્યો. એને પોતે એને ચરણે નમ્યો. એ લિક્ષુકે નમતા એવા રાજને કહ્યું—“ રાજન ! અનેક નિર્દેખ લુચોનો સંહાર કરીને તમે કયું સ્વર્ગ લેવા માગો છો ! કોઈ પણ પ્રાણીની હિંસા કરવી એ સમુ ખીણુ કોઈ પાપ નથી. તેમાં પણ માણુસ વિનાકારણુ માણુસની હિંસા કરે એતો અધમતાની હુદ કહેવાય. જગતમાં અદ્વિતીય એવા અહિંસા ધર્મનાં બારણાં દરેકને માટે ખુલાં ઝુક્યાં છે. તેમાં પ્રવેશ કરશો તો તમાડું કર્યાણુ થશો.”

એના ઉપરેશથી રાજના મનમાં તીવ્ર અસર થઈ. છતાં અચાવ કરતાં કહ્યું કે—“ લગવન ! ગુનહેગારો માટે આ સર્વે પ્રથ્યંધ કરવામાં આવ્યો છે ? ”

“ છતાં ધથ્યાય ખીનગુનહેગારો તમારા આ કર્પીણુ કૃત્યના લોગ થયા છે એને થાય છે. તમારા આત્માનું બે હિત ચાહતા હોય સાફાનું નસમાલય. તમારે જીવિતોના

કરવું જોઈએ. શુન્હેગારોને માટે તો ખીલુ શીક્ષાએ ક્યાં
એથી છે કે આવી શિક્ષાની એને જરૂર પડે ? ”

એ ઉપદેશને પરિણામે અશોક રાજને ત્યારથી એ
નરક સ્થાનનો નાશ કરી નાખ્યો. રાજને ચમત્કાર હેખાડનાર
ઓછ લિક્ષુકનું નામ ઉપગુમ હતું. ત્યારથી ઉપગુમ રાજને
ઉપદેશ આપી પોતાના ધર્મમાં ધીરે ધીરે એંગવા લાગ્યો કે
જેને પરિણામે અશોક ઓછ થઈ ગયો.

આખરે એવો એક દિવસ આવી પહોંચ્યો કે અશોકની
સરહારી નીચે એતું મોટું સૈન્ય કલિંગ તરફ રવાને થયું.

કલિંગવાસીએ ઉપર પડકાર કરતું અશોકનું સૈન્ય
આવી પહોંચ્યું. અશોકનો સતકાર કરવાને સ્વદેશાભિમાની
એકએક કલિંગવાસી નર આતુર હતો, બન્નેનાં આયુધો
ખાખડયાં. અશોકના બળવાન સૈન્ય સામે એ મુઠીલર પ્રભાએ
ખહાડુરીથી બચાવ કરવા માંડ્યો. સ્વતંત્રતાની સળગતી વેહી
ઉપર હુલરો માણુસોનો લોાગ આપતા પણ એ વીર પ્રભ અડગ
પહાડની માર્ક અશોકની સામે ઉલ્લી રહી દિવસ ઉપર દિવસ
ને મહિનાએ ઉપર મહિના પાણીના પ્રવાહની માર્ક વહી
ગયા છતાં કલિંગવાસીઓનું ધૈર્ય ડર્યું નહીં.

દેશાભિમાનના રક્તથી રંગાયેલો એકપણ નર બચ્ચો
હૃદાત હોય ત્યાં સુધી ચુદ્ધમાં લડવાનો કલિંગ વાસીએનો
નિક્ષેપ હતો. અશોકની તલવારે કંઈકના લોાગ લીધા, કંઈકને
ધોયલ અર્દી કંઈકને સ્વતંત્રતાની વેહી ઉપર હમેશાની શાંત

નિરામાં સુવાડયા. છતાં પાછા ખીજે દિવસે નવા કલિંગવાસીએ પોતાની સ્વતંત્રતાને માટે અશોકની તલવારના ધા જીલનાને ઝ્હાર આવતા.

ત્રણ ત્રણ વર્ષનાં જ્હાણાં કલિંગવાસીએ સાથે ચુદ્ધ કરતાં વહી ગયાં છતાં અશોકની તલવાર સામે કલિંગવાસી નરવીરોનું ધૈર્ય અડગ હતું. કલિંગનાં દરેક દેશાલિમાની રતનો આ ચુદ્ધમાં હમેશને માટે માતાની જોદમાં પોઢી ગયાં હતાં પરતંત્રતા કરતાં ભરવું એમને પ્રિય હોવાથી રણુસંઘભમાં આવીને શત્રુના માણુસોને મારતાં તે પોતે પણ ભરતાં હતાં. ત્રણ ત્રણ વર્ષને અતે આપરે કોઈ શૂરા પુરુષો ન હોવાથી એ બહાદુર પ્રજનનું ધૈર્ય ખુગી ગયું ત્યારે છેવટે ડેશરીયા કરી પોતાનું સામદું બાળ ખતાવવાને એ પ્રજનએ નિર્ણય કર્યો જેથી એક દિવસે એ બહાદુર પ્રજન ડેશરીયાં કરી અશોકની તલવાર સામે પડકાર કરતી એની ઉપર તુટી પડી. બન્ને વચ્ચે હુમુલ ચુદ્ધ થયું પણ મહાન અશોકની વિશાળ સેના આગામી એ મુઠીભર પ્રજનનું શું ગળું? પોતાની વીરતાને પરિચય કરાવી એ બહાદુર પ્રજનના કેટલાક શૂરા યોદ્ધાએ હમેશની મીઠી નિરામાં સૂતા. અને ચુદ્ધનો અંત આવ્યો.

વિજયી અશોકે લશ્કર સહિત કલિંગની રાજ્યધાનીમાં પ્રવેશ કર્યો ત્યાં એણે શું જોયું શહેરમાં લાખો મુડદાં પડેલાં હતાં લાખો માણુસો અજ પાણી વગર તરફ્ફીને ભરી ગયાં હતાં, એક લાખ તો એણે ચુદ્ધમાંજ કાપી નાખ્યા હતા. અને હોઠ લાખ કલિંગવાસી એની છાવણીમાં

કેદ પકડાયા હતા. કલિંગ દેશમાં દરેક ઘેર રડારોળ થઈ હતી નરહત્યાકંડની આ કોલાહલે અશોકના વજ સમા યહોને હુચ મચાવ્યું એણે જેણું તો આપો કલિંગ દેશ બેફાટ દૃદ્ધનમાં તરથોળ હતો. કોઈનો ભાઈ તો કોઈનો હીકરો એમ સર્વોકોઈ ચુદ્ધની આગમાં બળીને લાખ થઈ ગયા હતા એ ઉખ્ષુ રામ ઉપર ચુદ્ધ બંધ થતાં ઘેર ઘેર ઉખ્ષુ આંસુ પડતાં અશોકે નિષ્ઠાજ્યાં. એનું હૃદય કમકરણું, “આહા ! કયા સુખની ખાતર એણે કલિંગની સ્વતંત્રતાનો નાશ કર્યો હતો. લાખો કલિંગવાસીની જંહગીનો નાશ કરવામાં તે પોતે જેખમદાર હતો. હા ! હિસા ચુક્ત એવી આ રાન્યલક્ષ્મીને ધિક્કાર થાઓ એવા પરાક્રમને ધિક્કાર થાઓ ? કે આત્માને અજાન માર્યો એંચ્યો જઈ અનેક પ્રકારનાં પાપકર્મ કરવી. નરકગતિમાં લઈ જાય છે. આવો મોટો નરહત્યાકંડ કરી મારે કચ્ચી હુર્ગતિએ જવાનું હતું. અજાતશરૂએ ત્રણાંદનું રાન્ય જીતી લરતાર્ધના સર્વો રાજએને તાખેદાર બનાવ્યા છતાં આ પૃથ્વી એની ન થઈ. બીકસરદાર સિકંદરે હુન્યા જીતીને મોટું રાન્ય સ્થાપણું પણ આ પૃથ્વી એની સાથે પણ ન ગઈ. તો શું મારી સાથે આવશે ? અરેખર મેં કલિંગની શોલા નષ્ટ કરી એ સારું કર્યું નહું. ” ધત્યાદિક એને ધણો પશ્ચાત્તાપ થયો. આ છેદલી વિજય યાત્રા કરી એણે પોતાની તલવાર મ્યાન કરી. ચુદ્ધને નમસ્કાર કર્યો. શિકારપણું તળું હીધો. માંસપણું છોડયું. ને રાન્યમાં ખહાર ફરવા નિકળવું તો પ્રભના સુખને માટે ? એવી પ્રતિજ્ઞા કરી. કલિંગની વ્યવસ્થા કરી પોતાના તરફથી

એક અધિકારી નીમી તે લશકર સહીત પાટલીપુત્ર ચાહ્યો ગયો. એણે મને કે કમને વિજય મહેત્સવ કર્યો.

એના વખતમાં પાટલીપુત્રની જાહેરલાલી અપૂર્વ હતી લંખ્યોરસ આકારવાળા આ શહેરની લંખાઈ નવ માઠલની હતી. ૬૪ તો આ શહેરને દરવાજા હતા. તેમજ પ૭૦ ખુરજ વાળા કોટથી આ શહેર રક્ષાયેદું હતું. એની ચારે બાજુએ આસપાસ ૧૦૦ પ્રીટ પહેણી અને ધણી ઉંડી ખાઈ હતી. ચંદ્રગુપ્તના સમયમાં કોટનીદીવાલ લાકડાની હતી તથા ધણા ધરે પણ લાકડાનાં હતાં, પણ સમાટ અશોકે એ લાકડાની દિવાલો તોડી પાડી પત્થરનો કોટ કરાયો. એના સમયમાં શહેરમાં ધણા સ્તુપો અને વિહારો ઉલા થયા. ચંદ્રગુપ્ત કરતાં પણ અશોક મહા પ્રતાપી રાજ થયો.

લદ્રખાહુસ્વામી વીર સંવત ૧૭૦ માં સ્થુલિલદ્રને પટધર સ્થાપી સ્વર્ગદ્વારકમાં ગયા. એ સ્થુલલદ્રનો વીર સં. ૧૧૬ માં જન્મ થયો. યૌવનમાં બારવર્ષ પર્યાત વેસ્યાને ઘેર રહ્યાને સં. ૧૪૬ માં એમણે સંભુતિસ્કુર પાસે પ્રત શહેર કર્યું. ને સં. ૧૭૦ માં પટધર થયા.

સ્થુલલદ્ર છેલ્લા ચૌદ્દૂર્વી શ્રમહાવીરથી સાતમી પાટે. થય્યા છે એ સ્થુલલદ્રસ્વામીએ આર્ય મહાગિરિને આર્ય સુહસ્તિ નામના એ શિષ્યોને દિક્ષા આપી, તેમની પણી એ બંને પાટે આવ્યા છે. વીર સંવત ૧૭૯ માં આર્ય મહાગિરિને દીક્ષા આપી અને સં. ૨૨૨માં આર્ય સુહસ્તિસમામીને દીક્ષા આપી.

વીર સં. ૨૧૬ માં સ્થુલિલદ્ર સ્વર્ગે ગયા. હેતાથી આર્યમુહુ-
સ્તિ સ્વામીને સ્થુલલદના નામથી સં. ૨૨૨ માં આર્યમહાગિરિ
એ દીક્ષા આપી સં. ૨૧૬ માં આર્યમહાગિરિ પટધર અને
ચુગપ્રધાન થયા. વીર સં. ૨૪૬ માં આર્યસુહુસ્તિ સૂરીપદ ઉપર
આવ્યા.

મહાન અશોકના સમયમાં આર્યમુહુસ્તિ અને મહાગિરિ
ગંધનાયક હતા. તેમાં પણ આર્ય મુહુસ્તી સ્વામી તો મહા-
વીરસ્વામીના ત્રીજન સૈકાના અંતસુધી વિઘમાન હતા.

આ સમયમાં ત્રેવીશ ઉદ્યમાનો પ્રથમ ઉદ્ય ચાકતો
હતો પ્રથમ ઉદ્યમાં વીશ ચુગપ્રધાન થયા છે એમાં સુધર્માસ્વામી
અને જંખુસ્વામી મોક્ષ ગયા તે સિવાય ખાડીના અદારે
ચુગપ્રધાનો એકાવતારી જાળવા. આર્યમહાગિરિ સ્વામી
આર્યમુહુસ્તિ સ્વામીને ગંધનો લાર લગાવી લુનકડપનો
આચાર વિચ્છેદ ગયેલો છતાં પોતે એકાડીપણે વિચરી જિન-
કડપની તુલના કરતા હતા. આ ખન્ને ને એકજ પાટે એટલે
વીરસ્વામીની આહમી પાટે ગાળવામાં આવ્યા છે.



પ્રકરણ ૧૨ મું.

ભવિતોયતા.

સ્વીએનું હૃદય અને પુર્ઢોનું લાવી જગતમાં તોણું
જાળવાને સર્વથી છે. મનુષ્ય પ્રાણી તો મુખની આશાએ સંસા-

રની સુસાક્રીમાં આગળને આગળ ધેયા જથું છે ટાઈ, તાપ્ય, હુંખાદિક અનેક પ્રકારના પરિસરોં સહન કરવા છતાં પણ કવચિત નેહાચે તેનાથી અદ્વયકૃતી મળે છે. અથવા તો ઉલ્કુંજ પરિણામ પ્રાપ્ત થાય છે તો કોઈને અદ્વય પ્રયાસે વિશેષ લાભ થાય છે. ઉંધા પાશા પણ એનું જાયત ભાગ્ય સીધા કરી નાખે છે. કેમકે મનુષ્ય પ્રકૃતિ લિન્ન લિન્ન છે એમના કર્મોની રચના પણ લિન્ન છે. નેથી એ ભાવીના પડદામાં છુયાધને પડકાર કરતી કર્મ રચનાઓ ક્યારે શું કરશે એતો કેવલી ભગવાનજ જાણી શકે.

અવંતીમાં આજે ઉત્સવનો દિવસ હોવાથી સર્વત્ર આંનંદ આનંદનું વાતાવરણ પથરાઈ રહ્યું હતું. એનેક નાના મોટા નાગરિકો પોત પોતાના વૈલાવ પ્રમાણે વખાલુષણો પરિધાન કરી મોજ શોખમાં મશાગુલ થયેતા જણ્ણાતા હતા. આજે યુવરાજ કુણ્ણાલનો જન્મ દિવસ (જયંતી) હોવાથી રાજકોઠી લઈને પ્રજના દરેક ભાગોએ એ ઝુશાલીમાં પોતાનો હર્ષ જાહેર કર્યો હતો. પ્રજન ધનાદ્વય હતી. તેમજ શાંતિનું સામ્રાજ્ય હોવાથી વેપાર રોજગારે પણ અવંતી આજે ઉત્તીતના શિખરે હતું.

મધ્યાન્હ સમય પછી રાજગઢમાં એક મોટો દરખાર ભરવામાં આવ્યો. જેમાં યુવરાજ સુંદરમાં સુંદર વખાલંકાર ફેરીને રાજ્ય કર્મચારીઓ તેમજ નગરના ધનાદ્વય જનોની સલામતી લેવાને સિંહાસને બેઠો હતો—એ બાળયુવરાજની પાંચે અવંતીનો હુકેમ તથા તે પછી મંવીઓ વગેરે બેઠા

હતા. રાજના નાના મોટા અમલદારો યુવરાજની આગળ લેટણું મુક્કીને પોત પોતાનું આસન લેતા હતા. નગરશેડ, બીજા શેડ શાહીકારો વગેરે પણ યુવરાજને લેટ વગેરેથી ખુલુ માન કરતા હતા.

રાજ્ય તરફથીજ આજે આનંદનો દિવસ હેવાથી શહેરેમાં અનેક જગાએ નાચ, તમાસાના દેખાવો ગોડવવામાં આવ્યા હતા. કયાંક સંગીતનાં મધુરાં સ્વર્ગીય ગાન છુટી રહ્યાં હતાં. કયાંક મશકરાએ અનેક પ્રકારે હાસ્ય રસની વાતો કરી, પ્રેક્ષકોનાં દિલ રંજન કરી રહ્યા હતા. સમૃદ્ધિમાં ગર્વિષ બનેલું અવંતી આનંદમાં મસ્ત બની આજે સ્વર્ગીય શોભાની સ્પર્ધાં કરી રહ્યું હતું.

દક્ષિણાના લાલચું પ્રાણીણુંને અનેક પ્રકારે રાજ્ય તરફથી દાન દેવામાં આવ્યાં. ગરીબ લુલા, અપંગ, અંધ વિગેરે અને નિરાશ્રિત જનોને ભાવતું લોજન જમાડી સંતોષવામાં આવ્યા. યુવરાજના શુભ નિમિત્તે સારી રીતે યથદાન, કીર્તિદાન અને ઉચ્ચિતદાન કરવામાં આવ્યાં. અહિંસા પ્રધાનનો જમાનો હેવાથી સર્વત્ર અમારી પટહ વગડાવી—અહિંસાની આખ્યા પ્રવર્તાવી સર્વે જીવોને અલયદાન દેવામાં પણ આવ્યાં હતાં. એ વિવેકી જનો સુપાત્રની લક્ષ્ણ કરવાને પણ ભૂલ્યા નહોતા. જેથી રંકથી તે રાય પર્યાંત, સર્વ કોઈ આજે આનંદમાં હતું.

યુવરાજ કુણુલ ઉપર સગ્રહનો અસાધારણુ પ્રેમ એજ

પ્રણના ઉત્સવનું કારણું હતું. બાળ્યાવસ્થામાં તે ચુવરાજ પદ પામીને સમ્રાટના મોટા રાજ્યનો લવિષ્યનો વારસ નિર્દ્ધ થઈ ચુક્યે હતો, જે બાળક લવિષ્યમાં પોતાનો સ્વામી-શિરતાજ થવાનો છે. એનું પ્રણના નાયકો તેમજ પ્રણજન બહુ માન કરે એ ખનવા જેગ છે. આવા હૃદિના ઉત્સાહમાં એ બાળ-ચુવરાજનું હૈયું પણ આનંદથી મકલાતું હતું.

રાજસભા નાગરિકોથી પૂર્ણ ભરાઈ ગઈ. એટલે અવંતીના હુકેમે ચુવરાજ કુણાલ કુમારની એ મીડા શર્ફદોમાં પ્રણજનને એગાખાણું કરાવી. સમ્રાટ અશોકવર્ધનની રાજ્યનીતિનાં વખાણું કર્યો. લવિષ્યના સમ્રાટ માટે પણ એ શર્ફદો કહ્યા. તે પણી રાજ્યસભામાં સંગીતની મુંદરતા છવાઈ રહી. માગવદેશની ઉંચમાં ઉંચ ગણ્યુતી નાયકાઓએ પોતાની નૃત્યકાગા અને સંગીતકાગાથી રાજસભાનાં દિલ રંજન કર્યાં, સભામાં પાણીની માર્ક અતરોના કુવારા છુટવા લાગ્યા. એ વારાંગનાઓના હુવલાવોમાં, સંગીતના નાદમાં ને તાનમાં રાજસભા તરફોાગ હતી. દુઃખ, આઝીત, અલેશ શુદ્ધસ્તુ છે એની આંખી પણ અત્યારે તો કુયાંય જણ્યુતી ન હતી.

અચાનક પ્રતિહારે આવીને ચુવરાજ અને અવંતિપતિને નમી અરજ કરી. “ બાપુ ? અવંતીથી આપણો હુત આવ્યો છે, સમ્રાટના કાંઈક શુલ સમાચાર લાવ્યો છે. ”

દ્વારપાલની વાણી સાંભળી ચુવરાજ તેમજ અવંતિપતિ વળેરે ખુશી થયા. “ એહો મંગલમાં મંગલ ? સમ્રાટે ચુવ-

રાજને માટે કંઈ શુભ સમાચાર મોકદ્યા હશે. આજના આનંદમાં તે વૃદ્ધિ કરનાર થશે. ” સામંત માધવસિંહે—અધ-
તીના હાડેમે કષ્યું અને હૃતને પ્રવેશ કરવાનો હુકમ આપ્યો.
ક્રનિહારી નમન કરી ચાલ્યો ગયો. અદ્ય સમયમાં હૃત મંદ
મંદ ડગલાં ભરતો યુવરાજના નિંહાસન પાસે આવીને નમ્યો.
પંચાંગ પ્રણિપાત કરી સભ્રાદ અશોકવર્ધનની મહોર છાપ-
વળો લખેટો યુવરાજના હાથમાં આપ્યો. પિતા તરફનો એ
પોતાને માટેનો શુલ સંદેશો યુવરાજે મસ્તકે ચડાવી માધવ-
સિંહને આપ્યો. માધવસિંહે ધડકતે હૈથે એ લખેટો ઝેડી
અંદરથી મહારાજ અશોકના હાથથી લખેલો કાગળ કાઢીને
મંત્રીધરના હાથમાં આપ્યો અને વાંચવાને ક્રમાંયું.

આનંદમાં મસ્ત થયેલી સલા અન્યાં શાંત હતી.
નૃત્ય તથા સંગીતની કણ દેખાડીને થાકી ગયેલી વારંગનાચો.
હમણાં ક્ષણુભર વિશ્રામ લેતી હતી. ઉત્સુક હૈથે સલાના દરેક
નાગરિકો એ ખુશાખબર જાણવાને આતુર હતા. “ આહા ?
સભ્રાદનો પ્રાણુધિક પુત્ર ? જેને ખુદ સભ્રાદ પોતે જ હાથે
કાચળ લખે, એવા પ્રાણુપ્રિય પુત્ર માટે સભ્રાદ કાગલમાં કું
લખ્યું હશે ? ”

હુનરો ઉત્સુક હૈયાંની જ્ઞાસાને વધારતાં મંત્રીએ એ
કાગલ મનમાં વાંચી લીધે ને એનું મોં પડી ગયું. ચતુર
માધવસિંહ તથા બીજા મંત્રીઓ સમજુ ગયા કે “ કંઈ દાળ
માં કાળું છે. સમાચાર સારા જણુતા નથી ” ધડકતે હૈથે અને
સુશ્કેલીયે માધવસિંહે પૂછ્યું. “ પ્રધાનજી ? શું સમાચારછે ? ”

પ્રધાનના સુખમાંથી નિકળતા શાખાસંભળવાને સેંકડે હૈયાં આતુર થયાં ને એના તરફ આકર્ષાયાં. સલાની સેંકડે ચક્ષુઓ એની ઉપર ચોંઠી હતી. પણ પ્રધાન શું એલે ? આજના મંગલમય સમયે પાપમય-અંધકારમય શાખા બો-
લવા જતાં એની શુદ્ધા જરૂરાઈ ગઇ. એક શાખ પણ એ-
ન એદી શક્યો અને બાહુવરા જેવો એની માધવસિંહ અને
શુવરાજ તરફ જેવા લાગ્યો. “ આહા શી ભવિતવ્યતા ? એક
ક્ષણુમાં તે રંકને રાય અને રાજને રંક બનાવે છે.

પ્રક્ષનો ઉત્તર નહિ ભવવાથી બધાંને શાંકામાં વધારે.
થયો અને બ્રમમાં પડ્યા માધવસિંહે કરીને પૂછ્યું પણ પ્રધાન
કંઈ એદી શક્યો નહિ તે લતાની જેમ મુજવા લાગ્યો એની
આવી સ્થિતિ જેઈ બધી સલાના હૈયામાં ધ્રાસકો પડ્યો એ.
આતુર હૈયાં અધિક ઉત્સુક થયાં.

મગાધથી આવેલો હુત તો આ હેખાવ જેઈ આલોજ
એની ગયો, પાટલી પુત્રમાં બધું રાજકુડુંખ ખુશખુશાલ જેઠને
તે ચાહ્યો આવે છે, કાગલની અંદર પણ શુવરાજના ખુશીના
સમાચાર પૂછ્યા છે, અહીંની ખુશાલીથી એમણે પોતાની ખુ-
ખુશાલી જહેર કરી હશે એ એને મન નિઃસંહેઠ વાત હતી.
છતાં આવું પરિવર્તન જેઈ એને તો એહદ આશ્ર્ય થયું
“ મંત્રીશર ? આપ શ્રીમાન શા માટે પત્ર વાચ્યતાં અટકાવ છો.
મહારાજ વજેરે સર્વે રાજકુડુંખ ત્યાં આનંદમાં છે. પત્રમાં
પોતાનો આનંદ જણ્યાંયો છે, અહીંથી આનંદ મંગાયો છે.

(૧૦૮)

એ સિવાય બીજું શું હોય નેથી આપને અચકાવું પડે છે. ”
મગધથી આવેલા હૂતે સવિનય જણ્યાયું.

ઇતાં પ્રધાન તો ચૂપચાપ રહ્યો ને કાગળ માધવસિંહ
નરક ધર્યો. માધવસિંહનું હૈથું તો ઉચ્છાળા મારી રહ્યું હતું
એને લાગ્યું કે ‘આવો ચતુર પ્રધાન બોલતો નથી માટે નક્કી
કંઈ માઠા સમાચાર હુશે.’ હૃજતે હાથે પ્રધાનના હાથમાંથી
કાગળ લઈને પોતે વાંચી જેયો કાગળ વાંચતાંજ એક રીસ
પાડતો “આહ ! આ શું ? ” કાગલ એણે હૂર ઝેંકી દીએ. એનું તેજ લયું ગૌરવહન જ્લાનિથી છવાઈ ગયું.

સભાની વચ્ચમાં પડેલો યમના બંધુ સમે એને વિષધી
લરેલા સર્વ સમે એ કાગલ પવનથી મંદમંદ હાલ્યાં કરતા
હતો. પણ એ જેર ચડવાની લીતિએ કેાઈ પુરુષની એને અદુ-
ક્વાની તાકાત ન હેતી. સભાએ પ્રધાનને જેર ચહેલું જેયું
ખુદ માધવસિંહને પણ એ જેરે અસર કરેલી જેધ. જેથી
અધાંનાં હૈયાં એ નિર્જીવ એક કાગલનો કુકડો હેખીને હૃજ
રહ્યાં હતાં. માળવાના શૂરામાં શૂરા ગણ્યાતા અવંતીના શાલુ-
ગ્રારડ્ય સરદારો—યોદ્ધાઓ સભામાં હાજર હતા, એમનાં
ભયંકર ચુદ્ધના તૌક્ષનમાં પણ વજ સમાન દરે એને અલેધ
હૈયાં પણ એ કાગળના કુકડાથી કંપવા લાગ્યાં.

રાજસભાની આવી સ્થીતિ યુવરાજ પણ જેતો હતો
“કાકાળ ? કાગળમાં પિતાજીએ શું લાગ્યું છે. કે આપ પણ
આમ આભા થઈ ગયા ? ” યુવરાજના જવાબમાં સામંત

મૈન રહ્યો ને ટગર ટગર ચુવરાજના સામે જેવા લાગ્યોં ! “મહારાજે શું જેઠ આવી આજા કરી હશે ! શું લગ્બવામાં ત્યારે ભૂલ થઈ હશે ? ” એણે મનમાં વિચાર્યું :

માધવસિંહને મૈન રહેલો જેઠ હાથીના બંચાની માઝેક એ બાળ ચુવરાજ સિંહસન ઉપરથી નીચે ઉતરી કાગળ લેવા નમ્યો, ચુવરાજને કાગળ ઉચકતો જેઠ માધવસિંહ ચમક્યો, એકદમ ફાળ લરી ચુવરાજ પાસે આવી એને વિનયો ! “ એહ ચુવરાજ ! મહેરાનાની કરી આ કાગળને ના અડકતા ? એ જેરથી લરેલા કાગળને અહીંજ દાળી હેવા દો ! મહારાજ પાસેથી આપણે બીજા સમાચાર મંગાવશું ને સત્ય હકીકત જાણી લેશું .”

માધવસિંહની આવી વર્તણુક જેઠ ચુવરાજ ચમક્યો બધી સહાનાં હૈયાં કંઈયાં કે એમાં કંઈક માઠા સમાચાર હતા.

પહેલે ચકમાં એઠેલી સુંદરીએનાં ચંદ્રવહનો પણ પરી ગયાં, ચુવરાજની ધાવમાતાએ માધવસિંહની પ્રયત્નમા તેમજ નાગરિકેની રમણીએ, સામીએ, દાખીએ વગેરે એઠેલી હતી.

એ સર્વેના મુગ્યં ઉપર ને ક્ષણ પહેલાં હર્ષની જયેતિ ચમકતી હતી તે અદ્દશ્ય થઈને હૈયામાં ધ્રાસ્કો પડ્યો, ધાત્રીએ ચુવરાજનું મંગળ છંઢતી અલા બલા કર કરતી એનું શુભ ચાહુવા લાગી, રાણીએ ભરતા ભરતાં એક ધાત્રીને ખાસ ભક્તામણું કરેલી, અને ને ભરનારની પ્રાણુપ્રિયા

સામી સમાન હતી તે યુવરાજની પ્રત્યેક ક્ષણે કાગળ રાખતી આ સમયે ધાર્શાથી એ ધાત્રી રૂદ્ધન કરવા લાગી. પ્રત્યેક ક્ષણે એને આઇતની શાંકા થવા લાગી.

“ કાકાળ ! સખુર ! ગમે તેવો પણ એ પિતાજીનો પત્ર છે. પિતાજીના પત્રનું તમે અપમાન કરો છો તે તમે ઢીક કરતા નથી. ” બાળયુવરાજે કહ્યું. એમ કહીને એણે કાગળ ઉપાડી લીધો. યમરાજના પ્રિય ભિત્ર સમાન એ કાગળ યુવરાજે લઈને દરેક ખુશ સમાચારને અંતે “કુમારો અંધીયડ” એવા શાખા ઉકેલ્યા. એનો લાવાર્થ પોતે સમજુ ગયો. સમાટ ઉપર લક્ષિત વાળો એ આડ વર્ષનો આગાક યુવરાજ માધવ-સિંહ અને મંત્રીઓને ઉદેશીને બોલ્યો. “ કાકાળ ! ચંદ્રગુ-ઘ્નતના વંશમાં વડીલની આજાનું ઉદ્ઘાંધન કરનાર કોઈ થયો નથી અને જો હું જ અગ્રેસર થઈને સમાદ્ધી આજાનો લોપ કરીશ તો મારા આચરેલા માર્ગે બીજા પણ ચાલશો. માટે તમે જટ સમાદ્ધની આજાનું પાલન કરો ? આ કમનરીખ કુલાલને અંધ કરો ? ”

રાજ સલા ચિત્રવત્ સ્થિર થઈ ગઈ. સર્વે જણા એક બીજાની સામે જોવા લાગ્યા. જ્યાં હર્ષનો અવધિ હતો. એમાં-થીજ આ આઇતનો ઝણુંગો કયાંથી ઝાટી નીકળ્યો ?

“ યુવરાજ ! જરી સખુર ! અમને શક છે. એમાં કંઈક કાવતરાની ગંધ છે ? ” એક ચતુરમંત્રીએ કહ્યું.

“ ખરાખર છે ! એ માટે સત્રાદને કરી પૂછાવવું જોઈએ ! ” માધવસિહે કહ્યું.

“ નહીં ? બિલકુલ નહીં ? કાગાગ ઉપર મહારાજના મહોર છાપ સ્પષ્ટ છે. અક્ષરો પણ એમના હૃથનાજ પ્રગટ છે, માટે તમે રાજના હુકમનું પાલન કરો ? ” ચુવરાજે કરીને કહ્યું.

આમી સભામાં કેલાહુલ થયો દરેક જણાના સમજવામાં આવ્યું કે “ સત્રાદની ચુવરાજને અંધ કરવાની આજા થઈ છે ? ”

પડામાંથી કુમારની ધાવમાતા હોડી આવી હડાવરી જેવી ચુવરાજને પાંચ પડી. “ હાય ! હાય ! શું મહારાજની આવી આજા ? ”

“ માતાજી ! કદ્યાંત શામાટે ! પિતાની આજા એ પ્રભુ આજા છે ! એ આજાનું ઉલંઘન હુવે નજ થઈ શકે ? ”

“ પણ દિકરા ઉતાવળો શા માટે થાય છે એ બધી રાજ્ય ખટપટની પંચાત છે. મહારાજને કરીને પૂછાવવા હે ? એમ કંઈ આંખો ફોડાવાય નહીં ? હાય હાય ! તારી માતાને હું શું જવાબ દઈશ ! સ્વર્ગમાં રહેલો એનો આત્મા મારી ઉપર હુલાશો ! ”

“ માતા ! પિતાના હુકમનું અપમાન થાય જ નહીં. જેવું ભાવી ? કાકાજી ? તપાવેલા સળીયા લાવી ભારી આંખો ફોડી નાંખો ? ” એ નાનકડા ચુવરસાજનું જૈર્ય અપાર હતું.

ખાળક છતાં એ સિંહનું બચ્ચું હતું. સિંહણના દુધથી ઉદ્ઘરેલા નાનકડાં બચ્ચાં આકૃતો જોઈ કાંઈ ડરતાં નથી! અરે એટો ભયનું નામ પણ જાણુતાં નથી. ચુવરાજે ધણું કણું પણ એવો કોણું અભાગીયો. હોય કે ધગધગતા સગીઓ આંખો દ્રાડવા આપે?

“માઝ કરો ? અમારાથી એમાંનું કાંઈ નહીં બની શકે ?”
માધવભીંહ તથા મંત્રીએઓએ હાથ મોઈ નાખ્યા. કોણું અભાગીયો પાપના કામમાં લાગ લે !

“એહુ ? મહારાજના હુકમનું તમે અપમાન કરો છો ?
કાકાળ ! એ હુકમના અપમાન મારે તમારે પસ્તાવું પડશે ?

“ ઉતાવળા ન થાયો ? ચુવરાજ ? હું મહારાજ પાસેથી સત્ય હક્કીની જાણવાને આ હૃતને પૂર્ખી જોઉં ? એને મોંયે કંઈ સમાચાર કહ્યા છે કે વાર્તા ? ” માધવભીંહ મગધથી આવેલા હૃતની જુઆની લીધી.

એ હૃત તો આ અન્યથા ઘટના સાંલાગી મૂંઠ થઈ ગયો હતો, આ શું થાય છે એની એને ખખર પણ પડી નહીં. માધવસિંહે કણું. “ કહે ! એ કુમખખત ? તું આ શું સમાચાર લાવ્યો ? જોલ આમાં શું લેદ છે ? સાચું કહે નહીંતર તારી ઉપર શીકારી કુતાએ છેડવામાં આવશે ? ”

“મહારાજ ? આમાં હું તો કાંઈ બાણુતો નથી અંધ્રન શું ને વાત શી ? સાચ્છારે તો ચુવરાજને ખુશી ખખર લખ્યા છે.
હું કુમાર અદ્યાસ કરે એવી તેમની ઈચ્છા છે. મહારાજે નક્કી

લખતાં ભૂલ કરી છે. ઓપ રજા આપો તો અર્થે હું એની આતરી કરી લાવું, ચુવરાજ માટે મહારાજ તો અર્ધા અર્ધા થતા હતા ને વળી આ બદા તે કયાંથી નીકળી પડી. ”ઈજતાં મુજતાં હુતે સમાચાર કહી સંભગાન્યા.

“ને દિકરા ? સાચાની લખવામાં ભૂલ થઇ છે માટે તપાસ કરવાહે ? ખીજે હુકમ આવે ત્યાં લગી નાખુર કર ? ” ધાવ માતાએ કહ્યું.

“નહીં ? તમો અધારાનના હુકમનું અપમાન કરવા જોડા છે ? પિતાનું વચ્ચન હું સત્ય કરી બતાવું તોજ હું મુત્ર ? તમેજ નહેતા કહેતાં કે પિતાનું વચ્ચન પાળીને રામ લક્ષ્મણ બાર વર્ષ વનવાસી થયા, માટે જટ ધગધગતા સળીયા લાવી આ આંખમાં ચાંપીદો ? ”

જ્યારે કોઈએ એ હુકમનો અમલ ન કર્યો ત્યારે પોતાને હાથે લોખાંડના સળીયા ધગધગાવી પોતાની ઠાંને આંખોમાં ઓસી ધાવ્યા એ ધગધગતા સળીયા આંખમાં જતાજ એના એ ડોગા તરતજ નોચે નીકળા પહ્યા, એ બાળ ચુવરાજ પિતાનું વચ્ચન પાળીને અંધ થયો.

સર્વેએ પોતાનું ખનતું કર્યું. પણ ચુવરાજે કોઈનું કથન કાનપર ન ધરતાં પિતાનું વચ્ચન પાલન કરી બતાયું, રાંધ્ય સભામાં કર્દણા રસ છવાઈ રહ્યો, સર્વેની આંખોમાં આંસુ હતાં, અધે થતાં નાચ ગાન બંધ થઈ ગયાં ને ધરીક મહેલાં આનંદમાં મસ્ત બનેલું અવંતી અગાધ શોકના સસુદમાં હુણ્યું... ,

યુવરાજના અંધપણુની વાત આખા નગરમાં પ્રસરી ગઈ. નાચનારીઓ નીચે મેંએ ત્યાંથી વિદોય થઈ ગઈ. પડતે આંસુએ માધવસિંહે રાજસભા ખરખાસ્ત કરી. અત્યારે સભામાંથી નીકળતા દરેક સભ્યની આંખમાં આંસુ હતાં, ધાવમાતાએ, દાખીએ રડતી હતી. છાતી કુટતી ધાવમાતા સુનંદા અંધ કુણાલને તેડીને અંતઃપુરમાં લઈ ગઈ. એક હૃષેન્ભત્ત અવંતીની રાજસભાનો આવી રીતે કર્ણાજનક અંત આવ્યો, આહ શી લવિષ્યતા?

આ સવિસ્તર ફુખ દાયક સમાચાર માધવસિંહે સમાદ અશોક તરફ તુરતજ રવાને કર્યો.

—•—(૩)•—

પ્રકરણ ૧૩ મું.

—•—

મતલખની મોહમાં.

પેલી શ્યામ મુખવાળી શ્યામા જેમ તિથરક્ષિતાની પ્રિય સાખી અની હતી તેમ બૈધ્ય સાધુ નંદને પણ એને સાધી હતી. તિથરક્ષિતાની દરેક હુકીકત અવારનવાર તે એને જણાવતી હતી. ને રાજ તેમજ રાણી તિથરક્ષિતાનું દેખરેખ રાખવાનું કામ સાધુએ એનેજ જણાવ્યું હતું. તિથરક્ષિતાએ અવંતીના કાગળમાં કે ગોટાળો ઉલો કર્યો હતો એ વાત શ્યામાના જાણવામાં આવેલી હોવાથી એણું એ સમાચાર પણ નંદનને આયા

હતો. તિષ્ઠરક્ષિતાને સપડાવાનું આ અમુદ્ય સાધન હાથ લાગવાથી એને એક પ્રકારનો સંતોષ થયો હતો.

નંદન આચાર્ય તિષ્ઠરક્ષિતાના સૌંદર્યપર અંન્યો હતો. એ તે જમાનાની રૂપગર્વિતા અશોક મહારાજની પદૃરાણીના યૈવનનો પુનર્ની બન્યો હતો. એ તૌક્ષાની અને રાજ્યમતથી ગર્વિ છથ્યેલી સુંદરીને ડેવી રીતે સકંબમાં સપડાવવી એની રાહ જેતો હતો, શ્યામાને સાધવાથી દૈવયોગે એક ગર્વિષ યુવતીનું યૈવન મર્હન કરવાની અચાનક આ તક મળી ગઈ. એ ઇકત હુવે સમયનીજ રાહ જેતો હતો કે આ કાગળ અવંતી ગયા પણી એનું પરિવર્તન શું થાય છે ? તે છતાં એ પરિવર્તન પહેલાં નિષ્ઠરક્ષિતાના કાર્યથી જાણે અજાણ હોય એમ એ જૈથી ગુરુએ તિષ્ઠરક્ષિતાને મળીને કાંઈ આત્મ વાધા પૂર્વક પોતાનાં વાણાણ કરવાને મન લલચાણું ? વાણું તો તીર નહીંતર કાંઈ નહીં. પણ આ તક જાણ દેવી તો નજ જોઇએ જેથી અવસર મેળવીને એક દિવસ શ્યામા મારકૃતે એણે તિષ્ઠરક્ષિતાને દર્શનને હણાને બોલાવી.

તિષ્ઠરક્ષિતા પણ હુવે પ્રસન્ન હતી. એ પણ હુવે આ કાગળનું શું પરિણામ આવે છે એનીજ રાહ જેતી હતી. તેનું આ પાપ કૃત્ય એની બહાલી સખી શ્યામા સિવાય ડેઢ જાણુતું નહેાતું. શ્યામાને પણ એણે સખત તાકીદ કરેલી કે આ વાતનો મર્મ આપણાએ સિવાય અન્ય ડેઢનિા જાણુવામાં નજ આવી શકે.

અવસર મેળવીને વળી તિષ્ઠરક્ષિતા શ્યામા તથા સાહે-

લીએ। સાથે શુરૂ દર્શને જવા નીકળી, હુન્યામાં ઉત્તમ ગણુતો.
 નંદનનો મઠ જેમાં ધણ્ણા ઐંદ્ર સાધુએ। નિવાસ કરતા હતા.
 ઉપગુપ્તને માટે મહારાજે આસ આ મકાન બનાવી એને
 અર્પણ કર્યું હતું, જેથી એની રૈનક ધર્માજ આકર્ષક હતી.
 એ મહા વૈરાગી ઉપગુપ્તને સ્થાનકે અલ્યારે નંદન નામે જૌદા-
 ચાર્ય હતો, નંદન કાંઈક ખટપટી અને વિલાસ પ્રિય હતો. સાધુ
 થવા છતાં એની વાસનાએ। હજુ તાજુને તાજુજ હતી. જેથા
 જૌધ ધર્મના પડહામાં સગ્રાદને ફ્રસાવી બની શકે તો યોગ્ય
 લાલ લેવાની તક નંદને સાધવા માંડી. એ નંદનાચાર્ય બની
 ઠણ્ણીને પોતાના શિષ્યોને મધ્યાનહ પછી અધ્યયન કરાવતો
 હતો, એવામાં એક શિષ્યે દોડતાં આવીને ખરુર આગ્યા કે
 “પદૃરાણીજુ તિષ્યરક્ષિતાચાય શ્રીમાનના દર્શને પધારે છે?”

તિષ્યરક્ષિતાનું નામ સાંલળતાજ નંદનાચાર્યના કાન
 અમક્યા. એણે ચાલતો પાઠ ભીજા વિક્રાન શિષ્યને ભળાવી
 બધા શિષ્યને હું આવું ત્યાં લગી પાઠ આપવાની એને સુચના
 કરી. પોતે એક સુંદર દિવાનખાના જેવા ઓરડામાં જણે
 મોટાં શાસ્ત્રોનું અવલોકન કરતો હોય એવો ડોગ કરતો
 એડો. વળી એ ચિત્ત વૃત્તિનો નિરોધ કરતો ત્યારે જણે દ્રષ્ટ
 સુવર્ણે અવસ્થાન હોય એવી ચેદ્ધા કરી નાખતો. નંદન એવી
 રીતે જગતના બાધ આનંદમાંજ મસ્તઃ રહેતો હતો. એના
 બાધ ડોગનો પાર નહેતો.

તિષ્યરક્ષિતા રથમાંથી ઉત્તરી શ્યામાની સાથે નંદના-
 ચાર્યની પાસે આવી ઝીલુ સાહેલીએ મહેની શોલાં જોખામાં
 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

રોકાંદ એથી નંદન સાથે વાત કરવાની એને ટીક તક મળી ગઈ. નંદન સાધુ સમાધિમાંથી જાણે જાગ્યો હોય એવો તો કરતો એલયો. ” આવો ! આવો ! મહારાણીજી ! પધારો ! ”

“ શુરૂ ! આપતો ખુશીમાને ? ” મહારાણી ચુકુ હસતાં બોલી.

“ હા તમને જોતાં વળી વિશેષ ? ” સાધુએ પણ મીઠા-સથી જવાબ આપ્યો.

“ શુરૂવર ! આપ કાંદ આજે પ્રસન્ન છો ખડુંને ? ”

“ હા ! તમારું અનુમાન સત્ય છે. ”

“ છે કાંદ નવીન સમાચાર ? ”

“ તમારાજ લાલની વાત છે મહારાણીઓને ! તમારું કાર્ય મેં સિદ્ધ કર્યું છે. ખુદ્દ લગવાનની કૃપાથી થાડા હિવ-સમાં એનું પરિણ્યામ જોશો ! જ્યાં સુધી એનું પરિણ્યામ ન જણાય ત્યાં લગી હું પણ એનાજ પ્રયત્નમાં છું ? ” નંદન સાધુએ હાંકવા માંડયું.

“ આહા ? શું આપ મારા કાર્યની એટલીખંડી કાગજ રાખો છો કે રાત દિન એનો પછ્યાડે મહેનત કરો છો ! ” રાણી પ્રસન્ન થતી બોલી.

“ એમાં નવાં શું ! તમારું કાર્ય મારે કરવું જોઈએ. શું તમે મને તમારાથી જુદો સમજોછો ! લભે તમારા મનમાં હોય ! બાકી અમે તો કોઈનું બાવડું થાલીયે નહીં ને થાલીયે તો સંસારથી પાર ઉતારીયે તો પણી આવી નજીવી બાખતોનો તો અમારે મન હિસાબજ શો હોય ! ”

“ સત્ય છે ! આપના જૈવા સમથ પુરુષના પ્રલાવથી મારું કાર્ય સિદ્ધ થાવો ! મારો મહેંદ્ર લારતનો સાચાદ થાયો ! હુંતો એજ ધર્યું છું ! ” રાણી જંતોષ લેતાં ઓલી.

“ એમાં શું શક છે મારા પ્રલાવથી તમાડં કામ થયું જ સમજે. મને લાગે છે કે થોડાજ દિવસમાં તમો તમારા લાલની નવીન વાત સાંલગણ્યો ? ” સાધુએ અડાવ્યું.

“ તો તો તમારા મોંહમાં સાકર, શુરૂ ! ” રાણી મીહું હસતાં ઓલી.

“ બસ સાકરજ હેણાડી રાણું કરશોને ? ” મીઠા હાસ્યની સામે સાધુ પણ હસ્યો.

“ તો આપને હું બીજું શું આપું ? મારાથી ને અની શકશે તે આપની સેવામાં હું રજુ કરીશ પડી કાંઈ ? ”

“ બરાખર છે ! તમે ન આપી શકો એવી બીજાની કાંઈ મારી ? માગણી નથી. કે આકાશમાંથી ચાંદ લાવી આપો કે મને અજરામર બનવાને અમૃતનો કુપો લાવી આપો ? હું જે માગીશ. તે તમે સહેલાઈથી ધારશો તો આપી શકશો. રાણી સાહેબ ? ” સાધુએ મોંઘમ વાત કરી.

“ એશક તો આપની ધર્યા હું અવસ્થય પૂર્ણ કરીશ. એક વખત મારા લાલની વાત સાંલગવા ધો, એટાં મને હ્યે નિરાંત થાય ? ”

“ જરૂર હવે અદ્ય સમયમાંજ તમે સાંલળી શકશો રાણીજ ? મને સમાધિમાં એવું જખુાય છે કે કાર્યની શરૂ-

આત પણ તમારાથી થઈ ચુકી છે. ” હંતે કલેજે એાંદ્ર સાધુએ કહ્યું.

નંદન સાધુના વચન સાંભળીને તિષ્ઠરક્ષિતા ચમકી “ એાંડ ? પ્રલુ ? તમે તો ત્રિકાલજાની લાગો છો ને શું ? ”

“ ચૂપ ! ચૂપ ! જરીક આસ્તેથી બોલો ! ભીતને પણ કાન હોય છે. વાત ખાનગી રાખવા જેવી છે એ તમે ધ્યાનમાં રાખજો. તમારી શ્યામાને પણ જણાવતાં ના ? ” આસ્તેથી જોધ લિંગુક બોલ્યો.

“ આપની વાત મારા ધ્યાનમાં છે, પણ શું સમાધિમાં આવું બધું હેખાય છે ? ”

“ હા ? એમાં શું આશ્ર્ય છે. એવી તો કંઈ ચીને આત્મ સાક્ષાત્કાર થાય ત્યારે અંધકારમાં વિજળીના જખકારથી જેમ વસ્તુઓ માલૂમ પડે એવી રીતે પ્રત્યક્ષ થાય, એતો અમારો હુમેશાંનો નથ્યો અલ્યાસ છે એમે તો એથીય આગળ વધી ગયા છીએ. એ સમાધિ-યોગની વાત કહેવાય, એમાં તમે ન સમજો ! જેથી તમારી આગળ વિશેષ શું કહીએ ? ”

તિષ્ઠરક્ષિતાએ વિચાર્યું કે “ આ સાધુઓ વિક્રરે તો નાઓદ કાઢે એમાંતો શક નહીં, માટે જરૂર આનેતો હવેકોઈ ઉપાયે લાકચામાં લપટાવી આધિન રાખવો જોઈએ. મુવો નણુકાળની વાત જણુતો લાગે છે. ”

“ રાણીશ ? શું વિચારમાં પડી ગયાં ! સેવકની કંઈ કરુર તો નથી થઈને ? ” સાધુ હસ્યે.

“ અરે લગવન् ! આપતો આ કાળના સાક્ષાત્ સર્વજ્ઞ છે, આપની કસુર મારા મનમાં પણ કેમ આવે ? તમારી સર્વજ્ઞતાથી હું તો તમારી ઉપર અધિક પ્રસન્ન થઈ છું. પ્રભુ ! તમારી શી શી લક્ષિત કરું !

“ અકળાઓમાં ! રાખ્યીએ ! લક્ષિત ધણે પ્રકારે થઈ શકે છે. તમારી મરણ હશે તો તમારી લક્ષિતનો હું સ્વિકાર કરી પહેલો લાભ તમને આપીશ. પછી કાંઈ ? ”

“ તો તો આપની મોટી મહેરબાની, પ્રભુ ? અમારા જેવા તુચ્છ સંસારીયો ઉપર તો આપની કૃપા વરસવી જોઈએ. હુમેશાં અમી દસ્તિથી જોવું જોઈએ ? ”

“ એ તો ઠીક પણ રાખ્યીએ ! તમેજ કહેને ! કે આવી લક્ષિત સદાકાળ અમારી ઉપર રાખ્યી શકશો ? તન મન અને ધ્યનથી અમારી સેવા કરશો કે ! કામ થયું એટલે ગરજ સરીને વૈદ્ય વેરી ? ”

“ એવી હું નિમકહુરામ નથી. પ્રભુ ! અમારે મન તો શી વાત તે શુરૂ ? ખુદ મહારાજ કરતાં પણ તમને હું અધિક પૂજનીય સમજું તો પછી બીજી શી વાત ! ”

“ એ તમારા શાખો સત્યતા લારેલા છે કે બાધ્ય આડંખર વાળા છે. એની હું એક હિવસ કસોટી કરીશ. માટે વિચારીને બોલનો ? ” સાધુ મીઠું હસતાં હસતાં બોલ્યો.

“ એશક ! હું ખુશીથી એની પરિક્ષા આપીશ ! પછી

કાંઈ, આપ આહાર લેવાને અમારે ત્યાં પધારતા હો તો કેવું સારું ! હું શ્યામાને તેડવા મોકલીશ. આપના પગલાંથી અમારું મકાન પાવન થાય. અમારે જન્મ સફ્રેલ થાય ? ”

“ ને તમારે પણ અવાર નવાર દર્શન કરવાને આવવું સમજ્યાં ને ? રાણીલુ ? ગુરુની ભક્તિ કરવાથી સ્વીચ્છા સહસ્રાગર તરી જાય છે. પણ તન મન ને ધન પોતાનું સર્વચ્છ ગુરુને સમર્પણ કરી હેવું જોઈએ તો જ તમારો મોકાથ થાય સમજ્યાંને ! રાણી સાહેણ ? ” વ્યાંગમાં ને વ્યાંગમાં સાધુએ હાંકવા માંડયું. એની વૃત્તિએ તો એટલી બધી ઉચ્છાળા મારી રહી હતી કે અત્યારેજ કાર્યનું મંગળાચરણ કરી હેવું. પણ ઉતાવળા કરવા જતાં કદાચ તાલ બધો બગડી જાય માટે ઉતાવળા સો બાવરા ધીરા સો ગંલિર !

“ આપનો એ ઉપદેશ સત્ય છે. પ્રભુ ! આપના પ્રસાયથી અમને સહખુઓ રહો ? આપની ઉપર અમારી ભક્તિ અચળ રહો ? ”

“ તથાસ્તુ ? ” સાધુએ વરદાન આપ્યું.

સમય પરિપૂર્ણ થવાથી આસપાસ મહનું અવદોકન કરતી એની સાહેલીએ. આવી પહોંચી એટલે મૂળ વાત લ્યાંથી અટકી પડી. બધું રમણીમંડળ થોડીવાર એસી ગુરુનો ઉપદેશામૃત શ્રવણ કરી જેમ આંયું હતું તેવીજ રીતે વિદાય થયું.



પ્રકૃતણુ ૧૪ મું.

એકજ ભૂત.

“આહા ? સત્યાનાશ ? શું થઈ ગયું ! મારા એક
નળવા પ્રમાદથી કેવું લયંકર ઘોર કૃત્ય થઈ ગયું. હા !
પ્રભુ ! વિધિ ! આ જીલમ ! મારા પ્રમાદને ધિક્કાર થાયો ?
મારી એ ચયપળતાને દ્રિટકાર થાયો ! કે ઝરીને મેં એ કાગાં
વાંચી ન જોયો ? હા ? દુહૈવે કેવો હંગો હીધો ! અરે એ
પ્રાણુધિક પુત્રનું મેં પિતા થઈને શિશ કાયું. એની ઉગતી
જંદગીનું સત્યાનાશ વાજ્યું. એની નવીન આશાઓનું
નિકંદન કર્યું. મારે કયા જન્મનું પાપ ફરજ્યું. એની માતાએ
મરતાં મરતાં મને કેટલીય ભલામણો કરેલી, એ બધી આજે
વ્યર્થ થઈ. એનો સ્વર્ગમાં રહેલો આત્મા મારી ઉપર શ્રાપ
વરસાવતો હશે. કેટલી બધી મને કહુવા આપતો હશે. હાય !
ઘણું જ ઐદું થયું ! હવે શું ઉપાય ? આખું રાન્યપાઠ
આપતાં હવે એ ગયેલી આંખો ઝરીને તોણુ મેળવી આપો !
દિકરા ! મેં તારા પિતા થઈને કેવું શરૂનું કામ કર્યું !
કલિંગ દેશની આદ્રત લીધાનું પાપ મને અહીં ને અહીંજ
ફરજ્યું. અથવા તો પેલા નરક સ્થાનમાં ભૂરે મોતે માર્યે
ગયેલા કઈ જીવોનું પાપ મને અહીંજ પ્રગટ થયું ! હા ?
વિધિ ? વિધિ ! મારી સર્વે ઓશાઓ તેં નાશ કરી નાખી.
હવે એ વત્સ રાન્ય લોગવવાને અનધિકારી થયો. અરે એક

માંડલિક રાજ્યને યોગ્ય પણ ન રહ્યો. અહે ? જેની મારા ઉપર આવી લક્ષ્ણ હતી તેની મેં આવી અધમ દશા કરી. ’

એ યૌવરાજ્યપણું લોગવીને પછી મહારાજ થશે આ. મનોરથ હવે સમાપ્ત થયો. કેવો એ સાહસિક ! મારી એ અધમ આજાને પણ એણું અંગીકાર કરી પિતૃભક્તિની હદવાળી જગતમાં જનેતા આવા પિતૃભક્ત પુત્રો ઉત્પત્ત કરતી હોય તો હુન્યામાંથી ધાણું કષ્ટ ઓછું થઈ જત. પણ પિતા તરીકે હું નાલાયક થયો. મારેજ હાથે વાવેલા વૃક્ષનું મેં ઉન્મૂલન કર્યું. હા ? હૈવ ? હૈવ તું માણુસને પ્રમાણી બનાવી કેવાં અકાર્ય કરાવે છે. નહીં કરવા યોગ્ય પણ તું કરાવે છે. ” એ હુઃખબર્યા ઉદ્ગાર તે જમાનાના એક પ્રભાવશાળી પગાડકી પુરુષના હતા. જગતમાં ગમે તેવો સમર્થ માણુસ પણ ભૂલ કરી નાખે છે અને એ ભૂલનું પરિણ્યામ પણ એવું જ ભયંકર આવે છે. મહારાજ અશોકવર્ધને યુવરાજ કુણ્ણાલ ઉપર કાગળ લાખેલો તે ઇરીને મોકલવા સમયે વાંચ્યા વગર મહોર છાપ કરી મોકલી દીધે. એનું પરિણ્યામ ધાણું જ ભયંકર આવ્યું હતું. એ ભૂલને પરિણ્યાતે અત્યારે સમાઝ પારવાર શોકમાં દુષ્યો હતો.

સમાટ પ્રાતઃકાળમાં થોડો દિવસ ચડી ગયો. હતો એ સમયમાં પોતાના દિવાનખાનામાં બેસીને રાજ્યનાં ઉપયોગી કાગળીયાં તપાસતો હતો એવામાં પ્રતિહારે આવીને નમન કરી સમાચાર આપ્યા કે “ અવંતીથી ફૂત આવ્યો છે. અગત્યના સમાચાર લાવ્યો છે. ”

અવંતીનો હુત આ વખત તરતજ આવેલો જેઠ સમાટ ખુશી થયા ને તરતજ અંદર આવવાની આજા આપી. એટલામાં તો અવંતીથી આવેલો હુત એકદમ રઘવાયો અંદર ખસી આવી જેમ તેમ મહારાજનો વિનય સાચવતો પેલો લોહીથી ખરડેલો પત્ર ભાલાની આણી ઉપર ઘોંચી મહારાજની સામે ધર્યો. હુતની આવી વર્તાળુકથી સમાટ એની ઉપર ગુસ્સે થયો. પણ તે લોહીથી ખરડેલો પત્ર જેઠ ચમકયો એનું વજસુ મજબુત હૈયું ધડકયું છતાં મહારાજે કુર દાખિયે હુતની સામે જોયું. “ એ અદખ ? ગુલામ ! આવી એઅદખી ? અરે કોણ છે હાજર ! ”

“ મહારાજ ! સત્યાનાશ ? આપે સત્યાનાશ ? વાજ્યું આપની ભૂલે કેવું ભયંકર કામ કર્યું છે તે આ પત્ર વાંચો. પછી મને શિક્ષા કરમાવો. ”

હુતનાં વચન સાંભળી રાજને પ્રાસકો પડ્યો. શું થયું છે ? ”

“ તે હું મારી જીલે કહીશ નહીં ? આપ પત્ર વાંચો ! અરે આ પત્ર આપીને આપને હુદખ કરવા પહેલો હું મરી કેમ ન ગયો ! હા ! ધિક્કાર છે મને કે મારે આવું કૃત્ય કરવું પડે છે ? ”

મહારાજ ધડકતે હૈયે એકદમ ઉલા થયા ત્યાંતો પ્રતિહારે ભાલામાંથી કાગળ ખેંચી કાઢી મહારાજની આગળ ધર્યો ભુખ, તૃષા અને સુસાફરીના પરિશ્રમથી અર્ધમૃત જેવો થયેલો છતાં જુસ્સાના આવેશમાં અહીં સુધી આવેલો હુત પોતાનું કામ ખલાસ થતાં તે એકદમ ઐભાન જેવો બની જમીન ઉપર

તુટી પડ્યો તેને મહારાજના હુકમથી આવેલા માણુસો મહારાજના જુ સંકેતથી હૃતને ઉપાડી ગયા. ધડકતે હૈયે અનિષ્ટના ચિંતવના કરતાં રાજાએ કાગળ ફેડાઈને વાંચી જેયો જેમ જેમ વાંચતો ગયો એમ એની આંખે અંધારાં આવવા લાગ્યાં પોતાના પુત્રની મુદ્દામ હકીકત જ્યારે એના વાંચવામાં આવી કે મોટી ચીસ પાડતો મહારાજ ઐલાન જેવો બની જમીન ઉપર તુટી પડ્યો એની ચીસ સાંભળ્યા અંતઃપુરમાંથી રાણીએ વગેરે હોડી આવી. બીજી તરફ દાસ દાસીએ વગેરે લેગાં થઈ ગયાં, તરતજ મંત્રીએને ઓલાવવામાં આવ્યો. બીજી તરફથી વૈદ્યોને તાકીદે હાજર થવાને હુકમ થયો. મુચ્છિત થયેલા રાજ ની મુચ્છા વાળવા રાણીએ અને તેમાં વિશેષ કરીને તિથ્ય-રક્ષિતા પ્રયત્ન કરવા લાગ્યી.

ઓડી વારમાં મંત્રીએ, વૈદ્યો વગેરે આવી પહોંચ્યા. એટલે રાણીએ હુર ખસીને વૈદ્યો મહારાજની મુચ્છાનિા ઉપચાર કરવા લાગ્યા. મહાઅમાત્ય રાજની પાસે એડો હતો. રાજને એકદમ આ શું થયું એની કોઈને અખર પડી નહીં. આખરે વૈદ્યોના પ્રયત્ને રાજ સાવધ થયો. આંખો જોલી ચારે તરફ જેવા લાગ્યો ને રાણીએ દાસી વગેરે સર્વને રજ આપી દીધી રાજની સંજાથી વૈદ્યો પણ ચાહ્યા ગયા.

રાજ પેલો થમના બધું સમેં કાગળ મંત્રીશરના હાથમાં ફેંકતાં ઉપર પ્રમાણે વિલાપ કરતો હૈયાના ઉસરા ઠલવતો હતો મંત્રી પણ કાગળ વાંચીને જંખવાણો પડી ગયો. અત્યારે મારા રાજની આવી સ્થિતિમાં શું એલવું તેની એને કાંઈ સમજ

પડી નહીં. રાજની આંખમાંથી તો પશ્ચાતાપનાં અશુદ્ધો અસ્વામલિતપણે વહેતાં એણે નિહાળ્યાં.

“ મહારાજ ! પશ્ચાતાપ કરે શું વળે તેમ છે. ધાર્યું તો વિધિનું જ અને છે. આપે તો સંભાળીનેજ કાગળ લખ્યો હુશે છતાં હૈવની મરળુથીજ આવી બીના ઉલ્લી થઈ, ” આસ્તેથી મંત્રીથરે કહ્યું.

“ હા પ્રધાનજ ! એ મારા પ્રાણુધિક પુત્ર સદાને માટે અંધ થયો. મારી આશાનો અંભાર આજે તેજ રહ્યિત થયો.”

“ વિધિના ચકના આગળ માણુસનો શું ઉપાય ? ”

“ એ કાગળ ફરી મેં ન વાંચ્યો એ મોટી ભૂલ થઈ ગઈ. તેમજ કાગળ લખવા સમયે આ વખતે આવી રીતે ભૂલ થઈ ગઈ એતો નવાઈનીજ વાત ”

“ મહારાજ ! આપે કાગળ લખીને તરતજ બીડી હીધેં હતો કે કોઈને વાંચવા આયો હતો. કાગળ લખવા સમયે આપની પાસે કોઈ હતું કે ? ”

પ્રધાનનો આ ગ્રન્થ સંભળીને સત્રાદ્ર ચમક્યો. “ તમે આમ કેમ પૂછો છો ? શું તમને કાંઈ કાવતરાની ગંધ આવે છે, મને તો મારીજ ભૂલ સમજય છે. ”

“ મને એમ લાગે છે. મહારાજ ! કારણુકે આપનાથી આવી ભૂલ કદાપિ પણ નજ થઈ શકે એ યુવરાજ રાજ્ય વારસ હોવાથી એની અપર માતાઓમાંથી કોઈનું કૃત્ય હોય એવો સંભવ છે. ” પ્રધાને કહ્યું.

“ તમાડું કહેવું સત્ય છે અને તેને લઈનિ તો મેં એને અવંતીમાં રાખ્યો હતો. એટલે હૂર છતાં પણ હુષ વિધિએ એની અપર માતાઓનો મનોરથ આજે સફળ કર્યો. ”

“ તો શું આપને એવો વહેમ છે છે કે આપના લગ્ન-વામાંજ ભૂલ થઈ ગઈ ? ”

“ એશક ? તે સિવાય આવી બીના કેવી રીતે બની શકે ? ”

“ બની શકે ! તમારી કે મારી ઇચ્છાથી ન બની શકે તે વિધિની મરજીથી અવશ્ય બની શકે ? ”

“ ગમે તેમ છતાં અત્યારે તો પુત્રની જાંદગીનો હુંજ જોખમદાર છું. આ ગંભિર ભૂલનો હું પોતેજ જવાખદાર છું. ”

“ તથાપિ સત્ય હશે તે એક દિવસ તરી આવશે, કહેતો ખરા કાગલ લખ્યા પછી કોઈના વાંચવામાં આવ્યો હતો. વાર્ડ ? ”

“ નહી ! કોઈએ વાંચ્યો નથી. કુકુત પદૃરાણી તિખ્ય રદ્ધિતા હું કાગળ લખી રહ્યો ત્યારે મારી પાસે આવી હતી પણ કાગલ તો એણે વાંચ્યો નથી. એ આવી એટલે કાગળ પુરે કરી મેં એક બાળુએ સુકી દીધો. ”

“ પછી. ”

“ પછી શું ! થોડીવારે અમે બન્ને જમવા ગયાં. ”

“ ત્યારે કાગલ કયાં હતો ? ”

“ કાગળ ? (યાદ કરતો) બરાખર એતો અહીંજ હું ભૂલી ગયો હતો. પણ એ ઉપરથી કોઈની ઉપર શક લઈ જવાને કારણ નહોતું ? ”

“ કેમ કારણ નહોતું ? ” પ્રધાને પૂછ્યું.

“ જમીને હું તરતજ અહીંથાં પાછો ક્યેને હૃત આવ્યો એટલે કાગળ વાંચ્યા વગર મેં ખંધ કરી શીલમહેર કરાવી હૃતને આપ્યો. ”

“ આપ જમવા ગયા ત્યારે પદૃરાણી સાહેબ આપની સાથે હૃતાં આપ જમીને ઉડયા ત્યાં લગી તે આપની સાથે હૃતાં કે ? ”

પ્રધાનનો પ્રશ્ન સાંભળી સાંભળી પદૃ વિચારમાં પડ્યો. એને એ સુંદર સ્વી ઉપર શક આવ્યો વળી જતો રહ્યો. “ ના ? દિશાએ જવા ફૂકત ગઈ હતી તે તરતજ હું જમતો હતો ને મારી પાસે પાછી આવી ગઈ હતી “ રાજાએ જણાવ્યું.

પ્રધાન વિચારમાં પડ્યો. ” નક્કી ઉપરથી સુંદરતાની પુતળી ગણ્યાતી પણ હલાહલ વિષથી ભરેલી એ તિખ્ય રક્ષિતાએ દિશાના ઘડુને આ કામ કાળી નાખ્યું છે. ” એ મનમાં સમજ ગયો પણ આ વાત અત્યારે બહાર પાડવા જતાં કદાચ રાજ ગુસ્સે થાય અગર પોતાની જુંદગી જોખમમાં આવી પડે કે વળી કાંઈ નવી ખટખટ જાગે જેથી એ મૈન રહ્યો. બનનાર બની ગયું હતું. કોડ ઉપાય કરવા છતાં બનેલી ઘટના સુધારવાની જગતના કોઈ મનુષ્યની તાકાત નહોતી. એવી ભવિતવ્યતાની ભરજી હતી ? ”

“ તમને શું તિખ્યરક્ષિતા ઉપર શક આવે છે કે પાછાંથી એણે આવીને કાગલમાં ભૂલ કરી નાખી છોય; પ્રધાનજી ? ”

“ચોક્સ અલિપ્રાય એ માટે કેવીરીતે આપી શકાય ?”
હેવ ! આપને શું લાગે છે. ? એણે એમ કર્યું હોય કેનહી ?”

“ મેં યુવરાજને કાગળ લઈયો છે એની એને સુહૃદે
અખર નહોંતી. તો પછીએણું ભૂલ કરી હોય એવો શક કેમ
લઈ શકાય ? ”

“ ન જ લઈ શકાય ? આપનું અતુમાન સત્ય છે. જો
કદાચ આપનાથી ભૂલ થઈ હુશે તો તો નિરૂપાય ? બાકી કંધ
ખટપટને અંગે આ કાર્ય બન્યું હુશે તો હું એની
તપાસ ચલાવીશા ? ”

“ જરૂર તપાસ કરનો, પ્રધાનજી ! ઈષ્યાથી જો કોઈએ
પોતાની સુરાદ સિદ્ધ કરવાને ખાને મને હૃથીયાર બનાવ્યો.
હુશે તો હું એની જીવતાં ચામડી ઉત્તરાવીશા. એના પાપકૃ-
ત્યનો હું એને વ્યાજસાથે બદલો આપીશા.”

“ હેવ ! એતો જ્યારે ગુનહેગાર હાથ આવશે ત્યારે
વાત છે પણ હવે યુવરાજ માટે શું કરવું ! રાજ્યને માટે
એમનો હુક્ક હવે જતો રહ્યો.”

“ હોય ! એમજ થયું ? થોડા દિવસ પછી એને એક
સમૃદ્ધવંતુ ગામ આપો ! નેથી સુએ સમાધે એ પોતાનો કાલ
નિર્ગમન કરે ? ”

“ તો અવંતી માટે શું કરવું ? ત્યાં હાલમાં કોઈને
મોકલવો છે કે નહીં ? ”

“ એ માટે વિચાર કરશું ! હવે તો રાજ્યનો હક્ક

મહેંદ્રનોજ થશે એની માતાની મરજી હુશે તો અવંતી મહેંદ્રને આપશું ? ”

“ મરજી હુશે શું ! એતો આ સમયની રાહ જોતીજ હશે. એ જલ્દીમ સ્વીચ્છાજ આ સ્થિતિ ઉલ્લી કરી છે. છતાં માન તો અવક્ષ્ય આશો ! જગતમાં જરૂર સમયે એક તણુખું પણ મેંધું થાય છે. ” પ્રધાન મનમાં બબડયો.

ટેટલીક આડી અવળી વાતો કરી મંત્રી ચાહ્યો ગયો. રાણી તિખ્યરક્ષિતા રાજની પાસે આવી એની સારવાર કરતાં પેટો કાગળ જોઈ ગઈ હતી. અન્ય રાણીઓને કે કોઈને અખર ન પડે એમ સારવાર કરતાં સુદ્ધામાલ સમજી ગઈ હતી છતાં કંઈ ન જાણુંતી હોય એમ બીજી રાણીઓની માઝુક તે પણ અનાણી થઈ ગઈ હતી. સર્વે રાણીઓ અંતઃપુરમાં ગઈ. અને રાજનું શુલ્ક ઈચ્છતી એમના આરામની પ્રતિક્ષા કરતી હતી. તે સમયે તિખ્યરક્ષિતાના હૈયામાં તાલાવેલી જગી. પ્રધાન અને રાજ શું વાર્તા કરે છે એ જાણવાની એને જીજાસા ઉત્પન્ન થઈ. એણે આંખોના સંકેત પૂર્વક શ્યામાની સામે જોઈ એ દિશા તરફ મેં ફેરફયું. શ્યામા ત્યાંથી કાર્યના મીશો પસાર થઈ ગઈ. કોઈ ન જાણે એમ પછવાડે કરીને એમની આનગી વાતો અને એટલી સાંભળવાની ચેષ્ટા કરી તે પછી પ્રધાનના ઉડવા આગમય દાસી શ્યામા ત્યાંથી પસાર થઈ ગય. થાડી વારમાં રાજની તથીયતના આરામના સમાચાર આવ્યા. ને યુવરાજ કુણાલના અંધપણુંના સમાચાર પણ અંતઃપુરમાં ફેલાઈ ગયા. બધી રાણીઓએ શોક બતાવ્યો.

પદુરાણી તિથરક્ષિતા પણ પણ આ સમાચાર સાંભળી અપાર શોઇ કરતી હૈયાફાઈ રૂધન કરતી રાજ પાસે હોડી આવી. પેર લરીને રૂધન કરી તેણે પોતાનો શોઇ પ્રદર્શિત કર્યો. જેતાં જોતામાં આખા શહેરમાં અંધત્વના સમાચાર હેલાઈ ગયા.



પ્રકુરણુ ૧૫ મું.

—•—

પરિવર્તન.

કાળ કાળનું કામ કર્યો જાય છે એ કાંઈ કોઈના માટે થાલતો નથી. આજની અનેલી ગમે તેવી હૃદય વિદારક વાત પણ દિવસો જતાં એનો ઘા રૂળતો જાય છે. એ તાજી સમુનિ ભૂલાતી જાય છે. પૂર્વની ઘટના બન્યા પછી કેટલોક સમય પસાર થઈ ગયો. એ અરસામાં કંઈ કંઈ ઘટનાએ બની ગઈ હતી. યુવરાજ કુણુલ અત્યારે યુવરાજ નહોતો. એની અવંતીની મોજ મજાહ એ વૈલબ અધ્યો સુકાઈ ગયો હતો. આજે તો એ અંધ કુણુલ પોતાને અપાયેલા એક ગામમાં રહી પોતાની લાંદગી ગુજરતો હતો. જગતની સ્વાર્થતા તો જુએ ! સ્વાર્થાંધ હુન્યા ઉગતાનેજ પૂજે છે. આથમતાને નહીં. જે યુવરાજનાં એક દિવસ પ્રતિદિવસ માન સન્માન થતાં હતાં. આજે એમાંનું કાંઈ પણ એને માટે નહોતું. એ અંધ કુણુલ કયાં પડ્યો છે ! એની કોઈને અખર પણ નહોતી. જે પિતાના હૃદયમાં એક દિવસ એ પ્રાણુધિક હતો.

એ હૈયામાંથી પણ એ સ્નેહની લાગણી રક્તે રક્તે એધી થવા લાગી. સમયની એ વિચિત્રતા છે. છતાં કુણુલને મન એ માટે હર્ષશોક કંઈ નહોતું પિતાએ આપેલા ગામમાં રહી સાહાર્પણે પ્રભુ લજ્જનમાં પોતાનો કાળ નિર્ગમન કરતો હતો. એની સાથે એને પુત્રની માર્ક રાગનારી ધાવમાતા તેમજ એ ચાર દાસ દાચી સાથે રહેતાં હતાં. નિવૃત્તિમય જીવન ગાળનાર અંધ કુણુલનો પ્રભુ લક્ષ્મિમાંજ સમય વ્યતિત કરતો હતો છતાં એની ધાવમાતા સુનંદાને હૈયામાં બહુ હુઃખ થતું હતું. પશ્ચાત્તાપમાં એ અધી થઈ ગઈ હતી. પણ હવે કંઈ ઉપાય નહોતો. અવંતી છોડવાને સમયે તો એના હુઃખનો અવધિ હતો પણ હૈવ આગળ લાચાર !

મહારાજના પત્રથી એ તો સ્પષ્ટ થઈ ગયું તુંકે કુમારને અંધ કરવાનો હુકમ નહોતો. પણ કુમાર જણે એજ મારી અભિલાષા હતી. પણ ‘અધીયડ’ ને બદલે ‘અંધીયડ’ મારાથી કેમ લાખાઈ ગયું એ સમજાતું નથી. પિતાની આવી આજાતું પાલન કરી એણે પિતાને જીવતો માર્યો છે મારી આશાનો એણે નાશ કર્યો છે.” આવી રીતે સમાદ્દ હુઃખી થયા હતા અને એ રહેતે હૈયે એમણે કુણુલને એક સમૃદ્ધવંતુ ગામ આપી સુખમાં કાલ વ્યતિત કરવા કરમાંયું હતું. કેથી સુનંદાને બહુ હુઃખ થયું હતું એક તો ચુવરાજ ધિરજ ખમી શક્યો નહીં. બીજુ વખત જવાખ મંગાવ્યો હોત તો સ્પષ્ટ ખુલાસો થઈ શકતા ? બીજુ બાળુ એને આ કાવતરામાં અપર માતાઓના હાથની ગંધ આવી. ગમે તે રાણીએ રાજને

હથીયાર અનાવી આ કાર્ય સાધ્યું છે. આજે એના મનોરથ
પૂર્ણ થયા છે. એણે આજે મારો મનોરથ, એ સ્વર્ગંવાળો
એની માતાના આત્માનો મનોરથ વ્યર્� કર્યો છે. ધર્ત્યા-
દિક વિચાર કરતી સુનંદા બિચારી હુઃખ્યી રડી પડી. એવું
રડવું તો હું એને હંમેશાનું હતું. હુઃખ્યાના સમયમાં સ્વીએનાને
રડવું એ તેમનું બણ છે અરે સ્વીએનાની વાત તો ડીક પણ
હુઃખ્યાને સમયે સમર્થ પુરુષો પણ આગાંની માફક શું નથી
રડતા ?

સાઠ હુંનર પુત્રોના ભરણું સમાચાર ખીંજ સગર ચક-
વર્તીએ સાંલજ્યા ત્યારે એમનું હૈયું ક્ષાટવા લાગ્યું “પણ
રડતાં તે સમયે કોઈને આવડતું નહી જેથી શકેંદે જાણ્યું કે
ચકીનું હૈયું ક્ષાટી જશે જેથી શકેંદે પોક મુકીને રડવા માંડયું
તેનું અનુકરણું કરીને એ ખીંજે ચકી પણ પુત્રના હુઃએ પોક
પોક મુકીને રડ્યો હૃદયમાં ભરાયેલ ઉલ્લાસો એ રીતે ખાલી કર્યો.

બિચારી સુનંદા રડી રડીને અધી થઈ ગઈ હતી. એક
દિવસ સુનંદાને રડતી સાંલજી કુણાદ કહેવા લાગ્યો ” માતા ?
શા માટે રડે છે ? તું રડીને ખીંજાને પણ હુઃખ્યી કરે છે ? ”

“ અરે દિકરા ? તેં તો અમોને જીવતાં માયોં. તારી
ભરનારી માતાનો મનોરથ, મારો મનોરથ તેં વ્યર્થ કર્યો. અને
તારી શાનુ-શાવકીમાતાના મનોરથ તેં પૂર્ણ કર્યાં. હુાય ? એ
હું કેમ જોઈ શકીશ ? ” ઉચ્ચાં આતી સુનંદા બોલી.

“ પણ હું એનું શું થાય ! ભવિતવ્યતા કદિ અન્યથા

થતી નથી. જે બનનાર હોય એ અવશ્ય બને છે આપણું ધાર્યું
શું બને છે ? ” કુણાલ ઓદ્યો.

“ હોય ? આજે મારા હૃથ હેડા પહ્યા. જે તારું અવંતી ?
જે મહેલમાં તું રમતો જ્યાં બાલ્યકિડા કરતો, જે સમૃદ્ધિ તું
બોગવતો તે આજે પેદો મહેંદ્ર બોગવી રહ્યો છે. કેવો અમન
અમન કરી રહ્યો છે. ”

“ તેથી શું ? મહેંદ્ર પણ મારો લાઇજ છેને ? અવંતી
કોઈ હુશમનના હૃથમાં તો નથી ને ! કે જેથી તું હુઃખી થાય
છે. અમે બન્ને એકજ પિતાના પુત્રો છીએ. એને સુઅ૰ી જોઇ હું
પણ સુઅ૰ી થઈશ. ”

“ દિકરા ! રાબની ભૂલથી કેવું વિપરીત પરિણામ
આવ્યું. તું લગારે ધિરજ ન ખમી શક્યો; નહીંતર આ
પરિણામ ન આવત ! ”

“ મારું જેવું નરીણ ? એમાં એમનો શું હોષ ? બાકી
તો પુત્રની કુરજ છે કે ગમે તેવી પણ પિતાની આજાનું એણે
પાલન કરવું જોઇએ. ”

“ એ તો ટીક પણ દિકરા મને તો ગીજું કાંઈ હુઃખ
નથી પણ એજ હુઃખ થાય છે તું પિતાની આજાનું પાલન
કરવા જતાં કાવતરાનો બોગ થયો. ”

“ એમાં કાવતરદશાનું વળી; તમે સ્વીએને તો વહેમજ
ધણો. ”

“ દિકરા ? એમાં તું ન સમજો ! તે બધું હું શોધી

કાળીશ કે આ કાળું કામ કઈ શાખણીનું છે ત્યારે તું જાણીશ કે તારી અપરમાતાએ કેવું લયંકર કામ કર્યું છે. ? ”

“ તું તો નકામી શાંકા કરે છે ? શું હું મારી શાવકી માતાનો હુશમન હતો કે એમને આવું કામ કરવું પડે. એતો પિતાજીનાજ પ્રમાદથી ભૂલ થઈ ગઈ. પણ હવે એની પંચાત શું ? હવે કાંઈ નવી આંગેઓ આવે તેમ નથી. ”

“ તને અવંતી રાખવાનું કારણ ખખર છે ? તારી માતાના મરણ પછી તરતજ તારા પિતાએ યુવરાજ પદવી આપી બચપણુથી તને અવંતી મોકદ્યો તે ? ”

“ શા મારે અવંતી રાખ્યો તે તુંજ કહેની ! ”
કુણાલે પૂછ્યું.

“ તારી શાવકી માતાએઓ ! તું રાજ્યનો વારસ થાય એ એમને ગમતું નહોં. તેમાં પણ તિષ્યરક્ષિતા તારી તરફ વધારે નિર્દ્ય હતી. કારણું કે તારા યુવરાજપદવી એના મહેંદ્રનો ગાદીનો હુક્ક જતો રહ્યો તો એવી કંઈ માતા હોય કે પોતાના પુત્રનું શુલ ન હશે ? ”

“ તો એ અપરમાતાના સંકટમાંથી બચવા પિતાએ મને અવંતીમાં રાખ્યો એમજને ? ” સુનંદાનું અધુરં પુરું કરતાં કુણાલે કહ્યું.

“ હા ? એ જેરી સાપણોનું જેર તને ન અડે, અને તું સહિસલામત સુખપૂર્વક રહી શકે એ મારે વિશ્વાસુ માણુસો માથે તને અવંતીમાં રાખવામાં આવ્યો હતો. છતાં ફર રહ્યાં

રહ્યાં, પણ એ તારી અપરમાતાઓએ પોતાનો મનોરથ મને
તો લાગે છે કે પૂર્ણ કર્યો. ”

“એમ શક ઉપરથી કોઈને માથે આગ ન હેવાય; માતા?”

“ હુશો ? માટેજ હું સત્ય રોધી કાઢીશ, એનો મનો-
રથ હું વ્યર્થ કરવા પ્રયત્ન કરીશ. ”

“ જા ! જા ! એલું ગાંડુ ગાંડુ તું શું બોલે છે ? તું
કેવી રીતે વ્યર્થ કરીશ ? શું હું મને ફરીને તું આંખો પ્રાસ
કરાવી શક્યો કે ? ” મૃહુ હસતાં હસતાં કુણુલ બોલ્યો.

“ દીકરા ! એ મનુષ્ય શક્તિની બહારની વાત છે.
અત્યારે તો હું જીવતાં મુવેલી જેવી છું. પણ આ કૃત્ય કોનું
છે, એની તપાસ તો અવશ્ય કરવાની ! ”

“ તને ઠીક પડે તેમ કરજે, પણ રડે છે શું કરવાને ! ”

કુણુલે સુનંદાને આખાસન આપ્યું છતાં સ્વીચ્છાનું
હૃદય માયાથી ભરેલું હોય છે. પ્રાયઃ કરીને જગતમાં સ્વીચ્છાને
સંસારનાં માયા વૈલવ બહુ ગમે છે, જેમ એના સમાગમથી હર્ષ
ઉત્પન્ન થાય એવી રીતે ઉત્સ્વ સ્થિતિથી નીચે પડતાં વિધાદની
છાયા પણ છવાઈ જાય એ વાસ્તવિક છે. કુણુલને મન એ
અવંતીનો રાજ્ય વૈલવ ને અત્યારની સ્થિતિ સરખાંજ હતાં.
અત્યારે એનામાં ધીરતા, ગંભિરતા, વિવેકતા હતાં પણ પ્રથ-
મના જેવી ઉચ્છૃંખલતા કે તૌક્કાન નહોતા. એનું જીવન જીવવું
માત્ર નહોતું પણ પિતૃભક્તિ એ એનું જીવન હતું, જેવું હરિ-


શેંડનું સત્ય જીવન હતું. રામનું પિતૃભક્તિ જીવન હતું. ભક્તાનું પ્રભુ ભક્તિ જીવન હોય છે, સતીને પતિભક્તિ એજ જીવન છે. દ્વારાના સાગરને અહિંસા જીવન વત છે. વ્રત-ધારીઓને એમ વ્રતજીવન છે, જેનું એ જીવન અખાંડિત છે એજ જગતમાં જીવતો છે બાકી તો આ જગતમાં અનેક માતા પિતાઓ પુત્રોનો જન્મ આપે છે. એથી શું !

પણ સુનંદાના હુઃખનો પાર નહોતો, એણે મનમાં આ અધું પરિવર્તન જે વ્યક્તિત્વે રાજને હુથીયાર ખનાવી કરાવ્યું છે. એના વેરનો પ્રતિશોધ કરવાનો નિશ્ચય કર્યો.

આપણા જાણવામાં આંદ્યું છે કે રાજની સાથે તિષ્યરક્ષિતાએ પણ કુણુલના શોકને જ્હાને પોતાનાથી ખની શકે એટલો અધ્યો ઉલરો ખહાર કાડી નાખ્યો, થોડા દિવસ વિત્યા પછી મહારાજે કુણુલને એક સમૃદ્ધ ગામ આપી એને માટે પુરતો ખંડોખસ્ત કર્યો. કુણુલ પછી રાજ્યનો વારસ મહેંદ્ર હતો. જેથી મહારાજે મહેંદ્રને યુવરાજ પદવી આપી અને અવંતી આપવાનો વિચાર કર્યો, એમાટે એણે તિષ્યરક્ષિતાની સલાહ લીધી.

તિષ્યરક્ષિતાએ પણ મોંઘાઈ તો ધણીય ખતાવી. પણ છેવટે ખુશી થઈને રાજની વાતને જાળે પોતે અત્યંત હુઃખી થતા હૈયે અનુમતિ આપતી હોય એમ અતુમોદના આપી. થોડા દિવસમાં મહેંદ્ર કુમાર કુમાર મઠીને યુવરાજ થયો, યુવરાજ પદ ઉપર વિભૂષિત થયેલો મહેંદ્ર-લવિષ્યનો રાજ્ય-વારસ મંત્રીઓ અને આસ જનો સાથે માગવા તરફ વિદ્યાય થઈ ગયો.

તિષ્ઠરક્ષિતાના અંતરમા અત્યારે હુર્ઝનો કંઈ પાર હતો, ને શાલ્ય ધણ્ણા દિવસ થયાં એના હૈયાને ડંખતું હતું તે પોતાની ચુક્કિતથી ફર થઇ ગયું. ને પોતાનો પુત્ર યુવરાજપદ પામ્યો. ભાવી ભારતના તાજનો હુક્કદાર થયો. અવંતી જતા પુત્રને એણે ધણ્ણી ધણ્ણી સમજણું આપી. હુર્ઝના આંસુથી નવાજયો. પોતાની વિશ્વાસુમાં વિશ્વાસુ દાસી શ્યામાને પણ મહેંદ્રનું રક્ષણું કરવાને એણે અવંતી મોકલી. યુવરાજ કુણાલની જગ્યાએ આજે મહેંદ્ર અવંતિમાં મનગમતા વૈસલ બોગવતો સુખમાં પોતાનો કાળ બ્યતિત કરી રહ્યો હતો. ચપળ લક્ષમીની ચંચાગતા તો જુઓ સંસારમાં તે શી ચાલાકીએ ચાલાવી રહ્યી છે. છતાં નવાઈ તો એજ છે કે મહા સમર્થ આત્મા સત્ય વસ્તુને છોડી એની પાછળ દિવાનો ખની અનેક કણ્ઠો સહન કરે છે.



પ્રકુરણ નંબર મું.



એ ચંદા તે કોણું ?

“ ખાઈ સાહેબ ? આપ મને તમારી તહેનાતમાં રાખશો તો મોટી કૃપા થશો ? ” એક ગરીબ દેખાતી દેખાવડી બાળાએ અવંતિના રાજ્ય મહેલમાં આવીને એક રૂપાખદાર મગર રાખિને કહ્યું.

એ ખાઈએ તીચ્છી નજરે આ ગરીબ ખાઈ તરફ જોખું

એને લાગ્યું કે આવો પરિચિત ચહેરો ક્યાંય જોયેલો છે. પણ ક્યાં જોયેલો એ એને યાદ આવતું નહોતું. “ તું કોણ છે ! ક્યાંથી આવે છે ! મને લાગે છે કે મેં તને ક્યાંક જોઈ છે ! ” એ ઝવાખદાર બાધુંએ કહ્યું.

“ મને જોઈ છે ? એશાક જોઈ તો હશે જ ; હું પણ આ નગરમાંજ રહું છું, તો તેથી કદાચ જોઈહાય એ સંભવે છે. છુય રજુષુતની દીકરી ? પણ ?.....” એ ઓલતાં ઓલતાં અટકી પડી.

“ તારે કોઈ સગું ઠાલું નથી કે શું ? ” એ બાઇએ પૂછ્યું.

“ સગું ને ઠાલું ! ઉંચે આલ ને નીચે ધરતી એજ મારાં સગાં છે કે મને પડી રહેવા હે છે. રજુષુતની દીકરી એટલે કામધંઘો કરી શકાય નહી તો પછી ગુજરાન શી રીતે થાય ! તમે જો આશરો આપશો તો તમારી સેવા ચાકરી કરીશ. તમને પ્રસન્ન કરીશ. ” આજુજુની ફેં એ ગરીબ આળા ઓલી.

“ તું શું કામ કરીશ વાર્ડ ? વાર્ડ પણ તાર્ડ નામ શું ? ”

“ માર્ડ નામ ચંદા ? ”

“ ચંદા ! તું એક અનાણી છોકરી છે. અનાણી છોકરી રાખવામાં સોચે સો ટકાતું જોખમ તો છે. તેમાંય આ તો રાજના મામલા છે. તેની તને ખખર છે ને ? રાજ્યમાં અનેક ખટપટો ચાલતી હોય તેવી સ્થિતિમાં તલવારની ધાર ઉપર

રહેલું પડે છે તે કદાચ તારા ધ્યાનમાં નહીં હોય ? ને તું
તો હજુ અચ્ચું છે ? ”

“ જે કે મને તમારી રાજ્ય રીતિનો અનુભવતો નથી.
છતાં તમારે ત્યાં રહેતાં હું અદ્વયતામાં જાહીતી થઈ
જઈશ. તમારા કાર્યમાં કેમ બને તેમ હું મહદુગાર થઈશ. ”

“ ઠીક ત્યારે આજથી તું મારી તહેનાતમાં રહે દીકરી !
યાદ રાખજે મારે વિશ્વાસ મેળવીશ તો તું સુખી થઈશ.
તારા સૌંદર્યને યોગ્ય તનેયોગ્ય વર પરણુંબીશ. ” એ બાધ હુસી.

એ રૂવાખદાર બાઈ તે તિધ્યરક્ષિતાની માનીતી દાસી—
સખી શ્યામા હતી. શ્યામા રાજકુંવરની ધાત્રી તેમજ પદુરા-
ણીની માનીતી હોવાથી અહીંયા અવંતીમાં કુમાર—યુવરાજ
મહેંદ્રની સંભાળનું કામ સ્કી વર્ગમાં એનેજ સુખ્યતાએ ભગા-
વવામાં આવ્યું હતું. શ્યામા અહીંયા મોટા ઠાડમાડ
સાથે રહેતી હતી. અંતઃપુરમાં દરેક દાસ દાસીઓમાં શ્યામા
રાખી કેટલું માન લોગવતી ને દરેકના ઉપર હુકમ ચલાવી
શકતી હતી.

નોકરીની ઉમેદવાર બાગા ચંદાએ ભજવેલો પાડ આ
રીતે સફળ થયો ને શ્યામાના કામકાજમાં પળોટાઈ એને
પ્રસન્ન કરવાનો હેતુ એણે સાધ્ય કરવા માંડ્યો. શા માટે
એણે શ્યામાની નોકરી ભજવવાનો નાટક શરૂ કર્યો એ તો
એનું હુદ્ધય જણે. પણ ચંદાએ ખંતથી શ્યામાની સેવા બજાવતાં
અદ્વયતામાં જ એણે શ્યામાનો વિશ્વાસ મેળવી દીધો, એટ-

હું જ નહીં પણ ‘વચને કિં દરિદ્રતા’ વગર પૈસાના મધુર વચનોવડે અધાં દાસ દાસીને રીતવી એમનાં મન પણ જીતી લીધાં.

વચનમાં કેટલોય સમય પસાર થઈ ગયો. એક દિવસ શ્યામા પલંગ ઉપર સૂતી હતી. તેના ભાલ પ્રદેશ ઉપર ચંદા દવા ચોપડી રહી હતી. બીજાને પડેલી શ્યામા કંઈ વિચારોમાં વિહરતી હતી. શરીરની સ્થિતિ અત્યારે જરા અસ્થવસ્થ હોવાથી એચેન હતી. એની સેવા ચાકરીમાં ચંદાયે જરાય ખામી આવવા હીધી નહીં. એના મસ્તકમાં થતી વેહનાથી શ્યામા ઘણી પીડાતી હતી. પણ ચંદાના દખાવવાથી કંઈક શાંતિ હતી.

“ આઈ સાહેણ ! મહેંદ્રકુમારની આપ પુત્ર કરતાં પણ વધારે કાળજ રાખો છો. શું એ આપનો પુત્ર છે કે એમાં બીજું કંઈ કારણ છે ? ” ચંદા બોલી, સુખમાં પડેલી હોવાથી આ બાળાનું લાવણ્ય બીજું હતું.

“ આહા ! ચંદા ! એ મહેંદ્ર મારો પુત્ર હોય એવું માર્દ ક્યાંથી ભાગ્ય હોય ? છતાં હું એને પુત્ર કરતાં પણ વધુ ચાહું છું એ તો તારી વાત ખરી ? ” વિચારમાં જોથાં ખાતી શાચ્યોમાં પડી પડી શ્યામા બોલી. કંઈક અશાંતિને લીધે એના બોલવામાં મંદતા હતી.

“ હું સમજુ ! આપ પુત્ર કરતાં પણ વધુ ચાહેણો છો એનું કારણ ? ” ચંદાએ હસતાં હસતાં કહ્યું.

“ તું શું સમજુ ચંદા ! ” એહરકાર પણે શ્યામા બોલી.

“મહેંદ્ર ચુવરાજ છે. ભવિષ્યના ભારત સમાદ્દ છે માટે ? કેમ ખરૂને ? ”

શ્યામા હસી “ એ પણ ખરૂને બીજું થ ? ”

“બીજું શું ? ” ચંદાએ પૂછ્યું. હજુતો સોણ દિવા-જીએ પણ પુરી જોઈ નથી એવી તે બાગા ગંભીર બની.

“ ચુવરાજની હું ધાવ માતા છું. મહારાજની પદુરાણી તિષ્ઠરક્ષિતાની હું માનીતી સખી છું.”

“ એમ ! તેથીજ તમે એક રાજરાણી જેવું પદ અહીંયા લોગવી શકો છો ! ” નવીન હકીકત સાંભળીને જણે અન્યથા થઈ હોય એવી રીતે આશ્ર્ય ભાવ દર્શાવતાં ચંદાએ વિનયથી કહ્યું.

“ એશક ! ચંદા ! જગતમાં માણુસ પ્રયત્નથી ઈચ્છિત મેળવી શકે ! હું પણ પહેલાં તારા જેવી સ્થિતિમાં હતી. પણ મારી ચતુરાઈથી હું મહારાણીજની માનીતી થઈ. કુમારની ધાવ માતા પણ થઈ.”

“ આઈ ! તમે નથીબદાર છો ? જગતમાં પુણ્યવતી છો તેથીજ તમારા ધારેલા દાવ પાર પડ્યાને તમે આગળ વધી શક્યાં ! ” ચંદાએ મોધમપણે કહી સાંભળાવ્યું. આપણે ખન્નેય માણુસ છીએ છતાં કયાં તમે ને કયાં હું !

પોતાનાં વખાણું સાંભળીને શ્યામાં પ્રસન્ન થઈ, ચંદા ! ખુચીત તું પણ મારી સેવાચાકરી કરશે તો હું તને ન્યાદ કરી દઈશ. હજુ કાંઈ મોડું થયું નથી, ઉગીને તું પણ હજુ હમ-છુંજ સમી થાય છે.”

“ રામ રામ ! અમારા ગરીખનું નશીખતો ગરીખજ આઈસાહેણ ! જમે તેટલો પણું ધૂવનો તારો ચંદ્રની સ્પર્ધા તો નજ કરી શકે. હીવો શું સ્વર્યની સાથે હરીક્ષાઈ કરીશકે ! ” ચંદ્રાચે ખરાખર શ્યામા ઉપર માલેસનું જહુ કરવા માંડયું. “ બાઈ સાહેણ ! અમારી જેવા મનુષ્યો ઉપર તો તમારે ખાસ રહેમ નજર રાખી તમારાં વિશ્વાસુ ખનાવવાં; એથી તમારું ભલું થશો. સારું કરનારનું સારું જ થશો. ”

“ ધીરજ રાખ ! કંઈક એવો પ્રસંગ ઉલો થશો તો એમાં તને આગળ પડતો લાગ આપીને આગળ વધારીશ-મારી પ્રસંગતાનું ફૂલ બતાવીશ. ”

“ રંક માણુસનાં તો લાગ્યજ ઉલટાં ? તેમ છતાં તમારી રહેમ નજર છે એ અમારે મન ધણુંય છે. બાકી જગતમાં તો વેળા વેળાની છાંચડી છે. જુઓને અહીંથાંનોજ દાખલો; ચુવરાજ કુણુલ ઉપર મહારાજના ચારે હાથ હતા. છતાં આપરે ચુવરાજની શી વિથિતિ થઈ ? ”

ચંદ્રાની વાત સાંલળીને શ્યામા મનમાં હસી. “ સત્ય છે ચંદ્રી ! કુણુલ મહારાજનો માનિતો હતો પણ....” બોલતાં બોલતાં શ્યામા અટકી ગઈ.

“ પણ શું બાઈ સાહેણ ! જે મહારાજની મહેરખાની હતી તેમનીજ અપ્રીતિ થઈ ગઈ. એમજ ને ! ના ! ના ! હું ભુલી ? ડાગળ લખવામાં મહારાજે ભૂલ કરી જેથી બિચારાનું નશીખ કુટી ગયું. કેવી ગંભીર ભૂલ ? ” ચંદ્રા એની દ્વા

ખાતાં બોલી. “ છતાં ને થયું તે સારાને માટે નહીંતર તમારા જ્ઞિવાય આજે મારી શી વલેહ થાત ! અરરર ! બાઇ ! હું તો તમે નહોત તો આજે મરી ગઈ હોત મરી ? ” પાછી એણે વાતની કુગી મચરડી નાંખી. એ ખાલિકા ચંદાની વાત કઢા-વવાની ચાલાકી અદ્ભૂત હતી.

“ ગાડીરિ ગાંડી ! ને આપી હુનિયા ઉપર રાજ ચલાવે છે એ એવી ભૂલ કરે ખરો ? ” આસ્તેથી શ્યામાએ પ્રાણુ-ગ્રિય સખી આગળ હૈયાની ગુસ વરાળ બહાર કાઢવા માંડી.

“ મનેય લાગે છે કે એમ બનવું તો નજ જોઈએ, એમાં કંઈક ભરમ તો હશે, એ રહુસ્ય તો તમે જાણો. એનાથી પાલાગનીય અમને ઓછી ખખર હોય; એન ? મોટા રાજ રજવાડામાં એતો બનતું આવ્યું છે. એમાં કંઈ નવી-નવાઈ થોડી છે. ”

“ તો એવીજ ખટપટનું આ પરિણામ છે. સમજ ? અમારો મહેંદ્ર રાજપાટ વગર પરાધિનપણે જંદગી પુરી કરે, ને એનમાયો રાજને જ્હાલો થઈ રાજપાટ લોગવે તે હું અને મહેંદ્રની માતાથી કેમ સહન થાય ! ભલે ને એને મહારાજે માનીતો કર્યો, તેથી શું થયું ! ”

“ તમે સત્ય કહો છો એન ! પોતાના પુત્રની ઉજ્જતિ કથી માતા ન ચાહે ! એ જ્હાલા પુત્રની ઉજ્જતિમાં આડ ખીલી નડતી હોય એને ફૂર કરવા માતા તો અવશ્ય પ્રયત્ન કરે ! ” ચંદાએ શ્યામાના ઉદ્ગારોમાં હાઁઓહા મેળવી સત્ય વાત કઢાવા પેરવી કરી.

“ અવસ્થય કરે ! એ મહારાજનો માનિતો છતાં પણ મારી જ્ઞાલી સખી તિષ્ઠરક્ષિતાને મન તો કાંટા સમાન હતો, એને કોઈ રીતે ખસેડવાની અમે સારા સમયની રાહ જેતાં હતાં, એને ચંદા ! અરું કહું તો એ બધું મારી સમજાવટનું પરિણામ હતું મેં જે તિષ્યાને ન સમજાવી હોત; હિમત ન આપી હોત તો આજે આ દિવસ અમારે આવત નહીં.” એકેકો શબ્દ ગર્વલયો બોલાતો હતો, બોલનારને ચંદા ઉપર વિશ્વાસ હતો તેમ છતાં કદાચ વાત આગળ જાય તો હવે કંઈ પરવા નહોંતી, વાતોડીયાએને દ્ખાવવાની એનામાં શક્તિ હતી. એના મનમાં આવ્યું તો કોઈનો જન કેવો કે ચામડી ઉત્તરાવવી એ એને મન એક બાલકની રમત હતી. તેથીજ આઠલી નિર્ભયતા એને ઐદરકારી આવી હતી.

“ વાહ ! તમારી ચતુરાઈ ઉપર હું વારી વારી જઉં ? તમેય ખુબ ચાલાકી ચલાવી હો ! પણ એતો કહો ખાઈ સાહેબ ! કે તમારી કઈ ચાલાકી ઝાવી. કેનેથી લક્ષ્મી ચાલી ચલાવી તમારી દાસી થવા આવી ! ” પોતાનાં વખાણ સાંભળી શ્યામાનું હૈયું જન્જગજ ઉંચિળાનું હતું એનું ફુઃખ પણ જતું રહ્યું ચંદાના એ ચુંદર વદનમાંથી સરતા શાંહોં ખી છતાં એને મીઠા લાગ્યા.

“ ખસ એકજ ચાલાકી ! એકજ ચાલાકી ચલાવી કે ચંદા ? ઐડાપાર ! સાખી તિષ્યા હુમેશાં કોઈ અનુકૂળ સમયની રાહ જેતી હતી, તે તક એક દિવસે એને મલી ગઈ.”

“ હું...? જખરાં એ મહારાણી સાહેબ ! ખરેખર એક

વખત એવી સમર્થ વ્યક્તિનું મારે દર્શન તો અવશ્ય કરવું જોઈએ કે અમારા જેવા અણઘડ માણુસનામાં પણ અછું ના. એ છાંટા એમનાથી આવે ? ”

“ તારી ભરજી હુશે તો હું તને અનુકૂળ સમયે મહારાણીજી પાસે મોકલી આપીશ. અરે તેમની તો વાત રી કરવી ! જો પ્રસન્ન થાય તો સર્વસ્વ આપી હે એવા ઉદાર-ઉદાર છે. ”

મુદ્દામ રસ્તા પર આવેલી વાત પાછી સરી જતી જોઈ ચંદ્રાએ આગળ ચલાવ્યું, “ બાઇ સાહેબ ! તમારી વાતો તો એવી છે કે અમારા જેવાં મૂર્ખ માણુસેને પણ ખુદ્દિ આવે હો ? તમારા એક એક શાળની ભીડાશ તો ખસ ! એને હું :કેની ઉપમા આપું ? તમારી વાતોમાં એટલો તો રસ પડે છે કે ખરે તમારી પાસેથી ઉઠવાનું મન પણ થતું નથી. તમે જે પુરુષ હોતો.....” ચંદ્ર એમ બોલતા ઓલતા હુસી પડી, એનું જૌર વદન ખીલી ઉઠ્યું.

“ હું પુરુષ હોત તો તું શું કરત ? મારી ઉપર આશક પડી જાત કે શું ! ” શ્યામાને પણ વાતમાં રસ પડવાથી હુસી પડી. જાણે પોતે પુરુષ હોય ને એકાંતમાં એઠેલી આ પ્રિયતમા હોય એવો સ્નેહ ઉત્પન્ન થયો.

“ જરૂર ! જરૂર ! આવો તમારા જેવો હેંથીયાર, ભીડા બોલો. અને હેણાવડો વર તો ખીઓને ભાગ્યયોગેજ મલી શકે ! ” ચંદ્રાએ શ્યામાના ગાલ ઉપર ચુંટી ખણી બોલવામાં વિશેષ છુટ લેતાં ખસ હુદ વાળી દીધી. “ હું પણ કયી ચાલા-કીએ તમારા ભાગ્યના પડદા ઉધાડી નાખ્યા ! ”

“ અસ એકજ તક; એક દિવસ મહારાજ કુણ્યાલ ઉપર કાગળ લખતા હતા તે લખી રહ્યા એવામાં મારી સખી તિષ્યા ત્યાં જઈ ચડી. કાગળ લખીને એક બાળુએ મહારાજે મુક્યો ને અન્નેનું પછી જણે જ છેને ? ” શ્યામા ઓલતાં ઓલતાં હુસી પડી. નહાલથી ચંદાના કંઠમાં પોતાના એ હાથ સેરવી દીધા.

“ શું ? ” અનાણી થઈને ચંદા ઓલી.

“ શું વગી શું ! ચાલાવલી ! બધું મારી પાસેથી કઢાવે છે, સમજુ જાને હું અત્યારે પુરુષ હોત તો તું શું કરત ! ને હું પણ તને શું કરત ? ”

“ હાય ! હાય ! તો તો હું તમારી ચાલાકી ઉપર શ્રીદા શ્રીદા થાત ! મારા પ્રેમરસથી તમને ઠકવી ઠકવી નાખત ? વરમાળા તમારાજ કંઠમાં નાખત.” ચંદા ઓલતાં ઓલતી હુસી પડીને શ્યામાને વગળી પડી.

“ તો આવી રીતે મહારાણી તિષ્યાએ રાજને પ્રેમના રસમાં ઝુલાવતાં કાગળની વાત ભુલાવી દીધી. ત્યાંથી અન્ને સાથે જમવા ગયાં, ને કાગળની સ્મૃતિ રાજના હૃદયમાંથી તો ખસી ગઈ, પણ ચાણુંકચ તિષ્યા એ વાત ભૂલી નહોતી. રાજને જમતા છેડી રાણી કાંઈ જહાનું કાઢી ત્યાંથી અનુભી ગઈ. અટ પેઢો કાગળ વાંચી દીધો નેત્રાંજનની સણીથી ફૂકત એક બિંદુજ અકાર ઉપર કરી દીધું, અસ એડો પાર ! ”

“ આ બધું તમે જાતે જેયું કે મહારાણી સાહેખના

કહેવા ઉપરથી કહો છો ? ” ચંદાએ ખાતરી કરવાને કુરીથી પૂછ્યું.

“ હું પણ કયાં કાચી હતી ? તે સમયે એનું કૃત્ય હું છુપાઈને જોતી હતી એટલુંજ નહીં પણ કાગળમાં એ એક મીડું વધારીને જેવી બહાર નીકળી કે મેં તરતજ પકડી. એટલે તરતજ ને થયું તે મને કહી બતાવ્યું. પછી હું ત્યાંથી અસી ગઈ. મહારાણી મહારાજ પાસે ગયાં, એ અમુલ્યતકનું પરિણામ કેવું આવ્યું એ તો જગન્નાથ વાત છે. નહીંતર હું આજે અવંતીના રાજમહેલને બદલે પાઠલીપુત્રના એક અખલામાં સડતી હોત ! ” . . .

“ વાહ ? ઢીક ચુફ્ટિ લગાડી. તમારી ગોળી આખાદ નેપણાની માઝુક રામભાષ્ય સફ્રા થઈ. તો શું પછી મહારાજને ખખર ન પડી કે ? ” ચંદાએ વિશેષ ચોક્સી કરવા માંડી.

“ ખખર શું પડે ? અમારી ચાલાકી આગળ અધા પાણી ભરે ! સ્વીચ્છાની ચાલાકી આગળ પુરુષો કયારે પણ ક્રાવ્યા છે ? રાજને એકદમ કાગળ અવંતી મોકલી આવ્યો એના પરિણામની રાજને ખખર પડી ત્યારે પણ એને કોઈની ઉપર વહેમ ન આવ્યો, એણે નિશ્ચય કર્યો કે પોતાના પ્રમાદથીજ આ ભૂલ થઈ ગઈ. પણ હાં ? . . . ”

“ શું કોઈ રીતે એ ગુપ્ત વાત કુટી ગઈ વાર્દ ? ” ચંદાએ એના અટકી જવાથી શંકા કરી.

“ કુટી તે શું બય ? પણ રાજનો એક દોઢ ડાયો પ્રધાન

મહારાજને અનેક પ્રકારે આડું સમજનવવા જતો હતો પણ
મહારાણી તિથ્યરક્ષિતાએ એકાંતમાં એને એવો તો મોતનો
૩૨ ખતાવ્યો કે એ સડકજ થઈ ગયો. વાતનો ફણુગો કચાંય પણ
ન કુટે એવી આકરી પ્રતિજ્ઞા કરાવી લારે તો એ પ્રધાન જીવતો
છુલ્યો, નહીંતર એજ સમયે એની અજલ પોકારી રહી હતી,
સમજ ! ” શ્યામાએ ચંદાના હુલાસમાં ને હુલાસમાં આસ્તેઆસ્તે
સત્ય હકીકિત કહી હીધી. લારેજ એનું હૈયું કાઇક શાંત થયું.

પોતા ઉપર એને શકન આવે માટે ચંદાએ વળી હાસ્ય
કર્યું “ પરમ કૃપાળુ લગવન્ નહાલી સામી ? તમને શ્યામાને
બહલે શ્યામલાલ ઘનાવી હેં તો કેવું સારું ? ”

“ તો તો બસ હું રાજને તું રાણી; કેમ ખડુને ? ”
શ્યામા જોસથી એને છાતી સાથે ભીડી નાખતી જોલી.
વાતના રસમાં એવો તો એને આનંદ પડતો હતો કે એનું
દરદ પણ ખંડું જતું રહ્યું હતું.

“ ખચીત કહું છું જે તમે પુરુષ હોત તો તમે રાજજ
થાત. તમારી આવી હેંશીયારીની જરૂર મહારાજ અશોક
વૃદ્ધિન આગળ કદર થાત. ”

એવામાં મહેંદ્ર આવવાથી ખાનગી વાતમાં લંગાણુ
પડ્યું. બીજુ પણ એક એ દાસીયેા દોડી આવી મહેંદ્રની
સારવારમાં રોકાઈ. ચંદાએ પણ સંતોષનો એક દમ લીધો.
ને પણી પોતાના કામકાજે લાગી.



પ્રકૃતાણુ ૨૭ મું.

કુણ્ણાલની પ્રભુ ભક્તિ.

આશાના પાશમાં સપડાયેલો મનુષ્ય કાળ જવા છતાંપણુ
પોતાને અજર અમર માનીને નિરંકુશપણે સંસારચકમાં
આગળાને આગળ ધ્યાં જાય છે. સુઅરી માણુસને ગમે તેટલો
સમય જવા છતાંપણુ એને જતા એવા કાળની ખરર પડતી
નથી. તેમ હુઃઅરીયા માણુસોના એકએક દિવસ યુગસમા છતાં
એપણુ સ્વર્ણની માર્ક પસાર થાય છે. કાળને કંઈ આહિ નથી
તેમજ એનો અંત પણ નથી. સંસારચકમાં પ્રાણીરૂપી પાત્રોને
કર્મના નિમિત્તે અનેક પ્રકારના નાચ નચવતો નિર્ભયપણે તે
આગળ વંધે જતો હતો. યુવરાજ કુણ્ણાલને અંધ થયાને પણ
આજે દશ કરતાં વધારે વર્ષ વહી ગયાં હતાં. એ આડ વર્ષનો
બાલક મર્યાદાને આજે વીશ બાવીશ વર્ષનો યુવાન થયો હતો
જે યૌવનમાં હતા તેમની યુવાની બદલાતાં પ્રૌઢ અવસ્થાનાં
ચિન્હા પ્રગટ હેખતાં હતાં. પ્રૌઢ વૃદ્ધાવસ્થાનાં હુઃએ અનુ-
ભવી રહ્યા હતા. પુછુલ સમુહથી અનેલું આ શરીર અનેક
પ્રકારના ફેરફારોને ધારણુ કરતું પોતપોતાના ઢ્રૂપમાં પરિવ-
ત્તન કરતું હતું.

એ અરસામાં કંઈ કંઈ ઘટનાઓ બની ગાં. જગતની
સપારી ઉપર નહી બની શકે એવું કંઈયે નથી. અંધ કુણ્ણાલ
પ્રભુભક્તિમાં ધણોજ આગળ વધી ગયો હતો. એનાં એ

ભજનીયાંની ધુન, સિતારના મધુર અવાજ, એના કંઠના મધુરતા એ બધાં અહૃદ્ભૂત હતાં. તેમાંથી એના હૈયામાંથી નિકળતું એ લાવપૂર્ણ મધુરગાન તો ન્યારું હતું. એની પ્રવિષુતાની હુદ તો ઘણીજ ઉંચી હતી. ભક્તિમય ગાનતાનમાં સાંખળનારા તો કુખીજ જતા. ખાવું પીવું બધુંથી ભૂલી જતા, ભક્તોની મંડળી જમાવી અંધ કુણ્ણાલ પોતાના જીવનને એવી રીતે પ્રભુ ભક્તિમાં એંચી ગયો હતો. ભક્તિરસ પ્રધાનગાનમાં એની પ્રખ્યાતિ એટલી બધી વધી ગઈ કે ફૂર ફૂરથી પણ લોકો આવીને એના મધુરકંઠમાંથી નિકળતા ભક્તિરસનું પાન કરતા હતા.

આટલો બધો કાળ પસાર થયો છતાં સુનંદાનું હૈયું એવું ને એવું શોકપૂર્ણ હતું હમેશાં એ પ્રભુને પ્રાર્થના કરતી કે “હે પ્રભુ ! શું હવે હમારે જુંદગી પર્યાત આવીજ રીતે મરવાનું ! ઓ નિરાધારના એલી ! અનાથનાનાથ ! અમારી વક્રાદારીનું આ પરિણામ ! શું તું હુર્જનોના મનોરથ સક્રલ કરીશ ! હાય ! જગતમાં લોકો કહે છે કે સત્યનો જ્ય થયો ? પણ અમને તો એનો ઉલટોજ અનુભવ મળ્યો ! હા હૈવ ? જે તારામાં કંઈપણ શક્તિ હોય તો અમને ઉપર લઈ જ ? અને પોતાની હુર્જનતાથી આને વરસો થયાં જેના મનોરથ સક્રલ થયા છે એને નિષ્ઠળ કર ? ” આજ વર્ષો થયાં છતાં હજુ લગણું તો એની પ્રાર્થના સક્રલ થઈ નહોંતી. છતાં સુનંદાની ધીરજની હુદ હતી. એને પ્રભુ ઉપર દુદ વિશ્વાસ હતો, પ્રતિદિવસ પ્રાર્થના કરી. ભક્તિપૂર્વક

હૃદયની એકાશવૃત્તિએ અનંત શક્તિવાનને વિનવતી શુલ્પ
પુષ્ટાદોનું વાતાવરણ તે એકદું કરતી હતી. એ શુલ્પ પુષ્ટયમય
પુષ્ટાદોથી પાપનો નાશ થતો હતો શેખ લોગવઈને છુટતાં હતાં,
સુનંદાના એવીરીતે શોકમાં દિવંસા વ્યતીત થતા હતા.

સુનંદાની વિનતિથી મહારાજ અશોકે ઉમરમાં આવતાં
એક રાજકન્યા સાથે અંધ કુણુલનું પાણિઅહણ કરાવ્યું હતું,
રાજકાજમાં ગુંથાયેલા અશોકની સમૃતિમાંથી કુણુલ તો લગ-
ભગ હવે ભૂસાઈ ગયો હતો. પરન્તુ સુનંદા તરફથી પ્રસંગો-
પાત જ્યારે સમાચાર આવતા તે સમયે મહારાજને સમૃતિ
થતી. અને એવીજ એક સમૃતિથી અશોકે અંધ કુણુલને
પરણાવી દીધો હતો.

સુનંદા કાંઈક વિચારક હતી, દીર્ઘ દિલ્લિવાળી હતી.
મહારાજ. અશોક માર્દેંતે કુણુલનાં લગ્ન થાય એમાં એનો
કાંઈક છુપો ઉદેશ હતો. જો કે તે ઉદેશ સાંધ્ય થવો એ તો
હૈવાધિન વાત છે. છતાં મનુષ્યે પ્રયત્ન તો અવશ્ય કરવો જો-
ધએ. હૈવાધિન હોવાથી એવી પ્રવૃત્તિને અશક્ય માની જો
મનુષ્ય પ્રયત્ન છોડી હે તો એને કાંઈ લાલ થતો નથી. તેથીજ
ગમે તેવી મુશીબતો છતાં નાહિં મત ન અનતાં સુકૃત્યો,
પ્રલુબકિત, પુષ્ટયમય જીવન, વગેરેથી શુલ્પ વાતાવરણ મનુષ્યે
એકદું કરી અંતરાયને હુઠાવવું જોઈએ. સુનંદાએ પણ ભવિ-
ષણી કેાં અપૂર્વ સુખની આશાએ કુણુલની મરજી નહીં

છતાં ગમે તે રીતે સમજાવી મહારાજ અશોક માર્ક્ટે એનાં
લગ્ન કરાવી દીધાં હતાં.

બાળા શરતશ્રીની ઉમર અત્યારે અઠાર વર્ષની હતી.
રાજકુન્યા છતાં એનામાં ઉદ્ઘ્રતાઈ કે ઉત્સુંખલતા નહોતાં.
કુમારી અવસ્થામાં તેના ગમે તે વિચારે હોય છતાં અત્યારે તો
સાદાઈમાંજ એણે મહતા માની હતી. અંધાપતિની ભક્તિ એને
મન સર્વસ્વ હતું, સુનંદાને શરતશ્રી સાસુ પ્રમાણે માન આપી
એનો વિનય સાચવતી હતી. સેવાનેજ એણે પોતાનો ધર્મ માન્યો
હતો. જેમ ગાંધારી ધૂતરાઇ ઉપર ભક્તિમાન હતી. સુકુન્યા
ચ્યવનરૂપિની ભક્તિ કરી પ્રલુભ્ય જીવન ગાળતી હતી. તેમ
વર્ત્માન કણમાં શરતશ્રી એ બીજુ સુકુન્યા કે ગાંધારી હતી.

જે બેચાર દાસીએ હતી એમાં એનાજ જેવી સત્યને
માર્ગ ચાલનારી ને કુણુલ ઉપર ભક્તિવાળી એને દુઃખે દુઃખી
ને સુખે સુખી ચંદા નામે દાસી હતી. જેનું નામ એને કામ
સમજાઈ ગયું છે. ચંદા જો કે તરણું હતી છતાં એ ચેકોર એને
ઝુદ્ધિમાન હતી. વાતવાતમાં થીનને જીતી લેવાની, વશ કરવાની,
એના હૃદયમાંથી ચુંતમાં ચુંત વાત પણું કઢાવવાની એની
કળા ન્યારી હતી. ચંદા તે ચંદાજ હતી. કુણુલના અંધત્વ
માટે પણું એ જીવાન ણાળાનું હૈયું ડંખતું હતું. જેથી એને
વિશ્વાસ ચોગ્ય ધારીને સુનંદાએ સત્ય શોધવા માટે ચંદાને
અવંતી રવાને કરી હતી. એ ચંદાએ અવંતીમાં શું કયું ! એ
આપણે જેઈ ગયા છીએ. શ્યામાના હૈયામાં પેંડીને એણે કેવી
ચુક્તિથી વાત કઢાવી લીધી !

પોતાનું કાર્ય પાર પડતાંજ ચંદા એકદમ અવંતીના રાજમહાલયમાંથી ગુમ થઈ ગઈ હતી. પોતાની જંવાની પરિણા થઈ ત્યારે એણે એવો સંયોગ ઉલો કર્યો કે એના ગુમ થયા પછી સર્વે કોઈ અનેક પ્રકારની કદ્દપના કરવા લાગ્યું. કોઈ કહે એ કુવે પરીને મરી ગઈ. કોઈ કહે જીવાન હતી તેથી કોઈને લઈને લાગ્યી ગઈ. જગતમાં પુરુષો તો સ્વીચ્છાનું હરણ કરે એતો ટીક, પણ આણેજ કોઈ પુરુષનેજ ઉપાડીને પુરુષ હરણનો દાખલો એસાડ્યો. ગમે તેમ જેને જેમ ફાવે તેમ લદે ઓલે, હુનિયાને મોંએ કંઈ તાળું હેવાતું નથી.

ચંદા જેવી અવંતીના રાજમહાલયમાંથી ગુમ થઈ કે શ્યામાને અનેક પ્રકારની કદ્દપના થવા લાગ્યી. “ શું એ મારો ગર લેવા તો નહીં આવી હોય ! હુંચ રંડ લોગી કે એના મિથ્યામોહમાં સપડાઈ મેં હૈયાની વાત કરી હીધી. અથવા તો એના જેવી એક અનાણી બાઇને મેં મારી નહેનાતમાં રાગી એજ ટીક ન કર્યું, અને રાખતાં શું રાગી તો ટીક ! પણ મારા હૈયાની ખુંગી વાત મેં એને કહી એ બીજુ બૂક ! હુશો ! હવે જે થયું તે ખડું ! એના જેવી એક ગરીબ કંગાવ છોકરી મને શું કરી શકે છે ! કદ્દાચ માનો કે મારી વાતનો ચાર લેવા આવી હુશે તો મારા પગનું જુતુ ફાટયું ; એમાં તે શું થઈ ગયું કે એ તુચ્છ સ્વીમાટે હું આટલો બધો વિચાર કર્યું, મારી સત્તા, મારો વૈસલ, મારો દોરદમામ અને હું તે કોણું ?

ચંદાએ સુનંદા પાસે આવીને સર્વે વાત કહી સંભગાવી.

એ તિષ્યરક્ષિતાના નાટકનો પાડ, શ્યામાને સપડાવવાનો તેમજ પોતે લજવેલો પાડ વિસ્તારથી કહી સંભળાવ્યો. કુણાલ સુરદાસ અને શરતશ્રીને પણ અપરમાતાના અધમ કૃત્યની અધર પડી. એ તિષ્યરક્ષિતાના કૃત્યને પરિણામે પોતે આંખો શુમાવી અંધ થયો—પતીત થયો. આજે એણે પોતાના મુત્ર મહેંદ્રને શુવરાજ ધનાવી તાજનો વારસ ઠરાવ્યો. જેથી કુણાલને એ અસ્તિથર રાજસમૃદ્ધિ, રાજખટપટ ઉપર તિરસ્કાર આવ્યો.

“ આહા ? ધિકકાર થાઓ આ રાજસુકુટને ? કે જેના મોહની ધાતર કેવાં કેવાં પાપ કૃત્ય કરવાં પડે છે. રાજ્યને અન્તે નરક લઈ છે તે શાસ્ત્રકારોનું વચન અસત્ય તો નજ હોય ! પોતાના તુચ્છ સ્વાર્થની ધાતર માણસો કેવું નીચામાં નીચું કૃત્ય કરતાં પણ અચકાતા નથી. આહા ! પિતાના કાગલમાં માત્ર અકાર ઉપર એક મીડું વધારીને એણે કેવો ધાણ કાઢ્યો ! તિષ્યરક્ષિતા ! તેં તો પૂર્વ લવનું બરાખર દેર વાજયું : ” ઈત્યાહી વિચાર કરતો સુરદાસ કુણાલ એ એદવાળા ચિત્તને પ્રભુ લક્ષિતમાં પલટાવી નાખતો. કે કામ થતાં શું થઈ તો ગયું પણ હવે એ સુધારવાની કોઈનામાં તાકાત નહોંતી. જેથી શત્રુના મનોરથ તો સફલ થયા હતા, એમ તે સારી રીતે જાણું હતો. એ બધો પોતાના પૂર્વકૃત કર્મનો દોષ માની સુરદાસ કુણાલ પ્રભુનો સાચ્ચો લક્તા બનવા અથાગ મહેનત કરી રહ્યો હતો.

કોઈ દિવસ યુગ પ્રધાન આર્ય સુહુસ્તિસ્વામીના એક શિષ્ય પોતાના શિખ્યો સાથે શુદ્ધની આજાથી સુરદાસ કુણા-

લના ગામમાં ચોમાસુ રહ્યા. જેમના પરિચયમાં કુણુલ અને શરનશ્રી તેમજ તેમનું આખું કુદુંખ આવ્યું. ચારે માસના એમના સતત ઉપદેશને પરિણામે કુણુલ અને શરનશ્રીની પ્રભુ લક્ષિત સુવર્ણમાં કુંદન શોલે એમ લૈનતત્વના રંગે રંગાઈ કુણુલ શુદ્ધ ઉચ્ચ લાવનામય થઈ ગઈ. મુનિએ પોતાની વિક્રતાથી અનેક શાકાઓનું સમાધાન કરી કુણુલને જૈન ધર્મમાં સ્થિર કર્યો. એ વૈરાગી કુણુલનું મન સાધુ વત પાલવા મારે ઘણ્યાં ય નલની રહ્યું, પણ મુનિએ એમને સમજની શાંત કર્યો કે “તમારે ગૃહસ્થ પણેજ બની શકે તેવી સ્થાનિમાં ધર્મારાધન કરવું. આંખો વગર શુષ્ટ દ્વારા કામ બની શકે નહીં ને એથી ઉલડું ચારિત્રની આરાધના કરવા જતાં વિરાધના થવાના સંભેગો બને, મારે ગૃહસ્થપણુમાંજ જૈનધર્મનું આરાધન કરો ! ધર્મ પસારે સૌ સાડું થશો.”

“ પ્રભુ ! મારે હવે સાડું શું ને એદું શું ! જીવનમાં મારે કાંઈ આશા નથી-લાલસા નથી. મારે સમય આત્મકાચાણ મારે જય એજ મારે મારે હવે શેષ કર્તાબ્ય છે ! ” સુરદાસ કુણુલે કહ્યું.

“ આત્મ કલ્યાણ કરવું એજ માનવ જીવનની સાર્થક્યતા છે. અનેક ખટપટોથી ભરેલા ચક્કવતી જેવાના મહાલમાંપણું જે શાંતિ નથી એવો શાંતનો અપૂર્વ સ્થાદ આત્મતત્વના અલ્યાસી ત્યાગીને હોય છે. ધર્મના અલ્યાસીને મરણનો પણ જય હોતોં નથી. સુખમાં ફુઃખમાં પોતે કરેલો ધર્મ બંધુની માઝક એની મદદ કરે છે. મારે ધર્મનું આરાધનકર્ણે. ”

અંધ કુણુલ શુરૂનું વચ્ચન માથે ચઢાવી યમ નિયમ વ્રત
વળેરે પાગાતો કાયાને દમવા લાગ્યો. ને મુનિપણ ચોમાસુ પૂર્ણ
થતાં પોતાના પરિવાર સહિત ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા.



પ્રકરણ ૧૮ મું.

એક લિખારી.

“ અરરર ! યમના લાઈ સરખો આ હુકાળ તો
નુચ્ચો ! હાય ! હાય ! ભીક્ષા આપવાને તો કેાઈ સમજતું જ
નથી. હિ ઉંઘે કેટલુંચ માણુસ અજ વીના મરે છે. પણ કોની
કોને પડી હોય તે બચાવે ? પ્રલુ ! પ્રલુ ! બબે ત્રણ ત્રણ
દિવસે પણ એકવારે ખાવાનું મલતું નથી; પાણી ચી ચી નેતે
ક્યાં સુધી જીવી શકાય ? હા ! મોત પણ આવતું નથી કે આ
પાપમય જીવનમાંથી સુક્ત થવાય. શું કરૂં ! ક્યાં જઈ ! ને
આ હુઃઅની વાત કોને કહૂં ? ” વત્સ હેશની રાજમાની કૌશા-
ખી નગરીમાં ખાવાને માટે હુણરો કંગાલ રાંકડાએ રખડતા
હતા. એમાંના એક છપનીયા સરળા હુકાળીયાના આ ઉણા-
ર હતા. એ ગરીબ રાંકડાએ ઘેર ઘેર હુકડા રોટલાને માટે
રખડતા, શ્રીમતોને ઘેર અડગો લગાવીને બેસતા પણ
લાકડીએના સ્વાહો ચખાડીને એ લોકો આ ગરીબ લોકોને
નસાડી સુકતા હતા. બિચારા એ ગરીબ લિખારીએને
સ્વર્ણામાં પણ અજ હુર્દાલ હતું, તો પછી જગૃત અવ-

સ્થાની તે વાત શી ! પશુની માર્ક વનસ્પતિ ખાઈને આ
મનુષ્ય જીવનને ટકાવી રાખવાનો વ્યર્� પ્રયત્ન કરતા હતા. અજ
માટે હાથ માથાં કુટતાં પણ એમના નશીભૂમાં અજ ન હતું.
હુબદરો અજ વિના અજ અજ કરતા જલ વગર માછલાની
નેમ તરફ હતા. હુબદરો મોતની પથારીમાં ફૂકત અજ
વગર જ સુતા હતા; હુબદરો ખાઉં ખાઉં કરતાં આ લોક છોડી
પરલોક તરફ ગમન કરતા હતા. કંઈ લિખારીઓ અજને માટે
ડૃદ્ધ કરી રહ્યા હતા. પણ એ ડૃદ્ધનો દ્વારા કોઈ દાતારને કાને
અથડાતો નહીં કે જગડુશાહની માર્ક બહાર ધસી આવી
લાએઓ નિરાશીઓને આશાનું અવલંખન આપે !

અજ માટે હાથ પગ ધરતો કોઈ એક રાંકો-લિખારી
કરીને પોતાનું પ્રારંભ અજમાવવાને શહેરમાં લીખનો દુકોડા
મેળવવાને નિકળ્યો. પેટમાં એ ત્રણું દિવસથી મુદ્દે કાઇ પડ્યું
નહોતું. ઇમેશના અજને અસાવે એનો ચહેરો મોતના નેવો
કિંકો પડી ગયેદો હતો. ચાલવાની એની શક્તિ મંદ પડી ગઈ
હતીઃ છતાં આ છેહ્વી વખતનો એનો પ્રયાસ હતો. કૌશામ્ભીના
અમીરોના ઘેર ઘેર ક્રયોં પણ લાકડીને ગાળોજ એને અજને
બદલે મળી હતી. નિરાશ થયેદો એ લિખારી ધન નામના
એક ધનાઢ્યના આંગણુમાં આવ્યો, ધરના આંગણા બહાર
ધણીવાર મુખી ઉલો; એક રૈએલાના દુકડા માટે અનેક
પ્રકારના કાલાવાલા કરવા લાગ્યો. છતાં એ કંગાલના કાલાવાલા
સાંસાગરાની કોઈને પણ પરવા નહોતી.

એવામાં આર્થમુહુર્તિ સ્વામીના એ સાહુએ શુરૂની

આશાથી ધન નામના ધનાદ્વયના ધરમાં લીક્ષાને મારે ગયા. એ બન્ને મુનિઓને જોઈ ધન સાર્થવાહુ એકદમ ઉલ્લો થઈ ગયો. બહુ માનથી હાથ જોડતો વચ્ચનથી એમની સ્તુતિ કરતો એમના સાધુધર્મની અનુમોદન કરતો જેનાં રોમરાય લક્ષ્મિથી વિક્રસ્વર થયાં છે એવો લક્ષ્મિપૂર્વક તે નમ્યો.

ત્યાર પછી એ ધનાએ પોતાની સ્વી પાસે સિંહકેશરીયા મોદક તથા બીજુ કેટલીક ખાવાની ઉત્તમ ઉત્તમ વાનીઓ મંગાવી બન્ને મુનિઓને મુનિઓની ના ભરણી છતાં લક્ષ્મિથી વહેરાવી. બન્ને સ્વીપુરુષે લાવ પૂર્વક મુનિઓને ખાદ્ય વસ્તુ એથી પ્રતિલાભી એમની લક્ષ્મિ કરી. વારંવાર પોતાની કુંપડી ચરણરજ્ઞથી પાવન કરી પોતાનો ઉદ્ધાર કરવાની કૃપા કરવા વિનિતિ કરી, એ લક્ષ્મિના ખદ્દામાં ‘ધર્મ લાલ’ એવો અપૂર્વ મહામંત્ર આપીને એ બન્ને મહામુનિઓ ત્યાંથી નીકળ્યા.

મુનિઓ ઉપરની ધન સાર્થવાહુની લક્ષ્મિ પેદો રાંકો બોઈ રહ્યો હતો, પોતાને લાકડીઓ અને ગાળોનું દાન કરનારા આ ધન ધનાદ્વયની લક્ષ્મિથી દાન આપવાની કિયા તેમજ મુનિઓની દાન લેવાની વિધિથી તે તાજુખ થયો. “એહે ? જગતમાં ખરેખર આ સાધુઓને ધન્ય છે કે જેઓ ને આવા ધનવાનો પણ દેવતાની માઝક નમે છે. તેથીજ એમનું જીવીત કૃતાર્થ છે. એમનું લિક્ષા વૃત્તિપણું પણ સ્વર્ગથીય અધિક છે કે જેમને અમૃતથી પણ અધિક ને મારા

જેવાને તો સ્વર્ણામાંય પણ દુર્લભ એવા સિંહકેશરીયા લાડુ-
ઓની લિક્ષા મળે છે, ત્યારે નારકી સરખા અમે કાલાવાલા
કરીને એમને આજુનુ કરીયે છીએ છતાં કયાંયથી અજ્ઞ પણ
દેશમાત્ર મલતું નથી. અહું ? સમયની વિચિત્રતા તો જુઓ !

એવી સ્થિતિ છતાં કદાચ કેંધ્ર તુચ્છ એવું કંઈક આપે
છે તો કેટલાય તિરસ્કાર ને ગાળોના શિરપાવડ્ય ઝેંમય
વચેનોથી મિશ્રિત થયેલું તે હોય છે. મારે હ્યા રૂપી ધનવાળા
આ સાધુઓની હું પ્રાર્થના કરું કે જે એમાંથી કંઈક-થોડુંકિ
પણ આપે ? ” એમ વિચારતો કંગાળ લિઙ્કુક એમના
નિકળવાની રાહ જેતો । ત્યાં ઉલો રહ્યો.

ન્યારે બન્ને મુનિઓ ધનાના મકાનમાંથી નીકાયા,
એટલે આ લિખારી એમની પાછા ચાઢ્યો, એમની પાંચ
આવીને યાચના કરવા લાગ્યો, હે “ લગવંત ! બણે ત્રણું ત્રણું
દિવસો થયાં ભુખના હુંઘથી હું મરી જાઉં છુ. છતાં કેંધ્ર
જરીય લિક્ષા આપતું નથી. આપ કૃપા કરી થોડીક લિક્ષા
આપો તો આપને મોડું જીવ દ્વયાનું પુષ્ય થશો, એક જીવ
મરતો અચશો. ”

“ હે લદ્ર ? અમે આ લિક્ષા લધુ જર્ઝીએ એટલું જ
માત્ર ! ” બન્ને મુનિઓમાંથી એક મુનિએ કંદું,

“ કેમ ! આપ સરખા પણ આવું અસત્ય ભાષણું કરો
છો; અરરર ! શી હુન્યા થંડ ગર્ભ ! કેવો ભારિક સમય
આવ્યો ! ” લિખારી ધણો ઓશીયાળો બની ગયો,

એની દ્વારા જનકસ્તિથતિ જોઈ એક મુનિએ કહું. “ અમે સત્ય કહીએ છીએ કે હેલદ ! અમે તો ફૂકત આ લિક્ષાનું અજી ઉપાડનારા મળુરજ છીએ ? ”

“ ત્યારે આ કોણે મારે લઈ જાવ છે ? કોનીપાસે જાવ શે. ” લિક્ષાનું પૃથ્વ્યાં

“ એના માલેક તો અમારા ગુરુ છે, અમે એમની પાસે આ લિક્ષા લઈ જઈએ છીએ. ”

“ હું પણ તમારા ગુરુ પાસે આવું ત્યારે; તેઓ મારી ઉપર દ્વારા કરશે ? ” દ્વારામણે ચહેરે રાંક-લિખારી બોઢ્યો.

“ એમાં અમે કાંઈ અમળુંએ નહીં ? ” સાધુએઓ કહું.
હવે રાંકા અજીનો અર્થી થઈને જાળે લક્ષ્ણથી એમની પાછા જતો હોય એમ એ સાધુએની પાછા પાછા ઉપાશ્રેણે ગયો.

હૈવયોગે યુગ પ્રધાન તં જમાનાના મહાન्-સમર્થ નૈન શાસ્ત્રના નાયક આર્થસુહસ્તિ સ્વામી ઉપાશ્રેણા ખહારના એઠાંદે ઉલા હતા. એમની પાસે આવી બન્ને શિષ્યો નમ્યા. તં જોઈ પેદો રાંકા પણું એમને ગુરુ ધારીને નમ્યોને ખાવાને મારે એમની પાસેથી લોજનની યાચના કરવા લાગ્યો. કોઈ દિવસ નહીં બનેલી એવી આ ઘરના જોઈ સુહસ્તીસ્વામી વિચારમાં પડ્યાં. અચીન આ બનાવમાં હૈવનો કાંઈ છુપો મુંકન હોવો જોઈએ. ”

ગુરુને વિચારમાં પડેલા જોઈને એ શિષ્યો પણ બોલ્યા.
“ લગવંત ! અત્યંત દ્વારાની મુર્તિ એવા આ રંકું રસ્તામાં
પણ અમારી પાસે લોજન માગ્યું હતું. ”

પોતાના શિષ્યોનાં વચ્ચન સાંલાગી એ મહા મનસ્વીશુર
વર્તમાન સમયના ચુગપ્રધાન દશપૂર્વના જાતા હતા. એમણે
શુતર્ણાનના ઉપયોગથી એ રંક સંખ્યાંધી લાવી સ્થિતિનો ઘ્યાલ
કર્યો. એ શુતર્ણાનના ઉપયોગથી ગુરુ મહારાજે એનું લાવી
જીવન જોઈ લીધું, ને મનમાં અતિ આશ્ર્ય પામ્યા. “ ઓછા
કેવું એનું ઉજવળ ભવિષ્ય ? આ આત્મા ભવિષ્યમાં નૈન શાસ્ત
નનો આધાર થશે—પ્રલાવક થશે ” જાનથી એનું ઉજવળ લાવી
જોઈ ગુરુવરે કહ્યું “ વત્સ ! આ સાધુના પાત્રમાં પડેલું લોજન
અમારાથી કોઈપણ રીતે આપી શકાય નહીં ? ”

“ શા માટે ન આપી શકાય ! લગવન્ ! આપ તો દ્વારા
મય નૈન ધર્મી કહેવાવ ? જીવહ્યાના પ્રતિપાલક થઈ જે મારી
દ્વારા નહીં કરે તો હું મરી જઈશ. અજ અજ કરતો
આ હેઠ છોડી દઈશ. ”

“ જે તારે અમારી પાસેથી ખાવું હોય તો એક કામ
કરવું પડશે ! ”

“ અને તે કામ ! કહો ! કહો ! સ્તુર્દિશ્યર એ ગમે તેવું
કામ કરવા ભૂખને માટે હું તૈયાર છું. ”

“ આ મુનિના પાત્રમાં પડેલું લોજન મુનિજ લઈ શકે,
નહીં કે અહસ્થ ! તું જે અમારી પાસે દીક્ષા લે તો આવે ”

ઓરાક તને મળો ! આના કરતાં પણ તને મનોવાચિંશ લો-
જન પ્રાપ્ત થશે. ”

“ હે ભગવન् ? લક્ષે તેમ થાઓ ! પોતાના કદ્યાણને
કોણ ન છિંછે ! જન્મથીજ લિખારી હોવાથી આ હુંએ હું
લોગવું છું તે કરતાં આ વતનું કષ સહન કરવું શું ઓડું છે ?
કે જેમાં આરું સારું આવાનું તો મલે ? ” એ પ્રમાણે કહી
શુરૂની વાત દુમકે સ્વીકારી.

સુહુસ્તિસ્ત્વામીએ તે પછી દુમકને દીક્ષા આપી મોદક
આવાને એસાડ્યો, ગુરુએ એને તદ્દન અદ્ય આયુષ્યવાળો જા-
ણુવાથી એની ભાવવૃદ્ધિને અર્થે એક બીજા સાધુ સાથે આ
નવા સાધુને સાધ્વીએને ઉપાદ્રયે મોકદ્યો, ત્યાં આ આજના
નવ દીક્ષિત સાધુને શ્રીમન્તોની રમણીએ તેમજ પુત્રીએએ
ભાવ પૂર્વક વંદન કર્યું. સાધ્વીએ પણ ભાવલક્ષિતથી વાંદ્યા.
નેથી નવહીક્ષિત સાધુ મનમાં અનુમોદન કરવા લાગ્યા કે.
“ એહો ! મેં મારી જાંદગીમાં કદિ નેથેલ નહી એવું આજે
મને લોજન મળ્યું, વળી આવી ઉંચ્ચ કુગની—શ્રીમન્તોની
પુત્રીએ પણ મને કેવું ભાવપૂર્વક વંદન કરે છે. આવી મોટી
મોટી ગુણવંતી સાધ્વીએપણ મને વાંદે છે એ બધું ચારિત્ર
ધર્મનું ક્રલ છે. જે કે મેં તો માત્ર લોજનને માટેજ સાધુપણ
દીધું છે ” એવા વધતા પરિણામવાગ્યા નવહીક્ષિત સાધુને
લઈને એ મુનિ ગુરુ પાસે આવ્યા.

મધ્યાન્હ સમયે એ નવ દીક્ષિતે એવું તો આકંદ સુધી

લોજન કર્યું કે શાસોશ્વાસની ગતિ પણ એની મંદ પડી ગઈ
તેમાં પણ મોટક જેવા મધુર અને મિષ્ટ લોજનનો માટક
ઓરાક ! જેથી વાયુથી લરેલી ધમણની માટક એનું ઉદર
કુલી ગયું, શ્રાદ્ધમાં જમી આવેલા ખાહમણની માટક તે
ક્ષણુવાર સ્ફૂર્તો, હવે અત્યારે વૃતવાળું ને અતિ પ્રમાણુમાં વપ-
રાચેલું લોજન નહી પચવાથી શ્રુતાની વ્યાધિવાગ ઘોડાની
ચેઠે દુમકને ગુપ્ત રીતે વિસુચિકા થવાથી ભૂમિ ઉપર
આગોટવા લાગ્યો.

હવે ગુરુ મહારાજે એની છેલ્લી કુચિંચા તૃતી કરવાને
પૂછ્યું “ વત્તસ ! તારી હવે શી દુચાછે ! ”

હુંથી પીડાતા દુમક સાધુએ કહ્યું “ પ્રભુ ! જ્યાં
આપ સમાન સાક્ષાત કેવું ક્રાંતાં હોય ત્યાં મને હવે
શી દુચાછા હોય ! હવે તો આ સમયે આપજ મને શરણ
થાઓ ? આપના શરણુમાંજ મારી શુલ્ગતિ થાઓ ? ”

દુમકના અવય આંયુષ્યના હવે છેલ્લા શાસોશ્વાસ જણાતાં
એના સાવ વધારવાને અથેં ગુરુએ ડ્રિફ્ટમાન શ્રાવકેને એની
સેવા કરવાને મોકદ્યા. તેમજ સાધુએ પણ નિર્દોષ દવાદાર્થી
એની સેવા કરવા લાગ્યા, મોટા મોટા સાધુએ અને ડ્રિફ્ટ સમૃ-
દ્ધિવાગ શ્રાવકો કે જે એક વખતે એને ગાળો ફેતા હતા, તે
સર્વ વિનય પૂર્વક ખડે પગે અત્યારે એની સેવામાં હાજર હતા.
કોઈ એના પગ દાખતા, તો કોઈ એના પેટે દવા ચોણતા, કોઈ
મણ્ણકે દવા ધસતા. ઈત્યાદિ પોતાની સેવા થતી જોઈ એ દુમક

સાધુના હૃદયમાં છેલ્લે શુભ ભાવ જગૃત થયો “ અહા ? હું તૈણું ? કે જેની આવા મોટા મુનિઓએ અને શ્રીમાનો સેવા કરે છે. એ બધી મારા આ અવ્યક્ત સામાયકનોજ પ્રલાવ ? સાધુ ધર્મનુંજ એ મહાત્મ્ય છે કે જે મુનિ ધર્મને મોટા મોટા શ્રીમાનો પણ નમે છે. આહા ? આખરે મરવા સમયે પણ મને જીક્ષા પ્રાપ્ત થઈ એ ધર્મનુંજ સારું થયું. ” ધૃત્યાદિ વિચાર કરતો અને અનેક શ્રીમન્તોથી સેવાતો એ દુમક સાધુ પોતાનુ આચુષ્ય પુર્ણ થવાથી મૃત્યુ પામ્યો. શ્રાવકોએ એ મુનિના શરીરને ચોખ્ય એની મૃત્યુ કિયા કરી.



પ્રકરણ ૧૮ મું.

આશાનું એક કિરણ.

“ ગ્રલુ ! વિશ્વવત્તસલ ! અમારા સામું જે ? સુખનું સ્વરૂપ હેખાડી ક્યા પાપે અમને આ અથાગ હુઃઅના ખાડામાં ઝુંકી હીથાં, તે હળ લગી પણ અમે બાહાર નિકળવા શકિતવાન થતાં નથી. અરર ! શું ધાર્યું હતું ને શું થઈ ગયું ! માણસ શું ધારે છે ! વિધિ જુહુજ કરે છે. આ હુઃઅમાંથી ઉગરવાનો ને શરૂના મનોરથ નિષ્કળ કરવાનો હુંવે માત્ર અમારે એકજ ઉપાય છે. અને તે ઉપાય હે હૈવ ! તારેજ હાથ છે. તેં વડપણે જેમ અમારી અધોગતિ કરી છે તેમ હુંવે અમારો ઉદ્ધાર કર ? અમારી મનોડામના પુર્ણ કર ? ” પ્રલા-

તની અંખીના રમણીય દર્શનની લગાડેક વાર હતી, એવા અવસરમાં નહીં કાળ્ય નહીં આમાન્ય એવા એક મધ્યમ મડાનના એક દિવાનખાનામાં ગ્રાચ્યા ઉપર પડી પડી એક પ્રોફ્લાન્ડ સ્વી આ પ્રમાણે વિચાર કરી રહી હતી. એ પ્રોફ્લાન્ડ વથની ગોરાંગ સીનો સ્વભાવ કંઈક ઉચ્ચ હતો, હુકમ વલાંવવાની એની ટેવ હતી છતાં ઘણ્ણા વખતના દુઃખના પરિચયથી એનું મન હમેશાં ખિન્ન રહેતું હતું, સ્વીએને ઉચ્ચિત માયા પ્રિય એનો સ્વભાવ હોવાથી એક વખતની પોતાની જમુદ્રિ પોતાનો હરીક લો-ગવતો હોવાથી એના અંતરમાં અતિ દુઃખ થતું હતું. એ દુઃખમાંથી એનામાં ધીરજ, ગંભિરતા, સ્થિરતા, ને સહુન શીલિતા આદિ ગુણો વડાસ પામ્યા હતા. છતાં હજુ એના જીવનમાં એક મહત્વની આશા હતી. એ આશાના પાશથી બંધાયેલી એ પ્રોફ્લાન્ડ રમણી દુઃખમાં દિવસો વ્યતીત કરી જીવતી હતી. એ પ્રોફ્લાન્ડ વદના સ્વી તે કુણ્ણાલની ધાત્રી સુનંદા હતી. જેંક કુણ્ણાલનો રાજહુક તો હવે નાખૂદ થયો હતો છતાં જે બનાવો વિધિને હસ્તાક છે એવા બનાવોમાં આશા રાખી એ સ્વી જીવતી હતી. એ આશા પૂર્વી એ તો હૈવની મરળુની વાત છે. છતાં માણુસ જ્યારે અતિ દુઃખથી નાશીપાસ થાય છે લ્યારે અવિષ્ટની કોઈ અગમ્ય સુઆશાએ તે જીવન વ્યતીત કરે છે, પડી જાલેને એ આશા હૈવાધિન હોય ! છતાં હૈવ ઉપર વિશાસ ધરતાં તે શીખે છે. હૈવને અનુકૂળ કરવા પુણ્યકૃત્યો—ધર્મકૃત્યો કરવાની એના હૈયામાં સદ્ગ્રાવના બાળૃત થાય છે.

ગરીબ બિન્દારી સુનંદા ! તે પણ એક પરાવલંખન-વાળી આશાએ હૈવ ઉપર ભડંસો રાખીને જીવતી હતી. ને એ આશામાં ને આશામાં અત્યારમાં તે વિચારેના પ્રવાહમાં દુષી ગઈ હતી. એટલામાં તેની પાસે સુતેલી ચંદાએ એના વિચારમાં ઉપલ કરી. “ મોટી એન ? જાગો છો ને ? ”

“ કેમ શું કહે છે ચંદી ? ” વિચારમાંથી જગૃત થતાં ગંભિર મુખમુદ્રા ધારણ કરી સુનંદા એદી.

“ મને તો લાગે છે કે કોઈ હિવસ હુવે આપણો ઉદ્ધાર થાય એમ નથી. આવીજ સ્થિતિમાં આપણો કાળ જવાનો દુષ્પ હૈવે નિર્માણ કર્યો છે, છતાં મનમાં મોટી મોટી મહત્વાકંશાએ કેમ થતી હશે વળી ? ” ચંદાએ કંદિક વાતો તો કરવીજ જોઇએની, એમ સમજુને વાતાંની શરૂઆત કરી.

“ ચંદી ? ગમે તેમ થાય, છતાં ભવિષ્યની એક સુઆશાએ હું જીવું છું. તું પણ પોતાના શોડની આવી સ્થિતિ જોઇને તરણ અવસ્થા છતાં અખંડિત ખ્રદ્યાર્થ પાગતી સંસાર છોડીને બેડી છે, તો શું હૈવ એન્દ્ખું કઠોર થશે ! શું આપણી ઉપર એ દ્વારા નહી કરે ? ” સુનંદાએ આશા આપી.

“ મને નથી સમજતું કે એ કયી રીતે આપણુને મહદુદ્ધ કરશે ! કુણાલ કુંવર શું કરી દેખતા થશે ? એમનાં ગયેલાં લોચન કરી પ્રામ થશે. પ્રલુબ ? પ્રલુબ ? મુવેલાં માણુસ તે કાંઈ જીવતાં થતાં હશે ? ” ચંદીએ નિશાનાના ઉદ્ગાર કાઢ્યા.

“ ચંદ્રી ! હીકરી ! કદાચિત એ ન થઈ શકે પણ એક ચીજ તો અવસ્થ્ય થણું શકે ! કે જે ચીજ ઉપર આશા રાખીને હું જવું છું . ”

ચંદ્રા સુનંદાના શબ્દો સાંભળીને ચમકી. એણે આતુરતાથી પૂછ્યું. “ મોટી એન ? અને એ કયી ચીજ વાર ? ”

“ તે એ કે શરત વહુને સારો દ્વિવસ તો આવી શકે ? શરતશ્રી જે હૈવ છાચાએ કોણ લાગ્યવંત પુત્રનો જન્મ આપે તો..... ” સુનંદા ઓલતાં અટકી ગઈ.

“ તો શું ! ” ચંદ્રાએ પૂછ્યું. “ એ પુત્ર શું કરી શકે ? ”

“ સંભવ છે કે એ પુત્રના પુષ્યથી આપણે આપણો ગંયેદો વૈસવ પાછો મેલવી શકીએ, એટલું જ નહી પણ શત્રુના મનોરથ નિષ્કળ પણ કરી શકીએ.” સુનંદાએ પોતાના મનની વાત કહી સંભળાવી.

“ તમારી ધારણા પ્રમાણે બને તો કદાચ આપણે ઝાવી શકીએ એમ તમારું માનવું છે ? ”

“ હું તો શરતના સારા દ્વિવસનીજ રાહ જોઉ છું ચંદ્રા ? તે પછી પણ આપણે તો બનતા પ્રયાસો કરવાના છે. ક્રલ તો હૈવાધિન છે ? ”

“ એવી હૈવાધિન વસ્તુ ઉપર ભરુંસો કેમ રખાય ! જગતમાં કાંઈ ઓછું જ આપણું ધાર્યું બને છે તે ? ”

“ ખચીત ! તે છતાં આશા હુરાશા છે. હુઃ” આમેને આશા એજ જીવન છે. ” સુનંદા બોલી.

“ પરમહૃપાળુ પરમાત્મા તમારા મનોરથ સફ્રગ કરે ? ”

“ તારું અલ્લાયારિણીનું વચ્ચન સત્ય થાઓ ? તારુંને મારું તથ, કુણાલની પ્રભુલક્ષિત એ કંઈ નિષ્ટગ તો નહીં જાય.”

બન્ને જણાં એ પ્રમાણે વાર્તાલાપ કરતાં હતાં, હળુતો તેઓ ઉઠયાં પણ નહોતાં, એવામાં શરતકુમારી ત્યાં આવી, એનું હૈયું પ્રસન્ન હતું. વદન ઉપર આનંદની સુરખી છવાઈ હતી. એ પ્રસન્ન વદન જેતાં સુનંદાએ હું. ” શરત ? આજે તો કંઈ અત્યારમાંજ આનંદ ! શું છે કંઈ ? ”

“ ખાઇજુ ? એક ખુશાખખર કહું ! આજ કેટલાય દ્વિવસથી મારા મનમાં એ વાત હતી, પણ મને શાંકા હતી, ખસ હુવે મને ખાતરી થઈ. ” વાત કરતી કરતી શરતકુમારી ચંદાની સોડમાં ભરાઈ એની જેડમાં એડી.

ચંદા અને શરતકુમારી લગભગ સરખી ઉમરનાં હતાં, બન્ને સુંદર અને બુદ્ધિમાન હતાં તેમજ સાહું જીવન ગાળનારાં હતાં. જેથી બન્નેમાં સખ્યપણું સારી રીતે હતું. બન્ને એક ખીણની ખાનગી વાતો કરી એકાંતમાં નિર્દેખ વિનોદ કરી મન પ્રસન્ન કરતાં હત.. ચંદા પણ શરતકુમારીને એકાંતમાં ખાનગી વાતો પૂછીને એને વરદેલી કહીને બનાવતી હતી. બન્નેનો એવી રીતે સુખમાં કાળ નિર્ગમન થતો હતો.

“ એવી તે શ્રી વધામણી લાવી છે. શરત ! ઓદ જોડા !”
અદરકારપણે સુનંદાએ કહ્યું છતાં એના હૈયામાં ઉત્કર્ષ હતી.

“ કહું ! આજ મને માલુમ પડ્યું કે મારા”
ઓલતાં ઓલતાં શરતકુમારી શરમાઈ ગઈ ને ચંદાના હૈયા
ઉપર પોતાનું મુખ છુપાવી દીધું.

“ કેમ ? શરમાઈ ગઈ ઓલની ! કંઈ નવા જુની કરી
છ કે શું ? ” હસતાં હસતાં ચંદાએ એના કાનમાં કંદિક કહ્યું.

“ હા ! એમજ છે ? તારી વાત સત્ય છે ચંદા ? ”
શરતકીએ ચંદાને સમજાવી દીધું.

“ ચંદા ! તમે એ જણું શું ગુણ પુસ વાતો કરો છો,
આજ કાલની છોકરીયો તો જો ! ” સુનંદા મૃહુ ભાવે હસી
અને ઓલી.

“ મોટી એન ! એની વાત હું સમજુ પણ એ કહું શકતી
નથી. તમારી એક ધારણા આજે સત્ય થઈ, હુસ્મનના તેજના
ક્ષયની શરૂઆત થઈ. ” ચંદાએ હસતાં હસતાં જણુંયું.

“ લગાર સ્પષ્ટતાથી કહે ચંદા ! તારી મોંઘમ વાતમાં
હું શું સમજું ! ” ઉત્સુકતાથી સુનંદાએ પૂછ્યું.

“ શરતકુમારી ગર્ભવંતી છે, મોટી એન ? ” ચંદાએ
મૃહુ હાસ્યે ખુલાસો કર્યો.

ચંદાનું વચ્ચેન સાંલળી સુનંદાએકદમ સફ્રાળી એડી થઈ
ગઈ. પોતાના સાંલળવામાં ભૂલ તો નથી થતીને, તે નક્કી કર-
વાને એણે કુરીથી પૂછ્યું. “ ચંદા ! કુરી કહે જોઉ તેં શું કહું ? ”

“તમારી આશા કુળી, આપણી શરતને એધાન છે! ”

“ શરતને ગર્ભ છે ? ” ખાતરી કરવાને પૂછ્યું.

“ હા ! તેથીજ તમને કહેતાં શરમાય છે. શરત ! ”

“ આહુ ! આજે મારી ધણા દિવસથી હૈયામાં રહેલી એક આશા સકૃષ્ટ થઈ. શરત ! મારી આશીષ છે કે તું રાજરાણી તોન થઈ, પણ રાજમાતા થને. આપણા પૂર્વજ ચંદ્રગુમ અને અશોક જેવા સમર્થ પુત્રનો જન્મ આપનારી માતા થજે. ” આનંદથી ઉછળતા હૈયે સુનંદાના સુખમાંથી અક્સમાત એ શાખદો નીકળ્યા.

“ તમારાં વચ્ચેન હું માથે ચડાઉ છું. આપનું વાક્ય અંગીકાર કરે છું. ” શરતકુમારીએ શરમાતે શરમાતે શકુનની ગાંઠ વાળી.

“ આજ કેટલા દિવસ થયા; શરત ? ” આતુર હૃદયે સુનંદાએ પૂછ્યું.

શરમાતે દિવે શરતકુમારીએ કહું. “ એ મહિના ? ”

“ આજ બણે મહીના થયા છતાં અમારાથી વાત છુપાવે છે. ઘેલી ? ” ચંદ્રાએ એવું કહીને એને ગાલે મૃહુ ચુંદી ખણી.

“ આજ સુધી મને તો કાંઈ ખખર પડી નહીં. શું કરે ? ”

તે દિવસથી હુઃઅયાળા કુણ્ણાલના મકાનમાં આનંદની ઝાંખી થવા લાગી. સુનંદાના હુઃઅય હીલમાં પણ શાંતિ થઈ તેણુંએ ગર્ભને સારી રીતે પોષણ કરવાની, ખાવા પીવામાં તેમજ બહુ કામ ન કરવાની એવી કેટલીક શરતકુમારીને શિખામણું આપી.

તે પછી દિવસ જતાં એને-શરતકુમારીને સારાં સારાં સ્વરૂપો આવવા લાગ્યાં, દેવશુર અને ધર્મની લક્ષિત કરવાનો દોહુદ ઉપનિષદ થયો. એ દોહુદ કુણાલે પરિપૂર્ણ કર્યો. ત્યારથી પ્રસન્ન હૃદયે રહેતી શરતકુમારી ગર્ભનું સારી રીતે પાલન કરવા લાગી. સુનંદા અને ચંદા એની ઘણી સંભાગ રાખતાં. ખાવા પીવામાં એની કાળજી રાખતાં, બીજી દાસીએ ડગલે ડગલે એની સેવામાં હાજર રહેતી. ગર્ભનું પોષણ કરતી શરતકુમારીને અનેક પ્રકારની અભિલાષાએ થવા લાગી. બધાને હુકમ કરી સર્વ ઉપર સત્તા ચલાવવા લાગી. જગતને તાનેદાર અનાવવાનો હુનિયા ઉપર ચક્રવર્તી રાજ્યસ્થાપવાનો એને અભિલાષ થવા લાગ્યો. ડડી રીતથી ગર્ભનું પાલન કરતાં પૂર્ણમાસે અને શુલ મુહૂર્તે એક સુંદર અને તેજસ્વી પુત્રનો જન્મ આપ્યો. અહો બધા અનુકૂળ હતા, કેટલાક તો ઉંચા હતા. કેટલાક સ્વગૃહી હતા. એવા સારા અહ્યોગમાં શુદ્ગલારી શરતકુમારીએ ભન્ય પુત્રનો પીડા રહીતપણે જન્મ આપ્યો.

સુનંદા, ચંદા, વગેરે પુત્ર જન્મ સમયે શરતકુમારી પાસે હાજરજ હતાં. નિર્વિદ્ધને પુત્રનો જન્મ થયો જોઈ એ ખુશી થયાં. અશુદ્ધી વગેરે ફૂર કરી એ ખાળપુત્રનું ચંદ્રવદ્ધનને પણ તિરસ્કાર કરે એવું સુંદર વદ્ધન, ભન્ય લલાટ, મજબુત અને ઘાટીલું શરીર જોઈ સુનંદા અત્યંત હુર્ષઘેદી થઈ. “ દીકરા ? તારી માતાના મનોરથ પૂર્ણ કરને. મોટો ચક્રવર્તી રાજ થને. ” પુત્રને જોઈ એની આંખમાં હુર્ઝનાં આસુ આવ્યાં.

એ તરતનો જન્મેદો ખાળક પોતાના નાળુક હાથ ઉચ્ચા

(૧૬૬)

કરતો ને મેં મલકાવતો, ઉચ્છળતો સર્વેના હર્ષમાં વધારે કરવા લાગ્યો. તુરતજ એક દારીએ હોડી આવીને કુણાલને વધામણી આપી.

સુત્ર જન્મની વાત સાંસળી કુણાલ ખુશી થયો, પણ વળી વિચાર થયો કે “મારા જેવાના ધરમાં જન્મ ધારણ કરનાર એ સુત્રનું એવું શું લાગ્ય હુશે ? તે છતાં હુશે હૈવની મરણ હુશે તેમ થશે.” વધામણીમાં દારીને ખુશી કરો, પોતાની શક્તિ અનુસાર એને લેટ આપી.

સુત્રજન્મની વધામણીથી આજે આજા ધરમાં આનંદ આનંદ હુતો. આજનો આનંદ સાવિષ્યના આનંદની ઝાંખી રૂપ હુતો એવું કોણું જણું હતું !



પ્રકૃતાણ ર૦ મું.



આશાને હિંદોળો.

“ વત્સ ! આજે તું ઉદ્ઘયિનીના સિહાસન ઉપર હોત તો આ હીકરાનો કેવો જન્મ મહોત્સવ થાત ! છતાં હીકરે નશીભદાર છે એ સંતોષની વાત છે.” સુત્ર જન્મયા પછીના એક દિવસે સુનંદાએ અવસર મેલવીને કુણાલને કંધું એ કરે વાગ્માં એનું લક્ષ્ય આજે કાંઈ જુહું જ હતું.

“ કુમાર ? શો ગલાડ આ છોકરો છે. એને નિહાળવાને

પ્રભુ તમને આંખો આપે તો કેવું સારું ? આ ખાળ સુંદર વહન આંખો આગામથી હુર કરવું પણ ગમતું નથી હો ! ” ચંદાએ વચ્ચમાં કહ્યું.

“ ગમે તેવો સુંદર પણ હવે એ કંઈ રાજ ન થઈ શકે ? ” કુણાલે કહ્યું.

“ કેમ ન થઈ શકે ! રાજનો કુંવર શું રાજ ન થઈ શકે ! ” સુનંદાએ જુસ્સાથી કહ્યું.

“ એશક રાજનો કુંવર રાજ થઈ શકે; પણ અત્યારે હું કંઈ રાજ નથી કે એ રાજ્યવારસ થઈ શકે ? ” કુણાલ ઓડ્યો.

“ તમે ગમે તેમ કહો ! ખાડી મને તો છોકરાનું નશીબ મોટું લાગે છે. આવો ખત્રીશ લક્ષ્મણ યુક્ત ભાગ્યવાન् પુત્ર જો મોટા રાજ્યનો માલેક ન થાય તો પછી એમ જ સમજવું કે વિધિ પણ કોઈ વખતે ભૂલ કરે છે. ” ચંદા વચ્ચમાં ઓલી.

“ ચંદા ? પ્રભુ ઈચ્છા હશે તો તારી ને મારી આશા પ્રભુ-વિધિપૂર્ણ કરશે. આપણા મનોરથ સર્જણ થશે. ” સુનંદા ઓલી.

“ તમારે સ્ત્રીએને જીવનને માટે કંઈપણ આશાનું અવલંબન તો જોઈએ ના ? અનેક પ્રકારે લલે હવાઈ કીદ્યા બાંધો ? ” કુણાલે કહ્યું.

એટલામાં શરતકુમારીએ આવીને પુત્રને સુનંદાના ઓળામાં સુકયો. “ વત્સ ! તું ગમે તેમ કહે પણ આનું લાગ્ય

તો મોટું છે ? જે ને ખોળામાં પણ એ લુચ્યો કેવાં તોઝાન કરી રહ્યો છે.” બાળપુત્રને રમાડતી સુનંદાએ પુત્રને કુણ્ણાલના ખોળામાં મુક્યો. “લે આ તારો પુત્ર ! રમાડ એને ! એના કુણ્ણા માખણું જેવા શરીર ઉપર હાથ તો ફેરવ જરી !”

કુણ્ણાલ ખોળામાં રમતા એ બાળશિશુના શરીર ઉપર હાથ ફેરવતો એને લાડ લડાવા લાગ્યો. એ ચપળ વૃત્તિવાળું બાળક ખોળામાં આમતેમ ઉચ્છાળતું, હાથ પગ પચ્છાડતું આળોટવા લાગ્યું. બાળકના મોઢા ઉપર મધુર સિમત હતું એ સિમત વદનમાંથી શત્રુને ભડકાવનારા ખાદ્યોચિત પડકારા નિકળી રહ્યા હતા.

ખોળામાં રમાડતાં કુણ્ણાલ બોલ્યો. “ હીકરા ! મારા કરતાં મારા પિતાને લાં તું જન્મ્યો હોત તો કદાચ મોટા રાજ્યનો ધણી થાત ? અથવા તો આજે પાટવી મહેંદ્રકુમાર છે એને લાં જન્મ થવાથી તું લવિષ્યમાં તારો હુક્ક નક્કી કરત. પણ એર હૈવે તને મારે લાં જન્મ આપ્યો તો લલે ? તારા હિતને માટે હવે હું શું કરું ? ”

“ એના હિતને માટે તું એક કામ કર, હીકરા ? ધણાદિવસથી મારા મનમાં તારા હીકરાનું મોં જેવાની અભિલાષા હતી તે વિધિએ પૂરી કરી છે, બાકીની એક અભિલાષા તું પૂરી કર ? ”

“ કેણું હું ? માતા ? હું અંધ માણુસ બોલો. તમારી કથી અભિલાષા પૂરી કરું ? મારાથી એ બની શકે તેમ છે કે નહીં ? જે બની શકે તેવી હશે તો અવશ્ય પૂર્ણ કરીશા. ” અજાસાથી કુણ્ણાલ બોલ્યો.

“ તું ધારશે તો પૂર્ણ કરી શકશો અને એ પૂર્ણ કરવામાં જ આપણી ઉજ્જ્વલિ રહેલી છે. આપણી જાહેરતાતી એમાંજ સમાયલી છે. ” સુનંદા એ જણાયું.

“ઓલો ! ઓલો ! અટ ઓલો ? તે શું છે ! ” કુણાલે પૂર્ણયું.

તે હું એકદમ કહેવાની નથી તું મને વચ્ચન આપ ; કે હું તમે કહેશો તે પ્રમાણે કરીશ. ”

“ મારાથી અની શકશો ત્યાં લગી હું જરૂર તમારું વચ્ચન માન્ય કરીશ ? ” કુણાલે જણાયું.

“ દીકરા ? તો મારી એકન માગણી છે કે તું આપણી રાજ્યધાની પાટલીપુત્રમાં જા ? ”

“ પાટલીપુત્રમાં ! ત્યાં જઈને હું શું કરું, ભાતા ! ”
ઉત્સુકતાથી કુણાલે કહ્યું.

“ તારી સંગીતકળાથી મગધપતિને પ્રસત્ત કર ! તારા દીકરાને માટે રાજ્યની માગણી કર ! ”

સુનંદાના એ વચ્ચનથી કુણાલની આંખ ચમડી, એ વિચારમાં પહ્યો, “ વત્સ શું વિચાર કરે છે ! તું પ્રયત્ન કર ! મારે આ બાળ પુત્ર લાંબા કાગ સુધી જગત ઉપર ઐશ્વર્ય લોગવશો. આપણા અધાના મનોરથ એ પૂર્ણ કરશો. ” ઝરીને સુનંદાએ કહ્યું.

“ કુમાર ! શું વિચાર કરો છો ! તમારી અપર ભૂત્પ અપણું નિકંદન કાઢી રાજુ થઈ ગઈ છે. એના મનોરથ નિષ્ઠળ કરવાનો હવે સમય આવ્યો છે. ” વચ્ચમાં ચંદા ઓલી.

સુનંદાનું વચ્ચેન સાંલગીને એની મૃત આશા સળુનન થઈ હતી. ચંદાના વચ્ચેનથી એનો ઉત્સાહ વૃદ્ધિ પામ્યો હતો.

માળના ઉપર એઠેલું એ કુદુંણ એ પ્રમાણે ભાવી કાલની વાતોમાં નિમગ્ન હતું. કુણાલ હાદરા પાસે એકેદો હતો, એના જોગામાં એ નાનો શિશુ રમતો હતો. ભાલચાપદ્યતાથી એ જોગામાંથી કુદ્દતો કુદ્દતો નીચે ગણડી પડ્યો. તે હાદર ઉપરનાં પગથીઆંથી ગણડતો હેઠે જમીનપર પડી ગયો ને કદ્વાંત કદ્વાંત થઈ રહ્યું. શરતકુમારી તો ચીસ પાડતી મૂચ્છિંત થઈ ગઈ. સુનંદા એકદમ નીચે દોડી આવી એની પછવાડે ચંદા આવી નીચે કામકાજમાં રોકાયલાં ખીજાં હાસ દાનગીઓ ઘોંઘાર સાંલગી દોડી આવ્યાં. અરરર! બુદ્ધમ થઈ ગયો! હૈવે આ શો કોષ કર્યો. અમુદ્ય રત્ન ખતાવી પડાવી લીધું.” હાયપીટ કરતાં એ શિશુને જોવા લાગ્યાં તો નીચે પડેદો અને જોક કરતો ખાળક એકદમ સુનંદાએ આવતાંની સાથેજ ઉપાડી લીધો. એના શરીરને ખંડાં તપાસવા લાગ્યાં. પણ એને તો કયાંય લાગ્યું નહોંતું. હતુમાન અને લીમની માદ્ક પૂર્વના પુણ્યથીજ એ મજબૂત બાંધો લધુને જન્મેદો હતો, સુનંદાની કેડમાં પડેદો તો પણ એનો તૌક્ષાની ભાલચાપદ્ય સ્વભાવ ચાલુજ હતો, હાથ પગ ઉલાણતો સુનંદાને પણ હેરાન હેરાન કરી મુક્તો હતો. વાગવાનું કંઈ ચિન્હ ખાગકના વફનપર નહોંતું.

ખાળકને જોક કરતો જોઈ સર્વનો કદ્વાંત પાછો આનંદના રૂપમાં ફેરવાઈ ગયો. ને કુણાલ પણ ઝુશી થયો. શરત-

કુમારી બેલાનમાં હતી એને સાવધ કરી એના ખોણામાં બાળક મુક્યો “ લે આ તારો બાળક ? ”

પોતાના બાળકને અક્ષત અંગવાળો જોઈ એના જીવમાં જીવ આવ્યો. બાળકને હૈથા સાથે દાખાવી એને ચુંબન ઉપર ચુંબનથી નવાજ્યો. માતાના લાડથી એ શિશુનું વહન ખીલી ખીલી રહ્યું ને પાછો ખોણામાં હાથ પગ પચ્છાડતો તોડ્યાન કરવા લાડ્યો.

બધાંને લાગ્યું કે બાળક આટલે ઉચ્ચેથી નીચે પડ્યો છતાં લગારે એને લાગ્યું હોય એવી નીશાની એના શરીર ઉપર નથી એના મન ઉપર એની અસર પણ નથી. દાદરથી નીચે પડ્યા છતાં જોયું તો એ જોલજ કરતો હતો. માટે આગળ જતાં એ મહા પરાક્રમી થશે. ધણા શરૂઆના ગવંનું મહીન કરનારો થશે. એથી મુનંદાનું હૈયું તો હરખ્યું. “ કુણાલ ! દીકરા ! જોયું તારા બાળશિશુનું પરાક્રમ ? આટલે ઉચ્ચેથી પડ્યો છતાં એતો નીચે રમતો હતો. અન્યારથી જ એનું શરીર આટલું બધું મજબુત છે તે મોટો થતાં જરૂર પોતાનું રાજ તો સ્વપરાકમથીજ એ અવસ્થ લેશો. છતાં દીકરા ! એક વખત તું પ્રયત્ન તો કર ? તારી મહેનત અને મારા આ બાળકુંવરનું નશીબ ! મરતાં પહેલાં એટલું તો-હું જોઈ લઉં ! ”

“ જેવી રીતે પેલી તિધ્યરક્ષિતાએ આપણા મનોરથ નિષ્ઠા કર્યા છે, તેવીજ રીતે આ બાળના પુણ્ય પ્રતાપે એના મનોરથ પણ તમે નિષ્ઠા કરો ? ” ચંદાએ વચ્ચમાં કહ્યું.

એકતો બાળકનું અસાધારણું પુણ્ય હતું ને ઘરમાંથી આવી રીતે હંમેશાં પ્રેરણા થતી હોવાથી કુણુલના હૃદયમાં મરી ગયેલી આશા પાછી પુનર્જન્મ પામી. “ માતા ! મને વિચાર કરી લેવા હે ! પછી એ સંબંધી ચોકુકસ નિર્ણય હું કરીશ ? ” એમ કહી કુણુલ ત્યાંથી ચાલ્યો ગયો.

તે દિવસે સાંજના કુણુલ પોતાના એકાંત ઓરડામાં એસી વિચાર કરતો હતો. એણે પોતાના બાળજીવનથી લઈને આજ પર્યાંત જુંદગીનો ઈતિહાસ ઉથલાવવા માંડયો. એ ઉજાયનીનો આનંદ ? એ યુવરાજ પહવી, અવંતીનો વૈભવ એની એને જાંખી થવા લાગી. પેલી કુર માતાએ આઠ વર્ષની ઉમરમાંથીજ એને આંધળો બનાવી હુનિયામાંથી રહ ખાતલ કર્યો હતો. “ હા ! જો એનો શું શુન્હો કર્યો હતો ! કે. એણે પોતાના અધમ કૃત્યથી મારી જુંદગીનો વંસ કરી નાહયો. એના દીકરાની પહેલાં મારો જન્મ થયો એમાં મારો શું વાંક ! કે રાજને પોતાનું હથીયાર બનાવી એ અપરમાતાએ મારી આંગે ઝોડાવી. આજે કંઈ વર્ષો વહી ગયાં છતાં મારી અવંતીની જંહેજલાલી એનો પુત્ર મહેંદ્ર યુવરાજ પહવી પામીને લોગવી રહ્યો છે. જેવી રીતે એણે મારો મનોરથ વ્યર્થ કર્યો તેમજ હું પણ એનો મનોરથ વ્યર્થ કરે ! અને મારું રાજ્ય હુંજ પિતા પાસેથી એમને પ્રસન્ન કરીને માર્ગીજીજીં ? આજે સમય બદલાયો છે. તો મહેનત કરીને પુત્રનું નશીખ તો હું અજમાવી જોઉં ! જગતમાં બધા દિવસો કોઈના સરખા જતા નથી. હુનિયામાં જેવાય છે કે પિતાએ શુમાવેલું તાજ દીકરો

મેળવે છે, તો મારે પણ હવે અવશ્ય પ્રયત્ન કરવો, કદાચ એનું જાગ્રત લાગ્યજ મને પ્રેરણા કરતું હુશે તો કોણે માલૂમ ! બસ એજ નિશ્ચય, જેમ બને તેમ પાટલીપુત્ર તરફ રવાને થાઉં. મારી સંગીત વિદ્યાના ચમત્કારથી એમને પ્રસન્ન કરી વરદાન માણી લડોં ? ” વિચારમાં ને વિચારમાં એ પ્રમાણે નિશ્ચય થવાથી કુણ્ણાલે પોતાનો નિશ્ચય પોતાની માતાને કહી સંભળાવ્યો. એની વાત સાંલળીને સુનંદા વગેરે સર્વે પ્રસન્ન થયાં સુનંદાએ આશિષ આપી. “ દીકરા ? તારું કાર્ય સત્ત્વર સિદ્ધ થણે ? ને હુસ્મનના મનોરથ નિષ્ઠળ થણે ? ”

“ હું પણ છચ્છું છું કે કુમાર ! તમારા કામમાં તમને વિજય મળો ! ” ચંદાએ પણ કહ્યું.

“ દીકરા ! અહીંથી પાટલીપુત્ર ફૂર છે. તને મુશ્કેલી ન પડે માટે તું સાથે કોણે લઈ જવા છિંછે છે વારું ! ” સુનંદાએ કહ્યું.

“ કોઈને નહી માતાજી ? હું એકાકી જવા છચ્છું છું. તેય વળી ગુપ્ત રીતે ! પિતા મને ઓળખે તેવી રીતે પણ નહી પછી પાછળથી અનુકૂળ સમયે લલે ઓળખે ! પણ અહીંથી તો ગુપ્ત વેષેજ એક અંધ ગવૈયાના વેષમાં નીકળીને ફરતો ફરતો હું પાટલીપુત્રમાં જઈશ. ”

“ દીકરા ! રસ્તામાં તું એકલો અપંગ હોવાથી ખાવા પીવાની તને અડચણુ પડશો. માટેજ સાથે એક જણુને રાખવાથી તને ઢીક પડશો. ” સુનંદાએ રસ્તાની મુશ્કેલી બતાવી.

“ એને માટે મારી સંગીતવિદ્યાજ મને સાધનભૂત થાઓ ! જો એ સંગીતવિદ્યા મને ખોરાક કેટલુંચ નહી અપાવી શકે, તો મહારાજ પાસેથી મોટું સામ્રાજ્ય તો કેમ અપાવી શકે ? માટે મારો જીથી તો ઇક્તા મારી જીતાર જ ! ” કુણાલે કહ્યું.

સમય એવોજ હોવાથી હૈવ ઉપર લડ્સો રાજ્યા વગર છુટક્યો નહોતો, કેથી વિધાતા ઉપર વિશ્વાસ લાવી કુણાલના વચ્ચનને સર્વોચ્ચ અનુમોદન આપ્યું. તે પછી એક દિવસે શુલ્ક મુહૂર્ત સાચવતો કુણાલ શરત કુમારીએ મંગલ તિલક કરેલો. સામાન્ય લિક્ષુક ગવૈયાનાં કપડાં ધારણ કરી હાથમાં સિતાર લઈને પાટલીપુત્રને રસ્તે પડ્યો. માર્ગમાં એને ઘણા સારા શકુન થયા. એ શકુનને વધાવતો કુણાલ પોતાના સ્નેહી જનોથી અદૃશ્ય થઈ ગયો.



પ્રકરણ ૨૧ મું.

અંધ સિતારવાળો.

પાટલીપુત્રમાં જહેર રસ્તા ઉપર હમણાં કેટલાક દિવસ થયાં એક સિતારવાળો નજરે પડે છે. જ્યારે એ સિતાર વાળો સિતારના સૂર સાથે પોતાના કંઠથી મધુરા સૂર છાડી મુકે છે. ત્યારે એ સંગીતકાળ આગળ કિન્ફર અને

ગાંધર્વો પણ લજન પાંની જય છે. એવા એ અંધના મીઠા ગાનથી આખું પાટલીપુત્ર ઘેલું ઘેલું થઈ ગયું છે. જ્યારે એ ગાય છે ત્યારે હજારો માણુસો એના ગાનમાં લુંધ થઈને સાંલગ્નવા ઉલા રહે છે. સેંકડો કાર્યને પડતાં સુર્કીને મતુષ્યો એ હેવહુલ્લાલ ગાન તરફ આકર્ષાય છે. કેટલાક અમીર ઉમરાવો ને સરદારો એનાં વળાણું સાંલગ્નીને પોતાને મકાને બોલાવી એનું ગાન સાંસળે છે. એના સંગીત ઉપર મરી પડનારા લોકોના હૃદયમાં બસ એના સંગીતનીજ ધૂન લાગી હતી. કોઈ કોઈ વાર, અમીર ઉમરાવોના ત્યાંથી એને આમંત્રણું આવતું, એ આમંત્રણુને માન આપી અંધ સિતારવાળો એમને ત્યાં જઈ પોતાના સંગીતનો અદ્ભુત ચમત્કાર બતાવી,—શ્રોતાએને જીહદ ખુશી કરતો હતો;

પ્રસન્ન થયેલા સરદારો, શ્રીમંતો એનું નામ ડામ પુચ્છીતા. તેના જવાબમાં પોતે કહેતો કે “ હું સુરદાસ છું— અંધ સિતારવાળો છું.”

“ તમારા કુદુંખમાં કોણ છે સુરદાસજી ? ” એના જવાબમાં તે કહેતો કે—“ આ સિતાર એજ મારું કુદુંખ છે, મારી અંધાની એ લાકડી છે, જીવનું જીવન છે.”

સારી સારી લાલચો આપી સંગીતના લુંધ અમીરે એને પોતાને ત્યાં હમેશાં કાયમ રહેવાને લલચાવતા. પણ કોઈને ત્યાં કાયમ રહેવાની એ સિતારવાળો ના પાડતો. કરણુંમાં જણાવતો કે. “ કોઈને ત્યાં રહેવાથી પણી એનું જ

મન સાચવવાની ઉત્કંઠા રહે છે. ને પ્રભુભક્તિમાં જે લાવ
રહેવો જેઠાં એ લાવ પછી જતો રહેશે. માટે અમે તો
પ્રભુનાજ નોકરો કહેવાઈએ, એમને ગમે તેવું કરવા વડે
કરીને એ મહાન આત્માના નોકરી ખણ્ણવીએ છીએ. ”

સિતારવાળો એવી રીતે આપવો ઘટે એવો જવાણ
આપતો, પણ પોતાની મૂળ ઓળખાણ કોઈને આપતો નહીં.
જ્યારે એના જીવન સંબંધમાં પૂછવામાં આવતું ત્યારે કહેતો

“ મારું જીવન ધણું લેદ લયું છે તે હું કોઈને કહીશ
નહીં, તેમજ મહેરખાની કરીને કોઈએ મારા જીવનનો લેદ
પૂછવો પણ નહીં. ” એના આવા જીવાણથી એને નારાજ
કરવાને એના જીવન સંબંધી કોઈ એને પૂછતું નહીં,
જ્યાં ત્યાંથી એને લોજનનાં આમંત્રણ કરવામાં આવતાં
એ આમંત્રણને માન આપીને પોતે તેમને ત્યાં જતો પોતાના
સંગીતથી એમને પ્રસન્ન કરતો હતો. અમીરો એની આગળ
લોટણું સુકતા પણ એ પોતે માયાનો સ્વીકાર કરતો નહીં,
ને ત્યાગની મહત્તમાનું બધાને ભાન કરાવતો એ લોજનમાંજ
સંતોષ માનતો હતો. વિશાળ પાઠલીપુત્ર નગરમાં રંકથી તે
અમીર પર્યાંત દરેકને વેર આ અંધ સિતારવાળાના ગાનનાં
વળાણું થવા લાગ્યાં.

એક દિવસ સમાઈ અશોક દરખારમાં એઠા હતા. બધા
અમીર ઉમરાવો ને સરદારો પોતપોતાને યોગ્ય આસન ઉપર
એઠેલા હતા. તે અવસરે રાજકાર્યથી પરવાર્યા પછી કંઈક નવા
જુની વહીએ વંચાતી હતી. તેવામાં એક મંત્રીએ કહ્યું.

“ આહા ? મહારાજ ? હમણું થોડા દિવસથી નગરમાં એક ગવૈયો આંદ્રો છે; શું એની ગાન કળા ? હેવ ? આપણું આખું નગર એણે દિવાનું બનાવ્યું છે. ”

“ ખરી વાત છે મહારાજ ! મને તો લાગે છે કે એ કોઈ ગંધર્વ છુપાવેષમાં આંદ્રો હુશે અથવા તો એને કદાચ ઈષ હેવનું વરદાન હુશે ! નહીંતર આવું સુંદર ગાઈ શકે નહીં. એ સંગીતનો મીઠો સુર કાનમાં પેઠો કે બસ એની પાછળ એવી તો તાલાવેલી લાગે છે કે દિવ એમાંજ લુણ્ધ થઈ જાય છે. ” બીજાએ કહ્યું.

“ છતાં અફ્સેસ ? એવા સુંદર અને કળાવંત પુરુષને હુષ વિધાતાએ આંધળો બનાવ્યો છે. ”

“ આપણા નગરનો છે કે બહાર ગામથી આવેદો છે ? ” મહારાજે પૂછ્યું.

“ છે તો કોઈ પરદેશી ગરીબ.—સુકુલીસ ! છતાં ગાન કળા એની અનુપમ છે. એ ગાન શક્તિ આગળ ગંધર્વોપણ અવશ્ય હારી જાય. ” પ્રધાને કહ્યું.

“ અરે ! હારી ગયા એમજ કહેણી ! નહીંતર એ ગંધર્વો શામાટે માનવોની દૃષ્ટિ આગળથી અદૃશ્ય થઈ ગયા વાર ! આના સુંદર ગાનથી લજન પામીને બિચારા એતો હવે છુપાધજ ગયા ! ” એક કુવિએ કહ્યું. એના ઓલવાથી સભામાં હાસ્ય પ્રસરી રહ્યું.

રાજા હસ્ત્યો “શું એવું એનું સુંદર ગાન છે? તો આપણે પણ એને અહીયાં સંગીત કરાવવાને બોલાવીએ. ”

“ આપ એક વખત એના સુખમાંથી નિકળતું મધુંડ સંગીત શ્રવણું કરશો તો આપ એને જવાજ નહીં ધો. વારંવાર એનાં ગાન સાંભળવાની આપની આતુરતા વૃદ્ધિ પામશો. ” એક સામંતે કહ્યું.

“ તો આપણે એને સારો દરમાયો આપીને નોકરીએ રાખી લેશું ” રાજાએ કહ્યું.

“ અરે! એને લેટ આપીએ છીએ એપણું ચેં લેતો નથી તો પછી નોકરી રહેવાની તો વાતજ શી? ” ખીણે સામંત બોલ્યો.

“ શું નોકરીએ રહેવા ના પાડે છે! ” રાજાએ પૂછ્યું

“ ધ્રણોજ નિર્લોલી અને ત્યાગવૃત્તિવાળો છે મહારાજ ! લોજન માત્રથીજ સંતોષમય જીવન ગાળતો એ રાતદિવસ પ્રભુની લક્ષ્ણિને ”હાને પોતાનું સંગીત છોડી મૂકે છે ” કોઈ ખીણાએ કહ્યું.

“ કીક છે આપણે પણ એ સંગીત સાંભળાશું ત્યારે. ” એમ કહીને રાજાએ પ્રતિહારીને તેડી લાવવાનો હુકમ કર્યો. રાજાનો હુકમ સાંભળી પ્રતિહારી એને બોલાવવાને ચાદ્યો ગયો.

એ આંધળો હોવાથી એને માટે ચક નંખાવ્યો, કેમકે રાજાએ હુન અંગવાળા પુરુષોનું સુખ જોતા નથી. પડામાં રાણીએને ઐસવાની સગવડ કરી ત્યાંતો સતારવાળો આવી

પહોંચ્યો. રાજની નજરે ન પડવા દેતાં એને પ્રતિહારી એની બેસવાની જગ્યાએ લઈ ગયો. ત્યાં એને બેસાણ્યો.

હવે ગંધર્વોની સંગીત લક્ષ્મીનો નિરસ્કાર કરનાર આ અંધસતારવાગાને ગાવાનો હુકમ થયો, હજરો માણુસ સલામાં વિદ્યમાન છતા કંકરી પડે તો અંલગાય એવી શાંતિ હતી. હજરો નેત્રો એ સતારવાગાના શરીર તરફ ચાંદેલાં હતાં.

સતારવાળો જે સમયની રાહ જેતો હતા તે સમય અત્યારે આવી પહોંચ્યો હતો. જેને માટે એણે આઠ આઠલો પરિશ્રમ સહન કરી મહેનત ઉઠાવી હતી, તે વિષમ પરિક્ષાની અત્યારે કસોટી થવાની હતી. આજનો દિવસ એને મન ધણો મહૃત્વનો હતો. ક્ષણું પછી શું થવાનું છે એની આખી સલામાં કેાઇને પણું અથર નહોતી, છતાં સતારવાળો પોતાનું ધ્યેય સમજતો હતો. જેથી તે પોતાની ઉચ્ચમાં ઉચ્ચ ગાયન કળા અજમાવી મહારાજને પ્રસન્ન કરવાનો ઈરાદો રાખતો હતો. અથતન એને હાથ હતો ઇલ તો દૈવાધિન હતું.

સતારવાગાએ તૈયાર થઈ ક્ષણવારમાં સર્વાની અજયભી વચ્ચે પ્રભુભક્તિમાં વધારો થાય એવા સંગીતના સૂરો છાડી મૂક્યા.

દાદરો. માઠ લૈરવી.

હે જીવન સ્વામી, પ્રતિહિને, તુજ સામે ઉલો રહું:

હે જીવનેથર, કર જોડી, તુજ સામે ઉલો રહું; હે જીવનો નાનુ .૬૪ ગે પ્રેમાશ્રુ ભરી, તુજ સામે ઉલો રહું:

વીર વીર જપી એકાંતે, પ્રભુ સામે ઉલો રહું; હે જીવનો

સમસ્ત જગ માનવની વચ્ચે, તુજ સામે ઉલો રહું.
 હે જગ બાંધવ રાજ રાજેશ્વર, તુજ સામે ઉલો રહું; હે જીવની
 ભવરણુના આ કર્મ કિનારે, તુજ સામે ઉલો રહું.
 આ લાવમાં મમ કાજ પુર થતાં, તુજ સામે ઉલો રહું;
 હે જીવની

પોતાની કેટલી કાળ હતી તે સતારવાળાએ ઉપરના
 ગાનમાં અચી નાખી. પ્રભુ લક્ષ્મિનું રસ લયું એ શાંત રસ
 પૂર્ણ ગાન અત્યારે અદ્ભૂત હતું. સકળ સલા આ ગાનમાં
 લુંઘ હતી. ગાનારે પોતાની ગાન શક્તિથી સમર્થ વીર
 ઝૂદ્ધયોમાં પણ પ્રભુ લક્ષ્મિનો રસ જાગૃત કર્યો હતો. પોતાને
 આંખો હુત તો જેઠ શક્ત કે મોરદીથી મુંઘ થયેલો સર્વ
 એક ચિત્તે ડેલ્યા કરતો નેમ બીજું લાન ભૂલી જાય છે,
 સંગીતના તાનમાં લુંઘ થયેલું હરણીયું નેમ જંગલમાંથી
 એંચાઈને નગરમાં આવે છે, તેવોજ રીતે બધી સલા એના
 ગાન ઉપર શીદા હતી-મુંઘ હતી. ખુદ સમાડ અશોકવર્ધન
 પણ એ કંઠની માધુર્યતા ઉપર, ગાવાની શાલી ઉપર એને
 ગાનના પ્રભુ લક્ષ્મિથી લરેલા ઉંચ લાવ પર મુંઘ થયા
 હતા. મોટા પુરુષોની-સમર્થ પુરુષોની પ્રસન્નતા કે શુસ્તો
 વ્યર્થ જતાં નથી, મહારાજે તરતજ પ્રસન્નતા પૂર્વક સતારવા-
 ણાને વરદાન માગવા કહ્યું.

એનો મનોરથ હુવે પૂર્ણ થવાની તૈયારીમાં હતો. એમ
 એને ક્રાંતું. રાજાનું વરદાન સાંકળી સતારવાળો બોધ્યો.

આર્થ ગીતિ.

“ પ્રભાગ પ્રતાપી નરપતિ, મૈર્યાવંશના આદ્ય પુરુષ રાજે,
ચંદ્રગુમ પૃથ્વીપતિ, બિંહસાર પછી અશોક શ્રી ગાને;
પિતુ આજાને પામી, લોચન જેણે અર્પણ કરી દીધાં,
કુણ્ણાલ આજે આવી, પિતા પાસે કાકિણી માણે. ”

વરદાનમાં કુણ્ણાલે પોતાના વંશનું વર્ણન કરતાં કાકિણીની
માણણી કરી. તે સાંસાળીને મહારાજા અશોક એકદમ ચમકી
ઉછ્યો અને ઓહ્યો. “ ઓહા ! તું તોણ કુણ્ણાલ ? ”

“ હા પિતાજી ? તમારી આજાનો લેણ જોઈને જે
પોતે અંધ થયો હતો એજ આ કુણ્ણાલ ! ” સતારવાળે
પોતાની ઓગાખ આપી.

રાજાએ સફ્રાળા ઉડીને પડ્દો હુર કરી નાખ્યો. પોતાના
પુત્રને જોઈ ઓગાખીને આંખમાંથી અશ્રુ પાડતાં એને પોતાના
ઓગામાં જેસાડી સ્નેહપૂર્વક કહ્યું. “ આહા પુત્ર ! એ ખધું
કેમ બની ગયું તે કાંઈ સમજતું નથી. મેં તો કૃતા તને અખ્યાસ
કરવાને લખ્યું હતું છતાં હુદ્દેવે મોટો અનર્થ કરી નાખ્યો ! ”
આ ઘટના જોઈ આખી સભા આશ્ર્વર્ય પામી ગાઈ. કયાં
એક સામાન્ય અંધ ગવૈયો ને કયાં ચુવરાજ કુણ્ણાલ. આહા !
શું વિધિની ઘટના !

પિતાના વચન સાંસાળી કુણ્ણાલ સમજ્યો. કે “ પિતાને
કૃયાંથી ખખર હોય કે એ મારી અપર માતા તિષ્યરક્ષિતાનું
કાવતું હતું ! ખરે ! પણ મારે અત્યારે એ વાત કરવી નહીં.

પણ મારે મારું કામ કાઢી લેવું. એનો મનોરથ નિષ્ઠળ થશે તો એ જીવતાં સુવાજેવી છે. પછી એને મારવાવડે કરીને શું ! ”

“ પિતાજી ! બનનાર ઘટના અની ગઈ. એમાં હવે હર્ષ શોક શું ? જેવું મારું લાગ્ય. ”

“ હા ! રાત દિવસ એ ભૂલનો મને પચ્ચાતાપ થાય છે. અરે ! એનું પ્રાયશ્ક્રિત શું કરે ? ” જોલ ! પુત્ર ! તારું હું શું પ્રિય કરે ? ”

“ ખાપાજી ! મેં આપની પાસે વરદાન માણ્યું છે તે કાકિણી આપો ? એટલે ણસ છે ? ” કુણાલે કહ્યું.

“ હે વત્સ ! હું પ્રસન્ન થયો છું તો કાંઈ સારું માણીલે. એક કાકિણીમાં તે શું માણ્યું ? ” રાજાએ કાકિણીનો અર્થ ન સમજવાથી કહ્યું.

“ હેવ ! ખુબરાંજે કાંઈ સ્વદ્ધા માણ્યું નથી. એમણે જેટલું આપની પાસે છે એ બધુંચ્ય માગી લીધું છે ? ” મંગ્રીએ કહ્યું.

“ એટલે શું રાજ્ય માણ્યું છે એણે ? ” રાજાએ પૂછ્યું.

“ હા હેવ, કાકિણી એ રાજ્યપુત્રોનું રાજ્ય કહેવાય ! ” મંગ્રીએ ખુલાસો કર્યો.

દિકરા, તું રાજ્યને શું કરીશ ? કારણ કે તને રાજ્ય મળે તો પણ તું ચક્કુ રહીત હોવાથી એ રાજ્ય થીજાને સ્વાધીન થવાનું. મેં તો તને પ્રથમથીજ રાજ્ય આપવાનો નિશ્ચય કર્યો હતો, પણ હુંવે મારો એ મનોરથ નિષ્ઠળ કર્યો. ” રાજાએ ઐદ પામતાં કહ્યું.

“ પિતાજ ! એદ ન કરશો. હું આપને એક વધામણી આપું છું કે મારે પુત્ર થયો છે. તે રાજ્ય કરશો ! ” કુણુલે શાંકનું સમાધાન કર્યું.

“ શું તારે પુત્ર થયો ! કયારે થયો દિકરા ! હું પામતાં રાજાએ કહ્યું.

“ પિતાજ ! ‘ સંપ્રતિ ’ હુમણાંજ થયો છે. ”

“ શું હુમણાં ! ”

“ હા. ”

“ અત્યારે તે કયાં છે દિકરા ? ”

“ આપે આપેલા મારા ગામમાં. ”

ઓને દિવસે રાજાએ તરતજ ઘોડેસ્વારો સહીત મંત્રી-એને એ બાલકુમારને તેડવાને મોકલ્યા. ને તેમની સાથે થાડા દિવસમાં બાલકુમાર શરત્ કુમારી, સુનંદા, ચંદા વગેરે પરિવાર આવી પહોંચ્યો. રાજાએ ધામધૂમથી બાલકુમારનો પ્રવેશ મહેત્સવ કર્યો ને એનું નામપણ ‘ સંપ્રતિ ’ ઉપરથી ‘ સંપ્રતિ ’ જ કાયમ રાખ્યું.

દશ દિવસ વિલાળાદ મહારાજ અશોકવર્ધને સ્તન પાન કરતા એ બાળકુમાર ‘ સંપ્રતિ ’ ને મહેત્સવપૂર્વક તાજ નશીન કર્યો. ધણા કાળે સુનંદાની હૈયાની ઉમેદ એવી રીતે પરિપૂર્ણ થઈ.



પ્રકરણ ૨૨ મું.

ખેંચાખેંચ.

“આહા ! આતો અણુધાર્યું બની ગયું ! અરરર ! ભુંડી થઈ ! હૈવે મારી આશાનો કીલ્લો જડમુળથી ઉષેડી નાંદ્યો ; ને રાજ્ય લોલની ખાતર કુણાલની આંખો ફોડાવી મારા પુત્રને મેં તાજ અપાંગું. છતાં જુઓ તો ખરા હૈવની શું રમત છે ! આપણી ધારેલી આશાઓ એ હૃદ ધૂળધાર્ણી કરી નાખે છે. એક કાંઠો ફૂર કર્યો તો વળી આજે ખીલો કુટી નીકળ્યો. અરે ! મહારાજે તો એને રાજ્યપણું આપી હીધું હુવે એને રાજ્યબ્રાહ્મણી રીતે કરી શકાય ? આ હુનીયામાંથી એ રવાને થાય તોજ આપણું કામ થાય ! ” ઈત્યાદિક વિચાર કરતી એક મુંદર રમણી પોતાના આદીશાન ભુવનમાં ઉદાસ ચહેરે પલંગ ઉપર પડી હતી. આજે એની ચિંતાનો પાર નહોંતો. કોઈ રીતે એને સુખ નહોંતું જેથી આવા સુશકેલીના સમયમાં કોઈની સલાહ તો લેવીજ જોઇએ. એણે નંદનાચાર્ય પાસે જવાનો વિચાર કર્યો. પણ વળી એને વિચાર થયો કે એ દૃપલુણ સાધુ તો પોતાનો આશક બન્યો હતો. કેટલીક વખત એને હાથ તાલી આપીને પોતાનું શિયલ બચાંગું હતું. એવા એક બ્યાલિચારી પુરુષ પાસે જવાને એનો પગ ભારે થયો હતો. જો પોતે પોતાનું શિયલ એને આપે અને પોતાનો હૈયાનો માનિતો બનાવે તોજ એ સાધુ એનું કામ કરે તેમ હતું. શું

શિયલનો ભાંગ કરવો એ મને પરવડે કે ? કહિ નહીં. એની કા મણું ભરી આંખો અને એના ચૈનચાળા એ અધા તો તૌખાડ છે. પણ ત્યારે શું એ હુણે બધો ઘાણું બગાડયો હતો કે ! ને કામ કરી શકે છે એજ બગાડી શકે છે. એક દિવસ એણે કહેલું કે તમાડં કામ મેં સિદ્ધ કર્યું છે તે જટ હવે પાર પડી જશે.

મને ખખર નહીં કે એની આવી કાળી દાનત હશે, આ તો પાછળથી માલુમ પડયું. એ સુવો તે દિવસે બોલતો હતો તે અધું વ્યંગમાં બોલતો હતો. એ હવે સમજય છે, પોતાના કામમાં નિષ્કળ જવાથી એણે તો ઘાણું નહીં બગાડયો હોય. માટે એ સંબંધી એની સાથે વાતનો ખુલાસો તો કરવો જોઈએ. જોઈએ તો ખરા કે એ શું ખુલાસો આપે છે. એ જાણ્યા પર્થી આગળ શું કરવું એની કાંઈક સમજ પડશે. ”

તરતજ એ કૃપડાં પહેરીને સજજ થઈ ગઈ. કદ્વયાણી નામની પોતાની દાસીને લઈને તે રથમાં બેસીને ઓધમંહિર તરફ રવાને થઈ ગઈ.

નંદન આચાર્ય પણ પોતાની મનોસુધિમાં નિષ્કળ જવાથી તિષ્યરક્ષિતા ઉપર શુસ્તસે થયો હતો. હનીયાનું સુંદરમાં સુંદર ગણ્યાતું આ સૌંદર્ય એક વખતે પણ પોતાના ઉપલોગમાં ન આવે એ ખરીત એને મન અતિ હુઃખદાયક હતું. એ વારંવાર ખાનગી રીતે તિષ્યરક્ષિતાને તેડાવતો. પણ એ સુંદરી ચેતી ગયેલી હોવાથી હવે એના પાશમાં આવતી નહીં જેથી

નંદન નાશી પાસ થયો હતો. ખીજુ કથી ચુક્તિથી એ રમણીને પોતાની કરવી. એ માટે તે અનેક કહેણનાચો કરતો. પણ એ હવાઈ વિચારો એના હવામાં જ મળી જતા હતા. કોઈ દિવસ લીક્ષા લેવાને જ્હાને તે તિષ્ઠરક્ષિતાના મહેદમાં આવતો, પણ તિષ્ઠરક્ષિતા એને દ્વરથી નેતાંજ પોતે આધી પાછી થઈ જતી ને દાસી માર્ક્ઝે એને લિક્ષા અપાવી પાછો વાગતી. પ્રસંગે એની નજરે ચડતી તો સાવધાનતા પૂર્વક એણે પૂછેલા પ્રોનો-ના જવાય આપીને ઉડાવતી હતી. ઓટી આશા આપી વિદ્યાય કરી દેતી હતી. એ વર્ષોની આગ એના હૈયામાં ધૂંધવાયા કરતી હેવાથી એણે પણ જર એને નિકાલ કરી દેવાનો વિચાર કર્યો. “ હવે ઇકત એકવારજ પ્રસંગ મેળવી તિષ્ઠરક્ષિતાની મુલાકાત લેવી એ શું કહે છે તે સાંસળવું. જે મારી માગણી સ્વીકારે તો તો ડીક છે નહીંતર પછી કોઈ ઉપાયે એને સપડાવી દેવી. બાગાતકારે પણ એના મધુરા યૌવનનો સ્વાદ તો ચાખવો ! બસ ઇકત એકજવાર મારા લોગમાં એ આવે તો થયું. હું એને પૂછી નેહિશ. ‘ ઓસ્સો સુંદર સ્વી ? ઇકત એકજ વગત મારું મન રાખ ! ને તારા આ મધુરા અતુપમ અલેલા યૌવનનો સ્વાદ ચાખાડ ? કે કંથાં હીર્ઘાંગથી લાગેલી મારા હૈયાની તાલાવેલી કાંઈક નરમ પડે-શાંત થાય ! ’ મારી પ્રાર્થના એ સ્વીકારશે તો તો ડીક છે નહીંતર પછી....” એમ વિચારતાંજ એની આંખોના લાંબા ચઢી ગયાં. શરીર કોધના જુસસાથી કંપવા લાગ્યું. અગિનના તણુંખા ખરતા હોય એમ આંખમાંથી અગિનની જવાગાચો ખરવા લાગ્યી. ચહેરો ખીઠા-

મહેણુ થઈ ગયો. એણે હૃદયમાં કંઈક અપૂર્વ નિશ્ચય કર્યો. “ નહિંતર હું એને જાનથી મારી નામીશ. પછી ભલે એ સઆદ અશોકની માનિતી હોય ? તેથી શુ ? અશોક ભલે મને ફાંસીને માંચડે લટકાવે પણ એક વખત તો ને મને નાસીપાસ કરશે તો અવશ્ય હું એની અખર લઈશ. પણ હવે એને મળવું કેવી રીતે ? એજ મોટી પંચાત છે. અહોઅં ગો-લાવતાં આવતી નથી. લીક્ષાને નિમિત્તે રાજમહેલમાં જાઉ છું તો મને જોતાંજ આધી પાછી થઈ જય છે. અથવા તો કદાચ મળે તોપણ ત્યાં ખુલાસાથી વાત કરવાનો પ્રસંગ પ્રાપ્ત થતો નથી. કેમકે દાસીએ આસપાસ બધે કુર્તીજ હોય. કોઈ રીતે એનું દ્યાન પહોંચ્યું નહીં જેથી કોઈ અનુઝુગ સમયની નંદન રાહુ જોવા લાગ્યો.

કુલોડ સમય એ સ્થાતિમાં પસાર થઈ ગયો. નેતે દરમિયાન ઉપર પ્રમાણેની ઘટના પાટલીપુત્રમાં જની ગઈ. દેશોદેશમાં સંપ્રતિને રાજ્યપ્રાસિની વાત જાહેર થઈ ગઈ. પાટલીપુત્રમાં તો આ અપૂર્વ ઘટનાથી સર્વેના મનમાં અતિ આચ્છર્ય થયું હતું. નંદન આચાર્યે પણ આ વાત સાંભળી હતી. જેથી તિખ્યરક્ષિતા ઉપર કુટકે પણો જાણી પોતે પણ હૈયામાં ઘણો ખુશી થયો.

આ ઘટના અન્યા પછી નંદનને લાગ્યું કે “ હવે કદાચ એ સ્વાર્થી ઓરત પાછી કરીને કંઈ પણ પૂછવાને પોતાની પાસે આવે તો આવે ! હવે તો ને કદાચ આવે તો પહેલાં એના યૌવનનો ખહાર લઈ પછીજ એનું કામ કરવાની કણુ-

લાત આપું, એ તો હુનીયામાં સીધી અંગળીયે તે થી નિકળતું હશે ? કોઈ કંઈ કોઈના ઉપર ઉપકાર કરી હેતું નથી. આ સ્વાર્થી જગતમાં તો સ્વાર્થ માટેજ ખંડી મારા મારી થાય છે. પોતાને જે સ્વાર્થ હોય તો પગે પડતા આવે અન્યથા તો કોની કેને પડી હોય. તો પછી આપણે પણ દાવ આવે તો જોગઠી મારવા જરાય ચુકુવું નહીં. એવી વિચાર નુષ્ઠિમાં નંદન વિહાર કરતો હતો. એવામાં દાખીએ આવીને નંદન આચાર્યને પગે લાગી સમાચાર આપ્યા કે “મહારાણી તિષ્યરક્ષિતા આપને દર્શને પધારે છે.”

તિષ્યરક્ષિતાનું નામ સાંસારી નંદનના કાનો ચમકયા. “એ સ્વાર્થી ઓારત પાછી આવી તો ખરી ! જેણું તો સહીકે એ હવે કંઈ મતલબ મારી પાસેથી સાધવા ઈચ્છે છે !” તે નિશ્ચિંતમને એ રમણીના આવવાની રાહ જેતો બેઠો એટલામાં તિષ્યરક્ષિતા આવી પહોંચ્યી. કદ્યાણીને ખારણા નજીક એસાડી સાવધપણે તિષ્યરક્ષિતા અંદર આવી મહારાજને નમી “મહારાજ ! શાતામાં છોને ?”

“આવો તિષ્યરક્ષિતા ! આજે ધણે દિવસે કંઈ રસ્તો તો નથી ભૂલ્યાંને ?” નંદને ઠંડો આવકાર આપ્યો.

“ના ! ના ! ખાસ ચાલી ચલાવીને આપને દર્શને આવી છું, કંઈક આપને પૂછવા આવી છું.” તિષ્યરક્ષિતા-એ એ ઠંડો આવકારનું આમંત્રણું સ્વીકારતાં કહ્યું.

“બેસો ! ખુશીથી તમે પૂછી શકો છો. મારે યોગ્ય કામ કરમાવી શકો છો.”

“ ગુરુવર ! આપણી ધારણા બધી ધ્રગ્મણી ગઈ. જેથું ને ? ” રાણીએ શરૂઆત કરી.

“ કઈ ધારણા વાર ! ” અજાણ્યો થઈને સાધુ ઓછ્યો.

“ શું એટલીવારમાં તમે ભૂલી ગયા કે ? આંગ્રે ઝોડાવી એક પીડા પતાવી તો વળી ભીજુ પાછી ઉલ્લિ થઈ ! મહારાજે તો પેલા આંધગાના હિકરાને રાજ્ય પણ આપી દીધું. ”

“ એથી શું ? મહારાજે એમાં ઓદું શું કચું છે ? એ બધું મારી મરણથી થયું છે. ” સાધુ મર્મમા ઓછ્યો.

“ એટલે ! તમારી મરણ કેમ ! મહારાજ ? મહેંદ્ર તો તમારો હિકરો કહેવાય ! તમારા હિકરાના હિતમાં તમારે તત્પર રહેવું જોઈએ. ”

“ મહેંદ્ર મારો હિકરો ! છટ ? શું તું મને મીડાં મીડાં વચ્ચનથી છણવા આવી છે. ” તિથ્યરક્ષિતા ! હેંશીયાર ! હું એક વખત તારા વચ્ચનમાં લોલાઈ ગયો હુવે નહીં ? મહેંદ્ર તો અશોકનો હિકરો ! એમાં મારે શું ? ” સાધુએ તિથ્યરક્ષિતાના કાન ચમકાવ્યા.

“ તમારે કેમ શું ? એની કાળજી તો તમારેજ રાખવી પડશો. એ સંપ્રતિને રાજ્ય મહારાજે કેમ આપ્યું હુશે તે તમે જાણો છો કે ? ”

“ એમાં જાણવું”તું શું વળી ! મેં તમને કહ્યું નહીં રાખીજી ! કે મારી મરણથી એ બધું બન્યું છે. આજસુધી ભવિષ્યના પડદામાં કુપાયેલું તેજ આજે પ્રગટ થયું છે.

“ પણ શા મારે તમારે આમ કરવું પડે છે. તે જણાવશો જરી ? ”

“ તમારી બેવક્ષાઇની શિક્ષા કરવા મારે ? મેં તમારું આમ કરી હીથું. તમારા શાખ્ય સારુ મોટું પરિવત્તન કરાવ્યું, છતાં રાણીલુ ! તમે મારી કદર તો આવીજ કરી ! અરે એક વખત પણ તમે..... ” સાધુ આગામ ભાલતો અટકી ગયો.

“ તો શું આટલો બધો હદ્થી પણ વધારે તમારા હૃદયમાં મારે મારે પ્રેમ ઉલ્લાસ રહ્યો છે યુદ્ધા ! તમે સાધુ થયા, તમારે તો પરોપકાર એનેજ તમારું જીવન બનાવવું જોઈએ ?

“ તો શું ત્યારે સ્વીએ પણ પરોપકાર ન કરી શકે વારુ ? પારકાના હૃદયનું હુઃખ હુરકરવું એ શું પરોપકાર ન કહેવાય ?

“ પણ એ કરતાં સ્વીએને શિયલ બહાલું હોય છે. વળી તમે જાણો છો કે કદાચ મહારાજ જાણે તો તમારી ને મારી જીવતાંજ ચામડી ઉત્તરાવે કે બીજું કંઈ ?

“ તે તમારો ખાલી જ્યાલ છે. રાજ્યકારભારમાં દુલેલા મહારાજને શી પરવા છે કે તમે કયાં પડ્યાં છો ! અને શું કરો છો ? જુએની ‘કુણાલ આંધળો થયો એ તમારી વાત વર્ણનાં વર્ણો વહી ગયાં છતાં કોઈ પણ જાણી શક્યું છે ? ’

“ પણ મારા કરતાંથી સુંદર કોઈ મારી દાસી તમારી પાસે મોકલું તો ? મારા કરતાં તે તમારી અધિક સેવા કરશે. જે મારાથી નહીં જે તે એ તમને આપશે. ”

“ દાસી તે દાખી ! મીકું કદિ સાકરની બરાખરી કરવા

ભય એ બની શકે કે ? કીડી કુચારે પણ કુંજરથી હરીકાઈ કરી શકે છે ? રાણીલુ ! આજ વર્ષો થયાં તમારા વિયોગથી હું જુરી રહ્યો છું તમારા વિના મારા અંતરમાં કોણ જણે કે શું થાય છે; છતાં તમે તો તમારો સ્વાર્થ સર્યો એટલે વૈદ વેરોજ ? ”

“ હીક એતો, પણ હવે તો તમારે એક કામ કરવું પડશે સમજયા ? ”

“ અને તે કામ ? ”

“ આ મંપ્રતિનો રસ્તો સારુ કરવાનું ! ચાહે તો કેઝ ઉપાય ખતાવો અથવા તો તમે પોતેજ એ માથે વ્યો ? ”

“ એ મારાથી નહીં બની શકે ! મહારાણીલુ ! ”

“ હું કહું છું કે તમારે અનાવવું જ પડશે શું કહો છો ! ”

“ તમે કાંઈ મારાં સ્વી નથી કે મને આવી રીતે હુકમ કરી શકો ? ”

“ શું ત્યારે તમે ના પાડવા છઢો છો ? ”

“ હુા ! એક રીતે તમારું કામ કરું ? અને તે તમે મારાં થાવ એ રીતે ? ”

“ કોણું હું ? ” રાણી કંઈક ગર્ભ પામતી ઓલી.

“ હુા ? તમે ? ”

“ હીક છે. આપણું કાર્ય સત્વર સિદ્ધ થશે પછી તમે કહેશો એમ હું કરીશ પછી કાંઈ ? ”

“ રાણીલુ ? હજુ પણ શું તમે વાગ્નણ ચલાવી રહ્યાં છો. તમારા વચ્ચન ઉપર મને ભર્સો નથી. ”

“ હું તમને વચન આપું તો ? આટલીવાર કરીને ખાતરી કરી જુઓ ? ”

“ પણ એવા વચનનું શું કામ છે. આવેને અત્યારે જુઓ કેવી એકાંત છે—શાંત છે. પછી તમારું કામ હું સત્ત્વર કરી દઈશ. ”

“ અત્યારે તો ન બને ? એવું ખાનગી કામ તો રાતના ઢીક પડે ? ને તેથી વળી એકાંતે ! ”

“ તો ભલે એકાંતે ! મારી કયાં ના છે ! તમે કહો ત્યાં સેવક સેવામાં તૈયાર છે. ”

“ શું તમારી એજ ઇચ્છા છે ત્યારે ? ”

“ હા ? તે સિવાય બીજે કોઈ રસ્તો નથી. તમે મારું મન નહીં મનાવો ત્યાં લગ્ની હું કંઈ પણું કરવાનો નથી. સારું થયું કે તમે આવી ગયાં નહીંતર હું તો એટલો બધો શુસ્તે થઈ ગયો હતો કે તમારી વાત મહારાજને કહી નાણત ! તમને એ શુન્હાની નગ્રીયત કરાવત ! ”

રાણી એ સાંભળીને વિચારમાં પડી. “ ઢીક છે. ત્યારે પાટલીપુત્રની બહાર ગંગાના તટ ઉપર વૃક્ષોની આડીમાં જરૂર થઈ ગયેલું પેલું બુદ્ધ બાગવાનનું મંદિર છે. ત્યાં પહોરરાતના મારી રાહ જોજો. હું લગભગ પહોર રાત વીત્યાબાદ આવીશ. મધ્યરાત્રી સુધીમાં તો અવક્ષ્ય આવીશ ? ” રાણીએ જણાયું અને તો પછી ત્યાંથી કલ્યાણીને લઇને ચાલી ગઈ.



પ્રકરણ ૨ ત મું.

કાળીરાતે.

પ્રહુર રાત્રી લગભગ વહી ગઈ હોવાથી જગત અત્યારે ઘણું ખરું શાંતિમાં આરામ લેતું હતું. પ્રવતીમય પાટલીપુત્ર શહેર આખા દિવસની ધમાચકડીથી થાકીને શાંતિનો સ્વાદ ચાખી રહ્યું હતું. છતાં કવચિત કવચિત મનુષ્યનો અવરજન હુણું જણું હતો. એવા સમયમાં રાજમહેલના છુપા દ્વારમાંથી એ સ્વીચ્છા નિકળી. એકનો વેષ અદ્ભુત હતો. જ્યારે બીજુનો સામાન્ય; છતાં બન્ને સરળી ઉમરની ને એકજ ધારની હતી. એ બન્નેનો આકાર એવો તો લગભગ મળતો હતો કે બન્નેમાંથી એકને એગળી કાઢવી એ અશક્ય હતું. પેલી સામાન્ય જણું અતુર સ્વીચ્છે બીજુ સુંદર વસ્ત્રાભૂષણોથી સુસજજીત સ્વીને અધો પાડ શીખવ્યો હતો. અત્યારે એ પોતે દાસી બની ગઈ હતી. દાસીને પોતાનો પહેરવેશ આપીને પોતા સમાન બનાવી હતી. હરખાને કાર્ય સાધવું એ એનો મંત્ર હતો. એના મનમાં દદ ખાતરી હુતી કે એ સાધુ કોઈપણ મંત્ર તંત્ર વડે કરીને પોતાનું કાર્ય સિદ્ધ કરી આપશો. માટે કોઈપણ રીતે અંધકારનો લાભ લઈ એને છળવાનો એણે વિચાર કર્યો હતો. જેથી એ સામાન્ય જણું સ્વીચ્છે આ યુક્તિ શોધી કાઢી હતી. એ સામાન્ય સ્વી તે અશોકની પદૃરાણી તિષ્ઠરક્ષિતા હતી. બીજુ

એની એક દાસી હતી. પોતાનાજ સરખા આકારવાળી દાસીને બધો પાડ સમજની પોતાનો પાડ લભવવાનું કાર્ય એને સોંઘ્યું હતું. અત્યારે એ પ્રપંચ નાટકનો પાડ લભવવાને આ બન્ને સ્ત્રીઓ વેશ બદલીને નગર બહાર ગંગાના તટ તરફ ચાલી.

તેઓ ચાલતી ચાલતી એક વૃક્ષની ઘટા પાસે આવીને અટકી એને ત્યાંથી આસ્તેથી એ જાડેની ઘટામાં થઈ એક શુણ્ણ મંદિર પાસે આવી પહોંચી. એમની પછવાડે એક પ્રચંડકાય પુરુષ પાછળ થયો. આવી માઝમ રાતે નગરની બહાર આ એ સ્ત્રીએને એકાકી ચાલી જતી નોઈ એને કંઈક આશ્ર્ય થયું ! એ કયાં જાય છે નોઉં તો ખરો, એમ ધારી એ પણ એ સ્ત્રીએ ન જાણ્ણી શકે એમ પાછળ થયો. અંધારી મીણ જેવી રાત્રી જગત ઉપર જામી રહી હતી, અત્યારે સર્વે નિદ્રાના વશમાં શાંતિ અનુભાવતાં છિતાં એવા પણ જતુઓ જગતમાં ગમે તે કાળે વિદ્યમાન હોય છે કે એમને દિવસે તો શું પણ રાત્રેય શાંતિ હોતી નથી.

છુપાવેશ ધારી પુરુષે એ સ્ત્રીએને ઓળખવાને ખૂબું મહેનત કરી પણ વ્યર્થ એ કોણું છે તે એના જાણુવામાં આવ્યું નહિ. પણ એટલું તો જાણ્ણી શક્યો કે એ સારા કુળની સ્ત્રીએ હતી. ત્યારે આવી મધ્યરાતે તે આવા એકાંતમાં કયાં જતી હુશે એ એના મગજમાં શાંકા ઉદ્ભસ્તી. “ શું જરી વિજારી રમવાને તો નહી જતી હોય ! ” પ્રણયની આગ હૃદયમાં એવી તીવ્ર હોય છે કે એનાથી અંધ થયેલ પુરુષ કે સ્ત્રી એને એમાંજ એકાશ ચિત્ત હોય છે. તે સિવાય બીજું કંઈ એને સુઅતું નથી. હૃદયમાં એ કામદેવના મંત્રનું સમરણ કરતાં દિવસ કે

રાત કંઈ જેતાં નથી. જે સ્વીએ દિવસે કાગડાને દેખીને ભય પામે છે એવી સ્વીએ રાતે નર્મદા તરી જય છે. કીયોના હૃદયનો પાર કોઈ પામ્યું છે ? આહા ? જુએ તો ખરા કેવી રીતે નિર્ભયપણે તે પેકા જરૂર મંહિર તરફ ચાલી જય છે. એ અખગા નારી કેટલી સખગા છે તેનો આ પ્રત્યક્ષ દાખલોજ ખસ છે. બિચારો એનો પતિ તો કયાંય નિરામાં વોરતો હુશે. લોકોમાં કહેવાય છે કે મીઠામાં મીઠી ચીજ વિષય રસ છે તેનો આ સાક્ષાત નમુનો ?

વળી લોકમાં પણ એવી કિંવહંતિ પણ સંભગાય છે કે—

આલા ગાલાને વર્પાડાળ, સ્વી ચરિત્રને રોતાં બાળ,
તની જે કોઈ પરિક્ષા કરે, સહદેવ જોશી પાણી ભરે.

આકાશમાં શું છે ? એ શી વસ્તુ છે ? કેવું વિશાળ છે ?
વગેરેની તેમજ ગર્ભમાં રહેલો બાળક પુત્ર હુશે કે પુત્રી તેમજ
એ કેવો થશે. વર્પા કયારે વરસશે, તેમજ સ્વીએનાં હૃદય અને
બાળકેનું રહલું એ કોઈ જાણી શકે છે ? અદ્યપણુદ્ધિવાળા
મનુષ્યો આ પાંચ વાતોનો પાર પામી શકતા નથી.

આહા, સારા કુદુંખની સ્વીએ પણ વિષયને વશ થઇને
ચામના સ્વાદની ખાતર કેવી નીચ પ્રવૃત્તિ કરે છે—નારીવિ-
નારી રમે છે. સ્વી એકની સાથે રમે છે. બીજાની સાથે વાત
કરતી હોય ત્યારે ત્રીજા સામું જોઈને હુસે. એના હૈયામાં
વળી કોઈ બીજોજ પુરુષ હોય. પતિલક્તી સતીએ તો જગતમાં
થાડીજ હોય બાકી તો એમનાં અંદરનાં ચારિત્ર તો જે જાણુતું
હોય એજ બાણે !

આશ્ર્ય તો એ છે કે વ્યલિચારના સ્વાદમાં મસ્ત થયેલી રમણી ઉપરથી તો હુનિયાને ઠગવાને એટલો ખંડો આડંખર કરે છે કે જાણે સતીયોભાઈનું તે પોતેજ શ્રેષ્ઠતાની પદવી ન પ્રાપ્ત કરતી હોય. પોતાના પતિ આગળ તેમજ ખીંચ પ્રસંગમાં આવતા અન્ય પુરુષો સાથે એવી રીતે વર્તે છે કે એઓ સંમને કે “વાહ શું સતી છે ?” આપણી સાથે તો વાત પણ કરતી નથી. પરપુરુષનું મોંહ જેતાં પણ શરમાય છે. તો હસવાની કે ઐલવાની તો વાતજ ક્યાં ? પરન્તુ એ બિચારા લોગાઓને ઠગનારી એ નારીના હુશ્વરિત્રોની એને કયાંથી ખખરહોય કે તારી આગળ સતીને ડોગ કરનારી કુળવંતી સ્વી પોતાના ઘ્યારાને મળવાને પોતાના કુદુંખીઓથી કેવી : ગુંત રીતે હાથતાલી આપી છટકી જાય છે.” અસ્તુ. મારે પણ આ કુટિલ કામિનીયાનું ચારિત્ર જોવું તો જોઈએ કે ડોગ આશક એમની રાહ જીબે છે ? એ પ્રમાણે વિચારતો એ પુરુષ પોતાનાં હથીયાર સંલાગતો વૃક્ષની ઘરામાં એમની પછવાડે અહૃશ્ય થઈ ગયો.

જીર્ણમંદિરમાં નંદન આશ્વાર્ય કયારનેય આવીને આવનાર મેમાનની રાહ જોઈ રહ્યો હતો. પોતાના આવ્યા પછી કેટલોક સમય પસાર થઈ ગયો હતો. છતાં કોઈના કદમ આ તરફ હળુ લગણુ તો લંખાયાં નહોતા, જેથી એ આશા-તુર હૈયું સ્નેહમૂર્ત્તિના આવવાના માર્ગ તરફ આંખો ઝાડી ઝાડીને જોઈ રહ્યું હતું. આખરે એ સમય આવી પહોંચ્યો, ને નજીકમાં ખડખડાટ થતાં એના કાન ચમક્યા. મંદિરની ખહારજ એટલા ઉપર એ અંધારી રાતે ઉલો હતો. ને પેલી એ

સ્ત્રીએ આવી કે એક સી ને આગળ હતી એણે તરતજ મહા-
રાજ સાધુની પાસે આવીને એમનું કંડું પકડયું. આસ્તેથી
ઓલી. “ આપ રાહ જોઈને થાકી ગયા હશો ! ચાલો હુવે
અંદર ? ” તિથ્યરક્ષિતા જ ઓલતી હોય એવો એ સ્વર હતો.

“ તમારી સાથે આ કોણ છે. મહારાખુણીજુ ? ” સાધુએ
કામદેવના તોક્ષાનથી કંપતાં કંપતાં કહ્યું. આવનાર રમણીએ
જેવો એના હાથ ઉપર હાથ નાખ્યો કે એનાં ગાત્રો શિથિલ
થઈ ગયાં, શરીર પગ્નીનાથી તરફોળ થઇ ગયું. મહા મહેનતે
તે ઓલી શકતો હોય એમ જણાયું. પુણ્યધન્વાચે આવી
એકાંત સ્થિતિનો લાલ લઇ એને પૂરેપૂરો પોતાની જગમાં
ક્રસાંયો હતો.

“ એ તો મારી દાસી છે. મારી વિશ્વાસુ છે. એની દ્રિકર
તમારે કરવી નહીં. જેવી મારે શ્યામા હતી તેવીજ મારી
પ્રાણ સખી છે. ” એ રમણીનો ઉદ્દેશ કોઈ પણ રીતે પોતાના
લોણે પોતાની શેડાખુણીનો હેતુ પાર પાડવાનો હતો.

કામથી ઘેલો થયેલો નંદન ઓદ્યો. “ એમ ! તમારી
દાસી છે ? ઠીક ત્યારે લલે એ ઉલ્લિ ઉલ્લિ બગાસાં ખાય ને
આપણે આ મંદમંદ વાતી શિતલ લહેરોનો અનુભવ કરીયે ? ”
એમ કહી પોતાના હાથ એની કમર આસપાસ વિંટાજ્યા
અને એના ગોરા ગોરા ગાલ ઉપર એક મધુડં ચુંખન કર્યું.

“ અંહુ ! અહીયાં આ શું કરો છો ? મારી દાસી જુએ
છે તે બેતા નથી. અંદર ચાલોને પછી હું તમારીજ છું ના ? ”
ધીરેથી એ રમણી ઓલી.

“ ટીક અંદર ચાલો ? ” સોયથી લેહી ન શાકાય એવા અંધકારમાં એ બન્ને આશકમાશુક દિવસના પરિચિત ખંડી-ચેરમાં અદશ્ય થઈ ગયાં. પેલી દાસી જેવી જણુતી રમણી એમના ગયા પદ્ધી જીજુ મંદિરના ઓટલા ઉપર આવી સાવધાનતાપૂર્વક પોતાનું ખંડર સંભાળી, મંદિરના ખારણુંની અંદર છુપાતી એક બાળુના ઝુણુમાં એમના આગમનની માર્ગપ્રતિક્ષા કરતી એડી.

પેલો ત્રીજે પુરુષ છુપાઇને એમની ચેપ્ટા જેતો હતો. એને હૂરથી આ કૃત્યની કંઈક ગંધ આવી હતી. એને લાગ્યું કે પોતે જે ધારણા કરી હતી તે તદ્વન સત્ય પડી હતી. વ્યલિચાર ચામરસના શોખમાં આ કુલવંતી સ્વીએ કોઈ પુરુષને હૃદયદાન આપ્યું હતું. તે પદ્ધી એ બન્ને અંદર ચાલ્યાં ગયાં એટલે તે પણ આ જગ્યાનો પરિચિત હોવાથી એક વૃક્ષ ઉપર ચડીને મંદિરના ઉપરના લાગ ઉપર થઈને આસ્તેથી તે ફરતો ફરતો કોઈ ન જાણે તેમ નીચે શૂન્ય જગ્યામાં ઉત્તર્યો, જ્યાં પેલાં એ સ્વીપુરુષ શુપચુપ પ્રેમરસની વાતો કરતાં એક ધીજામાં મળી ગયાં હતાં ત્યાં આવી પહોંચ્યો. અંધકાર છતાં એમની પાપ કીડાની એને આત્રી થધી, પણ એ હૂર ઉલો રહ્યો. એમની ચેષ્ટાને જોતો એમને શિક્ષા કરવાને એણે તલવારપર હાથ નાખ્યો. પણ વળી વચ્ચાર થયો, જગતમાં ; એવા કેટલાએ જુવો વિષયમાં દુષેલા છે. હું કેટલાને મારી નાખીશ. એમના પિશાચીકર્મનું ફ્રલ એ પોતેજ લોગવો.

કેટલીકવારે જ્યારે એમણે પોતાની એ રતિકિયા પૂર્ણ

કરો. એટલે પેલા સાધુનું હૈયું કંઈક શાંત થયું. પરસેવાથી શરીર લીનિદ ગયું ને પરિશ્રમથી તે અર્ધ ભૂત જેવો થઈ ગયો. હતો, લ્યારપઠી એનું ચિત્ર કંઈક સ્વસ્થ થતાં જે વાત પ્રથમ કામાંધપળામાં એ ન સમજી શક્યો તે અચ્યારે એને સમજાઈ “શું આ તિષ્યરક્ષિતા હશે કે ? એણે મને ઠગ્યો તો નથીને ?” વિચાર કરતાં એના સ્વરમાં એને કંઈક એની નકલ માલૂમ પડી. એણે એની સાથે ધીમે ધીમે વાતો કરવા માંડી. પણ એ ખી કંઈ બોલી નહીં, પણ એણે છેઢાં કહ્યું કે “ હવે હું જાંખું મારી દાસી કયારનીય રાહ જેતી હશે . ”

“ હવે કયારે આપનાં દર્શન થશો ! ” ફરીને એના સ્વરની પરિક્ષા કરવાને પૂછયું.

“ જ્યારે તમારી મરજ હશે ત્યારે ! ” એ રમણીએ દુંકમાં પતાવ્યું.

ખી જેમ બને તેમ એની પાસેથી જવાને દર્શાતી હતી. પણ આ બૌદ્ધ લિઙ્ગુક એને બાહુપાશમાં લઈને પડેલો તે છોડે એમ નહોંતું. એની શાંકા મજબુત થવા લાગી. એના શરીર ઉપર એ હાથ ફેરવવા લાગ્યો. એને ખાતરી થઈ કે “ આ તિષ્યરક્ષિતા નથી. તિષ્યરક્ષિતાએ નકદી મને ઠગ્યો છે. અંધકારનો લાલ લઈ એણે પોતાને બદલે એનાજ જેવી ખીજી ખીને અડાવી દીધી છે. મને લાગે છે કે પેલી દાસી જેવી જણ્ણાતી ખી એજ નકદી તિષ્યરક્ષિતા હોવી જોઈએ. જે મારી ધારણા સત્ય હોય તો એને પણ મારે નકદી આજે લોગવવી

નોંધુએ. આવો વખત કરી કરીને હાથ આવશે નહીં. પણ એક વખત આની તપાસ કરી લેવી નોંધુએ. ” એમ વિચારી એહું સત્યાસત્યની તપાસ કરવા માંડી.

◆◆◆◆◆ પ્રકરણ ૨૪ મું.

પરિણામ.

“ હું છોડોની ! ” પેદી સ્વી ગુસ્સે થતી ઓલી.

“ છોડું ! તું કોણું છે એ પ્રથમ મને કહે પણી ! ”
સાધુ ઓદ્યો.

સાધુની વાણી સાંભળીને પેદી સ્વી ચમકી. “ અરરર ! સત્યાનાશ ! શિયલ વેવવા છતાંપણું લેદ તો કુટી ગયો. ” છતાં ધીરજ ધરીને ઓલી. “ તમે ગાંડા તો નથી થયાને મહા રાજ ? તમે રાત દિવસ જેને જાંખી રહ્યા છો તે હું ? મેં આજે તમારું હૈયું ડાયું છે તેવું મારું પણ ડારને ? ”

“ શું તું તિષ્ઠરક્ષિતા છે કે ? ”

“ તમે નામ ન ઓદ્યો ? રાત અંધારી છતાં લીંતને પણ કાન છોય છે. કોઈ સાંભળી જરો ? ”

“ લલે સાંભળી જાય ? તું સત્ય કહે કે તું કોણું છે ? ”

તમે કહ્યું તે વળી ખીણું કોણું છોય ? મારા સિવાય ખીણને તમારી મહન તૃપ્તા શાંત કરવાની શી પડી છોય ? ”

તિષ્ઠરક્ષિતાનું નામ સાંભળીને પેલો એમની ચેષ્ટા જનારો પુરુષ ચમક્યો. એની રગેરગમાં કોધની જવાળા પ્રગટી. કોધથી કંપતા એણે પોતાના અધર કરજ્યા. અનેક વિકારો એના શરીર ઉપર પસાર થતા ગયા. પણ અંધકાર હોવાથી કેછિ એ ભાવો દેખી શક્યું નહીં. વારંવાર તલવાર ઉપર હાથ જતો ને પાછો પડતો. એ સમજી ગયો કે પોતાનીજ માનિતી તિષ્ઠરક્ષિતાનું આ કૃત્ય હતું. પુરુષ તે બૌધ સાધુ નંદનચા-
ચાર્ય હતો. આહા જેને પોતે પૂજન્ય શુરૂ તરીકે માનતો. રાજ
દરખારમાં એનું કેટલું સંન્માન સાચવતો તે આવો વ્યલિ-
ચારી ? હૈવ ? હૈવ ? ને તે વળી મારાજ ધરમાં મારી પદૃરાણી
સાથ ! અનેક વિચારો કરનાર એ છુપાપોશાકમાં છુપાયેલો
વીરપુરુષ અશોકવર્ધન પોતે હતો. રાતના અંધાર પછેડો
એઢી નગરચચર્ચા જેવા નિકળેલો, તેની અચાનક આ બન્ને
સ્વીચ્છા ઉપર દાષ્ટિ પડતાં કુતુહલ જેવાની ખાતર એમની
પાછળ પડેલો, હાલમાં શુદ્ધ રીતે આ પિશાચાની પશુકિડા
જેતો ઉલો હતો.

બન્નેની રકજકમાં એને ખખર પડી કે તિષ્ઠરક્ષિતા
આ સાધુડાની સાથે ઝુટેલ હશે, પણ વળી જન્યાં સુધી સત્ય
શું છે ? તિષ્ઠરક્ષિતા આ પોતે જ છે કે બીજુ કોઈ ગોઠવાઈ
ગઈ છે તે જાણુવું જેધીએ. એમ ધારી એમની રકજક સાંભળતો
ગુપચુપ ઉલો રહ્યો.

“ શી પડી હોય ? લુચ્ચી ! જોકું બોલે છે. હું જાણી
ગયો છું કે તિષ્ઠરક્ષિતા તું નથી. બોલ સાચું બોલે છે કે

નહી ? ” ધીમે સાહે પણ જુસસાથી એલતો એ બલિષ્ટ
ઔધસાધુ એને મારવા લાગ્યો.

“ હા ! હા ! મને મારો માં ? હું સાચું જ કહું છું.
મહારાજ ? ”

“ રાંડ ? હજુ એઠું એલે છે; જ્યાંસુધી સાચું નહી
કહે ત્યાં લગ્યી હું તને છોડું તેમનથી, સમજુ ? જનથી મારી
નાખીશ. તારો સ્વરજ કહી આપે છે કે તું તિષ્યરક્ષિતા નથી.”

“ એ તમારી બ્રમણું છે ! મારો સ્વર જરા બદલાઈ
ગયો છે તેથી તમને એમ લાગતું હશે. ”

“ આહા ? હજુય સાચું એલતી નથી, એલ ? એલે
છે કે ગળું દખાવી મારી નાખું ? હજુ સમય છે સલ્ય કહી હે ?
તારી સાથે આવેલી પેલી કોણું છે અને તું કોણું છે ? ”

એમની આ રકજકમાં પ્રચૃષ્ટજ્ઞપણે ઉલેલા રાજને મળ
પડતી હતી. એણે જેચું કે, “ અહીને અહીં એ પિશાચ્યાની
પશુકિડાનું પાપ પ્રગટ થયું હતું. એને લાગ્યું કે કંઈક
નવાજુની થશે. આ કલેશનું મૂળ સાર્દં તો નજ આવે ? પણ
મારે બચાવવાને—કોઈને મદદ કરવાને વચ્ચમાં પડવું કે નહી.
એજ માત્ર સ્વાલ હતો. ટીક છે પરિણામ તો જેવાદે કે આવા
કૃત્યોમાંથી વિધાતા શું પરિણામ ઉત્પત્ત કરવાને ધારે છે
વાર ? ” એમ વિચારી તેમનું તોક્કાન જેતો ઉલો.

“ તમારા સોગન ખાઈને કહું છું કે હું એજ છું. હાથ
કુરવો જરી એજ આ વઢન ? એજ આ વખાલુષપણું ? એજ

આ રૂપરંગ ! તમે નશીખદાર તો પૂરા કે તમારી છચ્છા પૂર્ણ
કરવાની મને કુણુદ્ધિ સુણ ? એક તો મેં તમને મારા પ્રાણ-
વદ્વલ કર્યા છતાં ઉપરથી આ શિરપાવ ! વાહ ! ”

“ ટીક છે. તું તિખ્યરક્ષિતાજ છે તો ચાલ અહાર, ચંદ્ર
હવે ઉગ્યો હુશે તેના પ્રકાશથી ખાતરી થઈ જશે.” એમ
ઓલી એનું ખાવડું પકડી અહાર ઘસડી.

પેલો ગુસ પુરુષ એમના પાપનું પરિણામ જોવા એમના માર્ગમાંથી અટ ખુણામાં ભરાઈ ગયો. એટલે આ બન્ને જણાં બહાર નિકળ્યાં, ચંદ્રના ઉલસમાં સાધુએ ધારી ધારીને એને જોઈ એટલે ખાતરી થઈ કે આ તિથ્યરક્ષિતા નથી. “ રંડા ? મને ઠગે છે ? ” એમ જોલતાં એક અડખોત લગાડી એને નીચે પટકી. પેલીએ ચીસ પાડી એટલામાં ત્યાં છુપાયેલી દાસી જેવી જણાતી સ્ક્રી સઘળું સમજુ ગઈ. તરતજ એ બહાર નીકળી આગળ ધર્સી આવી. “ અરે ? અરે ? મહારાજ ! આ શું કરેં છે ? મારી શેડાણીને શામાટે હેરાન કરેં છે ? ”

સાધુ પેલી સામાન્ય સ્વીનો અવાજ સાંખળી એના તરફ
કૃયો. “ શું આ તારી શેઠાણી છે ત્યારે તું કોણું છે ? ” નંદને
એને ચંદ્રના પ્રકાશમાં ધારી ધારીને જોઈ.

“ અમે તો દાસી માણુસ ? તમે :આવી રીતે અમારી શેડાણીને હેરાન કરશો તો ફરી આવશે નહી સમજ્યા ? ”
પેલી દાસી કરડાકીથી બોલી.

“તું દાસી છે ? ભલે દાસી હો ? આવ મારી પાસે ?

મારા દિલની આગ બુઝવ ? ” નંદન ખેડી સ્વીને છોડી દાખી જેવી જણુતી સ્વીની પાસે આવ્યો.

“ હું હું ? એટલેજ ? તમે આવા મોટા માણુસ થઈ અમારા જેવી નીચ દાખી ઉપર નજર બગાડો છો ? જરા શરમાવ ? ”

“ એથી શું ! પુરુષ તો ગમે તે સ્વીને લોગવી શકે ? પછી ભલે તે રાજની રાણી હોય કે એક ગરીબ લિખારણુ ? ”

“ જે મારું દાખીનું તમારે કામ હતું તો પછી રાણીનું શા માટે બ્રહ્મ કર્યા, ! તમારે દાખીનું કામ હોય તો કાલે દાખી આવશે પછી કંધ ! ”

“ કાલે નહીં પણ આજેજ ? સમજુ ? મારે તો તારેજ કામ છે બીજુનું નહીં ? ”

“ ઢીક તો ભલે પણ અત્યારે તો તે નહીંજ બને, સમય અધિક થઈ ગયો છે. ઘરે મહારાણીની બધાં રાહુ જોતાં હશે. માટે અત્યારે તો અમે જરૂરશું. ચાલો મહારાણીજ ? ” જેમ બને તેમ દાખી જેવી જણુતી આ સ્વી અર્હાંથી હવે છટકવા માગતી હતી.

“ જય છે તે કયાં જહુનમમાં ? ભલાધથી કહું છું છતાં સમજતી નથી. મારી મરજ સાચવ્યા વગર તારાથી એક ડગલું પણ આગળ નહીં ભરી શકાય સમજુ ? ”

“ હવે મરની મુવા ? મને સતાવીને તું સાર નહીં કાઢે ? દાખી છું તેથી સહન કરું છું નહીંતર તો તારાં ખાવડાં પણ

પીખી નાખું સમજયો ? ચાલો બાઇજુ ? ઉઠો અટ ! ” એ
સ્વીચ્છે પોતાનું પોત ધીરે ધીરે પ્રકાશવા માંડયું. નીચે પડેલી
સ્વીચ્છે ઉલા થઈ પોતાનાં વસ્ત્રાભૂષણું અંઘેરી આગળ
ચાલવા માંડયું.

“એમ છે ! મારા પંજામાંથી તું છટકી જવા માગો છે !
એ દાસી ? શું તું દાસી છે. હુચ્ચી ? ”

“ દાસી નહી તો કોણું વળી ? તેથી તો તારાં કડવાં
વેણું સાંભળી રહી છું. ”

“ મેં તને ઓળખી છે તુંજ તિખ્યરક્ષિતા છે. છતાં આ
દાસીને તારાં કપડાં આભૂષણું પહેરાવી એને તિખ્યરક્ષિતા અ-
નાવી છે. ને તું દાસી બની છે. સમજ ! હવે તું મારા હૃથ-
માંથી છટકવા પ્રયત્ન ન કરીશ. મારી મરળને આધીન થા ? ”
નંદન વાતનું સ્પષ્ટીકરણું કરતો આગળ ઝુરી વખ્યો ને
અન્નેને અટકાવ્યાં.

તિખ્યરક્ષિતાએ જણયું કે લેદ બધો કુટી ગયો હતો.
છતાં જીવને લોગે શિયલ સાચવવું એ એનો દદ નિશ્ચય હતો.
એને લાગ્યું કે “ હવે સહેને આ પાપમાંથી મુક્તા થવાય એ-
મતો નથી. કરેલા પાપોનું પ્રાયશ્ચિત કરવાનો સમય આવી
પહોંચ્યો છે. કાલે સવારે આ હુકીકત મહારાજના જણવામાં
આવશે. વર્ષોનાં દખાયેલાં જૂનાં પડ તાણાં થશે. ઐર ! જે બને
તે અર્દ પણ એક પાપ તો કર્યું. શિયલનો લાંગ કરી બીજું
પાપ તો અવશ્ય નહીજ કર્ય ! ”

“ કેમ શું વિચારમાં પડી ગઈ. રાણીજી ? ચાલ ! ફરીને આપણે આ મંદિરમાં જઈએ ! પછી ખુશીથી તું તારે ઘેર જા ! ” વિષયનો લાલચું નંદન બોલ્યો.

“ જ સુવા ! આ તિષ્યરક્ષિતાએ તારા માટે આઠલી સગવડ સાચવી છતાં એનો આ બદલો ! તો સમજ કે તિષ્યરક્ષિતાનું જીવન તો મહારાજ અશોકને માટે છે. ”

“ અશોકને માટે છે. ટીક છે જેણ છું કે અશોકને માટે છે કે આ તિષ્યરક્ષિતા અત્યારે મારે માટે છે. ” એમ બોલતો નંદન એની ઉપર ધસ્યો.

પોતાની ઉપર ધરી આવતો જેઈ કમરમાંથી તરતજ છુપાવેલું ખંજર જેંચી કાઢી હવામાં ફુરકાવતી તિષ્યરક્ષિતા ગાળ ઉઠી. “ ખણરદાર ? નર પિશાચ ! ”

પાણીદાર ખંજર ચંદ્રની ચાંદનીમાં ચમકતું જેઈ નંદન એકદમ પાછો હઠ્યો. શુસસાથી ફુકડતો કોધથી કંપવા લાગ્યો. “ ખંજરથી ડરાવે છે ? ” તે બોલ્યો.

“ સુવા જાલીમ ! ક્ષત્રીયાણીએના હાથનો સ્વાદ તે ચાંચ્યો નથી. તિષ્યરક્ષિતાના શિયલ સામે આંખ કરવાની પણ તૈની તાકાત છે નરપિશાચ ? ”

“ મારી ! તિષ્યરક્ષિતા મારી ? સાચવી રાખજે તું તારે શિયલ ? ” એમ કહેતો તે એકદમ કુદ્ધો અને તિષ્યરક્ષિતાનું કાંકુ પકડી લીધું. જીને હાથે ખંજર જેંચવા માંડયું. તિષ્યરક્ષિતાએ પણ બળથી પોતાનો હાથ છોડાવવાનો પ્રયત્ન કર્યો. ખંનેની

હેંશાતોંશી વધી ગઈ. તિષ્યરક્ષિતાએ બગપૂર્વક એક મુડી એના મેં ઉપર મારી. નંદને એક ધક્કો મારી એને નીચે નાખી દીધી. ને ખંજર એના હાથમાંથી હુર ઝેંકી દીધું. એને નીચે પટકી જેવો એને હેરાન કરવા જાય છે. એટલામાં પેલી સ્વીએ જોરથી એની છાતીમાં એવી તો લાત મારી કે તે હુર પડ્યો, સમય કટાકટીનો હતો જેથી તરતજ સાવધ થઈ પેલી ખીજુણી સ્વી તરફ ધસ્યો એને પટકીને એની ઉપર ચઢી એઠો. ત્યાં તો તિષ્યરક્ષિતા સફ્ફાળી ઉડી પેલું ખંજર ઉડાવી. એકદમ એ નરપિશાચ ઉપર ધર્સી ગઈ. પેડુમાં એવી તો બગપૂર્વક લાત મારી કે તે નીચે પટકાયો. એના કોધનો પાર નહોતો. સાક્ષાત ચાંડિકા સમાન હાથમાં ખંજરથી શોખતી તે લયંકર સ્વી શુસ્સામાં તે શું કરતી હતી એનું ભાન એ ભૂલી ગઈ હતી. “હુષ રાક્ષસ! હવે તારો કાળ આવ્યો છે એમ સમજ?” કોધથી બોલતી ડ્ર મુર્ત્તિને ધારણુ કરનારી તિષ્યરક્ષિતાએ પેલો નંદન જેવો ઉડીને એના ઉપર ધર્સી જાય છે ત્યાં તો એકદમ એની ઉપર ધર્સી જઈ એના પેટમાં પેલું તીક્ષ્ણ ધારવાળું વાંકડીયું ખંજર પધરાવી દીધું. ને આંતરડાં બહાર એંચી કાઢ્યાં. ધા એવો સખત હતો કે નંદન અદ્ય સમયમાંજ તરફડતો શરીર છાડીને વિદ્યાય થઈ ગયો. થોડી વારે તિષ્યરક્ષિતાનો કોધ શાંત થયો. એટલે બન્ને સ્વીએ જેમ આવી હતી તેમ એ શખને જંગલી પણુ પંખીના શિકારને માટે રખડતું મુડી ત્યાંથી પોતાને ઠેકાણે જવા અદ્યશ્ય થઈ ગઈ. પેલો ગુર્તિ પુરૂષ સાગ્રાદ અશોક પણ અનેક પ્રકારના સંકદ્ય કરતો એમની પછવાડે

ચાહ્યો ગયો. “ આહા ? સારું થયું કે મારે પ્રત્યક્ષન થવું પડયું. તિષ્ઠરક્ષિતાએ પોતાની આખરું સાચવી છે, પણ આટલું અધું કરવાનું એને કારણ શું ? ”



પ્રકૃતાણ ર્ઘ મું.

પત્રાતાપ.

ભીજે દિવસે પ્રભાતના તિષ્ઠરક્ષિતા વહેલી ઉડી તો ખરી, પણ એને આજે યેચેની વધારે હતી. પ્રતિક્ષણે પોતાની શુંત વાત કુટવાનો લય રહ્યા કરતો હતો. એ જૈદ્ધસાધુના ગુમ થઈ જવાની ખરી પડી કે તરતજ શોધ ખોગ થવાની; અને એને અંતે જે મદહું હાથ લાગ્યું તો એના ખુનની તપાસ રાન્યે માર્ક્યતે અવસ્થય થશે. અરરર ? ત્યારે શું પરિણામ આવશે, એનો વિચાર કરતાં એનું હૈયું ધડકતું હતું. એને દાચી ઉપર શાંકા આવી રહેને મહારાજ આગામ મારો બધો ભરમ ઝોડી નાખે ! ઝડકત આ દાચી મારો ભરમ જાળે છે જેથી પ્રગત થવાનો અય રહે છે, તો એ લેદ હમેશને માટે અદ્રશ્ય રહે એ સારું આ દાચીને અહીંયાંથી મોતાની મુસાફરીએ મોકલી હોય તો હીક ? એક ગયો તો બીજું ને પણ રવાને કરી દેવી. એમાંજ ધજજતની સલામતી છે. માટે એ કામ હમણુંને હમણુંજ કરી નાખવું જોઈએ, નહીંતર આજેજ પોગાળ કુટી જવાનું છે.” એમ વિચારતી તે એકરૂમ સાવધ થઈગઈ. એની આંખ

ખીજું ખુન કરવાને ચમકી રહી. કોધથી શરીર કંપવા લાગ્યું
તરતજ ખંજર લઈને દાસી સુતી હતી ત્યાં આવી. આસ્તેથી
નેથું તો દાસી રાત્રીના પરિશ્રમથી થાકેલી હોવાથી ઘોર
નિંદામાં હતી. હજુ સૂર્યોદય થવાને પણ ચોડી વાર હતી. નેથી
ખેદે શાંતિ હતી, આસ્તેથી ક્ષાર ખંધ કરી એની પાસે આવી
પોતાનું ખંજર તૈયાર કર્યું, પોતે શું કરે છે એનું પણ એને લાન
નહોતું, એણે તરતજ જુસ્સામાં ને જુસ્સામાં ખંજર એના ઉદ-
રમાં એવા તો ખગપૂર્વક ધૂસાડી દીધું કે એક શાખ પણ એ દાસી
નતો બોલી શકી નતો ચીસ પાડી શકી ? નિંદામાં ને નિંદામાં
જ એ આ લોકમાંથી વિદાય થધ ગઈ. એને એમને એમ છોડી
તે પોતાનું ખંજર ઉચ્કી સાંકે કરી ત્યાંથી જેવી પાછી કરે છે
ત્યાં તો આશ્વર્ય ? ભારણ્યામાં એક પ્રચંડકાય પુરુષ એનું પાપ-
કૃત્ય નેતો ઉસો હતો. એને નેઈને એ હેખતાઈ ગય. એના પગ
થંલાઈ ગયા. શરીર પરંસેવાથી તરણોણ થયું. આએ અંધારાં
આવવા લાગ્યાં. પૃથ્વી જણે દૂરતી હોય એમ હેખાયું. એને
થયું કે જો જમીન માર્ગ આપે તો એના ભૂગર્ભમાં આ મા-
ણુસથી બચવાને છુપાઈ જાઉ ! જે લયની ખાતર એણે આ
ખુનનું પાપ કર્યું હતું તે લય એણે સામે ઉલેલો નોયો.
શું કરવું એ એને કંઈ સૂઝ્યું નહીં.

ભારણ્યામાં ઉલેલો એ મહાન્ પુરુષ ભારત સાત્રાદ
અશોક હતો. રાત્રીના બ્યાધમંહિર આગળનું હુદ્ધકૃત્ય એણે ન-
જરે નિહાજ્યું હતું. પાછળથી એ પણ રાજગઢમાં આવી પ-

હોયેલો, પરન્તુ જે ભૂલ એ સ્વીચ્છાએ કરી હતી તે ભૂલ એણે તરતજ સુધારી લીધી. પોતે તરતજ એક પોતાના વિશ્વાસુ માણુસને જગાડી એળે એ મંદિરની નિશાની આપી શાખની વ્યવસ્થા કરવા અને કાંઈપણ નામ નિશાની ન રહે એ રીતે સાઝે કરવા એને મોકલી દીધો હતો. તે મજ એ વાર્તા શુસ્ત રાખવાને પણ એને સમજાવવામાં આવ્યું હતું. તે પછી એ સુતો પણ એટલા બધા વિચારમાં ચઢ્યો કે નિદ્રાએ એને પોતાના પાશમાં લીધો નહીં. હજુ સવાર થવાને થોડીવાર હતી એટલામાં તિષ્યરક્ષિતા પાસે ખુલાસો કરવાને એ અધિરો થયેલો તરતજ ત્યાં આવ્યો. તિષ્યા પોતાના શયનગૃહમાં ન હોવાથી રાજને કૈતુક થયું. કોઈને પૂછિયા વગર પ્રથમ એ શુસ્ત તપાસ કરવા લાગ્યો. પેલી સાથે રહેલી દાસીને પણ એ જાણતો હોવાથી એના સુવાના ઓરડામાં આવ્યો. કે કેથી એમણી ખાનગી વાતો સાંભળવાનું બની શકે ? પરન્તુ અહીંયાં તો અખુદારીજ ઘટના બની ગઈ. તે ઘટના નિહાળતો આસ્તેથી દ્વાર ઓલી ત્યાં ઉલો રહ્યો. દ્વાર તરફાં તિષ્યાની પીઠ હોવાથી સમાદ્દરું આગમન તે જાણી શકી નહીં. પણ પોતાનું કાર્ય પૂર્ણ થતાંજ એની નજર ત્યાં પડી કે તરતજ મહારાજને જોતાં ચીસ પાડતી બેલાન બની સુર્ચિદૃત થઇ ગઈ.

એની ચીસ સાંભળીને આંખુગાળુથી દાસીએ હોડી આવી. પણ ઉમરામાં મહારાજને ઉસેલા જોઈ બહાર અટકી ગઈ. મહારાજના હુકમથી દાસીએ એને એના શયનગૃહમાં લઈ જઈને પલંગ ઉપર સુવાડી, પેલું બંજર મહારાજને લઈ

દીધું. દાસીઓને ખરાબર એની તપાસ રાખવાનું કહીને ચાહ્યા ગયા. દાસીના શબ્દનીપણ તરતજ વ્યવસ્થા કરાવી નાખવાનું ભૂલ્યા નહોતા.

જ્યારે સુચર્છામાંથી તિખ્યરક્ષિતા જાગી. ત્યારે તે પોતાના શથનગૃહમાં પલંગ ઉપર પડી હતી. અનેક પ્રકારના સંકદ્પો એના મનમાં થવા લાગ્યા. એની આજુખાજુ દાસીઓ એની સારવારમાં એઠી હતી તે એણીએ નેઇ. એને ખધું નવું નવું જણાયું. પોતાનું એંજર આમતેમ તપાસવા લાગી, પણ કયાંય દેખાયું નહીં. દાસીને પૂછતાં ખખર પડી કે એ તો મહારાજ લઈ ગયા છે. “ અરરર ! મહારાજ પુછશો તો હું શું જવાબ આપીશ. કરવા ગઈ સીધું ને ખધું અવળું પડી ગયું. ” દિવસ ઘણોં ચડી ગયો હતો છતાં એને ઉઠવાનું મન નંદાતું થતું. “ એણે ધાર્યું કે સર્વેચી સહેલો ઉપાય માત્ર એક છે કે ” જે રસ્તે બૈધ સાધુ ગયો. જે રસ્તે દાસી ગઈ ત્યાં પોતાને પણ જવું તે સિવાય બીજો ડેઈ રસ્તો નથી. જો હું નહીં મરીશ તો મહારાજ મારશો. અરરર ? મેં ધણુંજ અધમ કૃત્ય કર્યું. ખરાબ કૃત્ય કરનારના આખરે જે હાલ હુલાલ થાય છે તેવી આજે મારી સ્થીતિ થઈ. એક પાપ કર્યું એટલે એને છુપાવવા બીજું પાપ જીવને કરવું પડે છે, ઉત્તરોત્તર પાપમાં ને પાપમાં કુણી જઈ હુર્ગતિમાં અનંતોકાલ પાપનાં ફૂલ લોગવવાને ચાદ્યો જાય છે. તો મારે હવે કરેલાં પાપોનું પ્રાયશ્ચિત અવશ્ય કરવું નોઇએ. ! મનમાં એ પ્રમાણે નિશ્ચય કરીને એણે સર્વે દાસીઓને રજા આપી ને જણાયું કે “ મને આરામની જરૂર

એ હવે મને સારું છે માટે મારી ચિંતા કરશો નહીં, પણ તમે જાઓ તો નિરાંતે નિંદા લઉં ? ”

“ આપને છોડીને ભણાર જવાનો કે તમને ભણાર જવા દેવાનો મહારાજનો હુકમ નથી, છતાં અમે ભણાર દરવાજા પાસે એઠાં ઈચ્છા આપ સુગેઠી શયન કરો ! ” દાસીએ એમ કહીને ભણાર બેડી. એક દાસી મહારાજને એના સમાચાર આપવાને દોડી. આ તરફ તિષ્યાએ ખારણું બંધ કરી હીધું.

થોડીવારમાં મહારાજ આવી પહોંચ્યા. આહુ ! એક દિવસમાં એક સ્વામી કેટલા બનાવો બની ગયા; પણ એનું રહસ્ય એના જાણવામાં નહીં આવવાથી મહારાજનું મન જિન્હે થયું હતું. એને બૌધ્ધમત ઉપર તિરસ્કાર ઉત્પન્ન થયો હતો. જે ધર્મને માટે પોતે અથાગ ભક્તિભાવ રાખતો હતો. એના સ્થાને સમાન નંદનાચાર્યને ગણુંતો હતો એનું આવું હુક્કારિત જોઈ એ ધર્મમાંથી એની શ્રદ્ધા ઉડી ગઈ હતી, એના ચિત્તની સ્થીતિ અત્યારે ડામાડોળ બની હતી. તે આવ્યો પણ ખારણું બંધ હોવાથી એણે ધક્કે માયો. પણ તે અંદરથી બંધ હતું. દાસીએ ઘણું ઘણું સાદ કર્યા પણ અંદરથી જવાબ મહ્યો નહીં, જેથી એકદમ અથોકે દ્વારનું ચણીયારું ઉતારી ઉધાડી નાખ્યું તો તિષ્યાએ આપધાતની કેશિષ કરી હતી. ગળે ઝાંસો ઘાલી એ અધર લઈકી રહી. હતી, સારો તરતન એ બંધન છેહી નાખવાથી તિષ્યા નીચે પટકાઈ. તરતનો જ ઝાંસો હોવાથી તિષ્યા પુરી સાવધાન હતી..

નીચે પરકાયેલી એ પોતાની એ આંગ્રે ફ્રાડી મહારાજ જામે જોઈ રહી, મહારાજની સંશાથી દાખીએ બાકુર જતી રહી.

“ કહે ? આ દાખીનું શા માટે તેં ખુન કર્યું ? પેલો ઔધસાધુ નંદન રાત્રીના ગુમ થઈ ગયો છે એ સંબંધમાં તું કંધ જણે છે; ને કયા હું એ તું આપધાત કરની હુંહતી ? મારા મનની શાંકાનું અમાધાન કરી પછી તારે ભરવું હોય તો ખુશીથી મરજે. ” સમાટે કહ્યું.

એણે જાણ્યું કે હવે જે હક્કીકત બની ગઈ છે તે સત્ય કહી દેવામાં જ સાર હતો. પરિણામ ગમે તે આવે પણ જે હું જુણું કહ્યો શ તો મહારાજના મનનું સમાધાન થશે નહીં. વર્ષો ઉપર બની ગયેલી ઘટનાનો આજે પડ્યો ઉધડવાનો હતો. એમ એને નિર્શ્વય લાગ્યું. “ મહારાજ ? એ હુષ્ટ નંદન મારા ખંજરનો લોગ થયો. ” એમ કહીને રાતની વાત એણે મહારાજને કહી સંભળાવી.

“ ટીક તો પછી દાખીને તેં શામાટે મારી ? ” રાણએ ફરીને પૂછ્યું.

“ તમારા ભયથી ? કદાચ એ દાખી તમારી આગામ મારો લર્મ ફ્રાડી નાએ માટે એ પહેલાં જ મેં એને અહીંથી રવાને કરી હીધી. છતાં આપ્યે પાપનો ઘડો તો કુટી જ ગયો. ”

“ ટીક એ ઔધ સાધુની સાથે તારે પ્રપંચ ખેલવાનું કાંઈ કારણું ? ”

“ કારણું કે મારા પાપકાર્યમાં પ્રથમથી એ ભાગીદાર હતો. ”

“ પ્રથમથી એટલે ખ્યારથી ? કયા પાપમાં એ ભાગી-દાર હતો ? ”

“ કુણુલની આંખો ફેડાવવામાં ? ”

શું કુણુલની આંખો તારા કાવતરાથી ફેડાવવામાં આવી છે ? તે કેવી રીતે ? ”

એના જવાણમાં ઠંડે કલેને તિષ્યરક્ષિતાએ પોતે કાગ-દામાં ણિંહુ કરીને કેવી ચાલાકી ચલાવી હતી તે બધું એણે કહી સંભળાયું. રાજ કોધથી રાતોપીણો થઈ ગયો. “ અહા ? જગતમાં સાવકીમાતા જેરી નાગણુ કહી છે તે સત્ય છે અને તે તેં સાખીત કરી બતાયું : ” એમ કહી શુસ્સાથી તેણે એક લાત લગાવી.

“ એ અધમ એરત ? મને હથીયાર બનાવી તેં મારા એ લાડકવાયાની આંખો ઐવરાવી એનું તાજ હજમ કરી જવા ધાર્યું. પણ કુદરતને ત્યાં ઇન્સારું છે. પાપ કરનારા જગતમાં કોણુ ફ્રાન્યા છે. તારી સગી આંખે ને ? તારો એ મનોરથ બધો આજે કેવો વ્યર્થ થયો છે. રાજ્યનો માલેક તો હવે કુણુલનો પુત્ર સંપ્રતિ થયો છે. ”

“ મેં મારાથી બનતું કર્યું છે ક્લટો હૈવાધિન છે. ”

“ ખચીત, પાપિણી ? તેં તારાથી બનતું કર્યું છે અને હજપણુ શુવીશ તો બનતું કરીશ. આ જગતમાં હવે તારી

જરૂર નથી. રહેને વળી ક્યાંય ભીનું તોક્કાન જગાવે માટે મરવાને અટ તૈયાર થા ? પાપનું પ્રાયશ્ચિત્ત કરવાને સાવધાન થા ? ”

એમ કહી સઆદું જેવો તલવારનો ધા કરવા જય છે કે પાછળ કુણુાલ અને શરતકુમારી હાં ! હાં ! કરતાં અંદર ધર્મી આવ્યાં. “ પિતાજી ! શાંતઃથાઓ ! શાંત થાઓ ! ”

કુણુાલની બૂમ સાંશળી રાજ ચમક્કો. એણે પાછું ફરીને જોયું. “ દિકરા ? મને અટકાવ નહીં. તારી આંખો ઝોડાવનાર આ હુણા અધમ રંડા હતી. એનું ફલ આજે હું એને બરાબર આપીશ. ”

“ પિતાજી ? માઝ કરો ! આપની શૂરવીર તલવાર સ્વીરક્તાનું પાન તો નજ કરે ? આપ સમા શૂરવીરો ક્યા જીવનની ખાતર ખી હત્યા કરે ? ” કુણુાલના શબ્દોથી રાજની તલવાર અટકી ગઈ.

અંધ કુણુાલને જોઇ તિષ્યરક્ષિતાને પર્શ્વતાપમાં વધારે થયો. એણે ઉલાં થદ્ય કુણુાલ પાસે આવી. “ દિકરા ? મને જીમા કર ? મેં તારો મોટો અપરાધ કર્યો છે ! મારાજ પાપે હું તારી આંખો ચુમાવી એડો છે. એનું પ્રાયશ્ચિત્ત મને કરવા હે ? તું તારા પિતાને રોક નહીં. એમને એમની ફરજ બનવવા હે ? મને મારું ઝોડી લેવા હે ! મારી છેલ્લી પ્રાર્થના સ્વીકારી તું મારો ગંભીર ચુન્હો માઝ કર ? ”

તિષ્યરક્ષિતાની આજીજીથી કુણુાલ બોલ્યો “ માતાજી ! બનનાર બની ગયું છે. હવે તમે મરશો એથી કાંઈ મારી આંખો નવી આવશે નહીં. પ્રલુ તમને સહખુદ્વિદ્ધ આપેઅને પા-

ઇલી અવસ્થામાં પાપનું પ્રાયશ્ક્રિત કરતાં ધર્મસાધન કરે કે જેથી કરેલા હુંકર્મણનો ક્ષય થાય ? ”

“ કરેલાં પાપ ને ત્યાગી, પ્રલુભ ! આજ માગું છું :
ભમણૂં મોહની લાગી, ચરણમાં સ્થાન માગું છું :
અની પાપી ખુની હું તો, હવે એ નિંદ ત્યાગું છું :
ક્ષમા એ પાપની ઘારા, પડીને પાપ માગું છું . ”


તિષ્ઠરક્ષિતા સજાળ નથને પ્રલુબી ક્ષમા યાચવા લાગી.

“ જે ! એ મેતની મેમાન ? જે ! તારા તરફ એને
કેવો સહલાવ છે. એની સારી ખુદ્ધિનું ઇલ પણ એને મદ્દ્યું
છે. જગતમાં સારા ઓટા કૃત્યનું ઇલ અહીંને અહીંનું મળે છે.
સત્યનો જમાનો હજુ વહી ગયો નથી. જ આટલો ગુનહો તારે
માઝ કરું છું. તારાં કરેલાં કૃત્યોનાં ઇલ તુંજ લોગવ. ” એમ
કહી સારાટે તલવાર ભ્યાન કરી અને પોતે ત્યાંથી ચાદ્યો ગયો.

પ્રલાતના સમયમાંજ આ ધર્માચકડીની સુનંદાને ણણર
પહ્યાથી એ કુણાલ, શરતકુમારી વગેરેને લઈને તિષ્ઠરક્ષિતાના
મહેલમાં આવી પહોંચી હતી. ને આહીને સમયે કુણાલે તિષ્ઠ-
રક્ષિતાનું રાજની તલવારથી કેવી રીતે રક્ષણ કર્યું તે
આપણે જેયું .

મહારાજ અશોકના ગયા પછી સુનંદા શરતકુમારી કુણાલ
વગેરે પોતાની અપર માતાને ખરમાવી પોતાનાં મહેલમાં આ-
વ્યાં. તિષ્ઠરક્ષિતા પણ રાજ તરફથી માઝી મગાવાથી નિર્શ્વિંત
થઈ હતી. એક રીતે એંબધી વાત પેટમાંથી નિકળી જવાથી
એના હૃદયનો બોંજે હલકે થયો હતો. ત્યાર પછી ફરીને

એવી ભૂલો ન થાય એ મારે એણે પણ લીધું ને અન્તિમદે
પતિનું મન મનાવી કુણાલ ઉપર પોતાના સગા પુત્ર કરતાં
અધિક સ્નોહ રાખવા લાગી.



પ્રકુરણ રડ મું.

—•—
આગ્નેજ.

સમયના વહેવાની સાથે અવિષ્યના પડદા વર્તમાન
કાળમાં ઘસડાઈ આવતાં કંઈ કંઈ ઘટનાઓ પૃથ્વી ઉપર બની
નાય છે. વચ્ચમાં સુએ સમાધી કેટલાંય વર્ષો પસાર થઈ ગયાં. જે
આજકાલ નવીન કહેવાતી વાતો પણ જુની થઈ ગઈ. જેમ
જેમ કાલ જતો ગયો, તેમ તેમ સંપ્રતિ વચ્ચમાં વધવા લાગ્યો. ખાલ્યપણુમાં એ સર્વેને લાડકો હતો. તેમજ એની તેજસ્વીતા,
એ પરાક્રમ, ખચપણુમાંથીજ પ્રગટ થવાનાં ચિનહુ જણ્ણુતાં
હતાં. મંત્રીઓની સાથે મહારાજ અશોક ખાનગી વાતો
કરતા હોય તે સમયે પણ એ ખાગક લાં દાખલ થઈ અશોકના
એળામાં બેઝી જતો. અને મંત્રીઓને હુકમ કરતો “ ઉલા
થાઓ ? મહારાજ પધારે ત્યારે તમારે ઉલા થઈમાન આપવું
નોઈએ ? હું તમારો મહારાજ છું.” એની ખાગ ભાષામય
વિનોદ વાણીથી બધા હરી પડતા.

કોઈ કોઈ સમયે રાજકાજની વાતો સાંસળતાં જ્યારે
સંપ્રતિ, દાદાનું ‘સાર્વલૈમરાન્ય’ છે એમ સાંલાગતો ત્યારે એને

બહુ હઃખ થતું. અને એકદમ ઉદાસ થઈ જતો. જણે ચીડાતો. હેઠય એમ જણ્ણાતું. જ્યારે એનું કારણ એને પૂછવામાં આવતું કું—“રાજકુમાર ! આવા મોટા રાજ્યના તમે વારસ છતાં ઉદાસ કેમ જણ્ણાયો છો ? ”

ત્યારે સંપ્રતિ દાદાજીને કહેતો કે “ દાદાજી ? તમે બધું જીતીને બેચી ગયા, મારે માટે કાંઈએ જીતવાનું ન રહેવા દીધું ? ” એનાં આવાં ખાગ વાક્યોથી રાજ અને મંત્રીઓ ખાંધા મનમાં ખુશી થતા.

બાદ્યાવસ્થાનાં વિવિધ તોઝાન કરતાં સંપ્રતિ પોતાનો કાલ વ્યતીત કરતો હતો. તિષ્ણરક્ષિતા પણ હવે ઢાહી થઈ ગઈ હતી. ઘરડે ઘડપણું એ પણ પાપનું પ્રાયશ્ચિત કરતાં પોતાનો સમય વ્યતીત કરતી હતી. મહેંદ્રરાજ થાય કે સંપ્રતિ, એ બધું એને મન હવે સરખું હતું. જે સંપ્રતિ માટે એણે મોદું તોઝાન એક દિવસ જગાવ્યું હતું. આજે એમાં પરિવર્તન થઈ ગયું હતું. આજે તો સંપ્રતિ જ એની આશાનું સ્થાન હતો. એને લેઈને તે પોતાની આંખો ઢારતી હતી.

ચંદાના પ્રથત્નથી સુનંદાએ કુણાલના અંધત્વનું મૂળ કારણ શોધી કાઢ્યું હતું. અને એ કારણથી હમેશાં એને પોતાને હઃખ થતું હતું. આજે એણે ઘરડે ઘડપણું પાછી સુખની ઘડી લેઈ હતી. જે કે કુણાલ તો રાજ્યભ્રષ્ટ થયો હતો છતાં કુણાલના પુત્ર સંપ્રતિ ને રાજ્ય મળેલું લેઈ એની છાતી હર્ષથી ગજગજ ઉછળતી હતી. જે આશા ઉપર મદાર બાંધીને તે દિવસો વ્યતીત કરતી હતી તે બધું એને કૃતકૃત્ય

અર્થ આજે સફુલ થયું હતું. તે સંપ્રતિની ખરૂજ સંભાળથી કાળજી રાખતી. જો કે તિથ્યરક્ષિતા સુધરી ગઈ હતી; છતાં એના ઉપર સુનંદાને વિશ્વાસ નહોતો. કેમકે મનુષ્યમાં રહેલો જેરી સ્વભાવ લલે શાંત હોય. છતાં નિમિત્ત પામીને તે પાછો સર્તોજ થાય છે. જેથી સંપ્રતિને ક્ષણુભર પણ રેઢો મુક્તી નહીં. શરતકુમારી સુનંદા કે ચંદા ગમે તેમાંથી એક તો અવસ્થ્ય એની સાથે હોયજ ! અથવા તો એના દાદા પાસે હોય ત્યારે પણ ચંદા કે ગમે તે એની સાથે હોય. દાદાને પણ સાવડી-માતાના ભયની કાળજી વધારે રહેતી જેથી મહારાજે પણ એની દેખરેણ માટે ખરાખર બ્યાવસ્થા કરી હતી. એવી સ્થીતિમાં કેટલાંચ વર્ષો પાણીના પ્રવાહની માર્કેક વહી ગયાં. એમાં એક ઘટના એ પણ ખનેલી કે ચુસ્ત જ્ઞાનોપાસક અશોકે નંદન જેવા ધર્મસ્થંભ પુરુષનું આવું દુષ્કૃત જણયું. તેમજ કેટલાક ખીજ એવા કારણુથી એ ધર્મ ઉપરથી એની શ્રદ્ધા ઉડી ગઈ. તો પછી એ રાજ આર્થસુહસ્તિ સ્વામીના સમાગમમાં આવ્યો. ને એને જૈન ધર્મમાં રસ પડવા માંયો. પોતાના જૈન ધર્મના સ્મરણ માટે એણે ગાંધારમાં એક શિલાલેખ કેઠરાવ્યો. એમાં અગાઉ અહીં પાર્વિનાથ તીર્થંકર બોધિ સતત થયેલા છે. એમ જણાંયું છે. તેમજ તક્ષશિલામાં પણ અશોકે એક શિલાલેખ કેઠરાવ્યો. તેમાં શ્રી પાર્વિનાથનું નામ આવે છે. એવી રીતે જૈનતત્વના અદ્યાસમાં એનાં હાડમાંસ રંગાઈ ગયાં. પોતાનો કાલ અશોક સુખમાં ને શાંતિમાં નિર્ગમન કરતો હતો.

પ્રભુચારિણી ચંદ્ર પણ પોતાને યોગ્ય પતિને પ્રાપ્ત કરી સુખમાં હિવસે હ્યતીત કરતી હતી. વર્ષોના વહેવા સાથે સંપ્રતિ હુવે નવીન તાર્ઝયમાં આવ્યો—મહારાજ અશોકે એને મોટા મોટા રાજાઓની કન્યાઓ સાથે પાણિથ્રહણ કરાવ્યું.

સંપ્રતિ કુમાર મરીને હુવે સાધારણ સંપ્રતિ થયો. એણે રાજ્યકારોધાર ઉપાડી લીધ્યો. રાજ્યની વ્યવસ્થા કરી પોતે પોતાના સકલ સૈન્ય સાથે એ નવીન યૌવનમાં પ્રવેશ કરતો સંપ્રતિ હિંગ્વિજય કરવા નિકળ્યો. તે કોશલ દેશમાં ગયો, ત્યાંના રાજનું લેટણું સ્વીકારતો કાશી દેશમાં ગયો, ત્યાંથી વિહેલ દેશની મથિલા નગરીના રાજનું લેટણું સ્વીકારતો મદ દેશમાં આવ્યો. પછી માગવા તરફ કર્યો. ત્યાંથી ગુજરાત સૌરાષ્ટ્ર, બિંધ વર્ગેરેમાં આણ વત્તાવતો નાના મોટા રાજાઓનાં આમંત્રણ ને લેટ સ્વીકારતો સમસિંધવ (પંબાળ-પાંચાળ) તરફ વળ્યો.

સ્વર્ગસમા કાશીમર દેશનો અનુભવ કરતાં તે ઠેડ હિમાલયની તળેટી સુધી પહોંચી ગયો. આ તરફ અટક આગામાથી ને તે અફ્ગાનિસ્તાન તરફ ઉત્તર્યો. ધરાન, મિસર વર્ગેરે સાધતો તે આગામ ચાવ્યો. ને રાજ પોતાને મસ્તક નમાવી લેટણું આપતો તેની સેવા તે માન્ય રાખતો, અન્યથા ચુદ્ધભૂમિમાં પોતાનો ચ્યમત્કાર અતાવીને તેને પોતાનો તાજેહાર ભનાવતો.

એ ઉગતા સ્રૂયનાં કિરણો સમસ્ત એશીયામાં ફરી વળ્યાં. તે પછી ખીજ શીસ વર્ગેરે દેશો પણ દખાવ્યા. હુનિયાના ખુણે ખુણે એનું નામ ગાજ રહ્યું. પારસ, શક, યવન, પઠાણુ, સિંધ

શ્રીમત વગેરે દરેક જતોને જીતીને પોતાની તાંબેદાર ભનાવી હીધી—ખંડણી ભરતી કરી હીધી.

ભારતની અહુરના સર્વ અનાર્યદેશોને પોતાની સત્તા છેઠળ સ્થાપતો સંપ્રતિ ભારતમાં પાછા કર્યો. ભારતમાં આવીને જ્યાં જ્યાં તે નહોતો ગયો એવા દેશો તરફ ચાહ્યો. બાંધિક અને ગાંધાર દેશમાં થઈને (આ દેશો હિંદુકુશ અને સુલેમાન પર્વતની વચ્ચે આવેલા છે.) ઇરતો ઇરતો પોતાની સત્તા મનાવતો દશાર્થુદેશમાં આવ્યો (ગંગા યમુનાના લેજ વાળા પ્રદેશથી નીચેનો પ્રદેશ તે દશાર્થુદેશ) ત્યાંથી સતત જ અને યમુના વચ્ચે આવેલા પ્રસ્ત્રવર્ણ દેશમાં પોતાની આણ મનાવતો તે કુરુદેશમાં આવ્યો.

જ્યાં ચર્મણ્યવતી નહીથી ઉત્તરમાં ભત્સ્ય દેશ અને શૈદરસેન દેશ આવેલા છે. ત્યાંથી યમુનાલુ એળાંગતા ગંગા યમુનાની વચ્ચે આતર્વેહી દેશ આવેલો છે. એ ખધા દેશોનાં લેટણ્ણાં સ્વીકારતો ઉત્તર-વાયવ્યમાં કુરુ પાંચાલદેશમાં આવ્યો. સર્વ ડેકાણે એ નવો રાજ પોતાની આણ મનાવતો મગધની પૂર્વ તરફ કર્યો. અંગ, વંગ અને જૌડની હવાખાતો તે પ્રાગ-જ્યોતિષ્ય અને કામરુ પ્રદેશમાં ગયો.

ત્યાંથી પુરુદેશ, ઉત્કળ દેશ અને વત્સદેશ તેમ જ ચેહી દેશમાં પોતાની આણ મનાવતો એ રાજ હનિયાના ખુણે ખુણે કરી વહ્યો.

ભારતના લગભગ ખધા રાજાઓ સમાદૃ અશોકના સામંતો હતા. જેથી ભારતના તમામ દેશોએ તો એ નવા:

રાજાની આણ મંબુર રાખી એને જેટણાં ધર્યાં, પોતાની કુંવરીએ પરણાવી; પણ લારતના બહારના પ્રદેશો મહારાજ અશોકથી સ્વતંત્ર હતા. એ રાજાએ સાથે સાંપ્રતિ વારંવાર ચુદ્ધમાં ઉત્તરતો. શત્રુની એ ગર્વભરી ઉત્તૃત ડેડને બાતકારે નમાવતો અથવા તો પોતાની સમશોરને આધિન કરતો.

પૂર્વે થયેલા અન્નતશત્રુની માઝક એણે ત્રણુખંડ ધરતી સાધી લીધી. ડેણિકે (અન્નતશત્રુએ) જેમ ત્રણ ખંડના રાજાને જીતી પોતાના તાણેદાર બનાવ્યા હતા; તેમજ છેદ્ધા મહાન् સંપ્રતિએ ત્રણુખંડના સોળહણર રાજાને પોતાના સામંતો બનાવ્યા હતા. બધી પૃથ્વીને પોતાના પરાક્રમથી દ્વારાવતો સંપ્રતિ અન્નતશત્રુની માઝક વૈતાદ્ય પર્વત લગી પહેંચી ગયો. બધી હુનિયા ઉપર વિજય મેળવનાર મહાન् સંપ્રતિ જ્યારે વૈતાદ્યથી પાછો ફર્યો ત્યારે એની ઝડ્ધિ સમૃદ્ધિનો પાર નહોતો. વાસુદેવના જેટલી ઝડ્ધિ એણે પ્રાપ્ત કરી હુતી. પણ વાસુદેવ નહોતો. સોળે હણર અર્ધ લારતના રાજાનો (થીજે આઠ હણર રાજાનો કહ્યા છે) એ એની તાણેદારી મંબુર રાખી. ડેઢિએ રાજ્ય જવાના ભયથી તો ડેઢિએ લક્ષ્મિથી સર્વેએ ગમે તે રીતે પણ એની સેવાનો સ્વીકાર કર્યો.

વિશ્વવિજયી મહાન् સંપ્રતિ મહારાજની ચુદ્ધ સામાનીમાં પચ્ચાસ હણર હાથીએ, એક કોડ અર્ધવો, સાત કોડ સેવકો-સૈનિકો, નવકોડ રથ, આ પ્રમાણેનું એનું વિશાળ સૈન્ય જ શત્રુઓનાં હૃદયો વિદારવાને ખસ હતું.

તે સિવાય સુવર્ણ રૂપ, હીરા, માણેક, મોતી, પત્રા, નિલમ આદિ ઉત્તમ ધાતુઓનો તો પાર જ નહોતો. તો એની ગણુતરી તે શી રીતે થઈ શકે.

આવી અખૂટ સમુદ્ર અને અસંખ્ય સૈન્યબળથી સંપ્રતિ તે જમાનામાં એક અદ્વિતીય વીરનર તરીકે પ્રસિદ્ધ થયો. જ્યાં જ્યાં એનું સૈન્ય પડાવ નાખતું ત્યાં મોટા નગર જેવો દેખાવ થઈ રહેતો છતાં સૈન્ય અને એનાં સાધનો એટલાં ખંધાં વિશાળ હતાં કે એને માટે સંપ્રતિને બીજી વ્યવસ્થા કરવાની જરૂર પડતી.

વિશ્વવિજયી કહે કે દશે દિગ્ભ્રિજયી કહે પણ આ મહાન સંપ્રતિ પછી આજસુધામાં ડેઢપણ નરપતિએ વૈતાઠ્ય પર્વત પર્યાત ત્રણ ખંડ પૃથ્વી સાધીને આડ હંજર રાજાઓને નમાવ્યા નથી. આ પૃથ્વી ઉપર છેહાં ચક્રવર્તી રાજ્ય ધણ્ણા કાલસુધી મહાન સંપ્રતિ લોગવવાને ભાગ્યવંત થયો.



પ્રકરણ ૨૭ મું.



વિશ્વવિજયીનાં માતાને નમન.

સહાનું સંપ્રતિ પૃથ્વી ઉપર દિગ્ભ્રિજય કરીને ફરતો ફરતો માળવા તરફ આવ્યો. પોતાનું કુદુંખ અવંતીમાં હેવાથી તે ઉજાયિનીમાં આવીને સોણહંજર રાજાઓની સમુદ્ર સહીત પોતાની માતાના ચરણુમાં નમ્યો. આખી ફુનિયા

ઉપર વિજય મેળવનાર મહાપરાકમી પુત્રને જોઈ કર્છ માતાં
હર્ષ ઘેલી ન થાય ? પુત્રનું આવું પરાકમ જોઈ માતાંનો
અત્યંત હર્ષવતી થઇ હતી. છતાં એના મનમાં તરતજ ખીણે
વિચાર સ્કૂર્ચેં. “ આહા ? મારા પુત્રે ગ્રણુખંડ પૃથ્વી સાધીને
સોણ હુલર રાણ્યોને નમાવ્યા. સંસારની અપૂર્વ ઋદ્ધ મે-
ળવીને તો એ કૃતકૃત્ય થયો. પણ ગ્રણુખંડની સમૃદ્ધિ મેળવ-
નારા વાસુદેવ અને પ્રતિવાસુદેવ અવશ્ય પાપનાં ક્રણ લોગવવા
અધ્યો લોકમાં (નરક ગતિમાં) ગમન કરે છે. છેલ્લાં અણત
શાનુ ગ્રણુખંડના રાણ્યોને નમાવી ઠેડ વૈતાઠયનાં દર્શન.
કર્દી આવ્યો. તો છુટી નરકપૃથ્વીમાં પાપના ભારથી દણાઈને
ઉતરી ગયો. હાય ? વિજયીને એ વૈતાઠયનું દર્શનજ એવું છે
કે અવશ્ય નીચે ઉતરી જવું પડે છે.

એ ઋદ્ધિમાં આસક્તા થયેલા વાસુદેવ અને પ્રતિવાસુદેવો
તો કુણી ગયા. પણ ચક્રવર્ત્તિએ છ ખંડના સાધનારા પણ ક્રાવી
નથી ગયા. જેમણે એ સમૃદ્ધિ તરફ ત્યાગપણું દેણાડી સંયમ-
સ્વીકાર્યું એજ બચી શક્યા. તો અનેક પંચાદ્રિય પ્રાણીયોની
હિંસાથી ચુક્ત એવું ઘોર યુદ્ધ કરીને લાખોનો નાશ કરીને
મારા પુત્રે શાનુ રાણ્યોને પોતાના બળથી તાખેદાર બનાવ્યા
તો ભલે ? પણ એની ફુર્ગતિ થાય તે હું ન ઇચ્છું ? મારે
દિક્રે અહિંયા પણ વિશ્વવિજયી થાય ને પરલોકમાં પણ પર-
પરાએ અનંત સુખનો લોકતા થાય એવા કોઈ રસ્તે જય તો
હુંએ ટીક છે.” એમ વિચાર કરતી માતાએ પુત્ર ચરણુમાં પડેલો
છતાં મૈન ધારણ કર્યું.

“ માતાજી ! સમંસ્ત પૃથ્વીવલયને જીતી સોણ હુલાર રાજાઓ સાથે તમારા ચરણમાં તમારો પુત્ર નમન કરે છે છતાં તમે કેમ હુષ્ટ નથી પામતાં ? ”

“ દિકરા ? તેં ધણા હશમન રાજાઓને જીતીને તારા સામંત ખનાવ્યા તે હુનિયાની દસ્તિએ તેં સારુ કસ્યું હશે. પણ લાખો મનુષ્યોની હિંસાને લોગે મળેલું એ રાજ્ય પ્રાણુંતે કેને હિતકર થયું છે ! કે જેથી હું આનંદ પાસું ? ” માતાએ પુત્રને ધર્મ તરફ વાગવાનો મનસુખો કર્યો.

“ માતા ! આવું આખી પૃથ્વીનું રાજ્ય છે છતાં મારા હિતને માટે એ કેમ નહી થાય વારુ ? ”

“ તેં લાખો જીવેનો સંહાર કરીને સંસાર વધાર્યો છે. પાપનો પોટલો—ગાંસડો બાંધ્યો છે. એ પાપનોજ સંચહુ કરનારા ધર્મરહિત મનુષ્યો ધણાય કુણી ગયા તે હજુ પણ ઉચ્ચા આવ્યા નથી. ”

“ શું ત્યારે હુનિયા જીતનારા રાજ ખધા નરકમાં કુણી જતા હશે ? વીર પુરુષે પૃથ્વીને શું ન જીતવી ? પૃથ્વી તો તલવારને તાબે છે. ”

“ એશાક ? વીરપુરુષ પૃથ્વી જીતે. પોતાની તલવાર ખડ-ખડાવી શરૂને ડરાવે, દિકરા ? તેં ત્રણુખંડ પૃથ્વી જીતી તેથી હું કાંઈ નારાજ નથી. તારા પરાક્રમથી તો હું ઝુશી છું. હુઃખ-માત્ર એટલુંજ કે તારા જેવા પરાક્રમ કરનારા પૃથ્વીને જીતીને

અંધકારમાં મળી ગયા છે જે હળપણું પ્રકાશમાં આવવાને રાહિતવાન થયા નથી. ”

“ કોણું ગયું ભલા એ તો જરી બતાવો ? માતા ? ”

જે હુનિયાના પ્રસિદ્ધ પુરુષો રામ, લક્ષ્મણ અને રાવણું એમાં લક્ષ્મણું-નારાયણું અને રાવણું ત્રણુખંડ ધરતી સાધી ઘણ્ણાકાળ સુધી રાજ્ય કર્યું. પણ એ લુખિંસા ને રાજ્યાસહિતને પ્રતાપે ચોથી નરકે ગયા. પરશુરામે સાતવાર નિઃક્ષત્રીય પૂર્વી કરી તો એમને પણ નરકના અંધકારમાં દુણી જવું પડ્યું. એમની પછ્યાડે એમને-પરશુરામને મારનાર આડમો સુભૂત ચક્રવર્તી અનંતાનું બંધીના લોલ કૃપાયથી સાતમી નરકે ગયો.

નેમિનાથ પ્રભુના સમયમાં થયેલા એમનાજ વડીલખંડું શ્રીકૃષ્ણ આ ભરતાર્ધના છેદ્વા વાસુદેવ ત્રણુખંડના પતિ જરાસંધને મારીને ભરતાર્ધપતિ થયા. પણ એ યુધ્યોને પ્રતાપે જરાસંધ ચોથી નરકે ગયો. કૃષ્ણ ત્રીજીએ ગયા. અરે ! એ નેમિ-પ્રભુના શાસનમાં પ્રભુદત નામે બારમો ચક્રી થયો. છખંડ પૂર્વી દખાવીને ચક્રીપણું રાજ્ય લોગવ્યું. પણ આપરે સાતસો વર્ષને અંતે સાતમી નરકે ગયો.

છેદ્વાં આપળું મગધના તખું ઉપર થયેલા મગધપતિ જિંબિસાર એ હૃદ લુખિંસાના પાપે પહેલીએ ગયા. એમનો પુત્ર કેણુંક-અન્નતશત્રુ ત્રણુખંડ લુતીને વૈતાંદ્ર લગી પહેંચ્યો. પણ આપરે તો એ છદ્રીએ ગયો. દિકરા ? પરાક્રમનો ઉપયોગ આવી રીતે લુખિંસામાં થવાથી એ રાજ્ય

લોગવ્યા પછી પરિણામે આખરે એની શિક્ષા લોગવવી પડે છે ? તું પણ આજે ત્રણખંડ લૃતીને ઘેર આવ્યો છે છતાં એ વિચાર આવતાં હું કહે કેવી રીતે ખુશી થાઉં ? ” માતાનાં એકએક વચન સંપ્રતિ ધ્યાનપૂર્વક સાંભળતો હતો.

“ તો માતા ? હું તમને કેવી રીતે ખુશી કરી શકું ? ”
સંપ્રતિએ પૂછ્યું.

“ ધર્મકાર્ય કરવાથી. તું જે નવાં નવાં જીનમંદિર અંધાવી પુષ્ટય ઉપાર્જન કરે તો મને હર્ષ થાય તે સિવાય મારું મન માને નહું ? ”

“ એ જીનમંદિર કરાવવાથી શું લાભ થાય; માતા ? ”

“ એનો અનંત લાભ શાસ્ત્રમાં તો બતાવ્યો છે. છતાં દશપૂર્વધર શ્રી આર્થસુહસ્તિસ્વામી પાસેથી મેં એકવાર સાંભળ્યું છે કે—

કાદાદીનાં જિનાવાસે, યાવંતઃ પરમાણવः ।

તાવંતિ વર્ષ લક્ષણિ, તત્કર્તા સ્વર્ગમાગ્ ભવેત् ॥

ભાવાર્થ—જીનમંદિરમાં કાણ પાણાણુ વગેરેમાં જેણા પરમાણુએ આવે છે તેટલા દાખ દર્ષ સુધીનું તે જીનમંદિરને કરાવનાર સ્વર્ગદ્વારકમાં દેવતાનાં સુખ લોગવે છે ”

“ માતાજી ? પરમાણું એટલે શું ? ”

“ સૂર્યનો પ્રકાશ જલીયાની અંદર પડેલો આપણે જોઈએ છીએ. એ સૂર્યના તેજમાં જે સુક્ષમ રજુ દેખાય છે

એનાથી પણ સુક્રમમાં સુક્રમ ત્રીશમે ભાગ કરીયે એને દોકિક
શાસ્ત્રમાં પરમાણું કહે છે.

“ વળી નવીન જીનમંદિર કરાવવા કરતાં જુનાનો
જીર્ણોદ્ધાર કરવાનું બહુ દૂલ કહું છે.”

“ બહુ તે કેટલું એની કાંઈ ગણુતરી કે એમજ ? ”

“ નવા જીનમંદિર કરતાં જુનાનો જીર્ણોદ્ધાર કરાવવાથી
સેણ ગણું વધારે પુણ્ય થાય છે. એમ વિવેકી પુરુષો કહે છે.”
નેનું ખન એવા શુભ માર્ગમાં વપરાયું છે એજ પુરુષને જગ-
તમાં ધન્ય છે.

“ એ જીનમંદિર બંધાવવાને આઠલો બધો મહિમા કેમ
વણ્ણવ્યો હશે. તમે આઠલું બધું પુણ્ય કહું એનું કારણ કાંઈ ? ”

“ સંસારના પાપમય વ્યાપારમાં આત્મા દુષ્ટેદોજ છે.
એવા કેટલાએ દુષ્ટેદા આત્માએને પાપથકી મુક્ત થવાને પ્રભુ-
નાં દર્શન કરી પાવન થવાને જીનમંદિર એ એક ધર્મસ્થાનક
છે. કેમકે એ જીનમંદિરમાં સાંસારિક કેચિપણ જાતની કિયા
થતી નથી. જેવી કે સાંધ્વવાનું કામ, દગ્વવાનું કામ, વિષય
સેવન, જુગાર, મદિરાયાન, એલવું, હાસ્યવિનોદ, વગેરે
અધર્મનાં કાર્યો થતાં નથી. અને લોકોનાં સ્થાનકો તો
એવા પાપથી લર્દાં છે. વળી એવા ધર્મસ્થાનકોમાં ગમે તેવા
પ્રાણીને પણ ધર્મ કરવાની સુખુદ્ધિ ઉત્પત્ત થાય છે. એ બધો
લાલ જીનમંદિર કરાવવારને મળે છે પણ એ જીનમંદિરે
કાંઈ રહ્યું નથે. કરાવવાં ધણું મંહિરો કરાવવાથી ને એને

અભિમાન, ધર્યા વગેરે ઉત્પત્ત થાય તો વળી લાલને ખદલે
હાની થાય, માટે ધર્મકાર્ય કરવું તે સરવતપણે અને લોકોના
ઉપકાર માટે થથાશક્તિએ કરવું. ”

“ માતા ! તમારું વચન મારે માન્ય છે. તમે જેમ રાજ
અશો એમ હું અવશ્ય કરીશ. !” સંપ્રતિનાં વચન સાંભળી
માતાને હર્ષ થયો અને આશિષ આપી.

પૂર્વે સંપ્રતિ રાજ જ્યારે મગધથી દિગુંવિજય કરવા
નીકળ્યાં તે પહેલાં મહારાજ અશોકે સાંભળયું હતું કે યુવરાજ
મહેંદ્ર ખુલ્લ શુદ્ધના ઉપરેશથી અવંતી છોડીને બૈદ્ધલિક્ષુક થઈ
ગયો છે, જેથી અશોકે સંપ્રતિને ઉજજવિની આપી મોટા
લશકર સહિત કુદુંખ સાથે અવંતી મોકદ્યો. પણ મહત્વાકંક્ષી
સંપ્રતિએ પિતાના લશકરવડે ઉજજવિની ન જતાં વિજય કર-
નાને પોતાના કુંઠુંખને અવંતીમાં મુકી હુનિયાના ખુણે ખુણે
ક્રીને પોતાની આણ વર્તાવી ને રાજએ પાસેથી સૈન્ય, શાસ્ત્ર,
અને સુવર્ણ પડાવતો તે જડ અને ચૈતન્યરૂપ અખુટ સંપદાનો
માલેક થયો.

વૃદ્ધાવસ્થાએ પહેંચેલા અશોક એ ઉગતા સૂર્યનાં કિર-
ણુનો પ્રકાશ બધી હુનિયામાં ક્રી વળેલો જેઠ અત્યંત ખુશી
થયા હતા. એને મનમાં સંતોષ થયો “ આહા ? હું ? મારા
દાઢા ચંદ્રગુપ્ત એતો ભારતના સભ્રાટ હતા પણ મારો પૌત્ર
તો બધી આલમનો સભ્રાટ થયો. હુનિયાભરમાં એવો દેશ ન
હાતો કે જ્યાં સંપ્રતિની આણ ન કરતી હોય, ભરતાર્થના

ત્રણ ખંડમાં એવો કોઈ આર્ય કે અનાર્ય રાજી નહોતો કે જે સંપ્રતિને કર ન કરતો હોય.” પૈત્ર જ્યારે દિગુંબિજ્યમાં હતો ત્યારે એની જીતના રોજ નવનવા સમાચાર અશોક સાંભળતો હતો. ત્રણખંડ ધરતીમાં મહારાજ સંપ્રતિના હતો જ્યાં ત્યાં પથરાઈ ગયા હતા. દરેક રાજ્યમાં સંપ્રતિના ગુમચરે કુરતા હતા. સોણહંજર રાજીએ પોતાની વક્ષાદારીના બદલામાં સંપ્રતિની સેવામાં પોતાના કુમારો અર્પણ કર્યા હતા. વર્ષમાં એકવાર તો એમને જાતે સાંદ્રાની સેવામાં હાજર થવું પડતું હતું. એવી રીતે દાદાજીએ તો સંપ્રતિકુમારને પોતાના લશ્કર સહિત ઉજાયિનીનું રાજ્ય લોગવવા મોકદ્યો હતો. પણ પરાક્રમના ઉગતા સૂર્ય આમી દુનિયાનું રાજ્ય દખાવી તે સોણ હંજર રાજીનો સ્વામી વાસુદેવ નહીં પણ વાસુદેવ સરખો જગત્ પ્રસિદ્ધ થયો.



પ્રકરણ ૨૮ મું.

આર્ય સુહસ્તિ સ્વામી.

વીર સંવતના ત્રીજા સૈકાના ભદ્યકાળમાં ચૈદપૂર્વધર શ્રી સ્થુલિલદ્રસ્વામીના શિષ્ય આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિ હતા. એ ઘનને યુગ પ્રધાનો અત્યારે જૈનશાસનના નાયક હતા. ન્યાગમાં ને વૈરાગ્યની ઉચ્ચ ભાવનામાં આર્ય મહાગિરિની તો પરાકાઢા હતી. જેથી આ સમયમાં જીનકદ્વારા જે કે

વિચ્છેદ થઈ ગયો હતો; છતાં જુનકદ્વારીની તુલના કરવાનો એમનો મનોરથ થયો. જેથી ગચ્છનો ભાર એમણે આર્યસુહસ્તિસ્વામી ઉપર નાખ્યો ને પોતે ગચ્છમાં રહીને જુનકદ્વારીની તુલના કરતા એકાકીપણે આર્યમહાગિરિ તપશ્ચયો કરતા પુછ્ચીને વિષે વિહાર કરવા લાગ્યા.

આર્ય સુહસ્તિસ્વામી શિષ્યોના પરિવાર સાથે વિહાર કરતા કરતા પાટલીપુત્રમાં આવ્યા. રાજ એમને નમવાને આવ્યો. ત્યાં વસુભૂતિ નામના શ્રેષ્ઠિને પ્રતિષ્ઠાધ આપીને જૈન અનાવ્યો. દેશ પરદેશ વિહાર કરતા અને ભવ્ય જીવોને પોતાના જ્ઞાનામૃતનું પાન કરાવતાં આર્યસુહસ્તિસ્વામી જીવંત સ્વામીને વંદન કરવાને અવંતી તરફ વિહાર કરી ગયા.

એક દિવસ અવંતીમાં^१ જીવંતસ્વામીનો મોટો મહેતસવ થયો. તે પ્રસંગે રથયાત્રાનો મોટો વરધોડો નિકળ્યો. સંસાર રૂપ સમુદ્રને તરવા વહાણું સમાન એવો જીવંતસ્વામીનો રથ નગરમાં ફરવા નિકળ્યો. હુલરો જૈન શ્રીમન્તો એ વરધોડામાં હાજર હોવાથી અવંતીની સમૃદ્ધિનું અત્યારે સાક્ષાત્ દર્શન થતું હતું. અનેક પ્રકારનાં વાદિઓ વાગી રહ્યાં હતાં. વોડો સ્વારોનો કંઈ પાર નહોંતો. તે સિવાય સેંકડો જૈનો સામેલ જનીને પોતાની સમૃદ્ધિ બીતાવી રહ્યા હતા. રથની પાછળ અનેક સાધુ સમુદ્દરથી પરવરેલા આર્યમહાગિરિ અને આર્યસુહસ્તિસ્વામી મોખરે ચાલતા હતા. તેમની પછી શ્રાવક સમુદ્દરાય, સાધી ને શ્રાવિકા સમુદ્દરાય વગેરે બ્યવસ્થાસર વરધોડો નગરમાં ફરતો હતો.

વરદોડો કુરતાં કુરતાં રાજગઢ નશ્ચક આવી પહોંચ્યો તે
 સમયે રાજગઢનાં અનેક માણુસો કોઈ જરૂરાથી તો કોઈ ખા-
 રીમાંથી તો કોઈ અગાસીમાંથી કે પોતાને અનુકૂળ આવે તેવી
 જગામાં ઉલા રહી જેતા હતા. એ વરદોડાની અપૂર્વ ધામધુમ
 મહાન સંપ્રતિ પણ ગોખમાં બેઠા બેઠા નિહાળવા લાગ્યા. ચારે
 કેંદ્ર એમની ચંચળ દૃષ્ટિ કુરતી અનેક માણુસોનું અવલોકન
 કરી રહી હતી. અવંત સ્વામીનો રથ પણ એમણે નિહાળ્યો.
 વાહિના મીઠા રવો પણ સાંભળ્યા. અનુકૂળે એમની દૃષ્ટિ
 કુરતાં કુરતાં આર્થસુહસ્તસ્વામી ઉપર પડી. એ સૂર્યને નેંધ
 રાજાને વિચાર થયો કે, આ શાંતાત્મા, પવિત્રમુનિને મેં કયાંક
 જોયા છે, પણ કયાં જોયા છે તે યાદ આવતું નથી. એમને
 જોવાથી મને સ્નેહ ઉત્પત્ત થાય છે. વિવેકી મુર્દૂઓ કહે
 છે કે “ જેને જોવાથી હુર્દ ઉત્પત્ત થાય તે પૂર્વ
 ભવનો બંધુ જાણુવો ” એવી રીતે મહાન સંપ્રતિ
 એમને કયાં જોયા છે તેનું સમરણ કરવા લાગ્યા. પણ કંઈ યાદ
 આવ્યું નહીં; છતાં ચોકકસ નિર્ણયતો થતો હતો કે કયાંક જોયા
 છે. વારંવાર સમરણ કરતાં સંપ્રતિ એકદમ બેખાન જોવા બનીને
 સુર્ચિંધિત થઈ ગયા. રાજગઢમાં કોલાહલ થઈ રહ્યો. મંત્રીઓ
 દોડી આવ્યા અને મહાન સંપ્રતિને સુચર્છામાંથી જગૃત કરવા
 વિવિધ ઉપાય કરવા મંડી ગયા. વાયુપ્રક્ષેપ આદિ શીતોપચાર
 કરતાં કયારે સંપ્રતિ સાવધ થયા ત્યારે જતિ સમરણ જાન થ-
 વાથી એમણે જોયું કે “ ઓહો ! પૂર્વે હું કોણ હતાં અને શું
 કરવાથી આ રાન્ય પામ્યો હતોં ? ”

તરતજ સંપ્રતિ ગોખમાંથી નીચે ઉત્તર્યા. રાજગઢની ખહાર નીકળી કરધોડાની સમીપમાં આવ્યા. ને સર્વેએ એમને આવતા જોઈ માર્ગ આપ્યો. સુહસ્તિસ્વામીને ત્રણુ પ્રદક્ષિણા દેવા પૂર્વક નમ્યો. છેહાથ જોડી રાજએ હુર્ષ સહિત પ્રશ્ન કર્યો.
“ ભગવન् ? આપ મને ઓળખો છો ? ”

“ તમે રાજ છો એ સર્વ કોઈ જાણે છે. મહારાજ અશોકના પૌત્ર અને વીરકુણાલના પુત્ર ? ”

“ હું રાજ તરફિ આપને નથી પૂછ્યો. આપ બીજા કોઈ પ્રકારે મને ઓળખો છો ? ” મહાનું સંપ્રતિનાં વચ્ચન સાંભળીને સુહસ્તિસ્વામીએ જાનનો ઉપયોગ સુક્યો. જાનથી એનું વૃત્તાંત જાણી લીધું. “ હે નરેશ્વર ? મેં તને સારી રીતે ઓળખ્યો ! પૂર્વે જ્યારે અમે વિહાર કરતાં કૌંશાખી નગરીએ ગયા હતા. તે વખતે હુકાળમાં એક રંકે અમારી પાસે લાડુની આશાએ દીક્ષા લીધી હતી. દીક્ષા લઈ એક દિવસનું ચારિત્ર પાળી. એ રંક તે ભવમાં આયુષ્ય પૂર્ણ થવાથી ચ્યાવી ગયો. તે આત્મા તું સંપ્રતિ રાજ થયો છે. ” આર્યસુહસ્તિસ્વામીએ દુંકમાં એ રંકનું ચારિત્ર ત્યાં સર્વ સમક્ષ કહ્યો સંભળાવ્યું.

“ હે ભગવન् ? જૈનધર્મ-અરિહંત ભગવંતનો ધર્મ પ્રાપ્ત થયાનું ક્રલ શું ? ” રાજએ કરીને પૂછ્યું.

“ એનું સુપક્વષ્ક્રલ તો મોક્ષપ્રાપ્તિ છે; છતાં એનું અપ્ત્વક્રલ સ્વર્ગ, રાજ્ય પ્રાપ્તિ વગેરે ધારે પ્રકારે જાણુવું ? ”

“હે પૂજય ! અવ્યક્ત સામાયિક ચારિત્રનું ફેલ કહેશો ? ”
રાજાએ તીજે પ્રશ્ન કર્યો.

“હે રાજન ? સામાયિક કરનારો પ્રાણી ને પુષ્ય બાંધે
તો તેના પુષ્યની સંખ્યા થઈ શકતી નથી. શ્રાવક પણ સામા-
યિક કરવાથી તેટલો સમય સાધુ નેવો ગણ્યાય છે. ‘ સમણો ઇવ
સાવઓ હવદ જમ્હા ’ તે માટે વારંવાર સામાયિક કરવાં. વળી.
અવ્યક્ત સામાયિકનું ફળપણ રાજ્યપ્રાપ્તિ છે.

આડી તો એક પુરુષ રોજ રોજ એક લાખ સુવર્ણનું દાન
આપે અને બીજે રોજ એક શુદ્ધ સામાયિક કરે તોપણું દાન
કરનાર સામાયિક કરનારની બરાબરી ન કરી શકે. પ્રતિ દિવસ
ઐધડી વિધિપૂર્વક શુદ્ધ સામાયક આચરનારો શ્રાવક પણ પુષ્ય
બાંધે તો બાળુકોઠ એગણુસાઠ લાખ પચીશ હુનર નવસોને
પચ્ચીસ પદ્ધોપમથી કંઈક અધિક દેવગતિનું આચુષ્ય બાંધે.
જે મોક્ષે ગયા, જાય છે અને જવાના છે એ અધા સામાયિકના
પ્રલાવથીજ જાણવા.

“હે ભગવન् ! આપના પ્રલાવથીજ મને રાજ્ય મળ્યું
છે. જે તે વખતે મને આપનું દર્શન ન થયું હોત તો મને
સંયમ લક્ષમી ક્યાંથી મળત ? મારો એ રંકનો જીવ આવો
અપૂર્વ લક્ષમીનો લોકતા ક્યાંથી થાત ? તેથી હે પ્રભુ ?
પૂર્વભવમાં પણ આપ મારા શુરૂ હતા. આ ભવમાં પણ આપજ
મારા શુરૂ થાવ ? ” સંપ્રતિએ કહ્યું.

“હે નરેંદ્ર ! અમને જોતાંજ તમને જાતિસ્મરણ જ્ઞાન

ઉત્પન્ન થયું અને એના પ્રશ્નાવે તમે તમારો પૂર્વનો ભવ જોયો? જૈનધર્મનું પ્રત્યક્ષફૂલ હીડું. મેં તમને કહ્યું છે કે જૈનધર્મનું પરોક્ષ ફૂલ તો મુક્તિ પ્રાપ્તિ છે આ બધાં તો એનાં અવાંતર ફૂલો છે. માટે ધર્મમાં પ્રમાદ કરશો નહીં.” ગુરુએ કહ્યું.

“ આપનો ઉપકાર અથાગ છે. આ રાજ્ય એ આપની કૃપાનું જ ફૂલ છે. તો એને આપજ અહુણુ કરો કે જેથી હું કૃતાર્થ થાઉં. આપના દુણમાંથી મુક્ત થાઉં ! ” રાજુએ આસાર દર્શાવ્યો.

“ રાજ્યનું ? નિસ્તપૃષ્ઠીજનોને કંઈપણ સ્પૃહ હોતી નથી; સંસારથી મુક્ત થયેલા ત્યાગીએ તો એક મુક્તિનેજ ભાજે છે તો તમારા રાજ્યવડે કરીને શું ? ”

“ તો ભગવન् ? કહો ? હું શું કર ? મારે શું કરવું ઉચ્ચિત છે ? ”

“ નરેશ્વર ? સ્વર્ગ અને ભોક્ષના દેનારા જૈનધર્મને ભાજે કે જેથી તમારા સંસારથી નિસ્તાર થાય. ધર્મ, અર્થ અને કામ એ ત્રણે પુરુષાર્થના સાધન વગર મનુષ્યનું જીવન પણુની માઝું નિષ્કળ છે. એ ત્રણે વર્ગમાં ધર્મ પુરુષાર્થને શ્રેષ્ઠ કહ્યો છે. કારણુંકે ખાડીના ત્રણે પુરુષાર્થની સિદ્ધિ ધર્મ વિના થતી નથી. જે પ્રાણીએ ઉત્તમ એવા જૈનધર્મને છોડી સ્વર્ણપુષ્પની ખાતર લોગોપલોગમાં ધર્મ માનીને એની આશામાં હોડ્યા જાય છે તે પુરુષો કદમ્પવૃક્ષને ઉન્મૂલન કરીને ધત્તૂરાને વાવે છે. ચિત્તામણીરત્નને તળ કાચનાટુકડાનો સ્વીકાર કરે છે. ઐરાવધુ.

ગજરાજનો ત્યાગ કરીને ગંધેડો ખરીદ કરે છે. માટે ઉત્તમ એવા નૈનધર્મનું હે રાજનુ? તમ્મારે પાલન કરવું? એ ધર્મનું સાક્ષાતું ક્રિલ તમે તો જોયું છે જેથી હવે તમને બીજા પ્રમાણેણાની શું જરૂર છે? ” ગુરુએ ઉપદેશ આપ્યો.

રાજને ધર્મ સાંલગ્નવાની જ્ઞાસા દેખાડવાથી ગુરુએ કહ્યું કે “ રાજનુ? અત્યારે તો અમે પ્રભુના મહોત્સવમાં છીએ. આ જીવંતસ્વામી-મહાવીરસ્વામીનો આને મોટો મહોત્સવ હોવાથી એના ઉત્સવમાં છીએ. ધર્મનું સ્વરૂપ વળેરે સર્વે તમે અમારા સ્થાનકે આવશો. એઠલે તમને વિસ્તારથી સમજવશું.”

આવી રીતે મહાન સંપ્રતિ ગુરુને આવીને નમસ્કાર કરવાથી વરધોડાનાં હળજરે. માણુસોને નવીન આશ્રીય ઉત્પજ્ઞ થયું રાજના શું કરે છે? શું પૂછે છે? એ સાંલગ્નવાને હળજરોનાં મન આતુર થયાં. ગુરુના ઉપદેશથી સંપ્રતિને બોધ થયો. જેને ધર્મ માટે એના મનમાં માન પૂજણખુદ્ધિ ઉત્પજ્ઞ થઈ. પોતાના ગુરુને નમન કરવાથી ને એમનો ઉપદેશ સાંલગ્નવાથી એમની માતા પણ અત્યંત ખુશી થઈ. વિશેષ ખુશાલી તો એ હતી કે “ એનો પુત્ર ત્રણુખંડ ધરતીનો લોકતા છતાં હવે સંસારમાં દુષી નહીં જાય. ” સર્વેની અનુયથી વચ્ચે તે પછી વરધોડા ત્યાંથી આગળ ચાલી પોતાને સ્થાનકે ગયો.



પ્રકરણ ૨૯ મું.

જવંતસ્વામી.

મહાવીર સ્વામીના સમયમાં ચંપા નગરીમાં કુમારનંદી નામે સોની રહેતો હતો. એ સોની હતો તો મેટો ધનાદ્ય, પણ વિષયનો લાલચું હોવાથી જે જે સુંદર કન્યા એના જોવામાં આવે તેને પાંચસો સોનૈયા આપીને અહુણું કરતો. એમ કરતાં કુમારનંદીને પાંચસો સ્વીચ્છા થઈ. તે સર્વેની સાથે એક સ્થંભવાળા મહેલમાં તે કિડા કરતો હતો. કુમારનંદીને નાગે શ્રાવક મિત્ર હતો.

એક દિવસ પાંચશૈવ દ્વિપની અધિકાર્યિકા હાસા અને પ્રહાસા નામની વ્યાંતરીએ શર્કેરની આજાથી પોતાના સ્વામી સાથે નંદીશ્વર દ્વીપે જતી હતી, માર્ગમાં એમનો સ્વામી વિઘૂનમાલી હેવ આખુષ્ય પૂર્ણ થવાથી ચ્યવી ગયો. પછી પોતાનો સ્વામી થવાને કોણું ચોગ્ય છે એમ એ વ્યાંતરીએ અવધિ જ્ઞાનથી જોયું તો વિષયી કુમારનંદીને પોતાના સ્વામી તરીકે પસંદ કર્યો. જેથી બજે હેવીએ કુમાર નંદી સમક્ષ એકાંતમાં પ્રગત થઈ. એમને જોઈ કામવિદ્ધા થયેલો કુમારનંદી એમને લેટવાને આતુર થઈ રહ્યો ને ઓદ્યો. “ તમે કોણું છો ? કયાંથી આવો છો ? ”

“ અમે તમારે માટે આવ્યાં છીએ ? ” હેવીએ હાવભાવ પૂર્વે ઓકી.

“ હીક તો હું પણ તૈયાર છું : ” એમ કહી તે એમને જેટવાને ખસ્યો.

“ હાં હાં સખુર ! ઉતાવળા થાઓ નહીં, તે માટે તમે પંચશૈલ દીપે આવજો. ” એમ બોલતી હેલીઓ અદૃશ્ય થઈ ગઈ.

વ્યાંતરીયોના લોગની લાલસાવાળો કુમારનંદી મહા અશિષ્ટતે પંચશૈલ દીપે પહોંચ્યો. ત્યાં પેલી હેલીઓ એની રુષ્ટિઓ પડી. એટલે તે એમની પાસે લોગની પ્રાર્થના કરવા લાગ્યો. ત્યારે હેલીઓ બાલી કે “ આ શરીરથી અમારો સ્પર્શ થાય નહીં પણ તું પંચશૈલ દીપના સ્વામી થવાનું નિયાણું કરીને અભિ પ્રવેશ કરે તો અહીંથાં તું ઉત્પન્ન થાય ને અમારો સ્વામી બને. ”

એવો જવાખ સાંભળી સોની વિચારમાં પડ્યો “ અરે ? હું તો ઉલ્લયભ્રષ્ટ થયો. મારી પાંચસો સ્વીઓને છાડી આમની પાસે હોડી આવ્યો તો એ પણ ગઈ ને આ પણ મારી ન થઈ. ” એવી રીતે ચિંતામાં પડેલા કુમાર નંદીને હેલીઓએ એના નગરની ખાડી સુકી દીધો.

ઘરે આવ્યા પછી હેવાંગનાઓનું દિવ્ય શરીર જેયેલું એટલે પોતાની સ્વીઓ પર એને સ્નેહ થતો નહીં. રાતદિવસ હેલીયેનેજ યાદ કરતો. જેથી એણે અભિપ્રવેશ કરવાનો વિચાર કર્યો. એના મિત્ર નાગિલે એને ઘણો સમજાયો. છતાં એ અભિમાં પ્રવેશ કરી પંચશૈલ દીપનો સ્વામી થયો. પેલી વ્યાંતરીઓ સાથે મનગમતા લોગ લોગવવા લાગ્યો.

એક દિવસ દેવતાએ નંદીશ્વર દ્વીપે યાત્રા કરવા જતા હતા. તેમની આજાથી હાસા ને પ્રહાસા ગાયન કરવા આગળ ચાલી. જેથી એમણે પતિને કહું કે “ સ્વામી ? તમે ઢાલ વગાડો ને અમે એ ગાઈએ ? ”

અહુંકારથી ઢાલ વગાડવાની વિદ્યુન્-માલી દેવતાએ ના પાડી. એટલે કર્મદયથી ઢાલ એના ગળે લાગી ગયો તેથી મહા હુઃએ તે ઢાલ વગાડતો આગળ ચાલ્યો.

પેલો નાગિલ શ્રાવક પણ આયુષ્ય પૂર્ણ થવાથી ભરીને ભારમા દેવલોકે મહર્દ્ધિકદેવ થયો હતો, તે પણ આ બાત્રામાં સાચે હતો, એણે અવધિજ્ઞાનથી વિદ્યુન્-માલીને પોતાનો મિત્ર જાણી તે તેની પાસે આવ્યો અને જોદ્યો “ ભરે ? તું મને ઓળખે છે ? ”

“ હે તેજસ્વી ? તમે કોણ છો ? એ હું જાણુતો નથી.”

એટલે એણે નાગિલનું ઝ્રિપ ખતાવી સર્વ હડીકત કહી સંભળાવી. “ અરે લોણા ? મનુષ્યભવ પામીને તું નરભવ હારી ગયો. ને શ્રાવકનો ધર્મ સારી રીતે આરાધન કરીને હું ભારમા દેવલોકમાં મહર્દ્ધિક દેવ થયો. ”

પોતાના મિત્રને એણાની પંચશૈલપતિ પશ્વાંતાપ કરવા લાગ્યો. “ હે મિત્ર ? વિષયમાં અંધ બનીને હું તો બધું હારી ગયો ! શું કરું ? ”

“ તારે મારે હજુ એક રસ્તો છે. અને તે એ કે તું હાલમાં અહુસ્થપણે ચિત્રગૃહમાં રહેલા મહાવીર સ્વામીની

પ્રતિમા ભરાવ ? કે તેમની અક્ષિથી તને ગોધિખીજ ઉત્પન્ન થશે.”

યાત્રાનું કાર્ય સમાપ્ત થતાં વિદ્યુન્માલીએ પોતાના મહેલમાં કાર્યોત્સર્વ મુદ્રાએ ઉભા રહેલા વીર લગ્વાનને જેયા ? તે પછી હિમવંત પર્વત ઉપર જઈ ગોશીર્ષ ચંદ્રન છેદી લાવી તેનાથી જેવી પ્રભુની સુર્તિ જેઇ હતી તેવી અલંકાર સહીત ખનાવી જાતિવંત ચંદ્રનની એક પેટી ખનાવી કપિલ ડેવલી પાસે પ્રતિષ્ઠા કરાવી તે પ્રતિમા એ પેટીઓ સુકી.

એ અરસામાં સમુદ્રમાં એક વ્યાપારીનું વહાણું ડામાડોળ સ્થીતિમાં હતું. તે વિદ્ધ નિવારીને વિદ્યુન્માલીએ પેદી પેટી તે વ્યાપારીને આપી સિંહુ સૌવીર દેશના વીતલય પાટણુમાં જવાની આજા કરી.

વહાણું સહીસલામત વીતલયપાટણ આવ્યું. અહીંયાં ત્રણસોને ત્રેસઠ નગરાનો અધિપતિ અને દશ સુકુટખદ્ર રાજુઓ જેની સેવા કરે છે એવા ઉદાયી નામે રાજુ રાજ્ય કરતો હતો. શૈવ ધર્મમાં ચુસ્ત એવો એ રાજુ તાપસોનો ભક્ત હતો. ત્યાં આવીને વ્યાપારીએ નગરના ચોકમાં પેટી સુકી ઉદ્ઘોષણા કરી કે—“આ પેટીમાંથી દેવાધિદેવની પ્રતિમા અહુણું કરો ? અહુણું કરો ? ”

રાજુ, અમાત્ય. નગરજનો આહિ અનેક જનો ત્યાં એકડા થયા. દરેક ધર્મના પુરુષો, તાપસો, સન્યાસીએ આવ્યા. પોતપોતાના દ્ધર્મદેવની સ્તુતિ કરવા માંડી, પણ

ઉધડી નહીં. આખરે રાજની પદ્મરાણી અને ચેડા મહારાજની પુત્રી પ્રભાવતીએ દેવાધિહેવની સ્તુતિ કરી એ પેરી ઉધાડી. એને પોતાના ચૈત્યબ્રહ્માં સ્થાપી નિરંતર તે પૂજા કરવા લાગી.

હું એક હિંસ રાણી પ્રભાવતી રાજની આજા પાળી ચારિત્ર લઇ દેવલેલાકમાં ગઈ. તે પછી પ્રભુની પૂજા દેવહતા નામની કુણજ નિરંતર કરવા લાગી. પ્રભાવતીનો જીવ દેવતા થયેલો, તેણે રાજને પ્રતિબોધ કરી જૈન ધર્મમાં સ્થીર કર્યો.

એ અરસામાં ગાંધાર નામે શ્રાવક દેવતાધિકાત ગુટિકાના પ્રભાવથી આકાશમાં ઉડી જીવંત સ્વામીનાં દર્શન કરવાને ત્યાં આવ્યો. ભગવાનને પૂજુને પોતાનો કાલ સુખમાં તે અહીયાં નિર્ગમન કરતો હતો. કેટલોક સમય તેને ત્યાં પસાર થઈ ગયો.

ગાંધાર શ્રાવકે પોતાનું મૃત્યુ નાણક જાહીને એની સેવા કરનારી પેલી કુણજને પોતાની પાસે રહેલી ગુટિકાએ આપી દીધી. પોતે દીક્ષા લઇ આત્મહિત કરવા લાગ્યો.

ગુટિકાનો પ્રભાવ ગાંધાર શ્રાવકે કહેલો. હોવાથી સુંદર ઝૂપની ઈચ્છા કરતી દેવહતાએ એક ગુટિકા સુખમાં રાખી એટલે તે સૌંદર્યભૂત પદ્મ ઘની ગઈ. રાજનો એને આવી સૌંદર્યવતી નોંધ એનું નામ ‘સુવર્ણ ગુટિકા’ પાડ્યું.

એને ચિંતા થઈ. હું ઝૂપવતી તો થઈ પણ મારે ચોગ્ય વર નોંધાયે, વર વગર તો ખીનું યોવન નિષ્કળ છે. તો મારે

વર-સોક્તા કેણું થાય ? આ ઉદ્ઘયન તો મારે પિતા જેવો છે. “ મારે માટે તો અવંતીપતિ ચંડપ્રદ્યોત વર થાઓ ” એમ ચિંતવીને વળી ગુટિકા મોંમાં રાખી એટલે ગુટિકાની અધિષ્ઠાયિકા દેવીએ ચંડપ્રદ્યોત આગળ એના રૂપનું વર્ણન કર્યું. જેથી ચંડપ્રદ્યોતે સુવર્ણ ગુટિકાને તેડવાને ફૂત મોકદ્યો એટલે દાસીએ કહ્યું. “ રાજને અહીંયાં મોકલનો તે પછી બન્નેનું ધર્મિત કાર્ય થશો. ”

ફૂતે એ સમાચાર અવંતીપતિને આપ્યા. રાત્રીના અવંતીપતિ અનિલવેગ હાથી ઉપર સ્વાર થઈને લાં આવ્યો. નગરની અહાર ઉદ્ઘાનમાં બન્નેનો મેળાપ થયો રાજને એને ચોતાની સાથે આવવાને કહ્યું. ત્યારે સુવર્ણ ગુટિકાએ કહ્યું કે—“અહીંયાં રહેલી જુનમૂર્તિ વગર હું જીવી શકું તેમ નથી, માટે એના જેવી તમે એક મૂર્તિ બનાવીને અહીંયાં લાવો. એ મૂર્તિને આ જગોએ સ્થાપી આ પ્રતિમાને લઇ હું તમારી સાથે આવું !. ”

તે પછી પ્રદ્યોતે અવંતીમાં આવીને એક મૂર્તિ તૈયાર કરાવી ને કપિલકેવલી પાસે પ્રતિષ્ઠા કરાવી એ મૂર્તિને લઇને પ્રદ્યોત વીતક્ષય પાઠણું આવ્યો. દાસીને એ મૂર્તિ અર્પણું કરી. દાસી પણ એનવીન મૂર્તિ ચૈત્યમાં સ્થાપી તે મૂળ મૂર્તિને લઈ પ્રદ્યોતની સાથે અવંતીમાં આવી રાજની સેવા કરવા લાગી.

પ્રાતઃકાળે ઉદ્ઘયન રાજ દેવાલયમાં આવ્યો ને પ્રતિમાને નભી સન્મુખ જુઓ છે ત્યાં તો કરમાઈ ગયેલી પુષ્પમાળાવાળી

પ્રાતમા દીઠી. એને લાંબું કે આ મૂળ મૂર્તિ નથી. વળી અહીયાં હુમેશાં પુતળીની માદ્ક ખડી રહેનારી સુવર્ણ ગુટિકા દાસી પણ નથી. તેમજ ભારા હાથીઓના મદ્દ પણ ગળી ગયા છે. નક્કી ચંદ્રપ્રધોત અહીં આવીને મૂર્તિ અને દાસી બનેને ઉપાડી ગયો. ”

ઉદાયન કોપથી આકુળવ્યાકુળ થણું ગયો. દશ મુગુટખાંધી રાજાઓ સહીત સકલ સૈન્ય તૈયાર કર્યું. ને અવંતીપર ચહ્યો. પ્રધોત પણ આ સમાચાર સાંલગતો પોતાના લશકર સહીત એની સામે દોડી આવ્યો. બન્ને વચ્ચે મહા ભયંકર યુદ્ધ થયું. પ્રધોત હાથી ઉપર બેસી લડતો હતો. ઉદાયન રથમાં હતો. ઇરાદાપૂર્વક એકખીલના લોહીના તરસ્યા એમણે પોતાની ચાલાકી બતાવવામાં ખામી રાખી નહીં. બાણુવળી ઉદાયને તીક્ષ્ણ બાણોથી હાથીના ચારે પગ લારી દીધા. ગજરાજ અનિલવેગ પીડાને નહીં સહુન કરતો પૃથ્વી ઉપર તુટી પડ્યો. ચંદ્રપ્રધોત જેવો ઉઠીને સાવધ થવા જય છે એટલામાં ઉદાયને રથમાંથી કુદકો મારી એના કેશ પકડ્યા ને બાહુ યુદ્ધ કરી એને ખાંધી લીધો. અવંતીના સૈન્યમાં હાહુકાર થઈ રહ્યો.

ઉદાયને પ્રધોતના લલાટપર તપાવેલી લોઢાની સળાથી ‘ દાસીપતિ ’ એવા અક્ષરો લખાવ્યા ને પીજરામાં પુર્યો.

ઉદાયન રાજ અદ્ય પરિવાર સહીત અવંતીના રાજદરભારમાં આવ્યો, ત્યાંથી રાજમહેલમાં આવીને પ્રતિમાનાં દર્શન કર્યાં. એમની સ્તુતિ કરી પ્રતિમા વેવાને દણી મહેનત

કરી પણ એ પ્રતિમા ત્યાંથી ચલાયમાન થઈ નહીં. રાજીએ ધણી ધણી વિનંતિ કરવા માંડી. જેથી એના અધિકાર્યકે પ્રગટ થઈ કંધું કે “ હે રાજ ! તારું નગર થોડા સમયમાં ધુળીના વર-સાદથી દ્વારા જવાનું છે. તેથી પ્રતિમાળ ત્યાં આવશે નહીં. મારે તું શોક ન કર ! ” ત્યારપછી ઉદાયનરાજ પ્રધોતને લઇને પોતાના નગર તરફ રવાને થયો. માર્ગમાં ચાતુર્માસ આભ્યું એટલે રાજીએ ત્યાં છાવણી નાખી. તે ડેકાણે દશપુર (હસોરા) નગર વસ્યું.

‘બનુસણુ પર્વ આભ્યાં તે સમય અવંતીપતિએ ઉપવાસ કરવાથી ઉદાયન રાજીએ એને સાધમી જાણી ખમાય્યો ને એનું રાન્ય એને પાછું આભ્યું. અનુક્રમે પોતે વીતલાય પાટણ આય્યો.

કાળે કરીને ઉદાયન રાજ મહાવીર લગ્વન પાસે દીક્ષા લઇ છેદ્વા રાજર્ષિ થયા. એ રાજર્ષિને કર્મદાયથી વ્યાધિ ઉત્પન્ન થયો. કેદ્ય વૈદ્ય તેમને દહીનેા આહાર લેવાનો કહેલ હોવાથી પોતે નિસ્પૃહ છતાં વીતલાય પાટણ આભ્યા. અહીંથી એમનો લાણેજ કેશી રાન્ય કરતો હતો. એ કેશાને મંત્રીલોકે ભામાવેલો હોવાથી રાજર્ષિને વિષમિશ્રિત અજ અપાભ્યું. જેના કેાપથી હેવતાએ તે નગરને ધુળની વર્ષાથી દાઢી દીધું. ઉદાયી મુનિએ વિષવ્યાસ પોતાનું શરીર જાણી અનશન અંગીકાર કર્યું નીશ દિવસનું અનશન પાળીને કૈવદ્યપદ પાભ્યા—મોશે ગયા.

એ જીવંતસ્વામીની પ્રતિમા ત્યારથી અવંતીમાં ભવિક-જનાથી પૂજાવા લાગી. આર્યસુહસ્તિ સ્વામીએ પ્રભાવિક

પ્રતિમાનાં વંદન કરવાને આવ્યા હતા. શુરૂના મુખથી સંપ્રતિ-
રાજને જીવંતસ્વામીનો મહિમા ચાંલગીને એ લગવાનને
પૂજવા શરૂ કર્યો. ધણા કાગ પર્યંત એમણે પૂજયા.

કાલાંતરે એ પ્રતિમા અદરથી થઈ ગઈ. વીરપ્રભુના નિર્વાણ
પછી ૧૬૬૬ વર્ષ વહી ગયા બાદ કુમારપાળ નરેશ્વરે એ
જીવંતસ્વામીની પ્રતિમા તે નગરમાંથી કઢાવી પોતે પૂજને
આતમાને કૃતાર્થ કર્યો.

એ વીતલથનગર તો કેશીરાજના પાપે જમીનહોસ્ત
થયું. કેશી ઉદાયનરાજનો લાણેજ હતો. પોતાને અભિચી
પુત્ર છતાં કેશીને રાજ્ય આપ્યું! છતાં એ કેશીએ એવજી થઘને
રાજને દહીમાં વિષ અપાવ્યું. જેનું પાપ એને અહીને અહીં
પ્રગટ થયું. ઉદાયન સુનિનો શાચ્યાતર એક કુંલારને છોડીને
દેવતાએ કોધથી આખાગવુદ્ધ આખી નગરી ધૂળથી દાઠી
એનો નાશ કરી નાખ્યો. ત્યારપછી ત્યાં ગામ વસેલું તે આને
લેરા કહેવાય છે.

અભિચીકુમારને પિતાએ રાજ્ય ન આપ્યું કેથી તે ગુન્સે
થઘને ચાંપાનગરીમાં ચાલ્યો ગયો. ત્યાં એનો માસીઆઈ લાઈ
કેણિક-અભાતશાસ્ત્ર રાજ્ય કરતો હતો. રાજ્ય નરકને દેનાડું
જાણી પોતાનો પુત્ર હુર્ગિતાએ ન જય એમ જાણી ઉદાયને
અભિચીને રાજ્ય ન આપ્યું. પણ અભિચી એનો પરમાર્થ
સમજ્યો નહીં નેથી જાયો. ત્યાંલગી એને એના પિતા ઉપર
કૃષાય રહ્યો. એ કૃષાયની પ્રખળતાથી એની ધર્મકિયાએ ઝ્લ-

દાયક ન થઈ. જેથી મરણ પામીને એક પદ્ધોપમને આણુંથે
અસુર કુમાર હેવ થયો; છતાં એ જીવ ધણો સારો હોવાથી ત્યાંથી
ચ્યવીને મહાવિદેહક્ષેત્રમાં મનુષ્યપણે જન્મી દીક્ષા અંગીકાર
કરીને મોક્ષ જશો.

—૪૫(૩)૩—

પ્રકરણ ઉં મું.

રથયાત્રામાં.

સંપ્રતિ રાજ પ્રતિ દિવસ ગુરુ મહારાજની પાસે આવી
ધર્મશ્રવણ કરવા લાગ્યો. હુમેશાંના શ્રવણ માત્રથી એના મલીન
સંસ્કારિનો નાશ થતાં એનું હૃદય શુદ્ધ થયું. ધર્મતત્ત્વ એ-
નામાં પરિણમયું. સંઘ, યાત્રા, તિર્થલાકિત વગેરેથી જૈન શાસ-
નની શોભા વધારતો પોતાના આત્માને શુદ્ધ કરવા લાગ્યો.
તીર્થિકર એજ હેવ, સુસાધુ એજ ગુરુ અને અરિહંત લગ-
વંતે કહેલો ધર્મ એજ મારે પ્રમાણ છે. એમ ૬૬ નિશ્ચય
પૂર્વક રાજએ સમકિત અંગીકાર કર્યું. પંચ આણુંત્રત,
ત્રણુ ગુણુંત્રત અને ચાર શિક્ષાંત્રતનું સ્વરૂપ ગુરુ પાસેથી ય-
થાર્થપણે સમજુને ખારવત ધારી શ્રાવક થયો. ત્રણે ખંડની
લક્ષ્મીથી શોભાતો સંપ્રતિ ત્રિકાલ જીનપૂળ કરતો સ્વજનોની
જેમ સાધમીએનું વાત્સલ્ય કરવા લાગ્યો. નિરપ્રરાધી જીવોની
દ્વારા પાળવામાં પ્રીતિવાળો, દાન દેવામાં તત્પર સંપ્રતિ દીન

જનોને અધિક અધિક દાન દેવા લાગ્યો. સર્વત્ર શાંતિનું સા-
આજ્ઞય પથરાઈ રહ્યું હતું.

આર્થ સુહૃસ્તિ સ્વામી રાજાને ધર્મમાં સ્થીર કરીને વિ-
હાર કરી ગયેલા તે પાછા કુરતા કુરતા અવંતીમાં આવ્યા,
તે પ્રસંગે જિનેશ્વરમાં લક્ષ્મિવાળા શ્રાવકોએ જુન ચૈત્યમાં
માટો. ઉત્સવ શરૂ કર્યો. એ ઉત્સવમાં સુહૃસ્તિ સ્વામી પણ પ્ર-
તિહિવસ લાગ લેતા હતા, શુરૂનું આગમન જાણીને સંપ્રતિ
પણ અંજલિ જેડીને હુમેશાં એની સાથે બેસતો હતો. આ
ઉત્સવ નિમિત્તે સંપ્રતિ એ ફરેક સામંતોને ઉજ્જવિનીમાં
નોતર્યા હતા.

યાત્રોત્સવ પૂર્ણ થતાં લક્ષ્મિવાળ શ્રાવકોએ રથયાત્રાની
તૈયારી કરી; કેમકે રથયાત્રા વગર યાત્રોત્સવ સંપૂર્ણ ગણુતો
નથી જેથી સૂર્યના રથ સમાન સુવર્ણ મણિ-માણેકની કાંતિથી
ભવ્ય એવો રથ રથશાળામાંથી ખડાર કઢાયો, વિધિને
જાણુનારા મહર્દીક શ્રાવકો રથમાં ધિરાજેલી શ્રી અહૃત
પ્રતિમાની સ્નાતપૂજનદિક કરવા લાગ્યા. હજારો શ્રાવક શ્રાવિકા
પોતપોતાનું મહર્દીકપણું જણુવતાં એ ઉત્સવમાં લાગ લે-
વાને હાજર થતાં, શ્રાવિકાઓ એનેક પ્રકારે ધવલ ગીતો ગાતી
હતા. મંગળ વાળ રૂડે પ્રકારે વાગી રહ્યાં હતાં. જૈનશાસનના
જ્યના પોકારોથી આકાશ છવાઈ રહ્યું હતું.

શ્રદ્ધાવંત શ્રાવકો લગવંતનું સ્નાત જળ કરતા છતાં
પૂર્વે દેવતાઓ મેરુ પર્વત ઉપર લગવંતનો જન્માલિષેક કરે

છે તે સમયે અભિષેકનું જળ શિખર ઉપરથી જેમ નીચે પડતું હોય તેમ રથ ઉપરથી લગવાતનું સ્નાત્ર જળ જમીન ઉપર પડવા લાગ્યું. સ્નાનથી શુદ્ધ થયેલા શ્રાવકો લગવાતનો સ્નાત્રાભિષેક કરી સુગંધી દ્રવ્યોથી પૂજવા લાગ્યા. સુગંધી પુષ્પોની વિવિધરંગી માળાદિથી પૂજન કરવા લાગ્યા. જેથી શરદ ઋતુના વાદળાંથી વેરાણેલી ચંદ્રની કળા હોય એવી જીનેશ્વર લગવાનની પ્રતિમા શોલવા લાગી. અગર આદિ ધૂપથી ચારે દિશાઓ સુગંધમય બની ગઈ. એ પ્રમાણે પૂજન કરી શ્રાવકોએ લગવાનની આરતી ઉતારી પછી જીનેશ્વર લગવાનને નમસ્કાર કરી લક્ષિતવંત શ્રાવકોએ અશ્વની જેમ રથને એંચવા માંડ્યો.

રથના આગાળ માર્ગમાં નાગરિક રમણીએ તાલપૂર્વક રાસડા ગાતી હતી. ચતુર્વિંધ વાળું ત્રના નાદ સાથે સુંદર નાટક ખીલુ તરફ થતું હતું. ચારે ખાળુ શ્રાવિકાએ માંગલીક ગાઈ રહી હતી. એવી રીતે લગવાનનો રથ પ્રત્યેક હુાટ ને મંદિર પાસે ઉલ્લો રહી વિવિધ પ્રકારની પૂજને અહૃણુ કરતો રથ સંપ્રતિ રાજના રાજભવન આગાળ આવ્યો. પોતાના નિયમ પ્રમાણે રથ અહુંયા પણ ઉલ્લો રહ્યો.

સંપ્રતિ રાજ હુર્ધથી વિકસવર થયેલા શરીરવડે લગવાનને પૂજવાને તૈયાર થઇને આવ્યો. એમની સાથે એમના સામંતરાજનાએ હતા. વિધિસહિત લગવાનની પૂજન કરતાં સર્વે સામંતોને વિધિ ખતાવા; ગુરુ પાસે એ સર્વે સામંતોને સમકિત લેવરાવી રાજને પોતાના સકલ સામંતોને આદેશ

કર્યો કે. “હે સામંતો? તમે જે મારા લક્ત હો, મને સ્વામી તરીકે માનતા હો, તો મારે તમારા ધનનું પ્રયોજન નથી. તમારો દેશ તમે સુખેથી લોગવો, પણ તમે બધા શ્રાવક-નૈન થઈ જાઓ? તમે નૈન થશો તેનાથી જેવો હું ખુશી થઈશ તેવો અન્ય ભીજુ કોઈપણ રીતે તમે મને ખુશી કરી શકશો નહિ. તમારા દેશમાં, તમારા શહેરમાં જીનમંદિર બંધાવી જીનેશ્વરના લક્ત થઈ જાઓ? તમારી પ્રજનને પણ એ રસ ચાખાડો! બધી હુનીયામાં રાષ્ટ્રધર્મ નૈનજ હોવો જોઈએ.”

મહાન સંપ્રતિની આજા સર્વેએ સપ્રેમ માન્ય કરી. જેવી રીતે સરતાધિપ વાસુદેવ કે પ્રતિવાસુદેવની આજા પણ ખંડના એના સામંતો મસ્તક ઉપર ધારણું કરે છે. એમની અખંડ આજામાં શંકા કરવાને પણ કોઈ સામંતની તાકાત નથી હોતી. દરેક સુણુટ બદ્ધ સામંત રાજાઓએ મહાન સંપ્રતિની આજા મસ્તકે ચડાવી અને તેઓ નૈન થઈ ગયા.

પોતાના રાજમહાલય આગળ રથમાં રહેલા લગવાનને પૂજુને સંપ્રતિ પોતાના આત્માને ધન્ય માનતો છતો સામંતો સાથે વરવોડામાં ગયો થોડીવારે તે પછી રાજ પોતાના મહેલમાં ચાહ્યો ગયો.

વરધાડો લ્યાંથી આગળ આગળ ચાહ્યો અને દરેક ભાગોમાં ફરતો ફરતો પોતાની સમૃદ્ધિથી જૈનધર્મની વિજય દ્વારા જાઓ. ફરકાવતો પોતાના સ્થાનકે ગયો.

એ ચૈત્યમહેલસવ પૂર્ણ થયા પછી સંપ્રતિની અનુજ્ઞા

પામીને એના સામંતો પોતપોતાની રાજ્યધારીમાં ચાલ્યા ગયા. તેમણે પોતપોતાના દેશમાં જુનમંદિરે ઉલાં કરીને તીર્થકરની લક્ષિત કરવા લાગ્યા. પ્રભામાં એ ધર્મને આશ્રય આપવામાં આવ્યો. સાધુઓની લક્ષિત કરતા અને શ્રાવકોને ઉત્સેજન આપતા રાજીએએ પોતપોતાના દેશમાં રથયાત્રા વગેરે મહેત્સવો પ્રવર્ત્તિત્યા. જૈન આચાર પોતે પણ પાળીને પ્રભાનાં દૃષ્ટાંતરૂપ થયા. કે જેથી આર્થ અને અનાર્થ દેશોએ મિશ્યાત્વથી ભારેલા તે પણ શુદ્ધ અને સાધુઓને વિહાર કરવાને વોગ્ય થયા.

એક દિવસે મહાન् સંપ્રતિ આર્થસુહસ્તસ્વામીને વંદન કરીને બેઠા હતા. એમણે જીવંત સ્વામીનું કંધક વિશેષ સ્વરૂપ પૂછ્યું આર્થ સુહસ્તસ્વામીએ એની ઉત્પત્તિથી માંડીને ઇતિ પર્યંત સર્વે વૃત્તાંત કહેલો. છતાં જે વિશેષ હતું તેપણું સંભળાવી હીધું. જેથી એ પણ જીવંતસ્વામી ઉપર લક્ષિતવાળો થઈને એમની ત્રિકાળ સેવા-પૂજા અને લક્ષિત કરવા લાગ્યો.

એક દિવસ સંપ્રતિ રાજ વિચાર કરવા લાગ્યો કે “ત્રણ ખંડ પૂછ્યી ઉપર મારું રાજ્ય છે. એ સર્વ અનાર્થ અને આર્થ દેશોમાં સાધુઓ શામાટે ન વિચરી શકે ? ” એ પ્રમાણે વિચાર આવવાથી એમણે શુરૂને પૂછ્યું. “ ભગવાન् ? આપનો સાધુ સમુદ્દર કયાં કયાં વિહાર કરી શકે ! ”

“જ્યાંજ્યાં જુનમંદિર હોય, શ્રાવકોની વસ્તી હોય, આર્થ જગા હોય એવે સ્થાનકે સાધુઓ વિહાર અવશ્ય કરી શકે. ”

“ તો પ્રભુ ? આપણા સાધુઓ અનાર્ય જેવા દેશોમાં સગવડ હોય તો વિહાર કરી શકે કે ? ”

“ અનાર્ય દેશોમાં વિહાર નહી કરવાનું કારણ એ લોકો મહા અજ્ઞાનરૂપી અંધકારમાં દુષેલા હોવાથી એવા લોકોથી સાધુઓને ઉપસર્ગ થવાનો સંભવ નિરંતર રહે, તેમજ શ્રાવકેના અભાવે સાધુઓને આહાર પાણીની અગવડતા રહે, ઉત્તરવાની જગ્યા પણ મલેકે ન મળે, એમ અનેક પ્રકારની મુશ્કે લીચો ઉભી થવા પામે, સાધુઓને પણ એથી કદાચ આર્ત્યાન થાય. એના કરતાં જ્યાં સુખે ધર્મ સાધન થઈ શકે તેવી જગ્યાએ રહીને સાધુઓ સુખપૂર્વક ધર્મ સાધી શકે એજ ઠીક છે ” સુહૃસ્તિસ્વામીએ કારણું ખતાન્યું.

“ આપનું કારણ જો કે વાસ્તવિક છે, છતાં મારી ઈચ્છા છે કે આપના સાધુઓ મારા રાજ્યમાં આર્ય કે અનાર્ય દેશોમાં ગમે ત્યાં વિહાર કરી શકે કે જેથી મારી અનાર્ય પ્રભા પણ ધર્મતત્વને પામે. ”

“ એ કેવી રીતે થઈ શકે વાર્દ ? રાજ્ય ? તમે એમાંથી કંઈ રસ્તો કાઢી શકો છો ? ”

“ ભગવન् ? પ્રથમ શ્રાવકેને કે જે સાધુઓના આચાર વિચારમાં પારંગત હોય એમને સાધુઓનો વેશ પહેરાવી દેશો દેશ મોકલવા, અને મારી દરેક પ્રભા મારા શુરૂ તરીકે ગણીને એમની સેવા ભક્તિ, બહુમાન કરતાં શીખે. એવી રીતે કરતાં અનાર્ય પ્રભા પણ સાધુઓની ભક્તિ કેવી રીતે કરવી એ જ-

ખૂટી થાય. તે પછી આપે સાધુઓને મોકલી તપાસ કરાવવી કે વિહારને યોગ્ય તે શેત્ર થયું છે કે નહીં ? ”

“ તમાડું કહેવું સત્ય છે એવી મહેનતને પરિણામે સાધુઓ અવશ્ય વિચરી શકે ? ” ગુરુએ અનુમાદન આપ્યું.

તે પછી સંપ્રતિ રાજાએ વિક્રાન્ત શ્રાવકોને અને સુભાડોને કૃત્રિમ સાધુઓ જનાવીને અનાર્ય દેશોમાં મોકદ્યા, એ દરેક દેશોમાં પોતાના સુભાડો મોકલી એ અનાર્ય રાજ અને દેશવાસીઓને આજા કરી કે—“ અમારા પુરુષો તમારી તરફ આવ્યા છે તેઓ કે રીતે કર માગે તે પ્રમાણે તમારે આપવો ને એમની લક્ષિત કરવી. ”

—◆(૧૦)◆—

પ્રકરણ ઉ૨ મું.

—•—

હવે મારે શું કરવું જોઈએ ?

“ હું રાજુનું ? જગતમાં દાન એ સર્વોત્કૃષ્ટ વર્ણા છે. દાનથી ધાર્યા જીવો લાવસાગર તરી જાય છે. દાન સિવાયની વર્ણા તો પોતાનેજ માત્ર લાભકર્તા છે; કિંતુ દાન તો પોતાને અને પરને ઉભયને લાભકર્તા છે અભયદાન, સુપાત્રદાન એ એ દાન શ્રેષ્ઠ ગણ્યાય છે. તે સિવાયનાં ઉચ્ચિતદાન, કીર્તિદાન ને અનુકરાદાન એ સંસારમાં ફ્રેલ આપનારા છે. તીર્થીકર સમાન પુરુષો પણ દીક્ષાનો અવસર પ્રાપ્ત થાય છે ત્યારે વાર્ષિકદાન

આપે છે. માટે લક્ષમીવંતપુરુષે દાતા અવશ્ય થવું. પોતાની લક્ષમીને સહભ્યય કરીને માનવજનમ સદ્ગત કરવો; કેમકે વ્યાજથી કદાચ ધન અમણું થાય, વ્યાપારથી ચાર ગણું થાય. ક્ષેત્રમાં વાવવાથી સહૃદ ગણું થાય પણ સુપાત્રમાં જે એ ધન વાપરવામાં આવે તો અનંતગણું ઇલને આપનાર થાય છે.

હુઃખી જીવો ઉપર અનુકંપા લાવીને તેમનાં હુઃખ નિવારવા માટે જે સહાય કરવી તે અનુકંપાદાન. સગાં, બહાલાં કે કુદુંખીજનોમાં પોતપોતાને યોગ્ય જે આપવું તે ઉચ્ચિતદાન છે. અને લોકમાં વાહવાહ કહેવડાવવાની ખાતર દાતાર ખનવું તે ક્રીત્િદાન છે, છતાં એ દાનોથી પણ અધિક સુપાત્રદાન ને અલયદાન છે. એ બન્ને દાન તો પરંપરાએ મોક્ષનાં ખીજભૂત છે. અવશ્ય એથી મોક્ષની પ્રાસિ થાય છે. પૂર્વે મેધરથના લવમાં પારેવાની રક્ષા કરતાં તે મેધરથ શાંતિનાથ તીર્થંકર થઈ મોક્ષ ગયા. બિંખસારના પુત્ર મેધકુમારે પૂર્વ લાવે હાથીના લવમાં સસલાની રક્ષા કરવાથી ત્યાંથી ચ્યાવી મેધકુમાર થયા તે પછી એકાવતારી થઈ મોક્ષ જશે, અહિંસા ધર્મનું પાલન કરતાં એવા અનેક જીવો અદ્વિત્યમાં લવસાગર તરી જાય છે. એવાંજ સુપાત્રદાનને યોગ્ય હાલના સમયમાં સાધુ સાંદ્રી ગણ્યાય છે કે જેએ અતિથિ છે. ભાવથી એમની આહાર પાણી આદિથી ભક્તિ કરતાં અનેક જીવો લવસાગર તરી ગયા છે.

શ્રીરૂપભદેવના જીવ ધના સાર્થવાડે સાધુઓની ધૃતથી અક્રિત કરવાવડે પોતાનો સંસાર દુંકો કર્યો ને તેરમે લવે.

તीર्थंકર થયા એજ દ્વારાનાથને શોકઠીના રસનું પારણું કરાવવાવડે શ્રેયાંસકુમારે મુક્તિ લક્ષ્મી હાથ કરી. અરે એરલે ખંડે હૂર જવા કરતાં નળુકન જ વાત તમને કહું. જુઓ મહાવીરસ્વામી કે જે જીવંતસ્વામીની પ્રતિમા હાલ તમે પૂજે છો એ મહાવીરસ્વામીએ નયસારના ભવમાં સાધુઓને આહાર વહેઠાવવાથી સમકિત પ્રાપ્ત કર્યું હતું. પરંપરાએ મહાવીરસ્વામી થયા. તેમના સમયમાં જે જે પુરુષો પ્રસિદ્ધિમાં આવ્યા છે તે પ્રાયઃ મુનિને દાન દેવાના મહાત્મ્યથીજ થયા છે. જુઓ ધનાશાલિલદ્ર ! શાલિલદ્રે પૂર્વે ગોવાળના ભવમાં માસખમણુના ઉપવાસી મુનિને ઘીરનું પારણું કરાયું તો શાલિલદ્ર થઈ અક્ષય ઋદ્ધિ પામ્યા. એમના અનેવી ધનો શોઠ ! પૂર્વે સાધુને દાન દેવાના પ્રભાવથી એ પણ અનગળ દ્રવ્યનો માલેક થયો. એટલું જ નહી પણ હવે એકાવતારી થઈ તે મોક્ષ પણ જ શો. એવીજ રીતે કૃતપુણ્ય ? શ્રી મહાવીરસ્વામીની શ્રાવિકા રેવતીએ ભગવનને ભીજેરાપાક વહેઠાવવા વડે સંસારને દુંકો કર્યો ને તીર્થંકર નામકર્મ બાંધ્યું ભાવી ચોવીશીમાં સમાધિ નામે સતરમા તીર્થંકર થશો.

લક્ષ્મીનો સદ્ગુપ્યોગ કરવા માટે ભગવંતે સાતક્ષેત્રોની પ્રદ્યપણું કરી છે તે સાત ક્ષેત્ર તે જીનપ્રતિમા, જીનચૈત્ય, જીન, સાધુ, સાધ્વી, શ્રાવક ને શ્રાવિકા ! જીનપ્રતિમા, અને જીનચૈત્ય, એ સંસારથો પાર ઉતારવાને આત્માના સાધનો છે અનેક આત્માઓ એ નિભેત્ત પામીને પોતાનું હિત કરી ગયા છે ને હુરે છે. એ ખંડે લાલ જીનમાંદેર કરાવવનારને મળે છે. પ્રાણીએ

અવસાગરથી પાર ઉત્તરવું હોય અને ખીજને પણ ઉત્તરવાની ધ્યાન હોય તો ઠેક ઠેકાણે તેણે જુનમંહિર કરાવવાં, જુનપ્રતિમાઓ કરાવવી. તેમાં પણ નવાં કરાવવા કરતાં જુહ્ણોદ્ધાર કરાવવામાં સોણ ગણો લાભ સમાચેલ છે. જયાં જયાં જુનમંહિર હોય ત્યાં શ્રાવકોનાં ધર અવસ્થય હોય તેથી સાધુઓ પણ એવી જગાએ વિહાર કરી શકે, લોકો ઉપર ઉપકાર કરી એમને પ્રતિબોધ પમાડે. એમનીજ લક્ષમી સફળ થઈ છે કે જે લક્ષમીથી જુનમંહિરો બંધાવ્યાં હોય, જુના મંહિરોના જુહ્ણોદ્ધાર થયા હોય; તેમજ જુનપ્રતિમાઓ કરાવી હોય. બાકી તો શ્રીમંત તો ધણ્ણાય હોય છે. પણ જે લક્ષમી સહૃદયોગમાં નથી વપરાતી એની લક્ષમી એના મુવા પછી ખીજના હાથમાં જય છે. પોતે કંઈ પણ કર્યા વગર અન્ત સમયે પત્રીચાતાપ કરતો નરસવ હારી જય છે; તો ઉત્તમ જનોને આવો અપૂર્વ અવસર જે પ્રાપ્ત થયો તો પછી એનો સહભ્યય કરીને લાભ લેવો. કારણું કે લક્ષમી એતો પુણ્યથી મલે છે તેમ પાપથી જતી પણ રહે છે. હમેશાં એ કંઈ કાયમ રહેતી નથી, શ્રી કૃષ્ણ વાસુદેવ જેવા સમર્થ પુરુષને પણ સમૃદ્ધિએ તલુ દીધોઃ તો અન્ય પામર જનોની તે શી વાત ? માટે હે રાજન ? જુનમંહિર અને જુનપ્રતિમા કરાવવાવડે કરીને તમારે પુઢ્યીને શોઆની, આજે ત્રણ ખંડ ધરતી ઉપર તમારું સાઓન્ય પથરાયું છે. વાસુદેવની સમાન જગતમાં તમારી આજા ખંડીત કરવારાં તમારા સોણ હંજર સામંતોમાં કોઈ સમર્થ નથી. તો જુને ખરની ભક્તિ કરવા થકી નરસવ સફ્લ કરે.

તેવીજ રીતે જાન લક્ષિત પણ અનુપમ છે. જાન લક્ષિતથી કંઈ આત્માએ જાવસાગર તરી જય છે, જાન લક્ષિતથી જાન ઉત્પજ્ઞ થાય છે એ જાનથી વૈરાગ્ય પ્રાપ્ત થતાં સંસારનાં બંધનો આપોઆપ ક્ષ૟-શીથીલ થઈ જય છે; પૂર્વે જાન લારેલા ભારત મહારાજ પણ સંસારનું સુખ લોગવતાં આરિસા ભુવનવમાં કૈવલ્યપહ પામ્યા. જ્યાંત નરપતિએ જાનલક્ષિત કરતા તીર્થંકર પહ લીધું.

સાધુ સાધી શ્રાવક અને શ્રાવિકા એ ઉત્તરોત્તર એક ખાજથી ઉત્તરતી કોઈનું ક્ષેત્ર છે. સાધુ, સાધીને સુપાત્ર દાન દેવાથી તો મેં પૂર્વે કહ્યું છે તેમ અમોઘકુલ પ્રાપ્ત થાય છે એ નિઃસંદેહ વાત છે.

શ્રાવક શ્રાવિકારૂપ ક્ષેત્રમાં વાપરેહું ધન પણ અનંતકોઈ ક્રાંતિકા આપે છે, ધર્મથી રંગાએલાં હોય એવાં શ્રાવક શ્રાવિકા નિર્ધિન અવસ્થાને લઈને દ્રવ્યની ખાતર કદાચ ધર્મથી પતિત થતાં હોય તો ઝડિભાન શ્રાવક એમને પોતાની શક્તિથી અવશ્ય બતાવે-ધર્મમાં સ્થીર કરે તો ધણો લાખ ઉપાર્જન કરે. ધીજનને ધર્મ પ્રાપ્ત કરાવ્યાનું-ધર્મમાં સ્થીર કરવાનું ઇલ તે જરૂર પામે. પરન્તુ જે પોતે શ્રાવક છતાં-ઝડિભાન છતાં આવું પ્રલાવકપણું બતાવે નહિ તો અવશ્ય એને દોષ લાગે. મતુષ્ય પાસે જે શક્તિ હોય તે શક્તિ એણે પરમાર્થમાં વાગરવી જોઈએ.

પોતાના હન્દરે સ્વામી લાઇએ હુઃએ હોય, નરાધાર

આવિકાએ આજુવિકાને ખુને પોતાનો ધર્મ તળ બ્રષ્ટ થતી હોય, શ્રાવકો કંગાલ થઈ રહડતા હોય અથવા તો અન્ય ધર્મમાં જતા રહેતા હોય, તો શાસનની દાઝવાળો વીરનર એ સહુન કરી શકે નહીં. એમના ઉદ્ધાર માટે પોતાની લક્ષ્મી અર્પણ કરે, એમને જેઠિતાં સાધન પૂરાં પાડી આપી ધર્મમાં દદ કરે તો એ પ્રલાવક કહેવાય ! એની લક્ષ્મી ઉગી નીકળે, એ પાત્રમાં વાવેલું એને અનંતગણેા લાલ આપે.

હે રાજન ! શ્રાવક-આવિકા ક્ષેત્રને પોષવાનું હું તને ભાર મુક્કીને કહું છું તેનું કારણું એજ કે ખીણં પાંચે ક્ષેત્રનો આધાર શ્રાવક શ્રાવિકાજ છે. પૃથ્વી જુનમંદિરથી વિભૂષિત હોય પણું એને સાચવનારા શ્રાવકોને ન હોય તો—એ મંદિરો કેવી રીતે નલી શકે ? એમનાં પૂજન, સત્કાર તો શ્રાવક શ્રાવિકાએની ઉજ્ઞતિ ઉપરજ આધાર રાખે છે. માટે યત્નવડે કરીને પણું શ્રાવક અને શ્રાવિકાએનું રક્ષણું કરવું. એમના થકીજ ધર્મની ઉજ્વળાતા છે—શોલા છે. એમની ઉજ્ઞતિમાંજ ધર્મની. ઉજ્ઞતિ છે.

જે છતી શક્તિએ પોતાના સાધર્મિક બંધુનું હુંઘ હુર કરી શકતો નથી એનામાં ધર્મ પ્રેમ છે એમ ન સમજવું, જાલે ઉપરથી તે ગમે તેણલો આડંખર રાખતો હોય, ગાડી ઘોડે ફૂરતો હોય; પરન્તુ અજનના ગળામાં રહેલા સ્તરની માદ્રક એની લક્ષ્મી અને એનું જીવીત નિષ્ઠળ જાણવું. એ કૃપણું જાલે પોતાની લક્ષ્મી શુલ્ષ માર્ગે ન વાપરે પણું એના

મુવા પછી એ લક્ષ્મી ધીજના હાથમાં જ્યો અને તેનો શું ઉપરોગ થશે તે એ અદ્વિતી હોવાથી ન સમજુ શકે !

શ્રાવક શ્રાવિકા એ પણ સંધનું અંગ ગણુાય છે. એ સંધની લક્ષ્મિ કરતાં સંભવનાથ તીર્થંકરના જીવે પૂર્વ ભવમાં તીર્થંકર નામકર્મ બાંધ્યું અને તે સંભવનાથ થયા. માટે ઋદ્ધિવંતે પોતાના ગરીબ સાધર્મિકો તરફ અવસ્થ્ય ધ્યાન આપી ધર્મનો મહિમા વધારવો. એકવાર જમાડવાથી કે નોકારશી વગેરે કરવાથી જ કંઈ સાધર્મિકતા સમાપ્ત થતી નથી. ખરી સ્વામીવત્ત્સલતા તો એજ છે કે પોતાની જંદગીમાં પોતાના ગરીબ બાંધવોને વાસ્તવિક સુખી કરી તેમની આંતરડી ઢારવી.

શ્રાવક શ્રાવિકાએ જે સુખી હશે તો તેમનાથી ધર્મનું મહાત્મ્ય વધશે-તેએ પોતેજ ધર્મનું મહાત્મ્ય વધારશે અને એ બધેા લાભ જેણે એમને સારી સ્થિતિએ ચડાવ્યા છે તેમને મળે છે. માટે ઋદ્ધિવંતોએ પોતાના ગરીબ બાંધવોની સાર-સંભાળ અવસ્થ્ય લેવી. હે રાજન ! શ્રાવકેને મહદુદ કરવાની વાત તું ભૂલતો ના ?

વસ્તુતઃ જે કાળે જે ક્ષેત્ર સીદાતું હોય તે કાળે તેની ઉજ્જ્વલિ માટે જે પ્રયત્ન કરવામાં ન આવે તો એથી હાનિ થવાનો સંભવ રહે છે. લક્ષ્મીવંતોએ પોતાની લક્ષ્મીનો સફ્યય કરવો હોય તો એકજ ક્ષેત્રનું પોષણ કરવાથી-ભરેલામાં ભરવાથી થતો નથી. પરન્તુ સીદાતા ક્ષેત્રમાં ઉજ્જ્વલિને અર્થે જે પોતાની

લક્ષમી વાપરે તોજ તેને અધિકાધિક લાભ મળે છે. તે પણ પોતાના સગા સંખ્યાંથી કે સ્વાર્થની અપેક્ષા રાખ્યા વગર વપરાય તોજ લાભદાયક થઇ શકે. જેકે આ મારો સગો કે સંખ્યાંથી નથી પણ મારો સાધમિક ખંડુ હુઃખી છે માટે એનું હુઃખ મારે હુર કરવું કે જેથી એ પાછો ધર્મમાં સ્થિર થતું ધર્મ સાધન કરે. એવી નિષ્કામવૃત્તિથી પરમાર્થ કરે તોજ એની લક્ષમીની સાર્થકતા થાય ?

“ રાજનુ ? આજે તો સમય ધણો સારો થયો છે. શ્રાવક શ્રાવિકા સુખી અને વૈભવી છે. લિવિષ્યમાં એવો પણ કાળ આવશો કે જ્યારે ક્ષત્રિયમાંથી જૈન ધર્મ નષ્ટ થતાં ફૂકત વૈશ્યોને હાથ જર્થે લ્યારે તેઓ અર્થ પ્રધાન થશો. જેથી ધર્મના મહત્વને હાનિ પહોંચાડશો. પૈસાનેજ સર્વસ્વ સમજનારા દ્વયના પૂજારીઓ. પોતાના હુલરો ગરીબ બાંધવોને—શ્રાવક શ્રાવિકાઓને હુઃખી હાલતમાં જેશો છતાં એમની તરફ હુર્દક્ય કરતા પોતાને સ્વાર્થ સાધવામાંજ એકલપેટા થશો. જે ગરીબોના લોગો એ ઝડ્ધિમાન થશો એમનેજ એ તિરસ્કાર કરશો ને ભીજનાં ઘર ભરશો.

જેથી જૈન ધર્મની હાની વિશેષ થશો. શ્રાવક શ્રાવિકાઓ હુઃખી હુઃખી થઇ ધર્મભ્રष્ટ થશો. આજુવિકાની ખાતર ઉન્માર્ને ભજનારા થશો. સાક્ષાતું પોતાના સ્વામી ભાઈઓને હુઃખી જેવા છતાં એ ક્ષેત્ર તરફ કોઈ લક્ષ્ય ઓછુંજ આપશે પણ જે ક્ષેત્ર પુષ્ટ શયું હશે એનુંજ પોષણુ કરનારા થશો, જેથી સીદાતા ક્ષેત્રની તો હાની થશેજ. શ્રાવક શ્રાવિકાઓની સંખ્યા ઘટી જશો,

વस्ती નથુન થઈ જશે; એટલું જ નહીં પણ પુષ્ટ કરેલા શૈત્રનું
પણ વારંવાર પોષણું કરવા છતાં એમાંથી પણ અનેક અનથો
ઉત્પત્ત થશે. અસ્તુ હે નરકું જર ! એવી ભવિષ્યકાળની વાતો
કરી તારા શાસન પ્રેમીચિત્તને હું ક્ષોલ કરવા નથી છુંછતો !
જે ભાવી ભાવ-ભવિતવ્યતા ખનવાની હશે તે અવશ્ય ખનશે.
પંચમકાળમાં પ્રગટ થયેલા વડ-જડ જીવો પાસેથી એનાથી
ખીલું વધારે શી સારી આશા રાખી શકાય ! ગુરુવર આર્થસુહ-
સ્તીસ્વામી લક્ષ્મીને સહૃદ્યય કરવાનું વર્ણન કરીને અટક્યા.

“ ભગવન् ? અત્યારના સમયમાં મારે શું કરવું ? સાતે શૈ-
ત્રમાં કયા શૈત્રતરફ વિશેપ ધ્યાન આપવું ? ” મહારાજે પૂછ્યું.

“ અત્યારે તારે જુનચૈત્ય અને પ્રતિમા તરફ ખાસ
લક્ષ્ય આપવાની જરૂર છે. સમૃદ્ધિવંત શ્રાવક, શ્રાવિકા તેમજ
સાધુ સાધ્વીઓ એમના દર્શનવડે-ભક્તિવડે આત્મશુદ્ધિ
કરી ભવસાગર તરો જશે. ભાવી કાલમાં પણ ધણું સમય
પર્યંત એ મંહિરે અને પ્રતિમાઓનું જગત ઉપર અસ્તિત્વ
હશે ત્યાં લગી ચતુર્વિધસંધથી પૂનશે. એ બધો તને લાભ થશે.
ત્રણુણંડમાં તારું રાજ્ય હોવાથી દરેક દેશમાં જૈનમંહિરે થતાં
અને શ્રાવકોની સંખ્યા વૃદ્ધિ પામતાં અનાર્ય દેશમાં પણ
ધર્મની પ્રગતિ થશે એ બધા લાભનું કારણ તો તું જ છે ને ?
છતાં સાધ્મિકની ભક્તિ કરવી તું ભૂલતો નહીં. એવી રીતે
સાતે શૈત્રોની ભક્તિ કરતાં તારે સંસાર સ્વહૃપ થઈ જન્મ
મરણનો ઝેરો ટળી જશે. અજર અમર એવી મુક્તિ વધુનો.
હું લોક્તા થશે, ”

“ ભગવન् ? આજથી મારે મંદિરો ખંધાવવાની શરૂઆત કરવી, પ્રતિમાઓ પણ ભરાવવી, તેમજ જુના મંદિરોના જુહોંધારો કરાવવા હવેથી હું નિયમ કરું છું અને રોજ એક જુનમંદિર તૈયાર થયાના સમાચાર સાંભળવામાં આવશે ત્યાર ખાદ દાતણું કરીશ એ પ્રમાણે મહાન् સંપ્રતિએ રોજનું એક જુનમંદિર તૈયાર કરાવવાનોનિયમ અગ્રિકાર કર્યો.

તરતજ મહાન સંપ્રતિએ લાખો માણસોને એ કામમાં નેડી હીધા. વેકેને રોજ મળવા લાગ્યી. ને ઠેકઠેકાણે જુન મંદિરો એક પછી એક તૈયાર થવા લાગ્યાં. દરરોજ મહારાજ સંપ્રતિ એકની ખખર તો ઓછામાં ઓછી સાંભળતો ત્યારેજ દાતણું કરતો. ત્રણ અંડ ધરતીમાં આર્ય કે અનાર્ય દરેક દેશોમાં ગામડું હો કે શહેર પ્રત્યેક ઠેકાણે મંદિર પોતાની શોભાથી પ્રજાનાં મન આકર્ષવા લાગ્યાં.



પ્રકરણ ઉર મું.

હુનિયા ધર્મને માર્ગે.

મહાન સંપ્રતિએ પોતાના સર્વે દેશોમાં પોતાના સુખટો અને શ્રાવકોને કૃત્રિમ સાધુ બનાવીને મોકલ્યા હતા. તેઓ હુનિયાના ખુણે ખુણે ઝરી વખ્યા. અનાર્ય દેશોમાં પણ

ત्यांना જડ જેવા લોકોને શું શું કરવું તે સમજાવવા લાગ્યા. અમને ઉપદેશ કરવા લાગ્યા. જુઓ—ધ્યાન આપો ! અમે આવીએ ત્યારે અમને ઉઠીને વંદન કરવું. દૃષ્ટિએ પડીએ કે પગે લાગવું. અમારી પાસેથી તમારે ધર્મોપદેશ સાંભળવો. અમને અમુક અમુક જાતનો આહાર વહેલાવવો, એ માટે અમને તમારે તેડવા આવવું. ઉનું કરેલું પાણી નિર્દ્દેખ રીતે ઢારીને તે અમને પીવા માટે વહેલાવવું. અમને કપડા વગેરે અમુક અમુક વહેલાવવાં, અમે આવીએ કે તમારે અમને ઉત્તરવાની જગ્યાઓ આપવી. તન, મનને ધનથી અમારી ભક્તિ કરવી. તમારે હુંમેશાં નવકાર ગણુવો, જુનમંદિરમાં દર્શન કરવા જવાં, તેમજ જુનરાજને પૂજવા. ઈત્યાદિક ખટ્કર્મ તમારે અવશ્ય કરવું. અમારી પાછળ અમારા જેવા સંપ્રતિ-રાજના માણુસો આવશે તેમની પણ તમારે ડેડા પ્રકારે એવી રીતે ભક્તિ કરવી. જેથી સંપ્રતિરાજ તમારા ઉપર પ્રસન્ન થશે. એ માણુસો સંપ્રતિ મહારાજના પૂજય છે. એમના ચુર છે માટે તમારે તેમની લક્ષ્ણમાં ખામી લાવવી નહીં. આહાર પાણી વહેલાવતાં એંતાલીશ દોષ ન આવવા જોઈએ. એ એંતાલીશે દોષો એમને વિસ્તારથી સમજાવ્યા—શીખવ્યા. તે સિવાય ચુરની તેત્રીશ આશાતના ન થાય તે પણ સમજવી—શીખ-વાડી દીધી.

જુનમંદિરમાં જાઓ. ત્યારે મોટી દશ આશાતનાએ અવશ્ય તમારે ત્યાગવી, જેવી કે જુનમંદિરમાં પાનસોપારી ન ખાવું, લોજન ન કરવું, પાણી ન પીવું, પગરખા ન પહેરી

જવાં, શબન ન કરવું, મૈથુન ન સેવવું, થુકવું કે મત્તેલેમ ન કરવાં, લધુનીતિ-બડી નીતિ ન કરવી, જુગાર કે હાસ્ય કુતુહલ ન કરવાં. ઈત્યાદિક તેમજ બીજી નાની આશાતનાઓ મળીને ચોરાશી આશાતનાઓ ન કરવી. એથી મોટું પાપ લાગે છે. એ પાપના ફ્રલથી આપણુને હુઃખ થાય છે. માટે આશાતના રહિતપણે જુનેશ્વરને પૂજવાથી સંપ્રતિ જેવી સમૃદ્ધિ મળે છે. એના કરતાં પણ વિશેષ દેવલોકનાં સુખ પ્રાપ્ત થાય છે. એ દેવતાઓનાં એવાં તો અનુપમ સુખ હોય છે કે આપણે તો એ સુખનાં વર્ષુન પણ ન કરી શકીયે. અરે ! એ સુખોનો ખ્યાલ કરવાની પણ આપણામાં શક્તિ ન હોય. આપણી અદ્ય કદમ્પનાથી પણ અતીત એ સુખો કહેવાય. જો તમે જુનરાજની અને સંપ્રતિના અમારા જેવા માણુસોની ભક્તિ કરશો તો પહેલાં તો તમે સંપ્રતિના માનિતા થશો અને આ લોકમાં સુખ સંપત્તિ પ્રાપ્ત કરશો. અને એ ભક્તિના પ્રલાવથી તમે દેવલોકમાં જશો. ત્યાં અનેક દેવાંગનાઓ તમારી સેવા કરશો કે જે દેવાંગનાઓ મનુષ્યની સુંદરમાં સુંદર ગણ્યાતી સુંદર રમણી કરતાં અસંખ્યગણી શ્રદ્ધા, સુંદર અને ચતુર છે. તમને સુખી કરવામાં-લોગની કળામાં નિપુણ—પંડિતા છે. એ દેવાંગનાઓનાં હિંય સુખ લોગવતાં તમારો કાળ કેવી રીતે જાય છે તે પણ તમે જાણી શકશો નહીં. ત્યાં તમે અનગળ સમૃદ્ધિના સ્વામી થશો. જેમ દેવખાળાઓ તમારી સેવા કરી તમને સુખી કરશો એવી રીતે તમારા સેવક દેવતાઓ ગંધવો તમારી આગળ સંગીત કરશો. દેવખાળાઓ નાટારંગ કરશો

એ સંગીતમાં એ નાટારંગમાં તમારા વર્ષો પાણીના પ્રવાહની માટેક વહી જશો, એ દેવણાળાના શરીરની સૌંદર્યતા, લાવ-ધ્યતા, ચાતુર્યતા, એમના હાવલાવો, એમના ભૂલંગો એ સોહામણાં ચંદ્રવદ્ધનો નિહાળતાં તમે એવા તો સુંધર થઈ જશો કે હુઃખનો તમને સ્વર્પનામાં પણ હ્યાલ નહીં આવે.

એમનું એક નાટક જેતાં એટલો બધો કાલ વહી જાય છે કે આપણા અહીંના કાલની ગણુતરી કરીયે તો પાંચસો વર્ષ વહી જાય, એથી પણ જુનરાજની ને ગુરુની અધિક ભક્તિ હૃદયના લાવપૂર્વક કરે તો તમે ધણા સારા શ્રેષ્ઠ દેવતા થઈ શકો! ત્યાં એક એક નાટારંગમાં હુલર વર્ષ વહી જાય, એથી ઉચ્ચ કેટીના દેવતાઓને પંદરસો વર્ષ પણ વીતિ જાય. એતો નાટકનો કાલ કદ્યો તે નાટક-સંગીત મનુષ્યો તો નજ મેળવી શકે—એની કદ્યપના પણ ન કરી શકે; કારણ કે જે વસ્તુનું જીથું જીથું પણ જ્ઞાન ન હોય—એનો હ્યાલ પણ ન થઈ શકે એનું સુખ તો દેવ થયા પછીજ મળે. એ નાટકો-સંગીતોની મોજ હુંટવાનો તો દેવતાઓનો અધિકાર છે. એવાં અનુપમ સુખો મેળવવા માટે આપણે જુનરાજની ભક્તિ અને ગુરુનું ખહુ-માન કરવું પડે છે.

આપણાં મનુષ્યોનાં નાટકો-સંગીતો કરતાં અનંતગણ્યાં એ ઉત્તરોત્તર અધિક સુખ આપનારાં હોય છે. પોતાની ધર્શા પ્રમાણે તે કરી શકે છે. મનને ગમે ત્યાં એક ક્ષણી માત્રમાં જઈ શકે છે. મરજી પડે તેવું સ્વર્પ કરી શકે છે. આનંદ, મોજ, ઠકુરાઈ

વિગેરે લોપગવી શકે છે. આપણું શરોરની માઝેક એમનું શરીર હોણી, માંસ, હાડકાં, મજના, વીર્ય વગેરે મળીનતાથી રહીત હોય છે. વળી બચપણું કે જરાવસ્થાથી રહીત એવા હુમેશાં તરણુવ્ય વાળા રહે છે. એમનું શરીર હિંદ્ય વૈક્રિય પુફુગવોનું ને સુંગધમય હોય છે. તેમજ તેજસ્વી, સૌંદર્યસંપત્ત હોય છે કે જે શરોર મનુષ્યના ભાગ્યમાં જોવાને લખાયું નથી. એવીજ સુંદર એમની દેવાંગનાઓ હોય છે. એ દેવાંગનાઓ સાથેના સુખ મનુષ્યના સુખ કરતાં અનેક ગણું શ્રેષ્ઠ અને સર્વોત્તમ હોય છે.

આપણું મનુષ્યની માઝેક દેવતાઓના દેવાંગનાઓ સાથેના સંલોાગો અદ્ય સમયમાં પરિસમાઈત થતા નથી. બ્યાંતર જેવા દેવતાઓને પણ પ્રિયા સાથે સંલોાગ કરતાં સામાન્ય રીતે પાંચસો વર્ષ વીતી જાય છે. કેમકે એમને વીર્ય ન હોવાથી એવો લાંબો કાળ સંલોાગ સુખમાંજ મળ રહે છે. એથી ઉચ્ચ કોટીના દેવતાઓને દેવખાળાઓ સાથે મૈથુન સેવન કરતાં હુબ્લર વર્ષ પણ વહી જાય. તે થકી અધિક આયુષ્યવાળા દેવતાઓને પંદરસો વર્ષ પણ જતાં રહે આવો તો તેમનો સંલોાગનો કાળ હોય છે. એ એમનો ઉત્કૃષ્ટ કાલ ગણુયાય છે. આટલો કાળ જતાં પણ એ દેવતાઓ લોગથી ત્યારેજ નિવત્તે કે જ્યારે એમનું મન પાછું હુઠે. એમનું મન લરાઈ જાય-ધરાઈ જાય, સંતોષ પામે એટલે એ લોગ થકી વિરામ પામે અન્યથા તો એ લોગોમાં ને સંગીતમાં એકાશતા-આસક્રિતવાળા હોય છે. એઓ ઘણી શક્તિવાળા હોવાથી શ્રમ

તા એમને હોતો જ નથી. પરંતુ મનના નિવર્ત્તિ સાથે પોતે નિવૃત્તિ પામે.

હે લોકો ! એ દેવતાઓના સુખનું તમારી આગળ શું વર્ણન કરીએ. જુંદગી પર્યેત એમનાં સુખો વર્ણવીએ તો પણ એનો પાર આવી શકે નહીં. મનુષ્યની માઝક એમને ગર્ભાવાસનું હુંઘ સહન કરવું પડતું નથી. તેમજ એમને હુર્ગંધમય શરીરપણું ન હોય. વળી આચુષ્ય તો એટલાં બધાં લાંખાં હોય છે કે એ વર્ષોની ગણુત્તી પણ આપણે ન કરી શકીએ. એવાં સુખો તમારે મેળવવાં હોય તો માત્ર આ એકજ ઉપાય છે કે તમારે જીનેકદરોના મંદિરમાં પૂજન વગેરે કરવું. અમારા જેવા સંપ્રતિના માણુસોની લાક્ષ્ણી કરવી. ઈત્યાદિક સુખની લાલચવાળા ઉપદેશો. એ કૃત્રિમ સાધુઓએ અનાર્થ દેશોમાં આપવા માંડયા. એ ઉપદેશને ત્રણે હુનિયાના ખુણે ખુણે પડકાર કર્યો. ધર્મથી રહિત એવા જડ જેવા લોકોમાં એ લાલચથી ધર્મવાસના ઉત્પન્ન થઈ જેથી તેઓએ એ બધું કિયામાં મૂક્યું. કેમકે મુવા પછી આપણું શું થશો ? અહીયાંથી મરીને ક્યાં જઈશું વગેરે ચિંતાથી વ્યાપ્ત થયેલા એ અનાર્થલોકો મુવા પણીના સુખની આશાએ તેમજ કંઈક સંપ્રતિને પ્રસન્ન કરવાની ખાતર એમના માણુસોના ઉપદેશને અનુસરવા લાભ્યા.

સમસ્ત અનાર્થદેશ લગભગ જૈનધર્મને અનુસારે વર્ત્તન કરવા લાગ્યો. અનાર્થદેશોમાં પણ જૈનધર્મનું મહત્વ મહાન्. સંપ્રતિએ વધારી દીધું. એ કૃત્રિમ સાધુઓએ જેયું કે હવે સાચા સાધુઓને વિચરવાયોગ્ય આ શેર્ટો તૈયાર થઈ ગયાં છે

જેથી એમાંના કેટલાકે મહારાજ સંપ્રતિ પાસે આવીને અરજ કરી કે “ હેવ ? આપતુ કાર્ય કૃતોહમંદ થયું છે. અનાર્ય દેશોમાં પણ આપણા સાધુઓ વિહાર હવે સુખપૂર્વક ભલે કરે ? ”

મહાન સંપ્રતિએ તે પછી આર્ય સુહસ્તિ સ્વામી પાસે આવી અનાર્ય દેશોમાં સાધુઓને વિહાર કરવાને વિનંતી કરી, શુરૂવરે પ્રથમ પરિક્ષા કરવાની ખાતર જે પરિસહને સહન કરી શકે એવા ૫૬ પરિણામવાળા સાધુઓને તે દેશોમાં મોકલ્યા. એ સાધુઓ અનાર્ય દેશોમાં ફર્યો. તો લોકો એમને સંપ્રતિના અમલદાર જાણીને પૂર્વની શીખવેલી પદ્ધતિ પ્રમાણે આહાર પાણી આપવા લાગ્યા. એમને રહેવાને નિર્હોષ્ણ જગ્યાઓ આપવા માંડી. જેમ જાણુ પુરુષો જેવી રીતે ભક્તિ કરી શકે છે તેવી રીતે આ લોકોની ભક્તિ જોઈ સાધુઓ સંતોષ પામ્યા. ને શુરૂ પાસે આવીને જે સત્ય વાર્તા હતી તે કહી સંભળાવી. ગુરુએ પણ ત્યારપછી શિષ્યોને દરેક દેશોમાં વિહાર કરવાની રણ આપી. જેથી સાધુઓ સંપ્રતિની ત્રણુ ખંડ ધરતીમાં લગભગ ધર્મને સ્થળે વિહાર કરી શકતા અને લોકોને ધર્મમાં દ્રઢ કરી શકતા. પરિણામે એ સમયમાં શક, યવન, પારસ, ત્રીસ, સિંધ, કુમ, આદિ દરેક દેશોમાંના લોકો જૈન ધર્મને અનુસરનારા હતા.

પેલા કૃત્રિમ સાધુઓએ પણ પછી એ વેશનું મહત્વ સમજુને કાયમ રાખ્યો. તે વેશથી કૃત્રિમને બદલે શુદ્ધ સાધુ થઈ ચારિત્ર માર્ગનું આરાધન કરીને એમણે પણ આત્મકલ્યાણ સાચ્યું.



પ્રકરણ ઉત્ત ભું.

ગાજેદ્રતીર્થમાં આર્ય મહાગિરિ સ્વર્ગે.

“ ઓહા ! કયાં રંક લિખારી એક હુકડા માટે ટળવળનાર, અને કયાં સંપ્રતિ ત્રણ ખંડની સમૃદ્ધિનો માલેક ! જ્યારે લદ્ધમીનો અવકૃપા થાય છે. ત્યારે પુરુષની એવી તો અધોગતિ થાય છે કે ત્રણ ત્રણ દિવસનો ભૂખ્યો છતાં એક હુકડા માત્ર એને મળતો નથી. આહા ! શું સંસારની એ વિચિત્રતા ! એ બધા કર્મના વિલાસો છે. ગરીબ, અનાથ, લુલા, લંગડા, અંધ અપંગ માણુસોની શી સ્થિતિ હશે ? એમનો નિર્વાહ શી રીતે ચાલતો હશે ! અરે એક રોટલાના હુકડા માટે મને જે હુઃખ હતું એવું હુઃખ ગરીબોને કેમ નહીં હોય ? જિચારા એ ભૂખ્યા સુતા હશે—આખો દિવસ ભૂખ્યા રહેતા હશે. માટે મારે એમની સાર સંભાળ લેવી જોઈએ. રાજ તો ગરીબ, અનાથ અને રંક જનોનો એલી હોય છે. પ્રભના પિતારૂપ ને રાજાની પ્રભ હુઃખી હોય એ રાજ જ ન કહેવાય. હુઃખી પ્રભને હુઃખ સુક્તા ન કરી શકે તો એ માટે એને માથે જોખમદારી વધે જાય છે. માટે મારે પણ આવા અનાથ, રંક જનોને માટે કંઈક કરી જવું જોઈએ.” મહાન્ સંપ્રતિને એક દિવસ આ પ્રમાણે વિચાર સ્કૂર્ચે. પોતાનું પૂર્વજનમનું રંકપણું યાદ આવતાં તેના સુકોમળા હૃદયમાં દ્યાનો પ્રવાહ જોરથી વહેવા માંયો.

એ દ્વારા પરિણામે નગરના ચારે દ્વારમાં એમણે લોજનશાળાઓ કરાવી, એ લોજનશાળાના લોજનનો દરેક જનો લાભ લેતા હતા. આ પોતાનો છે અને આ પારકો છે, એવી જતનો મમત્વ ત્યાં નહોતો. અનેક ગરીબ અનાથ, અપંગજનોને ત્યાં લોજન આપવામાં આવતું હતું અને એ લોજનમાંથી શોષ ને ખાકી રહેતું તે રસોઈ કરનારાઓ લઈ જતા હતા.

એને માટે મહારાજે વ્યવસ્થા સારી કરી હતી. પોતે જતે પણ તપાસ રાખતા હતા. કે જેથી કામ કરનારાઓ મારા તારાપણું રાખીને ગરીબોને સતાવે નહીં. મહાનું સંપ્રતિનો તાપજ એવો હતો કે માણુસો પ્રાયઃ અનીતિ કરવાની હિંમત પણ કરતા નહિં. તેમજ એ લોકો પણ સમજતા કે આ પરમાર્થ-લોકોને ઉપકાર કરનારું કાર્ય છે. એમાં જો આપણે સ્વાર્થદ્રષ્ટિ રાખીને વિક્ષેપ કરશું કે કંઈ પણ લોદ્ભાવ કરશું તો પાપના ભાગી થઈશું; તેમજ મહારાજના અધિક ગુનહેગાર થઈશું. માટે ફુરાચારથી દૂર રહેનારા એવા એ લોકો બનતા લગી તો પ્રમાણિકપણેજ કામ કર્યો જતા હતા.

એક દિવસ મહાનું સંપ્રતિ એ લોજનશાળાઓ તપાસવાને ગયા. એમણે એની વ્યવસ્થા જોઈ માણુસોની કામ કરવાની પદ્ધતિ, પ્રમાણિકપણું વગેરે જોઈને ખુશી થયા. એમને એક વિચાર સ્કુર્યો. એમણે માણુસોને પૂછ્યું. “ અરે ? લોજનનું અજ વધે તેનો શું ઉપયોગ કરો છો ? ”

મહારાજનો પ્રશ્ન સાંભળી રસોઈઆઓ બોલ્યા. “ હેવ ! તે અમે ભાગો પડતું વહેંચી લઈએ છીએ. ”

તો હવેથી તમારે વહેંચી ન લેવું. હું તમને જેવી આજા કરું તે પ્રમાણે એની વ્યવસ્થા કરવી. ”

મહારાજની નવીન વાત સાંભળવા રસોઈઅઓ ત્યાં એકઢા થયા ને મહારાજ શું કહે છે તે આતુરવંત થઈને સાંભળવા લાગ્યા.

“ એ લોજન આપણે લોકોને માટે બનાવી તૈયાર કરીયે છીયે માટે એ નિર્દેખ શુદ્ધ અજ તમારે લિક્ષાના અર્થો એવા સાધુઓને વહેંચાવવું ? ”

“ પણ હેવ ? એ અજ અમે અમારા મહેનતાણુને અદલે લઈએ છીએ તે ? ” એક જ જીણે કહ્યું.

“ તમારી મહેનત માટે હું તમને દ્રવ્ય આપીશ. જેથી તમારી આજીવિકાનો વાંધો રહેશો નહીં. કેમકે દ્રવ્યવાન માણુસ અયાંય પરાભવ પામતો નથી, માટે તમારે હવેથી આ અજ સાધુઓને વહેંચાવવું ને એમની લક્ષ્ણ કરવી. ”

મહારાજ એ પ્રમાણે હુકમ કરીને ચાલ્યા ગયા. ત્યારથી શેષ અજ-સોજનાદિ તેઓ સાધુઓને વહેંચાવવા લાગ્યા. ચોતાને માટે તે નહીં થયેલું હોવાથી શુદ્ધ જાણીને સાધુઓ પણ અહેણું કરવા લાગ્યા.

એ પ્રમાણે અવશિષ્ટ અજથી સાધુઓને પ્રતિલભાતા જોઈને મહારાજ ખુશી થયા. હવે એમને ખીંલે વિચાર સ્કૂર્ચો. જેથી એમણે નગરમાં ધી, દ્વારા, પકવાન, વખો ગંધીયાણું વગેરે વેચનારા લોકોને હુકમ કર્યો કે “ તમારે તમારા ઉત્તમો-

તમ દ્રંયોથી સાધુઓની લક્ષ્ણ કરવી. અને એના જે પૈસા થાય તે તમારે દરખારમાંથી લઈ જવા. એ માટે તમારે લેશ પણ શાંકા કરવી નહીં. ”

આ સાંકળીને વ્યાપારીએ તો ઉલટા ખુશી થયા. કારણું કે એ બહાને તેમની હુકાનોમાંથી ઉત્તમ ઉત્તમ વસ્તુ-ઓનું વેચાણ થતું હતું. વ્યાપારીને એથી વિશેષ હું ખીને શો હોય ? મહારાજનું વચન એમણે માન્ય કર્યું. અને દરરોજ તે વ્યાપારીએ પોતપોતાની ઉત્તમ વસ્તુઓ સાધુઓને વહેં-રાવવા લાગ્યા. જે જે વસ્તુઓ તેઓ સાધુઓને આપતા તેની વ્યાજખી કિંમત તરતજ મહારાજના હુકમથી તિનોરી-માંથી પગાર કરવામાં આવતી હતી. પોતાનાથી બની શકે તેટલી શક્તિથી જૈન શાસનમાં દ્વદ્દી શ્રદ્ધાવાળા મહાન સંપ્રતિ ગુરુ અને ધર્મની લક્ષ્ણ કરવા લાગ્યા.

રાજ જેનું મૂલ્ય આપે છે એવી વસ્તુઓ લોડો પાસેથી વહેંરનારા પોતાના શિષ્યોને દોષ લાગે છે, એવું આર્યસુહ-સ્તિ સ્વામી જાણુતા હતા. પરન્તુ શિષ્યોના મોહથી એ બધું સહુન કરતા હતા. એમનો આવો શિથિલ આચાર આર્ય મહાગિરિ સ્વામીના જાણુવામાં આવ્યો, એતો એકાકી વિહારી હતા. પોતાના શરીર ઉપર પણ નિસ્પૃહ હતા. એમણે વિચાર્યું કે “ આહા ? આર્યસુહસ્તિજી જાતા છતાં આ બધું દોષ યુક્ત કેમ કરી રહ્યા છે, આ ઠીક થતું નથી. ”

એક દિવસ આર્ય મહાગિરિએ એમની પાસે આવી

આર્યસુહસ્તિ સ્વામીને કહ્યું “તમારા શિષ્યો લોકો પાસેથી વહોઠી લાવે છે ! પણ એનું મૂલ્ય તો રાજ આપે છે. રાજભીંડ આપણુંને ન કહ્યે તે તમે જાણુતાં છતાં શા માટે શિષ્યોને નિષેધતા નથી.”

“હે ભગવન् ! લોકો તો પૂજતાને પૂજનારા છે. અમોને રાજપૂજય માનીને આદરમાનથી વસ્તુએ આપે છે એમાં શું ?” આ વચન સાંભળીને આર્ય મહાગિરિ કોધથી મૈન થઈ ગયા. તે પછી ઓદ્યા. “એમાં શું ? પાપ શાંત થાએ ? આજથી આપણો વ્યવહાર લિન્ન છે. કારણું સમાચારીમાં સમાન સાધુએ સાથે રહેવું ચુક્ત છે. તમારું વર્તન એથી ઉલદું છાવાથી તમે સંઘાડા બણાર છો ! ”

એક રીતે આર્યસુહસ્તિસ્વામીના એ શુરૂ હતા. એમને દીક્ષા આપનાર આર્ય મહાગિરિજ હતા. છતાં શુરૂભાદ્યની જેમ સ્નેહથી તેએ બન્ને રહેતા હતા. આયે મહાગિરિની ઉપર પ્રમાણેની વાણી સાંભળીને આર્યસુહસ્તિ સ્વામી તીર્થ-કર સહૃદા આજા લોપના ક્ષયથી કંપવા લાગ્યા. બાલકની જેમ ક્ષયથી લતાની માદ્ક કંપતા ભક્ત આર્યસુહસ્તિએ આર્ય મહાગિરિના ચરણમાં વંદન કરી ક્ષમા માળી. “હે ભગવન् ! હું અપરાધી છું. મારો અપરાધ ક્ષમા કરો ? હું એ માટે મેચયાહુષ્કૃત આપું છું. મારું એ પાપ શાંત થાએ ? નિષ્કૃ-જ થાએ ! ફરીથી આ પ્રમાણે હવે નહી થવા પામે ! ” સુહસ્તિસ્વામીને આ પ્રમાણે પશ્ચાતાપ કરતા જેઠ આર્ય મહાગિરિ ઓદ્યા. “એમાં તમારો શો હોષ છે ! ભવિતવ્યતાજ

એવી છે ! પૂર્વે મહાવીર સ્વામી ભગવંતે કદ્યું હતું કે—
 “સ્થૂલિલદ્ર સુનિ પછી મારા શિષ્યોની સમાચારી અતિશિથિલ
 થતી જશો. આજે સ્થૂલિલદ્ર પછી આપણે તીર્થ પ્રવર્ત્તક થયા
 અને ભગવાનનું વચન તમે સત્ય કરી બતાવ્યું.”

તે પછી આયે મહાગિરિએ સુહસ્તિ સ્વામીને સંધાડમાં
 લીધા. ને રાજને પણ ઉપદેશ આપ્યો. હે રાજન ? ઉત્તામ
 એવા સાધુઓને રાજપિંડ લેવો કહ્યે નહીં. ભાવીકાલમાં કાંઈ
 અધા રાજાઓ તમારા જેવા થશે નહીં. એથી અનેક દોષેનો
 સંભવ જાણીને શ્રી ભગવંત મહાવીર સ્વામીએ રાજપિંડ
 નિષેધ્યો છે. જેથી વિશેષ પ્રકારે સાધુઓને તો તે અચાહ્ય છે.
 પૂર્વે પણ રૂપભાવસ્વામીએ પોતે ઈંદ્રાદિકની સાક્ષીએ ભરત-
 મહારાજના રાજપિંડને પણ સાધુઓ માટે નિષેધ્યો હતો. તે
 પ્રભુએ ખારમું વ્રત પોષવાને ભરત મહારાજને પણ શ્રાવક
 અને શ્રાવિકાઓને તેવા દાનને પાત્ર કર્યાં હતાં. માટે હે
 વત્સ ? તું પણ તેજ માર્ગ ચાલ.

મહાન સંપ્રતિને એ પ્રમાણે પ્રતિષેધી આર્થમહાગિરિ
 સ્વામી લુંતસ્વામીને વાંદીને અવંતિમાંથી ચાલ્યા ગયા.

‘ પોતાનું આયુષ્ય અદ્ય રહેલું જાણીને શ્રી મહાગિરિ
 ‘ગાજેંડ્રપદ’ નામના તીર્થમાં આવ્યા. ત્યાં અનશાન કરીને મહા-
 ગિરિ વીર પછી ૨૪૮ વર્ષ વિત્યે દેવલક્ષ્મી લોગવવાને સ્વર્ગે ગયા.



મનુષુ ઉત્ત્ર મું.

ગજેં દ્રપદતીર્�.

ગજેં દ્રપદતીર્થ એ શ્રીમન ભગવન મહાવીર સ્વામીના સમયમાં પ્રગટ થયેલું. એક દિવસ મહાવીર સ્વામી વિહાર કરતા દશાર્ણુદેશમાં દશાર્ણુપુર નગરની સમીપે દશાર્ણુ પર્વત ઉપર પરિવારસહ સમવસર્યા. ત્યાંના રાજી દશાર્ણુભદ્રને ખબર પડતાં એ ભગવનને વાંદવા જવાની તૈયારી કરવા લાગ્યો. એને એવો વિચાર થયો કે હું ભગવંતને એવા મહોત્સવપૂર્વક વાંદીશ કે એવી રીતે કોઈએ ન વાંદ્યા હોય, જેથી આપા શહેરને શાણુગારવાને હુકમ આપ્યો. રાજીના હુકમથી પ્રબળ અને અમલદારોએ ધ્વનિ, તોરણ, ચંદનમાળાદિથી શહેરને સુશોભિત કર્યું. તેમજ અગર, તગર, કપુર આદિ સુગંધિ દ્રોગોથી રસ્તા અને આકાશ વ્યાપ્ત થઈ ગયાં. રાજમાર્ગે પુણ્યો મિઠાવવામાં આવ્યાં. એવી રીતે નગરને સુશોભિત કરવામાં રાજીએ કંઈ પણું મણ્યુ રાખી નહિ.

હું પ્રભાતે રાજી દશાર્ણુભદ્ર હુસ્તિઓમાં શ્રેષ્ઠ એવા ચીતાના પદૃહસ્તિ ઉપર આરૂપ થઈને ચાહ્યો. એની સાથે અદ્દાર હંજર હસ્તી, ચોરાશીલાખ અંધ્ય, એકવીશહંજર રથ, એકાણું કોડ પાયદળ, સોળ હંજર ધ્વનિ, પાંચ મેધાડંખર છત્ર, સુખાસને બેઠેલી પાંચસો રાણીઓ, તેમજ આભૂષણુ વસ્ત્ર પ્રમુખથી સંજ થઈ રહેલા સામંત, સચ્ચિવાદિક ચાલ્યા.

એની સાથે લોકો પણ પોતપોતાની ઝડ્ધુ પ્રમાણે તૈયાર થઈને આવ્યા. સ્થળે સ્થળે સંગીત નૃત્ય થતાં હતાં. યાચકોને રૂપાનું સોનાનું ને મુક્તાઙળનું દાન અવાર નવાર દેવામાં આવતું હતું. રસ્તા ઉપર પુષ્પો પાથરી દેવામાં આવ્યાં હતાં. એવા સુંદર રાજમાર્ગે આડંખરપૂર્વક ચાલતો તે રાજ જગતને તૃણું સમાન ગણવા લાગ્યો. પ્રભુના સમવસરણું આગળ પહોંચ્યો. એટલે વાહન ઉલાં રખાવી પંચ અભિગમ સાચવી પ્રભુને પ્રદક્ષિણાદ્ધ યોગ્ય સ્થાનકે એઠો. એના મનમાં ગર્વ આવ્યો કે “આજે હું જેટલી સમૃદ્ધિથી વંદન કરવા આવ્યો છું તેટલી સમૃદ્ધિથી કોઈ દિવસ દીદ કે ચક્કવતી રાજ પણ વંદન કરવા નહીં આવ્યા હોય !”

રાજનાં આવાં ગર્વિષ્ટ વચન સૌધર્મ દેવલોકના અધિપતિ ઈદે અવધિજાનથી જાણ્યાં અને વિચાર થયો. “અહો ! આ રાજ શ્રેષ્ઠ છે; પરન્તુ તે ગર્વ કરે એ તો ઢીક નહિ. કારણું કે ગર્વથી મેળવેલું પુષ્પ નાશ પામે છે. બધા વિશ્વને પૂજ્ય એવા પ્રભુને વંદન કરવામાં એનો લક્ષિત રાગ આણુમોદી છે. પણ આ અહુંકારનો એમાં દોષ રહેલો છે. તો કોઈ રીતે એ પોતાનો ગર્વ તજે એ પ્રમાણે મારે કરવું એ ઢીક છે.”

એમ ચિંતવીને શકેન્દ્રે દશાર્ણુલદ્રનો ગર્વ ઉતારવાને માટે આકાશમાં ચોસઠહળાર હુસ્તિ વિકુલ્યાં. એક એક હુસ્તિને પાંચ-શેને બાર ખાર મુખ કર્યાં. એક એક મુખે આડ આડ દંતુશળ બનાવ્યા. દરેક દંતુશળે આડ આડ વાવ્યો. અને દરેક વાવ્યોએ આડ આડ કમલ પ્રગટ કર્યાં. દરેક કમલે એક એક કણ્ઠિકા જ-

થુાતી હતી. એ દરેક કર્ણિકા ઉપર શકેંદ્રે પોતાને એસવા ચોઅય અણુમોલ સિંહાસન ગોઠવ્યાં હતાં, ત્યાં ઈંદ્ર પોતે પોતાની આઠ પદૃરાણીએ। સાથે એઠો. એ દરેક કમલને લાળ લાળ પાંદડાં હતાં. એ દરેક પાંદડા ઉપર ખત્રીશ ખત્રીશ હેવ હેવીએ। ખત્રીશ પ્રકારનાં નાટક કરતાં હતાં. એ ખધું ઈંદ્રે પોતાની શક્તિથી વિકુંઘું. એ ખત્રીશ નાટક જોતો ને આકાશમાં થતા હું હુલી નાંદે સમસ્ત વિશ્વનું ધ્યાન એંચતો ઈંદ્ર નીચે ઉત્તરવા લાગ્યો. નીચે ઉત્તરી પ્રભુને વાંદી વંદન કરી ચોઅય આસને એઠો. ઈંદ્રની આવી અપૂર્વ શક્તિથી સર્વે ચક્કિત થઈ ગયા હતા.

દશાર્થભદ્ર રાજ તો ઈંદ્રની આવી અપૂર્વ સમૃદ્ધ જોઇ ચિત્રમાં આળેખયો. હોય એવો સ્તંભિત થઈ ગયો. તેને પોતાનો ગર્વ ઈંદ્રની સમૃદ્ધિ અને સામર્થ્ય જોઇ ઉત્તરી ગયો.

ને સમયે ઈંદ્રને હસ્તિ ઉપરથી ઉત્તરવાનો વિચાર થયો; ત્યારે પોતાના સ્વામીને સુખપૂર્વક નીચે ઉત્તરવાને માટે હસ્તિએ પોતાનો સધળો ભાર પોતાના એ આગલા પગ ઉપર લઈ લીધો. ભારને લીધે તેના બન્ને પગો પૃથ્વીમાં પેસ્તી ગયા. પછી ઈંદ્રે નીચે ઉત્તરીને પ્રભુને પ્રણામ કર્યો. જ્યાં હસ્તિના પગ પૃથ્વીમાં પેસ્તી ગયા હતા તે સ્થાનકનું ‘ગજપદ’ એવું નામ પાડયું. અને તે લોકોમા ગનેંદ્રપદ તરીકે પૂજાવા લાગ્યું. એ ગનેંદ્રતીર્થ ઉપર આવીને મહાગિરિ અનશન પૂર્વક સ્વર્ગે ગયા.

હવે દશાર્થભદ્ર રાજનો તો ગર્વ ઉત્તરી ગયો હતો. એણે ચિંતાયું કે “ અહો ? ધન્ય છે આ ઈંદ્રની ભક્તિને !

તેની સમૃદ્ધિ પાસે મારી સમૃદ્ધિ તો તૃણું સમાન છે. હા ! ધિક્કાર છે મને કે મેં વૃથા ગર્વ કર્યો. ડોઇએ જુનેશ્વરને સર્વ પ્રકારે પૂજ્યા નથી. ઈંદ્રે મને પોતાની સમૃદ્ધિથી હરાવી લીધો. હુવે જો હું દિક્ષા નહિ લઈશ તો હું હાર્યો કહેવાઈશ. માટે વત અહણું કરું કે જેથી ઈંદ્રથી પણ હું શ્રેષ્ઠ થાઉં.”

એમ વિચારી મહા યુદ્ધનિધાન એવા દશાર્ણુભદ્ર રાજ્યએ ગજ, અર્ધ, ખ્રી આદિથી શ્રેષ્ઠ એવું રાજ્ય એણે તત્કાળ તણું હીધું. ને પંચમુદ્રિ લોચ કરી પ્રબુ પાસે સંજમ લીધો. ઈંદ્રે જાણ્યું કે રાજ જીત્યો ? હું દીક્ષા લેવાને તો સમર્થ નથી. તેથી ઈંદ્રે ભક્તિ સહિત દશાર્ણુભદ્ર મુનિને વાંદીને કહ્યું “હે મહાનુભાવ ? તમને ધન્ય છે ! તમે સંયમવડે મને જીતી લીધો છે. એ સંયમને જીતવાને હું સર્વથા અસમર્થ છું. બીજાથી ન પુરી શકાય એવી પોતાની પ્રતિજ્ઞાને તમે પૂર્ણ કરી છે.” એમ વારંવાર એની સ્તુતિ કરતો વીર પ્રબુને વાંદીને પોતાને સ્થાનકે ગયો.

દશાર્ણુભદ્ર રાજ પણ દીક્ષા લીધા પછી ઘોર તપ કરી હુંકર્મનો ક્ષય કરીને કેવલપદ પામી મોક્ષે ગયા.

ગર્વથી ઈંદ્રને હરાવવાને લીધેલી દીક્ષા પણ દશાર્ણુ-મુનિને કર્મનો ક્ષય કરાવીને મુક્તિને અપાવનારી થઈ. એમ રંક બિખારીએ લોજનને માટે એક દિવસ જેટલી પણ લીધેલી દીક્ષા ત્રણું અંડની ઝડ્ઢી આપનારી થઈ.



પ્રકરણ ત૪ મું.

કંઈક નવાજૂની.

એક દિવસે સંપ્રતિ મહારાજે દિવાળીનું સ્વરૂપ પૂછ્યું.
કે “હે લગવન् ? દિવાળીને દિવસે હીવા પ્રગટે છે. તેનું
શું કારણ ? ”

તેના જવાખમાં આર્યસુહસ્તિ સ્વામીએ દિવાળીને
લગતું સ્વરૂપ કહી સંખળાવ્યું.

“હે રાજન ? મહાવીર સ્વામી પૂર્વ અસાડ શુદ ૬ ના
દિવસે દેવલોકથી ચ્યવેલા હોવાથી તે ચ્યવન કલ્યાણુક. ચૈત્ર
શુદ્ધી ૧૩ ની મધ્યરાત્રીએ પ્રભુનો જન્મ થવાથી તે જન્મ કલ્યા-
ણુક. ત્રીશ વર્ષ ગૃહવાસ પછી માગશર સુદ્ધી ૬ને દિવસે પ્રભુ-
એ ચારિત્ર લીધું તે દીક્ષા કલ્યાણુક. હુસ્સા તપ કરતાં ખાર
વર્ષ પછી વૈશાખ શુદ્ધી ૧૦ ના દીવસે કેવલજાન ઉત્પજ્ઞ થયું તે
કેવળ કલ્યાણુક ચોંધું. કંઈક ન્યૂન ત્રીસ વર્ષ કેવલપર્યાય લો-
ગવીને વીર પરમાત્મા પોતાનું આયુષ્ય અદ્ય જાણ્ણી અપાપા
નગરીએ આવ્યા. ત્યાં હસ્તિપાલ રાજની રાજસભામાં છેલ્લું
ચાતુર્માસ નિર્ગમન કર્યું. પ્રભુને આયુષ્ય થોડું ને તીર્થકર
નામકર્મનાં પુદ્ગળ અધિક હોવાથી એમણે છેલ્લાં સોળ પહોર
લગી અખંડ દેશના આપીને તે કર્મ લોગવી લીધું. એમાં
અવ્યજનોના સંશય ફૂર કર્યા. લાવીકાવનું સ્વરૂપ કહ્યું. એ

અરસામાં ગૈતમ સ્વામીને નજીકના ગામમાં રહેલા દેવશર્મા નામે પ્રાક્ષાણુને પ્રતિષેધ કરવાને મોકલ્યા.

આસો વહી અમાસને દિવસે સ્વાતિ નક્ષત્રનો ચોગ આવ્યો. ત્યારે છદુ તપના ધારણુ કરનાર પ્રલુ પાછલી ચાર ઘડી રાત્રી શેષ રહી તે સમયે બેઠા હતા. આસનકંપથી શહેર પ્રલુંનું નિર્વાણ જાણી ત્યાં દોડી આવ્યો. એમને વિનંતિ કરી. “ ભગવન् ! આપ એક ક્ષણુ ભાત્ર આયુષ્યની વૃદ્ધિ કરે, કારણુ કે આપના જન્મ સમયે સંક્રમેલો ભસ્મયણ હાલમાં એસે છે. જે બેહનાર વર્ષ પર્યાંત આપના શાસનને હેરાન કરશો. એથી તીર્થની ઉત્તેત્તિ થશો નહીં. માટે આપની દૃષ્ટિ આગળ જ એ ઉદ્ય પામી જય તો આપની દૃષ્ટિના પ્રભાવથી એનો ઉદ્ય નિષ્કળ થાય. ”

“ હે શહેર ? આયુષ્ય કર્સનાં પુહાલો પૂર્વભવને વિશે ખંધાયેલાં હોય છે. તેને અધિક કે ન્યૂન કરવાને કોઈની પણ શક્તિ નથી. તેમજ જાવીલાવ બનવાનું છે તે અવસ્થય બને છે. તે ટાળવાને કોઈ સમર્થ નથી. ”

ભગવન્ત એમ કહીને પછી મન, વચન અને કાયાના ચોગનો નિરોધ કરી મૌન રહ્યા. શૈલેશીકરણુ કરી સિદ્ધિ પદ પામ્યા. આ વખતે જેની યતના ન થઈ શકે એવા કુંથુઆ જીવો ઉત્પજ્ઞ થવાથી હુવે પછી ચારિત્ર પાળવું અશક્ય ખારી આ ઉત્તમ સાધુઓએ જીવરક્ષાને નિમિત્તે અણુસણુ કર્યું.

આ સમયે કોઈ કાર્યને માટે એકઢા થયેલા કાર્યી અને

કેશલ હેશના અઠાર રાજએ ચેડા મહારાજના સામંતો હતા. તે નવ મલકી જલ્લિના ને નવ લેચુંકી જલ્લિના હતા. તેઓએ અમાસને દિવસે પૌષ્ઠ કર્યો હતો. ને પૌષ્ઠમાં પ્રલુની વાણી સાંભળતા હતા.

એ વીરમાં લક્ષ્મિભાઈ રાજએ જુનેશ્વરના નિર્વાણુ કદ્યાણુકની પાછલી રાત્રે ભાવ ઉધોત નાશ પામવાથી અંધકારને સહુન કરવાને અસર્મર્થ એમણે દ્રવ્ય દીવાએ કર્યા. તેમજ તે સમયે ભગવંતનો નિર્વાણુ મહેતસવ કરવાને આવતા હેવ હેવી એના પ્રકાશથી રાત્રી તેજભય દેખાવા લાગી. તે સમયે અંધકારનો નાશ થાય એવાં રતનો હૃથમાં લઇને હેવતાએ બોલવા લાગ્યા કે “શ્રી જુનરાજ પ્રત્યે આ અમારું આરતી ઉતારણ થાએ.” આ હેતુથી લોકોમાં સર્વ ડેકાણુ મેરાઇઆ (મેઆરાત્રિક મારી આરતી) એ શાખ પ્રસિદ્ધ થયો, લોકો પણ હૃથમાં દીપક લઇને “આ મારી આરતી.” એમ બોલતા બોલતા ત્યાં આવ્યા. એ પ્રમાણે સર્વ સ્થાનકે દીવા થવા લાગ્યા. ત્યારથી પ્રતિવર્ષે એ પ્રમાણે થતું હેવાથી દિવાળીનું પર્વ પૂર્વી ઉપર પ્રસિદ્ધ થયું. તેમજ જુનશાસનમાં કદાચહુવાળા એવા મિથ્યાદ્રષ્ટિ હેવતાએ અને ભસ્તમથું જે હૃદપણું કરે છે, તે ફર કરવાને પણ આ મેરાઇઆ છે. તેનો અર્થ એવો થાય છે કે “શ્રી વીરપ્રલુના સંધની આર્તી-પીડા ફર થાએ. ! લોકમાં એવી રીતે દીવાળી પર્વ પ્રગટ થયું.”

હુવે પ્રલાતના જૈતમ સ્વામી દેવશર્માને બોધીને આવ્યા. તો માર્ગમાંજ એમણે મહાવીર સ્વામીનું નિર્વાણુ

સાંભળયું કે એમને ખેદ થયો. પછી અનિત્યની ભાવનાએ ચઢતા ક્ષપકશ્રેણી ઉપર આડદ થઈ કેવલશાન પામ્યા. ઈંદ્રે વીરપ્રભુને નિર્વાણ મહોત્સવ કરી પ્રાતઃકાલે જૌતમ સ્વામીનો કેવલ મહોત્સવ કર્યો.

ભગવંતના નિર્વાણથી એમના વડીલ બંધુ નંદીવર્ધન બહુ ખેદ પામ્યા હતા. એ ખેદમાં એમણે અજ્ઞ પાણી વગર એકમનો દિવસ લાઇના શોકમાં નિર્ગમન કર્યો. તેથી ઝીજને દિવસે એમની બેન સુદર્શનાએ લાઇને પોતાને ત્યાં તેડી લાવી એમનો શોક સુકાવી લોજન કરાયું, ત્યારથી લાઈધીજ જગતમાં પ્રસિદ્ધ થઈ. આજે પણ તે દિવસે બેન, લાઇને પોતાને ઘેર તેડીને જમાડે છે.” સુહુસ્તિ સ્વામી દિવાળીપર્વના માહાત્મ્યનું વર્ણન કરીને અટક્યા.

“ ભગવંત ! ભગવાન् મહાવીરનું શાસન કયાં સુધી ચાલશે. અને ઝીજા તીર્થીકર આ ક્ષેત્રમાં હવે કયારે થશે ? ” સંપ્રતિએ પૂછ્યું.

“ રાજન ! ભરમથાહનાં એ હુલર વર્ષ અને પાંચશો વર્ષીનાં મળીને પચ્ચીસો વર્ષ તો શાસન ડોળાશે, પણ તે પછી લૈન ધર્મને. ઉદ્ય થશે તે આ પાંચમા આરાના અંત લગી એક-બીશ હુલર વર્ષ પર્યેત અસ્ખલિતપણે ચાલશે. હાલમાં ચુગ-પ્રધાનોના ત્રેવીશ ઉદ્યમાં પહેલો ઉદ્ય પ્રવર્તે છે. પહેલા ઉદ્યની શરૂઆતમાં પ્રથમ સુધર્મા સ્વામી થયા અને છેલ્દા પુણ્યમિત્ર થશે. એ ઉદ્યમાં ૨૦ ચુગપ્રધાનો થવાના

છે. શ્રી મહાવીર નિર્વાણથી ૬૧૭ વર્ષ સુધીમાં પ્રથમ ઉદ્ય સમાપ્ત થશે તે પછી વજસેનસૂરીથી બીજો ઉદ્ય થશે. અંતમાં અહુનિમત્ર ચુગપ્રધાન થતાં બીજો ઉદ્ય સમાપ્ત થશે. બીજો ઉદ્યમાં ૨૩ ચુગપ્રધાનો થવાના શાસ્ત્રમાં કહ્યા છે. એ બીજો ઉદ્ય ૧૩૮૦ વર્ષ પર્યાત ચાલશે.

મહાવીરસ્વામીના મોક્ષગમન પછી ગૌતમ સ્વામી-કેવલજ્ઞાન પામ્યા. બાર વર્ષ પર્યેત કેવલીપણે વિચરી મોક્ષે ગયા. ને સુધર્માસ્વામીને કેવલજ્ઞાન થયું. સુધર્માસ્વામીથી પ્રથમ ચુગ પ્રધાનના ઉદ્યની શરૂઆત થઈ. પહેલા ઉદ્યમાં સુધર્માસ્વામીથી પુષ્પમિત્ર પર્યેત ૨૦ ચુગપ્રધાન થશે. આ ઉદ્યકાલ ૬૧૭ વર્ષ પર્યેત ચાલશે એનું કોષ્ટક આવી રહેતે સમજલું.

અનુક્રમ ચુગપ્રધાન અહ્વાસ દીક્ષાપર્યાય ચુગપ્રધાન સર્વાયુ-માસ-દીન

૧	સુધર્માસ્વામી	૫૦	૪૨	૮	૧૦૦-૩-૩
૨	જયુસ્વામી	૧૬	૨૦	૪૪	૮૦-૪-૫
૩	પ્રભવ	૩૦	૪૪	૧૧	૮૪-૨-૨
૪	શાખ્યાશવ	૨૮	૧૧	૨૩	૬૨-૩-૩
૫	થશોભદ	૨૨	૧૪	૫૦	૮૬-૪-૪
૬	સંભૂતિ	૪૨	૪૦	૮	૬૦-૫-૫
૭	ભદ્રભાડુ	૪૫	૧૭	૧૪	૭૬-૭-૭
૮	સ્થૂલિભદ	૩૦	૨૪	૪૫	૮૮-૫-૫
૯	મહાગિરિ	૩૦	૪૦	૩૦	૧૦૦-૫-૫
૧૦	સુહસ્તિ	૩૦	૨૪	૪૬	૧૦૦-૬-૬

૧૧	ગુણસુંદર	૨૪	૩૨	૪૪	૧૦૦-૨-૨
૧૨	કાલિકાચાર્ય	૨૦	૩૫	૪૧	૬૬-૧-૧
૧૩	સ્કંદિલ	૨૨	૪૮	૩૬	૧૦૬-૫-૫
૧૪	રેવતિમિત્ર	૧૪	૪૮	૩૬	૬૮-૫-૫
૧૫	ધર્મસ્કૃતિ	૧૮	૪૦	૪૪	૧૦૨-૫-૫
૧૬	ભરતગુપ્ત	૨૧	૪૫	૩૬	૧૦૫-૪-૪
૧૭	શ્રીગુપ્ત	૩૪	૫૦	૧૫	૧૦૦-૭-૭
૧૮	વજસ્વામી	૮	૪૪	૩૬	૮૮-૭-૭
૧૯	આર્યરક્ષિત	૨૨	૪૦	૧૩	૭૫-૭-૭
૨૦	પુણ્યમિત્ર	૧૭	૩૦	૧૩	૬૦-૭-૭

વજસેન સ્વામીથી યુગપ્રધાનોના ૨૩ ઉદ્ઘયમાં ખીણે ઉદ્ઘય થશે. એ ખીણે ઉદ્ઘયમાં ૨૩ યુગપ્રધાનો થવાના છે. છેલ્લા ત્રૈવીશમા અહુનિમત્ર યુગપ્રધાન થશે. ખીણે ઉદ્ઘય લગભગ ૧૩૮૦ વર્ષ પર્યાંત ચાલશે. તેની ગણુના અનુક્રમે સમજવી. નંબર યુગપ્રધાન અહવાસ દીક્ષાપર્યાંય યુગપ્રધાનપદ સર્વાયુ-માસ-હિન્દિ

૧	વજસેન	૮	૧૧૬	૩	૧૨૮-૩-૩
૨	નાગહુસ્તિ	૧૬	૨૮	૬૬	૧૧૬-૫-૫
૩	રેવતીમિત્ર	૨૦	૩૦	૫૬	૧૦૯-૨-૨
૪	સિંહસ્કૃતિ	૧૮	૨૦	૭૮	૧૧૬-૩-૩
૫	નાગાજુન	૧૪	૧૬	૭૮	૧૧૧-૫-૫
૬	ભૂતદિન	૧૮	૨૨	૭૬	૧૧૬-૪-૪
૭	કાલિકાચાર્ય	૧૨	૬૦	૧૧	૮૩-૭-૭
૮	સત્યમિત્ર	૧૦	૩૦	૭	૪૭-૫-૫

૬	હારિલ	૨૭	૩૧	૫૪	૧૧૨-૫-૫
૧૦	જુનપ્રભગણી	૧૪	૩૦	૬૦	૧૦૪-૬-૬
૧૧	ઉમાસ્વાતી	૨૦	૧૫	૭૫	૧૧૦-૨-૨
૧૨	પુષ્પમિત્ર	૮	૩૦	૬૦	૬૮
૧૩	સંભૂતિ	૧૦	૧૯	૪૯	૭૧-૨-૨
૧૪	સંભૂતિગૃહિત	૧૦	૩૦	૬૦	૧૦૦-૫-૫
૧૫	ધર્મરક્ષિત	૧૫	૨૦	૪૦	૭૫-૪-૪
૧૬	જયેષ્ઠાંગગણી	૧૨	૧૮	૭૧	૧૦૧-૩-૩
૧૭	કુલકમિત્ર	૧૪	૧૩	૪૯	૭૬-૭-૭
૧૮	ધર્મધોષ	૮	૧૫	૭૮	૧૦૧-૭-૭
૧૯	વિનયમિત્ર	૧૦	૧૯	૮૬	૧૧૫-૭-૭
૨૦	શીલમિત્ર	૧૧	૨૦	૭૯	૧૧૦-૭-૭
૨૧	રૈવાંતસ્કુરિ	૯	૧૬	૭૮	૧૦૩
૨૨	સ્વર્ણમિત્ર	૧૨	૧૮	૭૮	૧૦૮
૨૩	અહનિમિત્ર	૨૦	૧૬	૪૫	૮૧

૧૩૮૦ વર્ષી ખીને ઉદ્ય ચાલશે. તે પછી કાળાંતરે યુગ પ્રધાનનો ત્રીને ઉદ્ય પાડિવય (આદ્યસ્કુરિ) સ્કુરિથી થશે. આ ત્રીને ઉદ્ય સંવત ૧૯૬૦ માં થશે. ત્રીજી ઉદ્યમાં ૬૮ યુગ-પ્રધાનો થશે છેલાયુગ પ્રધાન વેશાખ થશે.

પાડિવયસ્કુરિ ૬ વર્ષ ગૃહસ્થપણુંમાં, ૮૨ વર્ષ વ્રતપર્યાય અને ૬ વર્ષ યુગપ્રધાનપણુંમાં, કુલ ૧૦૦ વર્ષ આયુષ્ય બોગવી હેવલોકે જશે. ત્રીને ઉદ્ય ૧૫૦૦ વર્ષપર્યાંત ચાલશે.

ચોથા ઉદ્યમાં પ્રથમ હરિસસહસ્રારિ ૮૨ વર્ષના આયુ-
ધ્વાળા થશે નવ વર્ષે દીક્ષા અહુણુ કરી ૬૦ વર્ષ વ્રતપર્યાય
અને ૧૩ વર્ષ યુગપ્રધાનપણુમાં એવી રીતે ૮૨ વર્ષનું આયુધ્ય
પૂર્ણ કરી સ્વર્ગે જશે. ચોથા ઉદ્યમાં ૭૮ યુગપ્રધાન થશે. છેલ્દા
સત્કીર્તિ નામે યુગપ્રધાન ૧૬ વર્ષ ગૃહસ્થપણે, ૨૨ વર્ષ વ્રતપ
ર્યાયને ૧૮ વર્ષ યુગપ્રધાનપણુમાં કુલ પદ વર્ષના આયુધ્ય-
વાળા થશે. આ ઉદ્ય ૧૫૪૫ વર્ષ પ્રમાણુ ચાલશે.

પાંચમો ઉદ્ય નંહિમિત્રસ્તુર્થી શરૂ થશે આ ઉદ્યમાં
૭૫ યુગ પ્રધાનો થશે. છેલ્દા યુગપ્રધાન થાવરસુત નામે થશે
એ પાંચમો ઉદ્ય ૧૬૦૦ વર્ષ પર્યાંત રહેશે.

છુટા ઉદ્યમાં પ્રથમ સૂરસેનસ્તુરિ થશે. અને અંતમાં
રહસુત યુગપ્રધાન થશે. આ ઉદ્ય ૧૬૫૦ વર્ષ પર્યાંત ચાલશે.
સાતમા ઉદ્યમાં રવિમિત્રસ્તુરિ પ્રથમ યુગપ્રધાન થશે. અને છેલ્દા
જ્યથમંગલસ્તુરિ થશે, આ ઉદ્ય ૧૭૭૦ વર્ષ લગ્ની રહેશે. આડમા
ઉદ્યમાં શ્રી પ્રલયુગ પ્રધાન થશે. તે ૧૩ વર્ષની ઉમરે દીક્ષા
અહુણુ કરશે. ૪૨ વર્ષ વ્રતપર્યાય અને ૮ વર્ષ યુગપ્રધાન પદ
ઓગવશે. જગતું વિખ્યાત કલાંકી આ આડમા ઉદ્યની શરૂ-
આતમાં અર્થાત શ્રી પ્રલયુગપ્રધાનના સમયમાં થશે. છેલ્દા
સિદ્ધાર્થ યુગપ્રધાન પછી એ ઉદ્ય પૂર્ણ થશે. આડમો ઉદ્ય
૧૦૧૦ વર્ષ પર્યાંત ચાલશે. કલાંકીના રાજ્યાંતમાં શ્રી પ્રલ
યુગપ્રધાન થશે.

છુટા ઉદ્યમાં ૮૯ યુગપ્રધાન, સાતમામાં ૧૦૦ યુગ

પ્રધાન ને આठમાગાં ૮૭ યુગપ્રધાનો થશે. એવી રીતે ૨૩ ઉદ્યમાં ૨૦૦૪ યુગપ્રધાનો આ પાંચમા આરામાં થશે.

સર્વે યુગપ્રધાનો એકાવતારી હોય જ્યાં જ્યાં વિચરે ત્યાં ચારે દિશામાં અઢીજોજન લૂભિમાં હૃષ્કાળ ડિંસક લુખોનો ભય નાશ પામે. ઉદ્યનું કોષ્ટક નીચે પ્રમાણે સમજવું.

ઉદ્ય. આદ્ય યુગપ્રધાન છેલ્લા યુગપ્રધાન વર્ષ પ્રમાણે યુગપ્રધાનસંખ્યા.

૧	સુધર્મા.	પુણ્યમિત્ર	૬૧૭	૨૦
૨	વજી.	અહનિમિત્ર	૧૩૮૦	૨૩
૩	પાડિવય	વૈશાખ	૧૫૦૦	૮૮
૪	હરિસંહ.	સતકીર્તિ	૧૫૪૫	૭૮
૫	નંદિમિત્ર.	થાવરસુત	૧૬૦૦	૭૫
૬	સૂરસેન.	રહસુત	૧૬૫૦	૮૯
૭	રવિમિત્ર.	જ્યમંગલ	૧૭૭૦	૧૦૦
૮	શ્રીપ્રભ.	સિદ્ધાર્થ	૧૦૧૦	૮૭
૯	મહીરતિ.	ઇશાન	૮૮૦	૮૫
૧૦	યશોમિત્ર.	રથમિત્ર	૮૫૦	૮૭
૧૧	ધાણુસિંહ.	લારણુમિત્ર	૮૦૦	૭૬
૧૨	સત્યમિત્ર.	દઠમિત્ર.	૪૪૫	૭૮
૧૩	ધમિત.	સંગતિમિત્ર	૫૫૦	૬૪
૧૪	વિજયાનંદ	શ્રીધરસુત	૫૮૨	૧૦૮
૧૫	સુમંગલ	માગધસુત	૬૬૫	૧૦૩
૧૬	જ્યદેવ.	અમરસુત	૭૧૦	૧૦૭
૧૭	ધર્મસિંહ.	રેવતીમિત્ર	૬૫૫	૧૦૪

૧૮	સુરદિન.	ક્રીતીમિત્ર	૪૯૦	૧૧૫
૧૯	વૈશાહિ.	સિંહમિત્ર	૩૫૬	૧૩૩
૨૦	કૌડિત્ય.	કુલકમિત્ર	૪૦૮	૧૦૦
૨૧	માયુર.	કલ્યાણમિત્ર	૫૭૦	૬૫
૨૨	વણિપુરી.	હેવમિત્ર	૫૬૦	૬૬
૨૩	શ્રીદિત્ત	કુલપસહસ્રરિ	૪૪૦	૪૦

છેદ્ધા કુલપસહસ્રરિ પછી પાંચમો આરો પૂરો થતાં જૈન ધર્મ નષ્ટ થશે. પછી રાજધર્મ નષ્ટ થશે ને છુટો આરો એસથે. એ આરો એકવીશહંજર વર્ષ પર્યંતનો પૂરો થતાં અવસર્પિણીના છ આરા પૂરા થઇ ઉત્સર્પિણીનો પહેલો આરો છફુટા આરા જેવો એસથે. અવસર્પિણીનો છેદલો અને ઉત્સર્પિણીનો પહેલો આરો ધર્મ-કર્મ અને વ્યવહાર રહિત સમજવો. એ આરાની અંતમાં સાતદિવસ પર્યંત જુહીજુહી જાતના વરસાદ થતાં પૃથ્વીમાં રસોત્પત્તિ થશે તેથી ધાન્ય વગેરે ડળી નીકળશે. અનુષ્ઠનનાં શરીર, આયુષ્યપણું ધીમે ધીમે વૃદ્ધિ પામશે, એક-વીશહંજર વર્ષનો તે આરો પૂરો થતાં ધીને તેટલાજ પ્રમાણું વાળો આવે છે. એ ધીન આરાની શરૂઆતમાં માણુસનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૦ વર્ષનું ને એહાથનું શરીર હોય છે.

આ વર્ત્તમાન અવસર્પિણીના પાંચમા આરાના અંતમાં પણ તેટલુંજ જાણી લેવું.

ઉત્સર્પિણીના ધીન આરામાં આયુષ્ય અને શરીર પ્રમાણું અનુકુમે વૃદ્ધિ પામતું જશે. તે અનુકુમે ધીન આરાના

અંતમાં સાતહાથનું શરીર અને ૧૩૦ વર્ષનું આયુષ્ય પ્રમાણું થશે. ખીજા આરાનાં કેટલાંક વર્ષો શેષ રહેશે ત્યારે જે જાતિ-સમરણ જ્ઞાન પામીને પ્રથમ પુર-નગર વળેરેની વ્યવસ્થા કરશે. અને તે પહેલો કુલગર કુહેવાશે, અનુકૂમે એના વંશમાં સાત કુલગર થશે.

ખીજે આરો પુરો થતાં ઉત્સર્પિણીનો ત્રીજે આરો શરૂ થશે એનાં સાડા ત્રણ વર્ષ જશે તે પછી સાતમા કુલગરને ત્યાં શતક્ષારપુર નગરમાં શ્રેણીક મહારાજનો લુધ પ્રથમ નરકના પહેલા પાથડામાંથી નીકળી પદ્ધનાલ નામે તીર્થીકર થશે. તે મહાવીર સ્વામીના સમાન આકૃતિ આયુષ્યવાળા થશે.

શ્રી મહાવીરસ્વામી અને પદ્ધનાલ તીર્થીકરને ૮૪૦૦૭ વર્ષ અને ૫ માસનું અંતર સમજુ લેવું. તેપછી અઢીસો વર્ષ મહા-વીરસ્વામીના કાડા સુરદેવ નામે ખીજ તીર્થીકર થશે એમ ત્રીજ આરામાં એકએકથી ચઢતી સ્થીતિ પ્રમાણે ત્રેવીશ લુન-વરો થશે. નવ વાસુદેવ, નવ ષણ્દેવ, નવ પ્રતિવાસુદેવ ને અગીયાર ચક્રવર્ત્તિએ ત્રીજ આરામાં પદ્ધાનુપુર્વીએ થશે. ચાથા આરામાં ચોવીસમા તીર્થીકરનો જન્મ થશે. તેમના સમયમાં ભારમા ચક્રવર્ત્તિ થશે તેમના મુક્તિગમન પછી કેટલોક કાળ જૈનતોત્વના જાણું એવા મુનિઓએ આ લરતક્ષેત્રને પાવન કરશે.

તેપછી યુગલિક ધર્મ સમીપ આવી પહેંચવાથી સુખ શીલીયા લુવો-સુખમાં મુંઘ લુવો ચારિત્ર લક્ષ શક્ષે નહી તેથી સાધુધર્મનો વિચ્છેદ જશે. સુખની સામની અધિક પ્રાપ્ત

થવાથી લોકો સુખનેજ લોગવનાર થશે. ને સાધુ ધર્મ વિચ્છેદ જવાથી ઉપહેશને અભાવે આવક ધર્મપણ વિચ્છેદ જશે. સર્વ કોઈ સુખમાં જ નિમજ્જ થશે આથી તીર્થનો વિચ્છેદ થશે. અતુક્કે સ્વામી સેવકનો ધર્મ પણ બધા મુખી હોવાથી નાશ પામશે. રાજ પ્રજાનો વ્યવહાર પણ લોકો અનીતિ રહીત હોવાથી નાશ પામશે ને સર્વે સમાન ઋદ્ધિવાળા થશે. યુગલિક ધર્મ પ્રગટ થતાં પહેલાં અધિન, ગામ, નગર, વ્યાપાર, કૃષિ વગેરે કાંઈપણ હોતું નથી. કદ્વપવૃક્ષો પ્રગટ થાય છે ત્યારે તેમની પાસેથી યાચના કરતાં જે જોઇએ તે યુગલિકો મેલવી શકે છે. એ યુગલિકો પણ ધણુ કાલ પર્યાત લોગમાં મગ્ન હોવા છતાં અતુસજ રહે છે. એમને વજડુષલનારાચ સંધયણ અને સમ ચતુરસ્ક સંસ્થાન હોય છે. તેઓ મુંદર અને કાંતિમાન હોય છે. રોગ, શોક, આધિ, વ્યાધિ, ઉપાધિ, દુઃખ, ખેદ, કુદ્ધીન, અરતિ વગેરે કાંઈપણ યુગલિકોને હોતું નથી. જુંદગીપર્યાત નિરોગી શરીરવાળા, સુખી, ઈચ્છા પ્રમાણે લોગ લોગવનારા અને પાપરહીત હોવાથી મરણ પદ્ધી પણ દેવલોકમાં જય છે. તે સમયે શાલી, દાલ, ઝોણો આદિ અનેક પ્રકારની ખાદ્ય વસ્તુઓ સ્વલાવથીજ લોજનને માટે યુગલીકોને કામ આવતી નથી. પૃથ્વીમાં પણ સાકર કરતાં અનંતગણી તે વખતે મીઠાશ હોય છે. અમૃતથી અધિક મીઠું જલ હોય છે. એ ભૂમિમાં ઉગનારા કદ્વપવૃક્ષોનાં ફુલ, પાંદડાં વગેરેમાં પણ ચકવર્ત્તિના લોજન કરતાં વધારે મીઠાશ હોવાથી તે ફુલફુલ વગેરેનો આહાર કરી

ધરની આકૃતિ સમાન ઉગેલાં એ કહેવુષ્ટોમાંજ ચુગલિકો નિવાસ કરીને રહે છે. ત્યાં જી, માંકડ, ડાંસ, મચ્છર, માખી વગેરે શરીરને ઉપરથ કરનારા ક્ષુદ્ર જીવો ઉત્પન્ન થતા નથી. હિંસાળું એવા સિંહ વ્યાપ્ત પણ અદ્ય કૃષાયવંત હોવાથી તે સમયે હિંસા કરતા નથી. મનુષ્યની માર્ક તિર્યંચ જીવો પણ જોડકાપણે ઉત્પન્ન થાય છે.

એવી રીતે આયુષ્ય, ખગ, શરીર વૃદ્ધિ પામતાં પાંચમા આરામાં જય છે. અનુક્રમે લ્યાંથી છફું આરે આવે છે તે પૂર્ણ થતાં પાછો અવસર્પિણીનો પહેલો આરો આવે છે. ઉત્સર્પિણીનો છફું અને અવસર્પિણીનો પહેલો આરો સરખાજ હોય છે. ફેર માત્ર એટલો જ કે ઉત્સર્પિણીમાં કાળ અનુક્રમે ચડતો હોય છે ત્યારે અવસર્પિણીમાં અનુક્રમે ઉત્તરતો કાલ આવે છે.

અવસર્પિણીનો પહેલો ભીજે ને ત્રીજે આરો ચુગલીક ધર્મવાળો હોય છે એટલે ઉત્સર્પિણીનો ચોથો, પાંચમો ને છફું અને અવસર્પિણીનો પહેલો ભીજે ને ત્રીજે એમ છ આરા ચુગલીક ધર્મવાળા હોવાથી લગભગ કંઈકન્યૂન અઠાર કેંડાકેડી સાગરોપમ પર્યત આ ભરતક્ષેત્રમાં ચુગલીક ધર્મ હોવાથી તે સમયે ધર્મનો વિચ્છેદ હોય છે. તેમજ કૃષિ, વાણી-જ્યાદિકથી પણ રહીત એ સમય સમજવો. એવી રીતે પાંચ ભરત અને પાંચ ઔરવતની સ્થીતિ સમજવી.

આવતા ઉત્સર્પિણીના ત્રીજા આરામાં થનારા તીર્થંકરનાં નામ લગવાન મહાવીરે શાસ્ત્રમાં ખતાવ્યાં છે તે પ્રમાણે સમજવાં.

આ પાંચમા આરામાં ભસ્મથહણું બળ અધિક હોવાથો જૈનશાસન બહુ ડોળાશે અનેક શાનુઓ એની ઉપર કટાક્ષ કરશે. એને અસત્ય ઠરાવવાનો પ્રયત્ન કરશે અને પોતાનું ખાડું હશે તેને સત્ય કરી સ્થાપશે; છતાં કાલના દોષે કરીને લોકોનાં મન એ અસત્યમાં સત્યનું લાન કરાવશે. અદ્યપસત્તવવાળા લોકો ઉત્પજ્ઞ થવાથી તેમજ બહુલકર્મી હોવાથી તપ કરવું કે કષ્ટસાધ્ય ધર્મસાધન કરવું એમને ગમશે નહીં. જીવાના લોલુપી એ લોકો ખાવા પીવામાંજ આસક્ત રહેશે. એવી રીતે પંચેંદ્રિયના વિષયમાં પ્રમત્ત એવા લોકોને આવો અપૂર્વ ત્યાગધર્મ ગમશે નહીં જેથી અનેક પ્રકારે એને ડોળવા પ્રયત્ન કરશે.

એટલુંજ નહીં પણું જૈન શાસનમાં પણું અનેક ગચ્છો પ્રગટ થશે. એ દરેક ગચ્છના આચાર્યો પોતપોતાના ગચ્છનું મહત્વ સ્થાપવા માટે પોતાનું સત્ય કહીને ખીલ મતને ઉત્થાપશે. એથી ગચ્છોમાં પણું અધડા ઉલા થશે. એવી રીતે અનુક્રમે આ ક્ષત્રિય ધર્મની સ્થીતિ વૈશ્યના હૃથમાં જતાં ચારણીની માર્ક થઈ જશે. એવી સ્થીતિમાં ભસ્મથહ પૂર્ણ થશે.

ભસ્મથહ ઉત્તરતાં એ વિખવાદ ઓછો થશે અને યુગપ્રધાનનો ગીલો ઉદ્ય થતાં જૈનધર્મમાં નવીન જોર પ્રગટ થશે. અંદર અંદરની આગ કંઈક શાંત પામશે.

એ યુગપ્રધાનેનો પ્રક્ષાવ ખીલ લોકોપર પણું પડશે. તેમના ઉપરેશની અસરથી ધર્મ વૃદ્ધિ પામતો જશે, ગમે તેવી

સ્થીતિ છતાં પાંચમા આરાના અંતપર્યેત જૈનધર્મ અસ્પલિત-
પણે રહેશે. જગત ઉપર જ્યાંસુધી જૈનત્વ હશે ત્યાંસુધી પુઢવી.
રસવાળી રહેશે. મેધવૃષ્ટિ કરશે. રાજ પ્રજાનો વ્યવહાર રહેશે.
કોકે સુખી જેવા જણુશે. વ્યાણિજ્ય, કૃષિકર્મ આદિ પણ ત્યાં
વળી રહેશે. પાંચમા આરાના અંતે છેદલા યુગપ્રધાન દુર્ઘસહ-
સ્તુરિ છઠુને તપે પ્રથમ હેવકોકે જશે. તે એ હાથના શરીરવાળા
થશે. તેપછી અનુક્રમે જૈનધર્મ નાશ પામશે. તેપછી તરતજ
રાજનું મરણ થતાં રાજ્યધર્મ નાશ થશે એટલે વ્યવહારધર્મનો
નાશ થશે. છઠુઆરાની શરૂઆતમાં એ હાથનું શરીર ને વીશ
વર્ષનું ઊત્કૃષ્ટ આયુષ્ય રહેશે, તે પ્રમાણું પણ અનુક્રમે એછું
થતું જશે. છઠુઆરાની શરૂઆતમાં ધરખાર, માલભિકૃત
વળેરે અભિના વરસાદથી નાશ પામી જશે.

આર્થસુહસ્તિ સ્વામીએ રાજના પૂછવાથી આગામિ-
કાલનું કંઈક વસ્તુ સુચન કહી બતાવ્યું. તેપછી રાજ વૈરાગ્યને
ધારણું કરતો ને ધર્મમાં પ્રીતિવંત થતો તેમાં અધિકપણે
સાવધ થયો.



મહરણુ ઉદ્ભુ.

અવંતી પાશ્વનાથ.

એક દિવસ આર્યસુહસ્તિ સ્વામી પોતાના પરિવાર સાથે વિહાર કરતા કરતા અવંતી નગરીમાં આવ્યા. તે લદા શેડાણીના એક વિશાળ મકાનમાં ઉત્તર્યા.

એકદા સાયંકાળે સૂરિવર નલિનીગુદમ વિમાનના અધ્યાચનનું પરાવર્તન કરતા હતા. તે લદા શેડાણીને દેવ સમાન કાંતિવાળો અવંતિસુકુમાલ નામે પુત્ર સાતમે મજલે ને લોગ વિલાસોમાંજ મળ્યા હતો તેના સાંલળવામાં આવ્યું. દેવાંગના સમાન બત્રીસ ખીચો સાથે લોગમાં મશગુલ છતાં એ અવંતીનું મન એ નલિનીગુદમ વિમાનનું અધ્યયન સાંલળવામાં અધિક ઉત્સુક થયું. પરન્તુ બરાબર સાંલળાતું નહીં હેવાથી તે કુમાર એ સુંદર રમણીઓનો ત્યાગ કરીને નીચે ઉત્તર્યો ને વસ્તીદ્વાર આગળ આવ્યો.

એ અધ્યયન સાંલળતાં એને વિચાર થયો. કે આવું મેં ક્ષ્યાંક જ્યેચું છે તેમ ઉહાપોહ કરતાં એને જલિસ્મરણ શાન થયું એટલે સૂરિવર પાસે આવી એમને વાંદી કહેવા લાગ્યો. કે “ભગવન् ? આપ શું એ વિમાનમાંથી આવો છો ? ”

આચાર્યો એના સામે જોઈ સમીત મુદ્રાએ કહ્યું “ વત્સ ! એ વિમાનમાંથી તો હું નથી આવ્યો ! પરન્તુ ભગવંત મહાવીરે ને કહ્યું છે તેનું હું તો અધ્યયન કરું છું. ”

“ આહા ? શ્રી ભગવંતની શી જ્ઞાન શક્તિ ? આપ જેવી રીતે એનું વર્ણન કરો છો અચુક એ પ્રમાણેજ તે છે.”

“ તેં શી રીતે જાણ્યું ? ”

“ ભગવન્ ? સાતમી ભૂમિકાએ હું વિલાસસુખમાં મળ્યા હતો ત્યાં આ અધ્યયનના શાખદો મારા સાંભળવામાં આવ્યા. જેથી મને જાતિસ્મરણ જ્ઞાન થયું એથી હું જાણી ગયો છું કે એ વિમાનમાંથીજ હું અહીયાં આવ્યો છું. હવે પાછો ફરીને ત્યાં જવા ઈચ્છું છું. તો ભગવંત ? ત્યાં શી રીતે જવાય ? ”

એની આવી વાણી સાંભળીને સૂર્યિવર વિચારમાં પડ્યા. “ એહા ? શી ભવિતવ્યતા છે. ભાવી બણવાન છે ? ”

“ વત્સ ! ત્યાં જવું હોય તો દીક્ષા લેવી જેઠાએ. ચાચિત્ર વગર એ સ્થાન પ્રાપ્ત થઈ શકતું નથી ? ”

“ તો મને આપ દીક્ષા આપો. મારા ઉપર એટલો અનુશ્રહ કરો ? એ મારું વિમાન, એ મારી દેવાંગનાએ, એ મારા સેવક દેવતાએ, એ સમૃદ્ધિ, વૈભવ, ઠકુરાઈ વીળેરે આગળ આ કંઈ નથી. આ મારી સ્વીએ તો મને ડાકણું જેવી લાગે છે. માટે હું હવે સત્ત્વર પાછો મારા સ્થાનકે જવા ઈચ્છું છું. ”

“ વત્સ ? તું હજુ બાળક છે ? સાધુવત પાળવું એ કુઝર છે. લોહના ચણા ચાવવા સહેલા છે, પણ અતિચાર રહીત વ્રત પાળવું એ હોહલું છે. ”

“ ભગવંત ? ગમે તેમ પણ હું વ્રત લેવાને ઉત્સુક છું ”

હું ત્યાં જવાને અધિરો થઈ રહ્યો છું માટે ગમેતેમ કરીને પણ
પ્રત આપો ? ”

“ જે તારો દ્રઢ આચહુ હોય તો પ્રથમ તારા બંધુ
વર્ગની અને માતાની સંમતિ મેળવ ? ” ગુરુએ કહ્યું.

તે પછી અવંતીએ ઘરે આવી માતાને નમી એમની
રજા માગી. પણ એ માતાએ રજા આપી નહિ જેથી એ સા-
હસિકે પોતાને હુથેજ કુદુંખનાં દેખતાં લોચ કરી નાંખ્યો.
ગૃહુવ્યવહારથી વિસુખ થઈ સાધુ થઈને રહ્યો. જેથી ન છૂટકે
રજા મળવાથી તેજ વેશે અવંતી આર્થસુહસ્તિસ્વામી પાસે
આવ્યો. ને તેમની પાસે પંચ મહાપ્રત ઉચ્ચર્યા.

“ ભગવન् ? ચિરકાલ પર્યેત પ્રત પાળવાને હું સર્વથા
અસમર્થ છું. માટે મારે શું કરવું તેનો રસ્તો બતાવો ? ”

“ વત્સ ? અવંતીના કંથારિકાના વનની સ્મરણભૂમિમાં
જઈ તું ત્યાં અનશન અંગીકાર કરીને રહેને. તારા ધ્યાનમાં
જ તું મળન રહેને.” ગુરુએ જ્ઞાનથી લાલ જોઈને અનુજ્ઞા આપી.

શુરુની રજા મેળવી અવંતી મુનિ સ્મરણ તરફ ચાહ્યા
ગયા. સુકુમાલ હોવાથી કંંકરા વગેરેના સ્પર્શથી એમને પગે
ઝીર નીકળ્યું; છતાં પણ એને નહીં ગણુતાં સ્મરણમાં આવી
ને કાયોત્ત્સર્ગ સુદ્રાએ રહ્યા. ને અનશન કરીને કાયાને વોસ-
રાવી હીધી.

માર્ગમાં તેમના ચરણુમાંથી ઝીર ટપકેલું હોવાથી તેની
ગંધથી આકર્ષયેલી એક શિયાલણું પોતાના ભાગકે સહિત

લોહી ચાટતી ચાટતી ત્યાં એ કંથારિકાના વનમાં પેઠી.

યમની એન સમી એ શિયાલણી દ્વિધરબ્યાઘત મુનિના ચરણુને ખાવા લાગી. રાત્રીના પ્રથમ પેહારે એ પગ ભક્ષણુ કર્યા. ખીજે પેહારે તેમના એ સાથળ ખાઇ ગઈ. અને ત્રીજે પેહારે તેમનું ઉદર ખાવા લાગી. ત્રણ પ્રહર લગી એ શીયાલણે એ મુનિની લારે કંદર્થના કરી. છતાં પણ ચાથે પેહારે એ મહાસત્વધારી શુલ ધ્યાનથી અસ્પલિતપણે મરણ પામીને જ્યાંથી આવ્યા હતા. ત્યાં દેવાંગનાઓના ઉત્સંગમાં રમવાને ચાદ્યા ગયા—નાલિનીગુરુમ વિમાનમાં મહર્દીંએ દેવતા થયા.

પ્રાતઃકાળે લદ્રા માતા પોતાની પુત્રવધુઓની સાથે શુરૂને વંદન કરવા આવી, પણ ત્યાં પોતાના પુત્રને જેયો નહીં. જેથી પૂછ્યું કે, “ મારો પુત્ર ક્યાં છે ? ”

ગુરુએ જ્ઞાનથી એનો વૃત્તાંત જાણીને કહ્યું કે ‘ તમારો પુત્ર તો જ્યાંથી આવ્યો હતો ત્યાં ઉત્પજ્ઞ થઈ ગયો ! ’

તે પછી લદ્રા શોક કરતી કંથારિકા વનમાં આવી. ત્યાં પુત્રનું કલેવર જેહને તે અશ્વ પાડતી પુત્રવધુઓ સહીત વિલાય કરવા લાગી. “ અરે દિકરા ? અમને તો આશા હતી કે ભલે દીક્ષા લીધી પણ તારાં રોજ દર્શન તો કરશું ? પણ તેં તો અમારો એ મનોરથ પણ નિષ્કળ કર્યો. તું આવો નિર્દ્ય થઈ ગયો. હા ? દીક્ષા લઈને એક વાર પણ તેં મારું આંગળું પાવનન કર્યું. ”

અરે કૃતની છંદાથી તું કદાચ અમારી ઉપર તો નિર્માણી થઈ ગયો પણ શુરૂ મહારાજને તું કેમ તળુ ગયો ? હાય ! વત્સ ? હવે તારું દર્શન કર્યાં થશો ? આહા ! જ્યાં સંજોગમાં વિજોગ છે અને વિજોગમાં હુંખ છે. હુંખથી કર્મબંધન છે. કર્મબંધનથી સંસારમાં જન્મ મરણ છે. અરે આજે મારું સમૃદ્ધિવંતુ ધર પણ શૂન્ય અરણ્યવત થઈ ગયું—સ્મરણ જેવું થઈ ગયું.” આ પ્રમાણે વિલાપ કરતી લદ્રા શોઠાણી ક્ષીપ્રા નદીના કાંઠા ઉપર પુત્રનું મૃતકાર્ય કરી વધુએ સહીત ઘેર આવી. આજે એ સમૃદ્ધ ધર એને ખાવા ધાતું હતું. એ શૂન્ય ધરમાં એને મુદ્દલે ચેન પડતું નહીં. વૈરાગ્યથી રંગાયેદી એ લદ્રા શોઠાણીએ પોતાની એક સગર્ભા વહુને ઘેર મુકીને સર્વની સાથે શુરૂ પાસે દીક્ષા અંગીકાર કરી.

એ અવંતીની એક સ્વી ગર્ભવંતો હતી તે ઘેર રહેલી, તેને એક પુત્ર થયો તેનું મહાકાલ નામ પાડયું. એ મહાકાલે યોવન વયમાં જે ડેકાણે પિતાનું મહામરણ થયેલું ત્યાં મહાકાલ નામે પ્રાસાદ બંધાવી શ્રી પાર્થિનાથની પ્રતિમા લરાવી પોતાના પિતાને નામે નામ રાખી એ અવંતી પાર્થિનાથ ત્યાં પ્રતિષ્ઠિત કર્યા.

શુરૂ મહારાજ તો તે પછી ત્યાંથી વિહાર કરતા ભવ્ય જનોને પ્રતિષેધ આપી પૃથ્વીને પાવન કરવા લાગ્યા.

એ અવંતી પાર્થિનાથ પણ શાસન પ્રકાશક અને પ્રતિષ્ઠિત ડોવાથી ચારે વણ્ણોમાં પૂજનવા લાગ્યા. પરન્તુ કાલાંતરે પ્રાણ્યોદ્ધૃ

બેર વૃદ્ધિ પામતાં એમણે એ પ્રતિમાને લોંયરામાં ભંડારી એની ઉપર મહાદેવનું લિંગ સ્થાપન કરી દીધું અને તે પછી મંદીર મહાકાલ તરીકે પ્રસિદ્ધ થયું. ઈવર તે મહાકાલેશ્વર કહેવાયા.

તે પછી મહાન् વિકભના સમયમાં સિદ્ધસેન દિવાકર સૂરિએ શિવલિંગને તોડીને એ અવંતી પાર્વતીનાથની મૂર્તિ હળારે દોક સમક્ષ પ્રગટ કરી એ ધર્તિહાસ જગતપ્રસિદ્ધ છે.



પ્રકરણ ઉ૭ મું.



અખંડિત આજા.

અનાર્ય દેશના કોઈ બળવાન સામંતે સંપ્રતિ રાજ ચુસ્ત અહિંસાધર્મનો ઉપાસક થવાથી એની સામે માથું ઉચ્ચકયું. ને તેણે પોતાની સ્વતંત્રતા જહેર કરી સંપ્રતિના હુતોનું અપમાન કરવા માંડયું. એક તરફથી એ પોતાનું લશકરી બળ અને તેનાં સાધનો વધારતો ગયો. બીજુ તરફથી નજીકના બીજા રાજાએને લયથી લાલચથી દ્યાવતો પોતાના પક્ષમાં એંચી બળ વધારતો હતો. એ ગર્વિષ્ટ રાજાએ જાણ્યું કે સંપ્રતિ હ્યાધર્મનો ઉપાસક બની નિઃસત્ત્વ થઈ ગયો. હુશે, એને જીતવો એમાંતે શું મારી વાત છે! ” એમ માનીને સંપ્રતિની આજાએ અમાન્ય કરવા લાગ્યો.

ફૂતોએ આવીને આ સમાચાર મહાન् સંપ્રતિને આ-
ખ્યા. એ ઉદ્ઘત રાજનો ગર્વ તોડવાને પોતાના સામંતોમાંથી
એક સામંતને એણે રવાને કર્યો, મોટું લશકર તેમજ ખીજ
અનેક સરદારો એની સાથે હતા.

એ સામંતનું વિશાળ સૈન્ય પોતાના દેશમાં ધર્સી આ-
વતું પોતાના અનુચરોથી જાહી લઈ એ અનાર્ય રાજ પોતા-
ના ભલવાન સૈન્ય તેમજ ખીજ કેટલાક રાજોએ સાથે તેમની
સામો આવીને ઉલો રહ્યો. અરસપરસ લયંકર યુદ્ધ થયું. એમાં
અનેક લુંબોનો સંહાર થયો.

રથી સાથે રથી, પાયદલ સાથે પાયદલ, ને ઘાડેસ્વાર સાથે
ઘાડેસ્વારો પોતપોતાના સ્વામીનું નિમકહુલાલ કરતા શૌર્યથી
લડ્યા. એ ભળવાન અનાર્ય રાજ તથા તેના પુત્રો લશકરને મો-
ખરે શાખને ધારણું કરતા ધર્સી આવ્યા. ધાસની માઝક લશકરનો
ધાણ નિકળતો જોઈ સંપ્રતિનું લશકર મહાન્છતાં ઉત્સાહ રહીત
થઈ ગયું. પોતાના લશકરની આ સ્થિતિ જોઈ પેદો સામંત
ચમક્યો. ” અરરર ! જે લશકર હાથું તો મહારાજને હું મોં
શું બતાવીશ ! માટે શ્યામ મુખે એમની પાસે જવા કરતાં
અહીયાંજ આત્મ સમર્પણું થાય તો સ્વામિલક્ષિત તો સાર્થક
થાય. ! વળી શત્રુ પણું ભળવાન છે. એક છતાં અનેકરૂપે હેખા-
તો તે મારા સૈન્યની ખુવારી કરી રહ્યો છે. તો મારે તેની
ઉપેક્ષા ન કરવી જોઈએ.”

એવી રીતે યુદ્ધ કરતાં કેટલાય દિવસો પાણીના પ્રવા-

હની માઝેક વહી ગયા છતાં પરિણામ કંઈ જણાયું નહીં. બન્નેના લશકરોમાં અસંખ્ય જનોની ખુવારી થઈ હતી; છતાં અનાર્ય રાજ ઉત્સાહમાં હતો એણે જેણું કે જીતનું પાસું એના પક્ષમાં હતું.

મહાન સંપ્રતિના સામંતે પોતાના સરદારોને લેગા કરીને મંત્રણા કરી કે “ શું કરવું ? આપણા લશકરનો ધણો લાગ નાશ થઈ ગયો છતાં જીત તો જણાતી ન હતી. ” એણે સરદારોની સલાહ મારી.

“ આપણે નવું લશકર મંગાવવું, અને ત્યાં સુધી બચાવ પક્ષમાં ઉલા રહેવું ? ” એક સરદારે કહ્યું. શાત્રુ બગવાન છે—અનેય છે !

“ શું મોં લઈને આપણે એ સમાચાર આપવા ? મહારાજને તરતજ આપણા નિઃસત્વપણાની એથી આતરી થશો, આટઆટલું બળ છતાં આપણે ન ફાયા તો ભીજ લશકર વડે કરીને શું ? ”

“ બરાબર છે ! આવતી કાલની પ્રલાતે આપણે કેશરીયાં કરી તુટી પડવું. જે એને જીતિશું તો જીવીશું. નહીંતર આપણી પદ્ધી મહારાજ ભલે લશકર લઈને આવે ! પણ હારીને કે હારના ત્યાં સમાચાર આપવા એતો આપણા શૈર્યાર્યને કલાકીત કરવા જેવું છે. ક્ષત્રીયનું બળ તો એના પોતાના ણાહુમાં છે—એની તલવારમાં છે. મહારાજ પોતેજ એ દૃષ્ટાંતનો નસુનો છે, ” એક સરદારે પોતાના અભિપ્રાય આપ્યો.

“ ખર્ચીત આ જમાનાના એતો મહારથી પુરુષ છે. એ મહારથી પુરુષ આપણી હારના સમાચાર સાંભળશે ત્યારે એને કેટલું હું ખ થશે. હાર શું છે એતો વાસુદેવની માર્ક્રક એ સમજતાજ નથી. બસ જીતવું એજ એમનો મહામંત્ર છે. માટે આપણે પણ આપણા બાહુ શરીરને આવતી કાલના યુદ્ધમાં બતાવવા ! ” બીજા સરદારે કહ્યું.

“ શાહખાશ બહાહુરૈ ! તમારા મતને હું મળતોજ છું. આવતી કાલે સૈન્યને મોખરે સેનાધિપતી થઈ હું ચાલીશ. તમે મારી પછવાડે રહેનો. યુદ્ધમાં તમારું ક્ષત્રીયત્વ બતાવનો. આવતી કાલનો આથમતો સ્ર્યું ચાહે તો એ ન જુવે અથવા તો હું ન જોઉં. પણ મારા જીવતાં તો હારના સમાચાર હું મહારાજને આપીશ નહીં. ” એ સામંતના રાખ્યો બધાએ વધાવી લીધા ને રણોત્સાહ વૃદ્ધિ પામ્યો.

ચર માર્ક્રીતે આ સમાચાર અનાર્ય રાજએ પણ જાણ્યા હતા. તે તો ખુશી થયો ઠીકજ થયું કે “આવતી કાલે યુદ્ધનો અંત આવશે. મારું રાજ્ય જગત ઉપર આ જમાનામાં સ્વતંત્ર મહારાજ્ય કહેવાશે. ”

બીજા દિવસનો સ્વોર્યોહય થતાં બન્ને લશકરૈ સામસામે આવીને હાજર થયાં. ને તરતજ યુદ્ધની શરૂઆત થઈ. આજે યુદ્ધનો જેશ લયંકર હતો. સામંત અને તેના સરદારે સૈન્યના મોખરે રહ્યી લડી રહ્યા હોવાથી એમના સૈન્યમાં ઉત્સાહ અપૂર્વ હતો. કાપાકાપી મારામારી અસી સામે અસી, લાલા

સામે ભાલા ને તીર સામે તીર અથડાઈ રહ્યાં હતાં. સંસારની દરેક પ્રવૃત્તિ છોડી યુદ્ધમાંજ એમના ચિત્તની એકાશ્રતા હતી. યુદ્ધ કરતાં ત્રીજે પ્રહર થવા આવ્યો. લાખો સૈનિકો એમાં હોમાયા. લડતાં લડતાં એ અરસામાં અનાર્યરાજ અને સામંત સામસામે આવી ગયા. બન્ને એક ખીજા તરફ ધસ્યા આંખોમાં ખુન હતું બાહુમાં બળ હતું શરીરમાં અપુર્વ શૈર્ય હતું. સ્કુર્ટિં હતી. એક ખીજાનો જીવ લેવાને-યુદ્ધનું છેવટ આણુવાને એક ખીજા ઉપર તુટી પડ્યા. હરીકુથી પોતપોતાનો બચાવ કરતાં એકખીજા ઉપર ધા કરવાને અચુક નેમ સંધાતી. કેટલોક સમય પર્યાંત એ યુદ્ધ ચાલ્યું. બાહુમાં બન્ને સરખા જાણ્યાયા, ડેનું બળ અધિક છે એ કળી શકાયું નહી. ડોણ હારશે એતો ભાવીના પડદામાં છુપાયેલ હોવાથી અવપ્રમત્તિવાળાને અનિ-શ્રિત હતું.

બન્ને એક ખીજાનો ધા ચુકવતા હતા. બન્નેના સરદારો પોતપોતાના સ્વામીની રક્ષા માટે એમની પડાએ પોતાનું શૈર્ય બતાવી શત્રુઓને હંકાવતા હતા.

એવામાં બન્નેના હાથીએનાં માથાં ભટકાયાં. સામંતના હાથીએ કોધથી પોતાની સૂંદ એવી તો હુશ્મનના હાથી ઉપર પછાડી એની સુંદને દખાવી કે હાથી ચકરી ખાવા લાગ્યો જેથી અનાર્યરાજ જરા એચેન થયો કે સામંત તરતજ છલંગ મારી એના હાથી ઉપર કુદ્ધો ને ત્યાં બાહુ યુદ્ધ જાણ્યું. સામંતના હાથીએ પોતાના સ્વામીને તક મલી જાણ્યીને હુશ્મનના હાથીને પોતાની સુંદના સપાટામાં સપડાવી રાખ્યો.

ખાડુ ચુદ્રમાં સામંતે અનાર્ય રાજને આખરે પટકીને
નીચે પાડી એને બાંધી લીધો. એ બંધન થયેલા રાજને ઉચ-
કીને પોતાના સરદારોની મહ્યમાં ફેંક્યો. ભાલાની અણીઓથી
જીતાયેલો એ રાજ મરતો મરતો માંડ બચ્ચીને બંધીવાન થયો.
તરતજ નજીકમાં ઉલેલા પોતાના હાથી ઉપર સામંત કુદી
ગયો ને શત્રુનું સૈન્ય ચારે તરફ નાસવા લાગ્યું. તે પછી કૂટેલા
રાજએને પણ સામંતે બાંધ્યા. એમની રાજ્યધાનીઓમાં
પોતાના સ્વામીની આણ અખંડિત કરતો પોતાનો અધિકારી
નિમીને તે સ્વામીને આવીને નમ્યો. મહાન સંપ્રતિએ સામંત
અને સરદારોને તેમની યોગ્યતા પ્રમાણે ખક્ષિસો આપી નવા-
જ્યા. ને જીતેલા અનાર્ય રાજને પોતાનો બંધીવાન રાજી
એના પુત્રને પોતાની આજા કખુલ કરાવી રાજ્ય આપ્યું. ત્રણે
ખંડમાં સંપ્રતિની આજા એવી રીતે અખંડિત રહી. એ આજા
વાસુદેવની માઝુક એના જીવનના અંત લગ્ની અલંગ રહી.



પ્રકૃતરણ ઉચ મું.



ઉપસંહાર.

સમય સન્યનું કાર્ય કરે જાય છે તે અનુસરે નવાનું જુનું
ને જુનું તે પુરાણું થયા કરે છે સુખશાંતિમાં ત્રણ ખંડનું
રાજ્ય લોગવતાં મહાન સંપ્રતિને વીર લગવાનની ત્રીજી સહી
પણ પસાર થઈ ગઈ. અને ચોથી સહીના પણ વર્ષો પાણીના

પ્રવાહની માર્કેક વિદ્યાં જતાં હતાં. એ અરસામાં પૃથ્વીના ચોક
ઉપર કર્દ કર્દ ઘટનાઓ ખને જતી હતી. કે કાલે કે નિર્માણ
હતું તે થયાં કરતું હતું, વીરસંવત ૨૬૧ માં એટલે લગભગ
ત્રણું સદીના અંતમાં શ્રી આર્યસુહસ્તસ્વામી શ્રી સુસ્થિત
અને સુપ્રતિષ્ઠદ્વારા પોતાની પાસે સ્થાપી હેવાળાઓની મનો-
કામના પૂર્ણ કરવાને ગયા. તે અરસામાં સમાદૃ અશોકપણું મ-
ગધના તર્ણત ઉપરથી પરલોકનું તર્ણત લોગવવાને રવાને થયા.
તે મહાન્ સંપ્રતિ ત્રણુણં ડના અધિપતિ તરફે રાજ્યાભિષેકથી
રાજ્યાર્દિન થયા. સેણ હંજાર રાજનો (ડેઈ ડૈકાણે આડ હં-
જાર કદ્યા છે તત્વ કેવલીગમ્ય) એમની સેવામાં હાજર હતા
જ્યાં સુધી દાદાળુની હુયાતિ હતી ત્યાંદાંગી મગધપતિ દાદાળ
અશોક હતા. અને મહાન્ સંપ્રતિ ઉજઝયિનીમાંજ રહીને ઘણેં
અરે વણત પસાર કરતા. ત્યાંથી દુનિયાના દેરેક દેરો ઉપર
હકુમત ચલાવતા હતા. એમનું આયુષ્ય પુરેપુરે સો વર્ષનું હો-
વાથી દીર્ઘકાળ પર્યાંત પૃથ્વીની સમૃદ્ધિ લોગવી ચોથી સદીનાં
પણું કેટલાંક વર્ષ પસાર થયા બાદ લગભગ દોદ બે દાયકા વીત્યા
પછી પોતાનું સંપૂર્ણ આયુષ્ય સો વર્ષનું પૂર્ણ કરીને હેવલોકની
સમૃદ્ધિ લોગવવા ગયા. લ્યાંથી તે શીવવધુના ઓળામાં રમવાને
જશે. ત્રણુણં ડ ધરતીમાં એમણે લગભગ ગામો ગામને નગરે
નગર જીનમંદિર કરવાથી પૃથ્વીને જીનમંદિરથી વિભૂષિત કરી
એમણે ૮૬૦૦૦ જીન મંદિરોનો જીર્ણોદ્વાર કરાવ્યો. અને
૩૬૦૦૦ નવાં મંદિરો તૈયાર કરાવ્યા આપણે જેધ ગયા ધીએ
કે દરરોજ ઓછામાં એથું એક જીનમંદિર તૈયાર થયેલું જાં-

ભરો

આચુધ્યના પ્રમાણ
મંહિરો તૈયાર થયા.

મ હતો. સો વર્ષના તેમના
પ્રમાણે નવાં અને લાર્ણાંદ્રાર

તે સિવાય સોના, ચાંદી, પીતલ, પાષાણ વગેરેની કરા-
વેલી પ્રતિમા તો સવાકોડની સંખ્યા જેટલા પ્રમાણવાળી હતી,
એમનાં બંધાવેલાં મંહિરો નાગોલ, ગિરનાર, શાત્રુંજ્ય, રત્નામ
વગેરે ધણે સ્થળે અધાપિપણ જોવામાં આવે છે. તેમજ એમની
પ્રતિમાઓ પણ ધણે ડેકાણે દર્શિગોચર થાય છે.

મહાન સંપ્રતિએ અનાર્યદેશોમાં પણ સાધુઓનો વિહાર
કરાવી એમને ઉપહેશવડે જૈનધર્મી બનાવ્યા હતા. એ મહાન
રાજના સમયમાં જૈનોની વસ્તી ઓછામાં ઓછી ૪૦ કરેડાની
અંકાતી હતી. પોતે પણ બારત્રતધારી ચુસ્ત જૈન, ત્રણેકાલ
જનપૂજન કરી સ્વજનોની જેમ સાધર્મિઓનું બંધુ વાતસર્ય-
પણું કરતા હતા.

એમના સમયમાં શ્રી મહાવીર સ્વામીથી ચાલ્યા આ-
વતા નિર્યથ ગચ્છનું નામ કૌટિકગચ્છ પડ્યું. આર્યસુહસ્તિ
સ્વામી પોતાની પાટે સુસ્થિત અને સુપ્રતિષ્ઠદ્ધને સ્થાપીને
દેવલક્ષમી લોગવવા ગયા. તે પછી આ સૂર્યિવરોએ કોડવાર
સૂર્યમંત્રનો જ્યાપ કરવાથી ‘કૌટિક’ એવું તેમના ગચ્છનું
નામ જગતમાં પ્રસિદ્ધ થયું.

આવા મહાન સ્વર્વીતમ ત્રણ અંડના અધિપતિનું અખંડ
રાજ્ય ધણું વર્ષ પર્યાંત પૂર્ખી ઉપર હોવા છતાં જૈનેતર

